

## ॥ અદ્યાય ૨૨ ॥

### અપમૃત્ય નિવારણમ् (ભક્તોના અકાળ મૃત્યુને પાછું ઠેલવું)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,  
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

આનંદથી પરિપૂર્ણ, મૂત્રિમંત જ્ઞાનનો અવતાર અને અતિશય પવિત્ર એવા સદગુરુ ! તારો જ્ય હો. તું સંસારના ભયનું નિકંદન કરનારો છે. કળિયુગમાં લોકોની પાપકર્મો કરવા માટેની અને અધર્મના આચરણ તરફની પ્રવૃત્તિઓ વધેલી હોય છે એવી એક સાધારણ સમજ છે. તેમાં ઉત્પન્ન થનારી દુષ્ટ વાસનાઓને જરૂરી ભસ્મ કરનાર સર્વ બાજુએથી પૂર્ણ એવા તારો જ્યન્યાયકાર થાઓ. તું આનંદકૃપી સાગર છે. તારા વર્તનમાંથી અનેક લહેરો એકદમ ઉડતાં ઈચ્છકૃપી મોન્નાં ઉછાળા થાય છે. પણ ભક્તો ઉપર કૃપા કરવા માટે તું જ તેને રોકે છે. આછા પ્રકાર અને થોડું અજવાણું હોય એવી સ્થિતિમાં જે હેખાય છે તે પ્રકાર થતાં જ દોરડું જણાય છે. આ જે સ્થિતિ છે, તે બંનેનો ઉત્પન્નકર્તા પણ તું જ છે. ડરથી સાપનો આકાર ભાવનામાં ઉત્પન્ન કરનારો પણ તું જ છે અને તે જ ભાવનાને દોરડાનો આકાર આપીને એ ભય દૂર કરવાવાળો પણ તું જ છે. પહેલાં જ્યારે અંધકાર હતો અને સાપ અથવા તો દોરડું આ બેઉ વૃત્તિઓને સમજવા માટેનો કોઈ અવકાશ જ ન હતો. ત્યારે પણ આકાર વગરનો નિરકાર તું જ હતો. પછી આગળ ઉપર નિરકારનો સાકાર થયો. અને થોડું અજવાણું થવાથી સર્પનો ખોટો ભાસ થવા લાગ્યો. જે આભાસ થયો તેનું કરાણ પણ તું જ છે. આમ આવી તારી ખુલ્લી હેખાની અંત: કરણાની પ્રવૃત્તિઓ આનંદથી વર્તવાનો તારો મહિમા અને મનમાં સારા અથવા તો નરસા એવા કોઈ પણ પ્રકારના વિકાર ઉત્પન્ન થતા હોય તેવો સ્વભાવ, આની કોઈને ખબર પડતી નથી. તેને કારણે બધા વેદો મૌન ધારણ કરીને બેઠા છે. અનેક મુખ્યથી સ્તુતિ કરીને શેષનાગ પણ તારા વાસ્તવિક સ્વરૂપને સમજી શક્યા નથી તો ત્યાં આ મારા જેવા પામરોનો શો હિસાબ ? બાબા ! તમારા સ્વરૂપનાં દર્શન કર્યા વીના મનને કોઈ પણ વસ્તુ બહારી કે રુચિકર લાગતી નથી. મન કહે છે કે તારા એ જ સ્વરૂપને ધ્યાનમાં રાખું અને આંખોની સામે હંમેશા રહેવા દઉં. પરમ શ્રેષ્ઠ સુખોનો લાભ લેવા માટે શુદ્ધ જ્ઞાનની સાક્ષાત મૂર્તિ એવાં તારાં ચરણો સિલાય અમને બીજે કોઈ આશ્રય કે ગતિ નથી. (ઓ. ૧-૧૦)

બાબા ! શું તમારી નિત્યની બેસવાની આ રીત ! અનેક ભક્તો દર્શન માટે આવે છે. અને તમારા ચરણ ઉપર માથું મૂકીને પ્રેમથી સુખ લૂંટાવે છે. તમારો એક પગ નિશાનીકૃપે જેવો ચંદ્ર અને ઝાડની ડાળી સાથે સંબંધ જોડનારા ઉદાહરણ જેવો પગનો અંગૂઠો પકડી ભક્તોના દર્શન માટેની ઉત્સુકતા દૂર કરનાર છે. કૃષણપક્ષની પંદરમી તિથિ એટલે પૂર્ણ અંધકારવાળી અમાસ પૂરી થતાં ચંદ્રના દર્શન માટેની બધાને સહેલે ઉત્સુકતા થતી હોય છે. કૃષણપક્ષની રાત પૂરી થતાં બીજે દિવસે સાંજે ચંદ્રદર્શની આશા ઉત્પન્ન થતાં તે આકાશ તરફ નજર કરીને પણ્ણિમ દિશા તરફ ઝીણવટથી જુવે છે. બાબા ! તમારો ભક્તોની એ ઉત્કંઠા તમે જ્યારે ડાબા ઘૂંટણ પર તમારો જમણો પગ મૂકીને બેસો છે ત્યારે તમરા પગ પાસે જ પૂર્ણ થાય છે. ડાબા હાથના અંગૂઠા પાસેની પહેલી આંગળી અને તેની પાસેની વચ્ચેની

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

આંગળી આ બે આંગળીડીપી જાડની બે ડાળીઓની વરચેની જગ્યા જેમાં પગનો અંગૂઠો પકડેલો દેખાય છે. ત્યાં નખરૂપી બીજનો ચંદ્ર ચમકતો દેખાય છે. ચંદ્રના દર્શનની ઉત્સુકતા ખૂબ જ મોટી હોય છે પણ આકાશમાં ચંદ્રકોર સહેલાઈ અને સાધારણ રીતે નજરે આવતી નથી, ત્યારે અનુભવી માણસો કહે છે કે જાડની બે ડાળીઓ વરચે નજર રાખો અને એ ખાંચામાં બરાબર જુઓ એટલે ચંદ્ર સામે જ દેખાશો. ચંદ્રકોર નાની હોવા છતાં ત્યાંથી તે નરી આંખે દિશિગોચર થાય છે. (ઓ. ૧૧-૧૮)

તે અંગૂઠાનો મહિમા ઘન્ય છે. બાબાએ પોતે જ વેણીમાધવ બનીને ગંગા-યમુના પ્રગટ કરીને દાસગણુને સંતુષ્ટ કર્યા હતા. પ્રથાગ તીર્થે સ્નાન કરવા માટે જવાની આજા માંગતા, ‘આ મારા પગનો અંગૂઠો એટલે પ્રથાગ તીર્થ જ છે, ત્યાં જ સ્નાન કર’ એવું બાબા બોલ્યા હતા અને દાસગણુએ તેમનાં ચરણો ઉપર મસ્તક મુકતાં જ ગંગા અને યમુનાના બે પ્રવાહ એ જ જગ્યા પર પ્રગટ થયા હતા. એવા પ્રસંગે ‘અગાધ શક્તિ, અધિત્તિત લીલા તારી શ્રી સહૃગુરુરાથ્યા’ આ દાસગણુનાં સુંદર પદોનું તત્પર અવણ શ્રોતાઓએ જે કર્યું હોય તો આ સાઈસતચરિત્રના ચોથા અધ્યાયમાં દાસગણુએ પોતાના શબ્દોમાં કહ્યું છે, જે શ્રોતાઓએ ફરી એકવાર વાંચવાથી એક નવું જ માધુર્ય પેદા થશે. આવું કહીને, શાખા-ચંદ્ર-ન્યાયાનુસાર એની ઉપર પહેલી આંગળીની વરચે જગ્યા રાખીને સાઈમાવડી પોતાના ભક્તોને આ સહેલો ઉપાય બતાવીને કહે છે કે, ‘અભિમાન છોડી દઈને દરેક લુખમાત્રની સામે નભ્રપણે પોતાની ગર્દન ઝૂકાવીને આ એક અંગૂઠાનું ધ્યાન કરો. એ જ ભક્તિનું મોટું અને સહેલામાં સહેલું સાધન છે.’ (ઓ. ૧૮-૨૫)

આગળ ઉપરની કથામાં બાબાએ ભક્તો ઉપર કરેલી અનેક કૃપાનું વર્ણન હતું. હવે તેમનું આગળનું અપૂર્વ ચરિત્ર ધ્યાનથી જોઈએ. બાબાના હિસાબે શિરડી એક અતિશાય પવિત્ર ક્ષેત્ર જાહેર થયું હતું. રાત અને દિવસ યાત્રા ચાલુ જ રહેતી હતી. અનેક સંમાર્ગી લોકો પુલ્ય પ્રાપ્ત કરવા માટે ત્યાં આવવા લાગ્યા હતા. જેનો દરે દિશામાં પુરાવો પ્રત્યક્ષ મળે અથવા તો બીજ પાસેથી પરોક્ષ રીતે સાંભળવા મળે તેવા જાણે કે આ સાક્ષાત્ કલ્પવૃક્ષ જેવા સાઈબાબા શિરડીમાં અવતર્યા હતા. ગરીબ હોય કે તવંગાર, તે દરેકને એક જ દિશાએ જેતાં કંઈ પણ ન સમજય તેવા કૌશલ્ય અને અતકર્ય નિદાનો બતાવીને તેઓ ભક્તોનું કલ્યાણ સાધતા હતા. શું એમની એ અગાધ પ્રેમાળતા, સ્વભાવિક જ્ઞાન સંપત્ત્રતા અને દરેક પ્રાણીઓમાં એક જ આત્મા છે એવી શ્રેષ્ઠ ભાવના હતી ! જેમણે આનો અનુભવ કર્યો તેમનું ભાગ્ય ઘન્ય બન્યું. કયારેક તો એક શબ્દ ન બોલતાં, મૌન તે જ તેમનું તત્ત્વજ્ઞાન વિષેનું વ્યાખ્યાન હતું. તો કયારેક ચૈતન્ય અને આનંદથી પરિપૂર્ણ એવા તેઓ ભક્તગણોથી ચારે તરફ ધેરાયેલા રહેતા. કયારેક ગૂઢ અર્થ સમજવીને બોલતા તો કયારેક મશકરી રૂપે અને વિનોદ દ્વારા કહેતા. કયારેક અનેક અર્થોમાં તો કયારેક અસ્પષ્ટ બોલવાનું છોડીને ફક્ત ગુરુસામાં તડકડ કરી નાખતા. કયારેક ભાવાર્થથી તો કયારેક તર્કથી સમજમાં આવે તેવો વિવેક તો વળી કયારેક ખુલ્લેઆમ ખાત્રી પૂર્વક કહેતા. આવી અનેક રીતોથી ઉપદેશ કરવાની તેમની રીત હતી. આમ સાઈ સમર્થનું વર્તન અને આચરણ મન, બુદ્ધિ અને વાણીની સમજવાની શક્તિથી બહારનું હતું. તેમનું દરેક કાર્ય ન સમજય તેવું, કઢી કલ્પના ન કરી શકાય તેવું, જણવા માટે ખૂબ જ અધું અને એકાએક જ થતું. તેમનું મુખ જેતાં તે ભક્તો સાથે વાતો કરતા, અને તેમની વાતો સાંભળતાં મનને પૂરેપૂરું સમાધાન કરી પણ થતું નહિ અને હૃદયમાં આનંદ સમાતો નહીં. કદાચ વરસાહની ધારો ગણી શકાય અથવા તો મોટા થેલામાં પવનને બાંધી શકાય પણ શ્રી સાઈના ચમત્કારને કોણ પામી શકવાનું છે ? (ઓ. ૨૬-૩૬)

હવે સાઈની ભક્તોના રક્ષાણ કરવા માટેની ચીવટ અંગે તેમજ તેમના વિકટ પ્રસંગોનું નિવારણ કરવા માટેની કથા મન દાખિને સાંભળો. ભક્તો ઉપર આવનારાં બધંકર સંકટોની બાબાને અગાઉથી જણ થઈ જતી હતી. ભક્તોના ગાંડાતૂર સંકટો જાણીને ભક્તોના કલ્યાણ માટે સદાયે તત્પર એવા સાઈબાબા તેમને સમયસર ધીરજ આપીને તથા તે સંકટ ટાળીને

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ભક્તોને પોતાનાં ચરણોમાં કેવી રીતે સ્થિર કરતા હતા તે વિષય ઉપરની એક કથા તમને બાબાની વાતો સાંભળવા માટે કાયમ ઉત્સુક રહેનારા તમારા જેવા શ્રોતાઓને આનંદ પમાડશે. તમારો સાઈ સમાગમના સુખનો વધારો થશે અને ભાવિક ભક્તોના મનમાં શ્રદ્ધા જન્મશે. દીન, હીન બિચારા લોકોમાં શ્રી સાઈની કથા સાંભળવાનું ખેંચાણ ઉત્પન્ન થશે. તેમજ દરેક ક્ષણે સાઈનામનો જપ કરતાં સાઈ તેમને સામે કઠિ પહોંચાડશે. અહુમદનગરમાં રહેનારા કાકાસાહેબ મિરીકરને અંગેજ સરકારે ખુશ થઈને સરદારની પદવી એનાયત કરી હતી. તેમના ચિરંજિવ બાળાસાહેબ મિરીકર જેઓ તે સમયે પોતાના કાયમાં કાયમ મશગૂલ રહેતા મામલતદાર હતા. તે ચિથળીના પ્રવાસ પર હોવાથી શિરડીમાં બાબાના દર્શનાર્થે આવ્યા. મસ્નિફદમાં જઈ બેસતાં અને બાબાનાં ચરણો પર માથું મૂકતાં, શું કેમ ચાલે છે? એમ પૂછતા બીજી બદ્ધી વાતો કરવા લાગ્યા. ત્યાં બીજી ઘણા ભક્તજનો બેઠા હતા. પાસે માધવરાવ દેશપાંડે પણ બેઠા હતા. અમૃતદ્વારી આ કથાનું માધુર્ય સરસ ધ્યાન દઈને તમે ચાખજો. આગળ ઉપર આવનારાં ભાવિ સંકટોની સૂચના આપીને, તેનું નિવારણ કરવા માટેનો ઉપાય કરીને તથા ભક્તોનું બાબા કેવી રીતે રક્ષણ કરતા એ મોટી ચમત્કારિક વાત હતી. તે સમયે બાબા બોલ્યા, ‘હવે જુઓ આ દ્વારકામાઠ એટલે આપણી મસ્નિફદ એ જ આપણી દ્વારકાદ્વારી માતા છે. તેના ખોળામાં બેઠેલાં બાળકોને તે નિર્ભયતા બદ્ધે છે. તે બધા જ પ્રકારના ડર દૂર કરે છે તેમજ તેને કોઈ પણ ચિંતાની રહેતી નથી. આ મસ્નિફદ માવડી મોટી ફૂપણું છે. ભોળા ભક્તોની એ માતા છે. કોઈ પણ સંકટોમાં ફસાય કે એ તેનું તરત જ રક્ષણ કરે છે. જે કોઈ એક વખત તેના ખોળામાં બેસે છે કે તેનો બેડો પાર કરે છે. આ મસ્નિફદની છાયામાં જેણે વિસામો લીધો તેણે એવું સમજવાનું કે તે આરામદાયક ગાઈ ઉપર જ બેઠો છે. આ જ એ દ્વારકા અથવા તો દ્વારવતી છે.’ (ઓ. ૩૭-૫૦)

બાબાએ ત્યારબાદ મિરીકરને ઉદ્દી આપી અને તેના માથા ઉપર સુરક્ષા આપનારો અભય હસ્ત મૂક્યો. મિરીકર પાછા જવા નીકળ્યા. પણ બાબાના મનમાં થયું કે, તેમને હજુય એક પ્રશ્ન કરવો જોઈએ કે શું તમને ‘લંબાબાવા’ એટલે સાપનું આશ્રય ખબર છે? ત્યારબાદ ડાબા હાથની મૂઢી વાળીને ખુણાથી તેને જમણે હાથે પકડીને ચારે બાજુ ફેરવીને મોઢેથી બોલ્યા, ‘એ ભયંકર જ હોય છે. પણ એ આપણું શું બગાડવાનો? આપણે દ્વારકામાઠનાં બાળકો છીએ. એની કરામતની કોઈને ખબર પડતી નથી. આપણે શાંત બેસીને એનું કૌતુક જોયાં કરવું. દ્વારકામાઠ જ બચાવવાળી બેઠી છે, પછી લાંબાબાવા કંઈ આપણને મારી શકવાના છે? એ તારણાહાર સામે મારનારનો શો હિસાબ?’ આ જ પ્રસંગે બાબાએ આ ખુલાસો શા માટે કર્યો અને મિરીકર સાથે આનો શું સંબંધ છે એ જણાવાની જિજ્ઞાસા બધાને થવા માંડી. તે બાખતમાં બાબાને પૂછવાની કોઈની હિંમત ચાલી નહીં. મિરીકરે બાબાનાં ચરણોમાં માથું મૂક્યું અને ચિથળી જવા માટે મોડું થઈ રહ્યું છે એવું કહીને નીચે ઉત્તર્યા. તેમની સાથે માધવરાવ દેશપાંડે પણ હતા. તેઓ બંને સભામંડપના દરવાજ સુધી જ પહોંચાયો હશે, એટલામાં જ બાબાએ માધવરાવને એક થોડી ક્ષણ પાછો આવ. એમ જણાવ્યું અને કહ્યું, ‘શ્યામા તું પણ તૈયારી કર અને તેમની સાથે ચિથળીનો પ્રવાસ કરી આવ. તને ખૂબ જ મજા આવશે.’ તરત જ માધવરાવ નીચે ઉત્તર્યા અને મિરીકર પાસે ગયા અને બોલ્યા, ‘તમારા ટાંગામાં મારે પણ સાથે ચિથળી આવવું છે. હું ધરે જઈને તૈયારી કરીને તરત જ પાછો આવ્યો સમજે ને! બાબાએ મને તમારી સાથે ચિથળી જવા માટે કહ્યું છે.’ તે સાંભળી મિરીકર તેમને બોલ્યા, ‘આટલે દૂર ચિથળી આવીને તમે શું કરવાના? કામ વગરનો ખોટો ત્રાસ તમને જ થવાનો છે.’ આ સાંભળી માધવરાવ પાછા આવ્યા અને બાબાને જે વાત મિરીકર સાથે થઈ તે કહી સંભળાવી. ત્યાં બાબાએ માધવરાવને કહ્યું, ‘સારું થયું. આપણું એમાં શું જય છે? મંત્ર, તીર્થનાં સ્થાન, બ્રાહ્મણ, દેવ, ભવિષ્યવેતા, વैદ્ય અને ગુરુરાજ એમની ઉપર જેવી શ્રદ્ધા કુ વિશ્વાસ અથવા ભાવ હોય તે પ્રમાણે જ ફળની પ્રાપ્તિ થાય છે. આપણે હંમેશા કલ્યાણ કરવાનો હેતુ જ મનમાં રાખીને યોગ્ય એવો ઉપદેશ કરવો. જેના કર્મમાં જેવું લખેલું હશે તે જ પ્રમાણે થાય છે.’ એટલામાં મિરીકરને મનમાં શંકા આવી

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કે બાબાના શર્જદોને માન આપવું જેઠાએ. તેમણે ધીરેથી માધવરાવને ઈશારો કરી ચિથળી આવવા માટે ચાલો એમ કહ્યું. એ સાંભળી માધવરાવ બોલ્યા, ‘થોલો હું આવ્યો, ફરી પાછી બાબાની આજા લઈ લઉં. જે હા કહેશે તો તરત જ પાછો આવું છું. તમારી સાથે જ હું આવવા નીકલ્યો હતો. પણ તમે જ મને ના પાડી અને પાછો મોકલ્યો.’ બાબા બોલ્યા, ‘સારું થયું આપણનું એમાં શું જય છે ? એમ કહીને તેમણે મને સ્વસ્થ બેસાડ્યો ફરી પાછો તેમને પૂછી લઉં છું. હા કહેતા જ તાબડતોબ આવું છું. બાબા કહે તે પ્રમાણે હું કરું છું. હું તો ફક્ત આશાનો દાસ છું.’ પછી માધવરાવ બાબા પાસે ગયા અને બોલ્યા, ‘મિરીકર મને બોલાવી રહ્યા છે. મને ચિથળી તેમની જેઠે લઈ જવા માંગે છે. તમારી આજા માંગવા આવ્યો છું.’ બાબાએ સાંભળીને હસીને બોલ્યા, ‘ભલે એ લઈ જતો હોય તો તું જલ. આનું નામ મસ્તિજીદમાઈ છે, એ પોતાનું વ્રત થોડું છોડવાની ? એ ખૂબ જ માયાળું મા છે. લોકો માટે ખૂબ જ ચિંતા કરનારી છે. પણ બાળકોને એની ઉપર વિશ્વાસ ન હોય અને નીકળી પડે તો તેમની સંભાળ એ કેવી રીતે રાખે ?’ પછી માધવરાવ બાબાને પગે પડી, નમસ્કાર કરી જવા માટે નીકલ્યા. જ્યાં મિરીકરનો ટાંગો હતો ત્યાં બેસવા માટે આવી પહોંચ્યા, અને બંને ચિથળી ગયા. તપાસ કરતા જણવા મળ્યું કે, મુખ્ય કાર્યાલયથી જે લોકો આવવાના હતા તે આવ્યા ન હતા. માટે તેઓ શાંતિથી સ્વસ્થ થઈને બેઠા. તેમના ઉતારાની સગવડ એક મારુતિના મંહિરમાં કરવામાં આવી હતી. ત્યાં તેઓ બંને જરૂર પહોંચ્યો ગયા. રાતનો એક પ્રહર વીત્યો હતો અને રાત્રીના ૧૦ વાગી ગયા હતા. તેઓ શેતરંજી પાથરીને અને ઓશિકું મુકીને દીવાના પ્રકાશમાં વાર્તાલાપ અને ગપ્પા મારતા બેઠા હતા. થોડીવાર બાદ મિરીકર ત્યાં એક વર્તમાનપત્ર પહુંચું હતું તે ઉધાડીને વાંચવા લાગ્યા. તેમનું ચિત્ત મુખ્ય સમાચારો વાંચવમાં મગન હતું. એટલામાં જ ત્યાં એક ખૂબ જ વિચિત્ર ઘટના બની. (ઓ. ૫૧-૭૭)

એ સમયે એક ભયંકર સાપ ત્યાં કયાંકથી આવ્યો. કોઈને ખબર જ ન પડી. તે બધાની નજર ચૂકવીને ગૂંચળું વાળીને બેઠો હતો. મિરીકરની કર્મર પરનો એસનો છેડો હતો તે નરમ કપડાંની ગડીમાં સાપ શાંતિથી કોઈની બીક વગર બેઠો હતો. ધીમે ધીમે સરકતો હોવાને કારણે કાગળનો અવાજ સુરસુર થવા લાગ્યો, પણ કોઈને એ સરકવાના અવાજને કારણે સાપ હોવાની શંકા આવી નહીં. ભયંકર પ્રસંગ બન્યો હતો. પણ મિરીકર વર્તમાનપત્ર વાંચવામાં લીન હતા. પટાવાળાને મનમાં સંશય થયો કે એ અવાજ કયાંથી આવી રહ્યો છે અને શાનો હશો તેની જણ માટે દીવો જરા સાધારણ ઉચ્કયો, તો ‘લાંબોબુવા’ એટલે લંબુમહારાજ ઉર્ફ સર્પરાજ દેખાયો. તે જેતાં પટાવાળો ગભરયો અને ‘સાપ રે સાપ’ એમ ધીરેથી બૂમ મારી. મિરીકરની તો ધીરજ જ ખૂટી ગઈ અને તેમનું આખું શરીર ડરના માર્યા કાંપવા માંડયું. શ્યામરાવ પણ આ જેઠાને આશ્રયચકિત થયા અને બોલ્યા, ‘બાબા આ શું કર્યું ? ન હતું ત્યાંથી આ સંકટ કયાંથી ઊભું કર્યું ? હવે એનો ઉપાય કરવો પડશે.’ પછી એ પરિસ્થિતિ સમજીને, જેના હાથમાં જે આવ્યું તે લઈને બધા જ પગનો પગરવ પણ ન થાય એ રીતે તે તરફ ધસ્યા એટલામાં એ સાપ કર્મરથી નીચે સરકતો દેખાયો. સાપ શેનો ! જાણો કે મૂર્તિમંત મોત જ ઉત્તરતું હોય એવું લાગ્યું. જેતા જેતામાં એ સંકટ દૂર થયું. તેમજ પહેલેથી જ હિંચેકેલા સોટા ઘડાઘડ એ સાપ ઉપર પડવા લાગ્યા, અને તેના દુકે દુકડા થઈ ગયા. આ પ્રકારે આપત્તિ ટળેલી જેવા છિતાં મિરીકર ખૂબ જ ગભરાઈ ગયા. અને સાઈસમર્થનો પ્રેમ અતિશય પ્રગટીને બહાર આવ્યો. ભયની પીડાથી થયેલો શરીરનો કંપ ઓછો થયો. આંખોમાંથી પ્રેમના આંસુ વહેવા લાગ્યાં અને મનમાં વિચાર કરવા લાગ્યા, ‘કેટલી મોટી ધાત ટળી ! બાબાને આની કેવી રીતે ખબર પડી હતી ? કેવું આ ભયંકર સંકટ નીકળી ગયું ? સમયસર સૂચના આપીને મારી ના કહેવા છિતાં પણ શ્યામરાવને ટાંગામાં જેઠે બેસાડ્યા અને મને મહદું કરવા માટે મોકલી આપ્યા ! કેટલી દ્વારા એમના મનમાં ! કેટલું એમનું અંતર્જાન ! આગળ આવનારી ખરાબ પળ જેઠાને યોગ્ય ઉપદેશ કર્યો. પોતાના દર્શનનું માહાત્મ્ય બતાવી દીધું. મસ્તિજીદમાઈનું ગાઢ મહત્વ પણ બધાના મનમાં સ્થાપિત કરાવી આપ્યું. અને સહેજ વાતવાતમાં ભક્તો ઉપરના પોતાના પ્રેમની જણ કરાવી.’ (ઓ. ૭૮-૮૨)

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

એક વખતે નાના ડેગળે નામના એક પ્રસિદ્ધ જ્યોતિષી બાપુસાહેબ બુટીને મળવા આવ્યા. તેઓએ તેમને શું કહ્યું તે સાંભળો, ‘આજનો દિવસ ખૂબ જ અશુભ છે. તમારા જીવને આજે જેખમ છે. મનમાં ધીરજ રાખો અને ખૂબ સાવધાનીથી વર્તજો.’ ડેગળેએ આમ વિચિત્ર વાત કરતાં બાપુસાહેબનું ચિત્ત ખૂબ અસ્વસ્થ થયું અને તેઓ તે બાબતની ચિંતા કરવા લાગ્યા. દિવસ પસાર થાય નહીં. પછી રોજના સમયે સૌ મસ્જિદ તરફ જવા નીકલ્યા અને બાપુસાહેબ નાના ડેગળેની જેઠે બાબા પાસે જઈને બેઠા. બાબાએ તરત જ બુટીને પૂછ્યું, ‘આ નાના શું કહે છે ? શું એ તને મારવા ધારે છે? આપણે વળી શાની બીક ? માર માર કેવો મારે છે, એ જેઓ તો ખરો !’ આવો ખુશાલ જવાબ તેને આપ.’ આવું બાબા બોલ્યા, તેની સાથે જ શું ચમત્કાર થયો તે સાંભળો. સાંજના સમયે બાપુસાહેબ શૌચવિધિ માટે ગયા હતા, તે દરમિયાન સંડાસમાં એક મોટો સાપ ઘસ્યો. એ બયંકર સંકટ જેઠેને બાપુસાહેબ બહાર દોડી આવ્યા. એમના લહાનું નામના નોકરે વિચાર કર્યો કે પેલા સાપને પથ્થરથી ઢીચીને મારી નાખું. માટે એ પથ્થર ઉચ્કીને જતો હતો. એટલામાં બાપુસાહેબ એને તેમ કરવા માટે ના કલી અને બોલ્યા, ‘જ લાકડી લઈ આવ, આવા કામમાં ઉતાવળ કામની નહીં.’ નોકર લાકડી લેવા ગયો હશે અને સાપ બીત્ત ઉપર ધીમી ગતિએ ચઢવા માંડયો. ચઢવામાં એનું સંતુલન જતાં એકાએક તે નીચે જમીન ઉપર પડ્યો અને વાંકો ચૂકો સરકતો કાણામાંથી તે બહાર નીકળી ગયો. એવી રીતે તે સાપ ત્યાંથી ચૂપચાપ સરકી ગયો કે, તેને મારી નાખવાનું કોઈ કારણ જ ન રહ્યું. બુટીસાહેબને બાબાના શબ્દોની યાદ આવી. અને એની સાથે જ તેમનું મન ભરાઈ આવ્યું.’ (ઓ. ૮૩-૧૦૩)

આવો સાઈબાબાનો મોજુલો સહવાસ જે ભક્તોએ આંખોથી જેયેલો, તેવા ભક્તોને માટે આવી જૂની વાતો પોતાની યાદમાંથી કાઢી નાખવી ક્યારેય શક્ય નથી. આવા અનેક પ્રકારે જત જતના અનુભવો બતાવીને ભક્તોનાં મન બાબાએ જીતી લીધા હતા. જેનું વર્ણન કરવા માટે આ કાગળ પુરતો નથી. કેમ કે તેનું વર્ણન ક્યારેય ઝ્ટે તેમ નથી. તેમ છતાં આવી જ બીજ એક વાત ચાવીમાં રાતના બીજ પ્રહેર એટલે કે સુમારે એક વાગ્યાની આસપાસ બાબાની સામે બની તે હવે સાંભળો. કોપરાંંવ તાલુકાનું કેરાળે ગામ જેમને વારસાગત બક્ષિસમાં મળેલું અને જે પોતાનું વતન હતું એવા ભક્તનું નામ અમીર શક્કર હતું. તેમનો સાઈચરણમાં અપૂર્વ ભક્તિભાવ હતો. જતના તે ખાટકી હતા. પણ ધંધો ફક્ત દલાલીનો કરતા. મુંબઈ પાસે વાંદરા કતલખાનામાં તેમનું સારું એવું વર્ચસ્વ હતું. તેમની બોલબાલા હતી. તેમને એક વખત અચાનક ખૂબ જ દુઃખાવો ઉપડ્યો અને આ દુઃખાવથી તેઓ અતિશાય અરાકત થઈ ગયા. સંકટ આવી પડે એટલે માણસને ઈશ્વરની યાદ આવે છે. અમીર શક્કરે ધંધાની ઊઠબેઠ અને દોડાદોડી બાજુ પર મૂકી. ત્યાં લેવાડ દેવહની બધી જ વ્યવસ્થા પતાવી અને શિરડીની વાટ પકડી. મહાભારતમાં પાંચ પાંડવોની માતા કુંતી ભલેને અજ્ઞાતવાસમાં અને વનમાં અનેક સંકટોથી ત્રાસી ગયેલી હતી છતાં તે ઈશ્વર પાસે સંકટોની જ માંગણી કરતી હતી. તેણે ભગવાનને કહ્યું હતું કે, ‘હે પ્રભુ ! પરમેશ્વર જે કોઈ માંગે તે બધાને સુખ સરગવડ અને ચેન આપ. પણ મને કાયમને માટે દુઃખમાં જ રાખજે જેથી હું કદાપિ તને ભૂલી ન શકું. બસ મારું આટલું જ માગવું છે. મને જે આપણું જ હોય તો બસ આટલું જ આપણે જેથી તમારા નામનો મારા કંઠમાં કાયમનો એક અલંકાર મારી પાસે રહેશે.’ આ વાત શ્રીમહૃભાગવતપુરાણ સ્કર્ષ જ અધ્યાય ૮ શ્લોક ૨૫માં આ રીતે કહે છે. વિપદ: સન્તુન: શચ્ચતત્ત્ર તત્ત્ર જગદ્ગુરો ! ભવતિ દર્શનં યત્સ્યાદ્ધપુનર્ભવદ્ધર્શનમ् ॥૨૮॥ હે જગતના ગુરુ ! અમારા આયુષ્માં પગલે પગલે સહાય સંકટો આવતાં રહે છે. અને સંકટોમાં જ આપનાં દર્શન મળે છે. આપનાં દર્શન મજ્યાં એટલે જન્મ અને મૃત્યુના ફેરામાં ફરીથી પડવું પડતું નથી. આપણે શ્રોતાઓ અને વક્તાઓ પણ રાત અને દિવસ શ્રી સાઈ પાસે આ જ માંગીએ કે, બાબા ! ‘તારા નામને વિસરવા દેતો નહીં. અને અમને કાયમ તારાં ચરણોમાં જ આ જગ્યા આપણે. તુડરામ મહારાજ પણ એ જ કહેતા હતા, ‘હે દેવા આ જ દાન આપજે ! કે તું કદાપિ ભૂલાય નહીં.’ (ઓ. ૧૦૪-૧૧૩)

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

અમીર શક્કરે બાબાને નમન કર્યું. વિવિધુક્ત બાબાના હથને ચુંબન કર્યું અને પોતાના રોગ વિષેનું સવિસ્તાર નિવેદન કરીને એ દુઃખાવામાંથી છોડાવવા માટે નમ્ર વિનંતી કરી. પછી પોતાને જે સંધિવાતાતો રોગ શરીરમાં થયો હોવાથી તેનો ઉપાય બાબાને પૂછ્યો. તે સાંભળીને બાબાએ જબાવ આપ્યો કે, ‘ચાવડીમાં જઈને સ્વસ્થ થઈને બેસ’ જે ચાવડીમાં બાબા એક દિવસના આંતરે નિયમિતપણે સુવા માટે જતા હતા. તે જ જગ્યા અમીર શક્કર માટે રહેવાની નક્કી કરી. અમીર સંધિવાતથી સખત પીડાતા હતા. ગામમાં બીજે કયાંય પણ સુખેથી તેઓ રહી શક્યા હોત. પોતાના ગામ કોરણા જઈને પડ્યા હોત તો તેમને વધારે ગમ્યું હોત. ચાવડી તો મલિકંબર નામનો ઈ.સ. ૧૬૬૦ના સુમારે જમીન મહેસૂલના સુધારા કરવા માટે પ્રસિદ્ધ પામેલો નિઝામશાહીનો એક વૃદ્ધ અનુભવી અધિકારી હતો, તે સમયની પ્રાચીન જગ્યા હતી. ઉપર નીચેથી તૂટેલી ફૂટેલી બિસ્માર હાલતમાં જીર્ણ હતી. કાંચીડા, ગરોળી, વીછી અને જેરી સાપ ત્યાં મન ફાલે તે રીતે વર્તતા હતા. તેમાં પાછા મહારોગીઓ અને રક્તપીતિયાઓ અને ફૂતરાં ત્યાં એકું ખાઈને બેસી રહેતાં. અમીર ખૂબ જ કંટાય્યા. પણ બાબાની સામે કંઈ પણ બોલાય તેમ ન હતું. ચાવડીના પાછળના ભાગે ધૂંટણ સુધીના કચરાના ઢગલા પડ્યા રહેતા. ભીતોમાં પણ સત્તરસોને સાઠ છીદ્રો પડ્યા હતા. ફૂતરુંયે ત્યાં બેસવા જતું નહીં. જાણે કે આયુષ્યની એક વગર ફોગટની યાતના જ હતી. ઉપરથી વરસાદ, નીચે ભીનું. ખાબડ ખૂબડવાળી જગ્યા અને પવનનું અને ઢાનીનું પુષ્કળ જેર તેમાં રહેતું. અમીરના મનમાં ખૂબ જ ચિંતા પેઢી. શરીરના સાંઘીઓ તો રહી ગયા હતા. તથા પવન અને વરસાદવાળી જગ્યા હતી તેમજ ત્યાં પુષ્કળ બેજ પણ હતો. પણ બાબાના શબ્દો એ જ ઓસડ હતું. પવન વરસાદ અથવા બેજ હોય કે જગ્યાં જગ્યા ઊંચી નીચી કે ખાડા ઘૈયાવાળી હોય તેનો વિચાર જ ન કરાય. કારણ કે, બાબાના શબ્દો નિશ્ચિત ફળ આપનારા હતા. એવો અમીરનો વિશ્વાસ હતો. માટે એ જગ્યા ઉપર રોગમાં સુધારો થશે કે નહીં એવી શંકા ભલેને હતી, છતાં ત્યાં સાઈબાબાના સહિતાસનો મહાન લાભ મળનાર હતો. એ માટે તેમનું વચન એ જ સુખનું ઓસડ માનીને અમીર ત્યાં ચાવડીમાં રહ્યો. ચાવડીનાં પગથિયાં ચઢીને જતાં સામે જ મધ્યભાગમાં બિછાનું પાથરીને તે અમીર શક્કર લગભગ નવ મહિના રહ્યો. સંધિવાનો રોગ શરીરમાં પૂરેપૂરો ઉતરી ગયો હતો. બહારથી બીજી રીતે જેતાં બધા ઉપચારો તદ્દન વિપરિત હતા. પણ અમીરના મનમાં વિશ્વાસ હતો માટે બધું યથાસ્થિતિ ચાલ્યા કર્યું. બાબાએ અમીરને નવ મહિના સુધી ત્યાં જ રહેવું એવું નક્કી કર્યું હતું. અને મસ્નિજદમાં દર્શન માટે આવવાની પણ મનાઈ કરી હતી. પણ તે ચાવડીનું સ્થાન એવું નક્કી કરી આપ્યું હતું કે તેને બાબાના દર્શન આપોઆપ પ્રયત્ન સિવાય થતાં હતાં. તે પણ સવારે અને સાંજે સવારે ભીક્ષા માટે જતાં અને સાંજના ફેરી માટે નીકળતી વખતે અને તે સિવાય પણ એક દિવસના આંતરે બાબા ચાવડીમાં જતા હતા અને ત્યાં જ પૂજન આરતી થયા પછી સૂઈ જતા હતા. બીજે દિવસે તે વહેલી સવારે કાકડ આરતી થયા બાદ મસ્નિજદમાં પાછા ફરતા હતા. રોજ સવારે ભિક્ષા માંગવા જતી વખતે બાબા ચાવડી તરફ થઈને જ જતા. એ હિસાબે અમીરને તેમના જતાં આવતા બાબાનાં દર્શન પોતાની જગ્યા ન છોડતાં પણ થતાં હતાં. રોજ સાંજે ચાવડી સામે ઊભા રહી ને બાબા પહેલી આંગળી અને માથું હલાવીને આકાશ તરફ દિશાઓનું અભિવાહન કરતા અને તેમાં જ ખોલાઈ જતા. ત્યાંથી પાછા તે સમાધિ મંહિરના ખૂણા સુધી જતા. અને ફેરી પાછા ત્યાંથી મસ્નિજદ તરફ ભક્તોની સાથે આવતા. ચાવડીનો બાબાનો એક દિવસ આંતરેનો મુકામ અને અમીર એ બંને વચ્ચે એક પાઠિયાનો દરવાજે ફક્ત નામનો જ હતો, તે એક આડ પડ્યા જેવો રહેતો. બાબાને અને અમીરને ગાંધીં મારવાની ટેવ હતી. પૂજન આરતી પત્યા બાદ ભક્તજનો પોતપોતાના ધરે જતા. તે પછી આ બંને જ જગ્યા સ્વસ્થ મને એક બીજાની જેઠે વાતો કરતા બેસી રહેતા. અમીર શક્કરને ચાવડીમાંનો મુકામ ભલે બહારથી એક જેલના ડેઢી જેવો હતો. પણ અંદરખાને સાઈબાબાનો ખૂબ જ નજીકનો સહિતાસ અમીરને મળતો હતો. જે બોગવવાનું બીજાનો માટે ખૂબ જ મુશ્કેલ હતું. આ બધું જ હોવા છતાં અમીર એક જ જગ્યા ઉપર રહીને કંટાય્યો. એને

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

તો ચાવડીનો નિવાસ કારાવાસ લાગવા માંડ્યો. તે અન્ય કોઈક ગામે જઈને રહેવું એમ બોલવા લાગ્યો. જેના મનને સ્વતંત્રતાની હોંશ હોય તેને પરતંત્રતા કયાંથી ગમે ? આ કેદખાનું જ હવે બસ, એમ અમીરને લાગતાં તે બાબાની આજા લીધા વીના, આ નિશ્ચિત સ્થાન છોડીને કોપરગાંવ ગયો અને ત્યાં એક ધર્મશાળામાં જઈને ઉત્તર્યા. ત્યાં પછી કયો ચમત્કાર બન્યો તે હવે જુઓ. (ઓ. ૧૧૪-૧૩૮)

મરવા માટે જીવતો હોય એવો એક ફૂલી ત્યાં તરસથી આકુળ વ્યાકુળ થયો હતો. આ ફૂલી અમીર પાસે એક ઘૂંઠડો પાણી માંગ્યું. અમીરને હ્યા આવતાં તે ફૂલીને પાણી પીવડાવવા માટે ગયો. ફૂલી પાણી જતાં જ તેનું શરીર ઠંડુ પડ્યું અને તે ફૂલીનું અવસાન થયું. આસપાસ કોઈ નહીં અને રાતનો વખત, અમીર ખૂબ ગભરાયો. ‘વહેલી સવારે જ્યુરી ભરાશે, અને આ અકુસ્માતથી થયેલા મૃત્યુને કારણે ધરપકડ થશે. તેમજ સરકાર તપાસ કરાવશે, કે આ ફૂલી પોતાના મોતે મર્યાદ છે કે કોઈએ અને મારી નાખ્યો છે ? હકીકતમાં તે જતે જ મરણ પામેત છે, પણ એ સત્ય બનેલી વાત હોવા છતાં તે વાતનો મારી ઉપર કોણ વિશ્વાસ કરશે ? ન્યાય કરવાની બાબતમાં સાક્ષી અને પુરાવા ઉપર જ બધો આધાર હોય છે અને તે મુજબ જ નિકાલ થાય છે. મેં જ ફૂલીને છેલ્લે પાણી પાયું અને ત્યાર બાદ જ તેના પ્રાણ ગયા. તે સાચી બનેલી વાત જે હું કહું તો, પોતીસના હાથમાં તો હું જ અવશ્ય ફસાવાનો. મારો જ પહેલો સંબંધ આવેલો જેઠિને મને જ પહેલો પકડવાના. પછી છેવેટે મરણાનું ખરું કારણ નક્કી થતાં જ મારો નિર્દોષ છુટકારો થવાનો. પણ આ નક્કી થાય એ વચ્ચેનો સમય મારા માટે અસહ્ય થઈ જવાનો અને મારા ભૂંડા હાલ થવાના એ નક્કી. આ વાત અમીરના મનમાં ઠસી ગઈ. માટે જે રસ્તે આવેલો એ જ રસ્તે પાછો ઝટપટ નીકળી જવાનો વિચાર અમીરિ કર્યો. તે પ્રમાણે રાતોરાત કોઈની પણ નજરે ન આવતાં અમીર ત્યાંથી ભાગ્યો. આગળ જતો જય અને પાછળ ગભરાઈને જેતો જય. આમ અસ્વસ્થ મને અને બીજનો માર્યાદ કયારે ચાવડી આવે અને તે સિવાય મનને શાંતિ નહીં મળે. તેવા સંશય સાથે એ શિરડી તરફ ચાલી નીકલ્યો. મનમાં કહેવા લાગ્યો, ‘બાબા ! તમે આ શું કર્યું ? મને કયાં સંકટમાં તમે ફસાવ્યો ? પાપ માથે પડ્યું ? મારા જ કર્મ મારે ભોગવવાનું આવ્યું એ અમીરને સંપૂર્ણપણે મનમાં સમજાયું. સુખની આશામાં ચાવડી છોડી માટે આ શિક્ષા ભોગવાવનો વારો આવ્યો. હવે કંઈ પણ કરીને બાબા ! આ સંકટમાંથી ઉગારો અને શિરડી ભેગો કરો.’ આ પ્રકારે અમીરિ તરત જ તૈયારી કરી અને તે જ રાતે પેલા શબ્દને એમને એમ જ ધર્મશાળામાં છોડીને એ રાતોરાત શિરડી તરફ ભાગ્યો. રસ્તામાં ‘બાબા.... બાબા’ બોલતો અને ‘ક્ષમા કરો’ એવી કરુણામય દશામાં તે જ્યારે ચાવડીમાં આવ્યો ત્યારે તેના જીવમાં જીવ આવ્યો. એ જ વખતે અમીરને એક પાઠ શિખવાનો મળ્યો અને તે દિવસથી અમીરે પોતાની ભૂલ સુધારી લીધી. તેણે પોતાના કાન પકડ્યા. ત્યાર બાદ તે ખરાબ રસ્તા છોડીને સારા માર્ગ ઉપર બાબાના ઉપદેશ પ્રમાણે વર્તવા લાગ્યો. તેની બાબા ઉપરની અપાર શ્રદ્ધાને કારણે તેને ખાસ્સો ફરક પડ્યો. સંધિવાતમાંથી છુટકારો મળ્યો અને આગળ બીજે એક પ્રસંગ બન્યો તે હવે સાંભળો. (ઓ. ૧૩૮-૧૪૮)

ચાવડીમાં આમ તો ત્રણ ઓરડા હતા. અગ્રિ ખૂણામાં બાબાનું સ્થાન હતું. ચારે બાજુએથી લાકડાનાં પાઠિયાંની આદશ ઊભી કરવામાં આવી હતી. અને ત્યાં બાબા સૂતા હતા. આખી રાત દીવા પ્રજ્વલિત રહેતા. બાબા હંમેશા અજવાળામાં જ સૂતા હતા. ફૂલીર, વૈરાગીઓ અને ભિખારી હંમેશા અંધારામાં બહાર બેસતા. અમીર જાણે કે એમાંનો જ હતો. આજુબાજુમાં કેટલાયે લોક રહેતા હતા, તેઓ પણ ત્યાં જ આડા પડતા અથવા સૂઈ જતા. ત્યાં જ બાબાની પાછલી બાજુએ સરસામાન મૂકવા માટેના વિભાગમાં બાબાના શ્રેષ્ઠ અને વિરકતભક્ત અબ્દુલ સેવા કરવા માટે તત્પર બેસતા. આબા જ એક પ્રસંગે અડવી રાતે બાબા બૂમાબૂમ કરવા લાગ્યા અને અબ્દુલને આંદંદ કરીને કહેવા લાગ્યા કે, ‘મારા બિછાના પાસે જેને ભૂત આવીને બેસેલ છે.’ બાબા એક સરખી બૂમો પાડવા લાગ્યા. ત્યાં તરત જ અબ્દુલ હાથમાં

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

દીવાબતી લઈને આવ્યા. તેમને, ‘ભાબાએ એકદમ જોશથી કહ્યું, ‘હમણાં તો તે અહીં હતું.’ અખ્ટુલે બધી બાજુ જેયું અને કહ્યું અહીં કશું જ દેખાતું નથી. તે સાંભળીને ભાબા ફરી બોલ્યા, ‘આંખો ખુલ્લી રાખીને બધી જ જગ્યાએ વ્યવસ્થિત જેને ?’ અખ્ટુલ ફરીફરીને ફરીથી જેવા લાગ્યા. બહાર સૂતેલા બધા જ જણી ગયા અને આમ તેમ જેવા લાગ્યા. અમીર પણ જેવા લાગ્યો. આજે પાછી અભ્યાસ રાતે શી ગરબડ અને ઉપરાઉપરી દંડુકાના પ્રહારો શા માટે થઈ રહ્યા હશે ? ભાબાની આ તીલા જેઠીને અમીર તરત જ મનમાં સમજ્યો કે કદાચ સાપ અંદર ધૂસ્યો હોય તેની જાણ ભાબાને થઈ હોય. તેમને ભાબાનો પુષ્કળ અનુભવ હતો. અને ભાબા પણ તેમના સ્વભાવને ઓળખતા હતા. ભાબાના સ્વભાવને તેઓ પણ ઓળખતા હતા. તેણે બધું જ સમજ લીધું. ભક્તોના ઓશિકા પાસે જ્યારે કોઈ ભય હોય ત્યારે તે પોતાની પાસે એવું થઈ રહ્યું છે તેવું જ જણાવી ભાબાની આ પ્રકારની ભાષાની અમીરને ખખર હતી. તેની ઉપરથી અમીરે અનુમાન કર્યું કે કોઈ ભક્તને કોઈ પણ પ્રકારનો ભય હોવો જેઠાએ. એટલામાં તેમના પોતાના ઓશિકા તરફ કોઈ વિચિત્ર પ્રકારનો સણવળાટ થતો જેયો. તરત જ તેમણે બૂમ મારી, ‘અખ્ટુલ, જલ્લી બતી લાવ’ અખ્ટુલ બતી ઘરમાં લઈને આવ્યા તો વીઠો વાળીને પડેલો સાપ નજરે પડ્યો. બતીના પ્રકારશમાં એ સાપ ચમક્યો અને ફેણ નીચી કરી લીધી. ત્યાં બેગા થયેલા લોકોએ તેને ત્યાંને ત્યાં જ ઢાર કર્યો અને ભાબાનો ખૂબ ઉપકાર માની કહેવા લાગ્યા કે, ‘શું ભાબાની આ વિચિત્ર પદ્ધતિ કેવી એમની ભક્તોના જેખમની ચિંતા ! કયું ભૂત અને કદ્ય પેલી દીવાની બતી. સમય સૂચકતા વાપરીને ભક્તોને સંકટોમાંથી બચાવવાની આ એક યુક્તિ હતી. આવી અનેક સર્પોની વર્તા ભાબાના ચરિત્રમાં વર્ણન કરી શકાય એમ છે. પણ ગ્રંથનો વિસ્તાર ખૂબ જ વધી જય માટે અહીંયાં થોડામાં જ એને પતાવી દઈએ. (ઓ. ૧૫૫-૧૭૧)

‘સર્પ વીંછું નારાયણ’ એટલે કે સાપ અને વીંછું એ નારાયણ સ્વરૂપ હોય છે આ તુકારામ મહારાજનાં વચ્ચેનો છે. ‘પરી તે વંદાચે દુરુન, શિયો નયે’ પરંતુ તેમને દૂરથી જ નામસ્કાર કરવા, પાસે જઈને હાથ લગાડવો નહીં આ પણ તેમના જ બોલ છે. તેવી રીતે તેમને તે ‘અધર્મ’ કહે છે તેમની સાથે ‘પૈન્નરીચે કામ’ એટલે કે તેમની સાથે જેહાથી જ વ્યવહાર કરવો જેઠાએ એવું પણ તેઓ કહે છે. આને લીધે સર્પ અને વીંછી સાથે કેવી રીતે વર્તન રાખવું તેનો નિશ્ચિત નિયમ સમજ્યતો નથી. જેવો જેનો સ્વભાવ, ધર્મ હોય અને જેવો ઈશ્વરીય યોગ હોય તે પ્રમાણે તેને કર્મ કરવાની બુદ્ધિ સૂજતી હોય છે, એ જ આનો સાર છે. આ શાંકાનું ભાબા પાસે એક જ સમાધાન હતું. જીવ માત્ર સર્વસમાન હોય છે. બધાની સાથે દરેક પ્રકારે એટલે અહિંસાથી વર્તવું અને કાયા, વાચા અને મનથી હાનિ અથવા તો ઠંજી કરવી નહીં કરું: ખ દેવું નહીં. એજ સર્વમાન્ય નિયમ છે. વીંછી શું કે સાપ શું ! ઈશ્વર જ બધાનો અધિષ્ઠાતા છે. એની ઈચ્છા સિવાય તેઓ કોઈને પણ ઠંજી કરી શકે ખરાં કે ? આ આખું વિશ્વ ઈશ્વરને આધિન અને તેની સત્તા નીચે આવેલું છે. અહીં કોઈ સ્વતંત્ર નથી, એવું ભાબાના અનુભવથી પ્રાપ્ત થયેલું જ્ઞાન છે. છતાં આપણું ફાલતું અભિમાન ધૂટતું નથી. એક વીંછી તળાવમાં પડતાં નીચે પાણીમાં દુખતાં તરફાવ લાગ્યો, ત્યારે એક માણસ આનંદથી તાજી પાડીને બોલ્યો, ‘સારું થયું તું લોકોને આવું જ દુઃખ આપે છે ને !’ બીજે માણસ આ તાજીનો અવાજ સાંભળી તે તળાવ પાસે દોડતો દોડતો આવ્યો, પેલા વીંછીને પાણીમાં નીચે ગુંગળાટો અને મરતો જેયો અને તેનું મન પીગળી ગયું. તેણે ધીરથી પાસે જઈને પેલાને ચચ્ચીમાં પકડી લીધો, તો એ વીંછીએ પોતાના મૂળ જ્ઞાતિસ્વભાવ અનુસાર પલ્લી મારીને આ બચાવનારાને જ આંગળી ઉપર ઉંખ માર્યો. અહીંયાં અમારું જ્ઞાન શું કામનું ? અમે તો બધી જ રીતે પરાધીન છીએ. બુદ્ધિ આપનારો નારાયણ છે. એ જેવું નક્કી કરે છે તેવું જ બનતું રહે છે. (ઓ. ૧૭૨-૧૮૧)

અનેક લોકોના જુદાજુદા અનુભવો છે. હું મારો અનુભવ કહી રહ્યો છું. સાઈભાબાનાં વચ્ચોમાં વિશ્વાસ રાખીને તેનો આદર અને તેનું ગૌરવ કરવું જેઠાએ, કારણ કે તેનો પ્રતાપ કેવળ નિષ્ઠાથી જ જણવા મળે છે. કાકાસાહેબ

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

દીક્ષિત જેમ દિવસે માત્ર નાથ ભાગવત વાંચતા હતા. તેવી જ રીતે તેઓ રાતના ભાવાર્થ રામાયણ વાંચતા હતા. એકાધ વખત ઈશ્વર ઉપર ફૂલ ચઢાવવાનાં બાકી રહી જાય, સનાન કરવાનું રહી જાય કે રોજના બીજા નિયમો ચૂકી જવાય પણ કાકાસાહેબ ગ્રંથોનું વાંચન કરી ચૂકતા નહીં. એકનાથ મહારાજના આ બંને ગ્રંથો પરમાર્થ સાધવા માટે સારપૂર્ણ હોવાને કારણે દીક્ષિત માટે તે સાઈબાબાની કૃપાથી પોતાનો ઉદ્ઘાર કરવા માટે જ મળ્યા હતા. આ અનુપમ માધુર્ય ધરાવતો ગ્રંથ આત્મજ્ઞાન, વૈરાગ્ય, રીતિ અને નીતિ આ ચારે ગુણોથી જ્યોતિનો સ્વરૂપી પ્રકાશ અખંડ ચમકતો હતો. તેમાંનો ઉપદેશકૃપી અમૃતનો પ્યાલો, જેના હેઠળ લાગ્યો તેના સંસારના ત્રણ પ્રકારનાં દુઃખો નાશ થતાં મોક્ષ તેમના પગમાં આળોટતો આવવાનો જ એમ સમજવું. સાઈકૃપાથી દીક્ષિતને કથા સંભળવવા માટે શ્રોતા મેળવવાનો સમય આવ્યો અને ભાગવત સાંભળવાનો મને યોગ સાંપડ્યો. જેને લીધે મારી ઉપર તેમના અનંત ઉપકાર થયા. તે પવિત્ર કથા સાંભળવા માટે હું દિવસ અને રાત જવા લાગ્યો. આ વાંચન સારા એવા દિવસ ચાલનારું હોવાને કારણે અને કાન પવિત્ર કરનારું હોવાથી મને પોથી સાંભળવા માટેનો લાભ મારા સદ્ગનસિબે સાંપડ્યો હતો. એવી એક રાતે તે પરમ પવિત્ર કથા ચાલી રહી હતી. તે સમયે એક વિચિત્ર અને વિષય બલનારી વાત બની. શ્રોતાઓએ તે હકીકત સાંભળવી. હું તો શું કરું? એક વાત કહેવા જતાં જ વચ્ચે બીજી વાત યાદ આવે છે અને તે ન સંભળવવા તેનો અનાદર કેવી રીતે કરું? (ઓ. ૧૮૨-૧૯૧)

રામાયણમાંથી એક રસાળ અને સુંદર કથા ચાલતી હતી. હનુમાનને પોતાની માતા અંજલિએ રામ અંગે કહેલી વાતો ભલે સમજાઈ પણ સ્વામીની એટલે કે રામચંદ્ર પ્રભુની શક્તિની તેઓ જાતે પરીક્ષા લેવા ગયાં. અને તેમાં જ મોટો અનર્થ સર્જયો. રામનાં બાળનાં પીછાંનો ફક્ત પબન લાગતાં હનુમાન આકાશમાં ગોળગોળ ફરવા લાગ્યા. તેમના પ્રાણ આકુળ વ્યાકુળ થઈ ગયા. તે સમયે ત્યાં તેમના પિતા વાયુ દેવતા આવી પહોંચ્યા અને તેમનો હિતોપદેશ સાંભળીને હનુમંત રામના શરણે ગયા. આ ભાવાર્થ રામાયણ કિર્કિદાકંડ અ. ૧ ઓ. ૪૮-૪૯માં કરી છે. આ ભાગની કથા ચાલતી હતી. તેવામાં જે કંઈ વિચિત્રતા થઈ તે સાંભળો. બધા શ્રોતાઓનું ચિત્ત કથા સાંભળવામાં તલ્લિન હતું અને તેના શ્રવણના આનંદમાં તેઓ મગ્ન હતા. એટલામાં એક જીવંત વીઠીનું વિદ્ધાન આવી પડ્યું. તેને વળી આ કથા સાંભળવાની ઈચ્છા કેમ કરીને ઉત્પન્ન થઈ કોને ખખર કે તે ન જાણતાં મારા ખખા ઉપર ફુફીને ગુપ્તપણે લપાઇને કથાસારની મીઠાસ ચાખતો હતો. અહીંયાં પણ બાબાની પ્રતીતિ થઈ. મારું ધ્યાન એ વીઠી તરફ સહેજ પણ નહતું. પણ જે શ્રી હરિની કથા સાંભળવામાં મશશુલ હોય તેનું રક્ષણ હરિ જાતે જ કરે છે. જયારે મારી નજીર પહેલાં પડી ત્યારે એ વીઠી જમણા ખખા ઉપરના વર્સમાં સ્વસ્થતાથી બેઠેલો હતો. હલન ચલન જરા પણ નહીં. શાંત ચિત્ત ધ્યાન દઈને પોથી સાંભળવા માટે અન્ય શ્રોતાઓની જેમ જણે કે તે પોતાની જગ્યા ઉપર જ બેઠો હતો. જલ્લિના સ્વભાવ પ્રમાણે વગર કારણની થોડી પણ મને તકલીફ આપ્યા વીના મને સ્વસ્થ બેસવા દીધો એટલું ધારું જ સારુ રહ્યું. નહિતર તેણે જો જાત બતાવી હોત તો રામકથામાં જે રંગ આવ્યો હતો અને શ્રોતા અને વક્તા જે પોથી સાંભળવામાં મગ્ન હતા એ સર્વનો રસ ભંગ થયો હોત. આવી આ દુષ્ટ સંગત મને મળી હતી. રામકથાનો મહિમા એ જ છે કે ત્યાં વિદ્ધનોનો પ્રભાવ ચાલતો નથી. વિદ્ધનોનો પોતાનો સ્વાભાવિક ધર્મ છીડીને ભૂલી જઈને શાંત થવું પડે છે. રામકૃપાથી મને બુદ્ધિ સુઝી કે આ ઉપાધિને દૂર ફેરી દેવી. ડેઠ અંત સુધી આ ચંચળ બુદ્ધિના પ્રાણી પર વિશ્વાસ મૂકવો યોગ્ય નથી. પણ જે પહેલેલું ઉપવશ્ચ હતું તેથી ખૂબ વિચાર કરીને તથા હરિ ઉપર ભરોસો રાખી મેં ઉપવશ્ચને ધીમેથી બંને બાજુએથી લેગું કર્યું અને તેમાં તે વીઠીને મજબૂત વીટાળી લીધો. અને ઉપવશ્ચ ભાગમાં જઈને ખંખેરી નાખ્યું. વીઠી જત જ ભયંકર અને તે દબાય અને જો તેને ફાવટ આવે તો તેને તેની જત પર જતા વાર નહિ લાગે એનો ઊર હતો. પરંતુ બાબાની આજા પાકી હતી. માટે તેને મારી નાખવા માટે હાથ પણ આગળ જતો ન હતો.

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

અહીંયાં શ્રોતાઓને સહેજ શંકા થવાની કે પ્રાણધાતક વીઠી ધાર મારવો યોગ્ય નથી કે ? ઉંખ માર્યાં બાદ એ કયું સુખ આપે છે ? તેને મારવો કે નહીં તે સમજતું નથી. સાપ, વીઠી અને અન્ય ઝેરી પ્રાણીઓ તરફ કોઈ પણ કયારેખ દુર્લક્ષ કરતું નથી. પછી બાબા તેમને શા માટે છોડી દેવાનું કહે છે ? શ્રોતાઓના મનની આ શંકા ખરી છે. મારા મનમાં પણ એ જ શંકા હતી. પણ પહેલાંના એક પ્રસંગ ઉપરની શ્રી બાબાની આ વાણી સાંભળો. (ઓ. ૧૮૨-૨૦૮)

પ્રશ્ન આના કરતાં પણ અધરો હતો. શિરડીમાં કાકાસાહેબ દીક્ષિતના વાડામાં મેડા ઉપરની બારી પાસે એક ભયંકર સાપે દેખા દીધી. તેણે આ બારીની બારસાખ નીચેના કાણામાંથી અંદર ઓરડામાં પ્રવેશ કર્યો અને દીવાના પ્રકાશમાં તેની આંખો અંજલિ ગઈ અને તે વીટળાઈને બેસી ગયો. દીવાના પ્રકાશમાં ભલે તે સાવધ થયો. ઇતાં મનુષ્યના ચાલવાના અવાજથી તે ગભરાયો. તેમજ ગહેર થતાં જ તે છંછેડાયો અને કાણાભર નિરાંતે બેસી રહ્યો. ના એ આગળ જથ્ય કે ના એ પાછળ ખ્રસે અને તેણે ફેણા હુલાવવાની શડ કરી. ત્યાં એક જ પ્રશ્ન થયો કે એને મારી નાંખવો કેવી રીતે ? કોઈ લાંબો ઢંડો તો કોઈ લાકડી લઈ જલ્દી જલ્દીથી ત્યાં આવ્યા. પણ એ જગ્યા ખૂબ જ અદ્યાણવાળી હોવાને કારણે તેઓ ખૂબ ત્રાસી ગયા. એકાદ વખત જે એ સરકતો સામો આવ્યો હોત અથવા તો જીતિ નીચે ઉતરી ગયો હોત, તો એ સીધો મારી વાળેલી પથારી પાસે જ પહેંચ્યો હોત, અને મને સંકટમાં નાંખ્યો હોત. લાગ જેઠિને એના નાજુક ભાગ ઉપર ફટકો માર્યો હોત પણ જે ન વાગે અને ચૂકી જવાત તો તેણે મારી ઉપર દ્રેષ્ભાવ કાઢ્યો હોત. પછી બતી લાવીને એનું ડેકાણું શોધતાં એ સાપને બહાર સરકી જવાની જગ્યા મળી ગઈ. તેની મરણની વેળા આવી ન હતી. અમારા બધાનું પણ દૈવીભળ સબળ હતું. એવી એ અશુભ સંકટની પણો હતી. તેમાં પણ બાબાએ અમારું રક્ષણ કર્યું. આવેલા રસ્તે એ સાપ પાછો બહાર સરકી ગયો. પોતે બયમુક્ત થયો અને અમને પણ બયમુક્ત કર્યા. તથા બંને પોતપોતાની રીતે સુખી થયા. પછી મુક્તારામ ઉઠ્યો અને બોલ્યો, ‘સારું થયું, છૂટ્યો બિચારો ! જે એ કાણામાંથી સરકી ન ગયો હોત તો માર્યો જત.’ મુક્તારામની આવી દ્વારાદિનો વિચાર જેઠિને હું બેચેન થઈ ગયો. ‘દુષ્ટ પ્રાણીઓની બાબતમાં આવી દ્વારા શા કામની ? આવી રીતે આ જગતનો કારભાર કેવી રીતે ચાલશે ? મુક્તારામ કોઈવાર જ આવે છે પણ, અમે તો ત્યાં સવાર સાંજ બેસતા. તેમાં પણ મારી વાળેલી પથારી તો બિલકુલ બારીની પાસે જ હોય છે.’ મને મુક્તારામનું કહેવું ગમ્યું નહીં. આરંભની બાજુની રજૂઆત તેણે કરી, અને તેની વિરુદ્ધ જવાબ આપવાની બાજુ મેં ઉઠાવી લીધી. વાદ વિવાદ ખૂબ જ લાંબો ચાલ્યો પણ નિર્ણય તેમનો એમ જ રહ્યો. એકે કહું સાપને મારવા માટે એક કાણનો પણ વિલંબ કામનો નહીં. તો બીજે બોલ્યો કે નિરપરાધી જીવો જેઠે આવો તે દ્રેષ્ભાવ શા માટે રાખવો ? એકે મુક્તારામનો વિક્કાર કર્યો, અને એકે મારા ભતનો પુરસ્કાર કર્યો. આ પ્રકારે વાદવિવાદ જેરથી જામ્યો. પણ એનો કોઈ અંત આવ્યો નહીં. પછી મુક્તારામ નીચે ગયા અને મારી જગ્યા બધલી નાખી. એ કાણામાં મેં એક ગોઢીનો દૂચો મારી દીધો. અને સૂવા માટે હું મારી વીટાળેલી પથારી છોડીને ઝોકા ખાવા લાગ્યો. અન્ય સૌ પોતપોતાની જગ્યાએ સૂવા માટે ચાલ્યા ગયા. હું પણ બગાસાં ખાવાં લાગ્યો અને વાદવિવાદ આપોઆપ થોભી ગયો. રાત પૂરી થઈ અને બીજી દિવસનું પ્રભાત થયું. દરરોજના નિયમ પ્રમાણે હું પણ સવારે ઠરેલા સમયે મસ્જિદમાં આવ્યો. મુક્તારામ વરેરે બધી ભક્ત મંડળી પણ આવી અને પોતપોતાની જગ્યા ઉપર બેસી ગઈ. કોઈ હાથમાં તંબાકુ ચોળવા લાગ્યા તો વળી કોઈ બાબા માટે ચલમ ભરવા માંડયા, તો કોઈ હાથ પગ દ્વારા માંડયા. આ પ્રકારે સેવા કાર્ય ચાલુ થયું. બાબા બધાના મનના વિચારો જાણતા હતા. તેમણે આસ્તે રહીને પ્રશ્ન કર્યો, ‘કાલે રાતે વાડામાં શેનો વાદ વિવાદ ચાલતો હતો ?’ પછી મેં જે જે કંઈ બનેલું તે બધું જ બાબાને કહ્યું. અને આવી પરિસ્થિતિમાં સાપને મારી નાખવો કે નહીં એ પૂછ્યું. બાબાનો આને માટે ફક્ત એક જ જવાબ હતો. ‘સર્પ, વીઠી ભલે ઝેરી જંતુઓ છે,

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

ઇતાં તે દરેકમાં ઈશ્વર જ વસેલો છે. માટે દરેક રીતે તેમની ઉપર પ્રેમ રાખવો. આ જગતના સુત્રધાર ઈશ્વર જ છે. તેમની જ આજા પ્રમાણે પ્રાણીમાત્ર વર્તતાં હોય છે. સાપ હોય કે વીછી તે પણ તેની આજાની વિરુદ્ધ કયારેય વર્તતાં નથી. માટે પ્રાણી માત્ર પર હ્યા અને પ્રેમ રાખવો. અવિચારી સાહસ કે ફૃત્ય કરવું નહીં. અને હંમેશા સખુરીથી કામ લેવું. દરેકને બચાવનારો તો શ્રી હરિ પોતે જ છે.' (ઓ. ૨૦૯-૨૩૩)

શ્રી બાબા હ્યાત હતા ત્યારે શિરડીમાં સાપ અને વીછીનું જેર ગામમાં વધારે હતું. અને તે કારણથી ગામનાં ઘણા લોકો તેના ઊંખના શિકાર બન્યા હતા. તે માટે ભક્તોને સંકટમાંથી બચાવવામાં બાબાની કથા કહેતાં કહેતાં સર્પદંશ કથા માટે હેમાડપંતને એક સંપૂર્ણ અધ્યાય અને તેના આગળના અધ્યાયમાં પણ એક ભાગ આ બાબત માટે લેવો પડે તો નવાઈ નહીં. પણ આ કથાનું પૃથ્વીકરણ કરતાં હેમાડપંતે પ્રત્યેક કથામાંથી જુદો જુદો બોધ જણાવવાનું ચાતુર્ય બતાવ્યું છે. પહેલાં મિરીકરની ચિથળીની કથામાં ભક્તે ના કહેવા છતાં બાબાની સંરક્ષણની આસ્થા આપણાને દેખાય છે. જ્યારે બુદ્ધીની કથામાં બાબાના જ્યોતિષ શાક્ર અંગેના વિચારો આપણાને જણાવા મળ્યા છે. ત્રીજું એ કે અમીર શક્કરની બાબતમાં ભક્તોના રોગ ઉપર અન્યબ ઉપાય કરવાની બાબાની ટેવ અને ભક્ત જે આજા ન પાળે તો તેની ઉપર ગુસ્સે ન થતાં તેને પોતાની હિતકારક આજા બળજબરીથી પળાવીને દરેક પ્રકારે તેનું રક્ષણ કરવાનો બાબાનો સ્વભાવ દસ્તિમાન થાય છે. ચોથું કે હેમાડપંતને વીછીથી બચાવવામ ટે જે હરિકથા સાંભળવામાં મશગુલ હોય છે તેની ઈશ્વર પોતે કેવી રીતે કાળજી લે છે તેની સાક્ષી પુરાવે છે. આગલા રૂમાં અધ્યાયમાં આપેલી શામાને સર્પદંશની પાંચમી કથામાં શ્યામાની બાબા ઉપરની અટલ શ્રદ્ધાનું દર્શન થાય છે. પણ તેની સાથે સાથે સર્પદંશથી મરણના દ્વારે પડેલા ભક્તનું વિષ ઉતારવા માટે અને તે પણ મંત્ર, તત્ત્વ કે ચોખાનું પાણી છાંટ્યા વગર એ વાતોમાં બાબાના સામર્થ્યનો આપણાને પરિચય થાય છે.

આ કથામાંથી બાબાનો સાપ અને વીછી જેવા ઘાતકી પ્રાણીઓ સાથેના વર્તાવ બદલનો સ્પષ્ટ નિર્ણય તો આપણાને મળે જ છે પણ તેની સાથે સાથે બાબાના ભક્તોને શિખામણ આપવાના કૌશલ્યનો પણ અનુભવ થાય છે. શિરડીના લોકો તે વખતે ગામમાં સાપ અથવા વીછીને જેતાની સાથે જ તેની હત્યા કરી નાખતા હતા તે બાબા શું જાણતા ન હતા? એક દિવસ તો ચાવડીમાં એક રાત્રીના અમીર શક્કરના ઓશિકા પાસે દેખાયેલા સાપને તો લોકોએ તેમની સામે જ મારી નાખ્યો હતો. પણ બાબાએ અદૃહાસ્યમાં લોકોને તે સમયે મનાઈ કરી ન હતી. અથવા તો ત્યારબાદ એનો વિરોધ પણ કર્યો ન હતો. પણ જ્યારે સમય આવ્યો ત્યારે હેમાડપંત જેવા સુશિક્ષિત ભક્તને તે અંગેનો મત પૂછતાં પોતાનો નિર્ણય સકારણ સમજલીને કહ્યો હતો. આ પ્રકારે યોગ્ય માણસને યોગ્ય હોય એટલો જ ઉપદેશ કરતા, જેથી તે દરેકને સમજલો અને મનમાં ઠસી જતો. આગળ ઉપર હેમાડપંત પોતે પોતાના ખભા ઉપર દેખાયેલા વીછીને ન મારતાં છોડી દઈને અને બાળાજી પાઠીલ નેવાસકરના પોતાના બંડારમાં નીકળેલા સાપને સાઈબાબાએ ભાવથી તપેલી ભરીને દૂધ લાવીને પાયું હતું. આ વાત અધ્યાય ઉચ્ચ ઓવી ૨૦૦ થી ૨૧૫માં જણાવી છે.

આ કથાનું બીજું એક વિશેષ એટલે કે એમાં દેખાઈ આવતી હેમાડપંતની વખાણવા જેવી વાર્ણન શૈલી. આખા સાઈસચ્યરિત્રમાં સ્વાભાવિક રીતે અનેક પ્રસંગોના વાર્ણન આવે છે. પણ આ અધ્યાયમાં એક કરતાં એક આબેહૂબ વાર્ણન આપણાને જેવા મળે છે. મિરીકરના ઉપરના વસ્ત્રમાં કાગળનો સરસર અવાજ કરીને ચઢનારો સર્પ, બુદ્ધીનો શૌચાલમાં ભીત ઉપરથી પસાર થતો અને તે નીચે પડીને અને કાળામાંથી સરકીને બહાર નીકળી જનારો સર્પ, કાંચીડો, ગરોળીઓ, વીછી વગેરેથી ભરેલી લેજવાળી, પવન અને ઢંડીને કારણે જરૂરી ચાવડી. દીક્ષિતના વાડામાં મેડા ઉપર હેમાડપંતની વાળેલી પથારીની પાસે નીકળેલો અને તે દીવાના પ્રકાશમાં અંજલિને માથું નીચે ઉપર કરનારો એ ઝેરીલો સાપ, આ બધાં

---

### શ્રી સાઈનું સત્ય ચરિત્ર

---

વર્ણનો એક ચિત્રની માફક આંખો સામે આવીને ઊભાં રહે છે. માટે જ આ અધ્યાય સારો એવો મોટો હોવા છતાં વાંચવામાં કંટાળો આવતો નથી.

આ રીતે સાઈભાબાની અનેક કથાઓ કહી શકાય તેમ છે. માટે શ્રોતાઓએ ઉપર કહેલી કથાઓનું તાત્પર્ય અને એટલો જ સાર કાઢીને સમજવાનો પ્રયત્ન કરવો. આગળનો અધ્યાય આના કરતાં પણ સરસ છે. ભક્તિ અને શ્રદ્ધા જેને મળી હતી તેવા એક સાઈભક્ત કાકાસાહેબ દીક્ષિત ઉપર આવેલો એક અધરો પ્રસંગ અને તેઓ બકરાને મારવા તૈયાર થયેલા તેનું વર્ણન જેવાનું મળશે. (ઓ. ૨૩૪-૨૩૫)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પામેલા ભક્ત હેમાડપંત રચિત.

શ્રીસાઈસમર્થના સત્ય ચરિત્રનો ‘અપમૃત્યુ નિવારણમ्’ નામનો બાવીસમો અધ્યાય

અહીં સમાન થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણ.



## ॥ અધ્યાય ૨૩ ॥

### ગુરુ-ભક્ત લીલાદર્શન

(ગુરુ અને ભક્ત એ બે વર્ચયેના ખેલ અને કીડાઓનું દર્શન)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,  
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદ્ગુરુ સાઈનાથ મહારાજને વંદન.

ખું જેતાં આ જીવામા ત્રણો ગુણોથી પર છે. પરંતુ માચાથી મોહિત થઈને પોતાનું ત્રિકાળ અભાવિત આસ્તિત્વદ્વારી તત્ત્વ, જ્ઞાન અને આનંદથી યુક્ત એવા પરમેશ્વરને તે ભૂલી લય છે અને પોતાના દેહને જ તે સાચો માનવા માંડે છે. પછી આ દેહના અભિમાનને કારણે બધી વાત હું જ કરુ છું અને ભોગવનારો હું જ છું એવું તે સમજવા માંડે છે. આ કારણે એક પછી એક આવતા મોટા સંકટોથી ન્રાહીમાં પોકારી લય છે. એમાંથી છૂટવાનો તેને માર્ગ મળતો નથી. ગુરુચરણમાં પ્રેમપૂર્વકની ભક્તિ એ જ આ સંકટોમાંથી નિવારણનો એકમાત્ર માર્ગ છે. શ્રી સાઈસમર્થ અનેક પ્રકારના ચ્યામતકારી ખેલ કરી બતાવનાર સાક્ષાત શ્રી કૃષ્ણ છે. પોતાના ભક્તોને પોતાના જ ખેલના આનંદમાં તલ્લિન કરે છે. અમે તેમને પૃથ્વી ઉપર જન્મ લીધેલા ઈશ્વર અથવા તો અવતારી પુરુષ માનીએ છીએ. કારણ કે તેમનાં બધાં લક્ષ્ણાંશો એવાં જ છે. પણ તેઓ ‘મી બંદા અલ્લાચિયા પદ્ધરીં – હું પરમેશ્વરના ધરનો ગુલામ છું’ આવું કહેતા હતા. જાતે ભલે ઈશ્વરના અવતાર હતા, છિતાં લોકોની પ્રચલિત માન્યતા મુજબ વર્તન કરવાનું તેઓ સારી રીતે પાળતા હતા અને વર્ણ અને આશ્રમ અનુસરીને લોકોએ શુદ્ધ આચારણ રાખવું જોઈએ તેનો જ પ્રચાર તેઓ કરતા હતા. બાબા કોઈની સાથે કે કોઈ પણ પ્રકારે બરોબરી કરતા ન હતા. અને કોઈને કરવા હેતા પણ નહિ. જે બધી ચર અને અચર વસ્તુઓમાં સર્વવ્યાપી પરમેશ્વરને જ જુએ છે તેનું ઓછાપણું શોભે છે. તેઓ કોઈનો પણ તિરસ્કાર કરતા નહીં અને સાથે સાથે કોઈને હલકો કે નીચ અથવા તુચ્છ માનતા ન હતા. પ્રાણી માત્રમાં પૂર્ણ ચૈતન્ય યુક્ત પરમેશ્વરને જ તેઓ નિહાળતા હતા. જાતે કદી પણ ‘અનલ હક્ક – હું જ પરમેશ્વર છું’ એવું કહેવડાવતા ન હતા, તેમજ હું પરમેશ્વરનો એક દાસ કે ભક્ત છું અથવા તો હું એક ગરીબ ‘યાદે હક્ક – એટલે કે પરમેશ્વરનું કાયમ સ્મરણ કરનારો છું’ એવું જ કહેવડાવતા અને સદ્ગય ‘અલ્લા માલિક’ એવો જ જ્યે કરતા હતા. કયા સંતની જત કઈ અને તેઓ કેવી રીતે વર્તે છે કે શું આય છે તેની ઉપરથી તેમનું સ્વર્ગ સમજનું નથી. તેઓ તો સર્વદા આ બાધ્ય વાતોથી પર હોય છે. મંદબુદ્ધિના પ્રાણીઓનો ઉદ્ધાર કરવા માટે અને બીજાઓ ઉપર ઉપકાર કરવા માટે આ જગતમાં સંતોનો અવતાર થતો હોય છે. આ પણ એક ઈશ્વરીય કૃપા જ સમજવી. પાછલા જન્મોનાં કોઈ પુણ્યનો જથ્થો હોય તો જ સુખ, સંતોષ પ્રાપ્ત કરવા માટે સંતોની વાતો સાંભળવાની ઈચ્છા મનમાં ઉદ્ભબે છે. (ઓ. ૧-૧૧)

એક દિવસે એક યોગ અભ્યાસી નાનાસાહેબ ચાંદોરકરને સાથે લઈને બાબાના દર્શન માટે મસ્નિદ્રામાં આવી પહોંચ્યા. તેમને પતંજલિ નામના પૌરાણિક ઋષિઓ અને બીજા યોગીઓએ શોધેલા પતંજલ યોગરાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. અનેક યોગોના અનેક પ્રકારના વિચિત્ર અનુભવોને અજ્ઞાતાવી જોયા બાદ સમાધિ એક ક્ષણ માટે પણ તેઓ સાધી શકતા ન હતા. ‘સાઈમહારાજ શ્રેષ્ઠ યોગી છે. એમની મારા ઉપર કૃપા ઉત્તરતા મારી શંકા દૂર થશે અને સમાધિ જરૂરથી સાધી શકાશે.’ એવી આશા અને શ્રદ્ધા સાથે તેઓ બાબાના દર્શન માટે ગયા. તો એ સમયે શ્રી બાબા કંદા

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સાથે ભાખરી ખાતા હતા. બાબાએ વાસી ભાખરી અને સ્કૂકો કાંદો મોઢા સામે ધરેલો જેઠને પેલા યોગ અભ્યાસીના મનમાં મોટી શંકા થઈ કે આ વળી મારી શંકા કેવી રીતે દૂર કરવાના ? યોગ અભ્યાસીના મનમાં સંશય તિભો થયો. પણ સાઈબાબા તો રહ્યા અંતર્યામી તે બોલ્યા, ‘નાના, કાંદા તો જેને પચે એણે જ ખાવા. જેને પચાવવાનું જેર હોય તેણે ખુશીથી ખાવા.’ કાંદો એ તામસી વૃત્તિ અને આપસ, બુદ્ધિનું જડત્વ વગેરે ઉત્પન્ન કરે છે. પરંતુ જેને યોગ સાધનાનું અંતિમ ચરણ મેળવ્યું છે, અને જેના મન પર અને શરીર પર યોગ્ય અથવા તો અયોગ્ય ખોરાકનું કોઈ પણ પરિણામ થતું નથી, તેણે જ એ સ્વેચ્છાએ ખાવો જેઠાએ. બાબાના આ પ્રકારના શર્દી સાંભળીને યોગ અભ્યાસી મનમાં ઓશિયાળા થઈ સરળ અને શુદ્ધ મનથી બાબાના શરણે ગયા. ત્યાં બાબા ગાંધી ઉપર આવીને બેસ્તાં પેલો યોગ અભ્યાસી મનમાં કોઈ પણ જાતનો સંશય રાખ્યા સિવાય કે કોઈ પણ પ્રકારના વિકલ્પ વગર અને ખરા અંતઃકરણથી બાબાની પાસે આવીને બેઠો. બાબાની હાજરીમાં જ પૂરી હોશિયારીથી પ્રશ્નો પૂછી પોતાની શંકાનું સમાધાન કર્યું અને ઉદ્દીપ્રસાદ તથા આશીર્વાદ લઈ પ્રસન્ન મને પાછો ગયો. (ઓ. ૧૨-૨૦)

આવી અનેક બાબાની કથાઓ ભક્તો જે ભક્તિ ભાવથી સાંભળે તો તેમના ત્રાસદાયક રોગ અને વિવેક બુદ્ધિની નાશ કરનારી ખરાબ ઠિચ્છાઓનો અને કર્મોનો ત્વરિત નાશ થાય છે. પાણીનો ભરેલો ખાડો ખૂબ નાના અને અતિશય ગંધાતો અને વાસ મારતો હોય તો દુક્કર કોઈ પણ જાતના સંશય વગર તેમાં આણોટવામાં શ્રેષ્ઠ સુખ માને છે. મનુષ્ય જીવાત્માની અને પોપટની આ જ દૃશા છે. એક શરીરમાં હાડકાના માળામાં હોય છે અને બીજે પિંજરામાં બંધ હોય છે. પોપટે સ્વતંત્રતા ગુમાવી હોવા છતાં પણ એને પરતંત્રતા કયારેય ખરાબ લાગતી નથી. કૂવામાં રહેલા દેઢકાની માફક આ પોપટને પણ પિંજરામાં પોતાનું સર્વ સુખ મળતું હોય છે. તેને સ્વતંત્રતાના આનંદની ખબર જ નથી હોતી. વિષય વાસનાઓમાં આસકત જીવાત્માઓના આવા જ હાલ હોય છે. ‘શું મજાનું આ મારું પિંજર ! શું એમાંની સોનાની દાંડી ઉપર ચક્કર ચક્કર લટકવું ! ઉધો લટકે તો પણ ચાલે, પણ પેલી સોનાની દાંડીથી મારા પગ જરાયે છૂટવા ન જેઠાએ. પિંજરામાંથી બહાર જઈશ તો આ બધા સુખોથી વંચિત જ રહેવાનો. મને ભાવતા દાડમના દાણા અને લાલ મરચાં પછી કયાંથી મળવાનાં ? હું મારું સુખ જતે જ ખોઈ બેસીશ.’ પણ એ પોપટની યોગ્ય ઘડી આવતાં જ અકલ્પિત પ્રસંગો જેઠે તેની સંધી થાય છે અને તેને પ્રેમની લપડાક પડે છે. એ પ્રેમના લપડાકના સામર્થ્યથી આંખો ઉધેઠે છે ત્યારે શક્તિપાત થાય છે. ગુરુ પોતાના શિષ્યને પોતાના મંગોનું બળ આપે છે અને તે શુદ્ધિમાં આવે છે. તેની સાથે જ એ પિંજરામાંથી છટકી જાય છે. બહાર નીકળતાની સાથે જ તે પાંખો ફફડાવીને આકાશમાં વિહાર કરવા લાગે છે. કોણ એને રોકી શકે ? અફાઈ જગત એને માટે ખૂલી ગયું છે. દાડમ તેને જમરુખની વાડીઓ જેઠાએ એટલી મળે છે. સ્વચ્છાંદપણે ઉડવા માટે મોકળું આકાશ પણ મળે છે અને આખરે તે સ્વતંત્રતાની ખરી મોજ લૂટે છે. આ જીવાત્માની પણ આવી જ સ્થિતિ થાય છે. દિશ્બરની કૃપા અને ગુરુની મુલાકાત એ બંને પ્રાપ્ત થતાં સંસાર બંધનમાંથી મુક્તિ અને સ્વતંત્રતાના આનંદનો ઉપભોગ, આ બંને અનુભવો તેને મળે છે. (ઓ. ૨૧-૩૦)

હવે ધ્યાન દઈને તમે બધા ભાવિક શ્રોતાઓ શુદ્ધ પ્રેમની રસાળ કથા ક્ષણભર સાંભળશો કે ? પાછલા અધ્યાયમાં ચ્યમત્કાર થયો. બાબાએ ભિરીકરને ચિથળીના પ્રવાસ પર શ્યામાની સાથે મોકલી આપ્યો. સાઈસમર્થે લાંબાબાવા પાસેથી એટલે કે સર્પ દ્વારા આવનારા સંકટને અગાઉથી જાણીને ભિરીકરને સમયસર સૂચના આપીને સાવધાન કર્યા. ફક્ત સાવધ જ નહીં પણ તે સંકટ નિવારણ કરવા માટેના ઉપાય પણ બતાવ્યા. ભિરીકરે ના પાડી છતાં માધવરાવને તેમની સાથે જબરનસ્તીથી મોકલ્યા અને સંકટમાંથી તેમનું રક્ષણ કર્યું. આમ ભક્તોનાં કલ્યાણ કરવા માટે તત્પર એવા બાબાએ બાળાસાહેબ ભિરીકરની આપત્તિ ટાળીને તેમને એક વિચિત્ર અનુભવ કરાવ્યો. તેના કરતાં પણ શ્યામાની સ્થિતિ જુઓ.

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

તેને તો અચાનક સાપે ઉંખ માર્યા બાદ જીવવાની આશા પણ રહી ન હતી. છતાં બાબાએ તેમાંથી તેને બચાવ્યો. તે પણ એક બાબાની જ લીલા છે જે શ્રોતાઓને પહેલાં કહીએ. સાપ ઉંખ્યો હતો પણ બાબાએ ઉપાય શો કર્યો તે સાંભળો. સાંજના સાત વાગ્યાના અરસામાં શ્યામાના હથ પરની છેલ્ટી ટચ્ટી આંગળી પર એકાએક એક સાપ કરડયો અને એટલા ભાગમાં જેરને કારણે બળતરાની વેદના થવા લાગી. અસહ્ય વેદનાથી તેઓ પીડાવા લાગ્યા. ગ્રાણ નીકળી જય એવો વખત આવ્યો અને માધવરાવ ભયભીત થઈને મનમાં ચિંતા કરવા લાગ્યા. શરીર વેદનાથી લાલચોળ થઈ ગયું. સગા સંબંધીઓ બધા ભેગા થઈ ગયા. તેમજ જીવ સંકટમાં આવી પડ્યો ત્યારે વિરોભા પાસે જવું એમ નક્કી કર્યું. વિરોભા શંકરનું સ્થાનક છે, ત્યાં સર્પદેશ થયેલાઓને લઈ જવાથી તે સારો થઈ જય છે એવી માન્યતા છે. માધવરાવના મોટા કાકાના દિકરા નાનસાહેબ નિમોણકર આગળ આવ્યા અને ઉદ્દી લઈને જવાનું કહ્યું. પરંતુ તે કાંઈ ન સાંભળતાં માધવરાવ મસ્નિજદ તરફ છોડ્યા, તો બાબાએ શું કર્યું? બાબાની સાથે નજર મળતાં જ બાબાનો ચ્યાતર જુઓ. બાબા એક સામી ગાળો દેવા માંડ્યા અને માધવરાવને મસ્નિજદ ઉપર આવવા જ ન હે, ‘ચઢૂ નકો ભટ્ટરડયા – ઉપર ચઢ્યો તો ખબરહાર! ચાલ નીકળી જ, નીચે ઉત્તર.’ એવી મોટી ગર્જના બાબાએ કરી. ક્યારે પણ ન થયા હોય તેટલા ગુસ્સે ભરાયા. કલ્પના બહારનો કોધ તેમણે વરસાવ્યો. માધવરાવ તો આશ્ર્યમાં પડી ગયા કે બાબા મને આચા કઠોર શાંદો શા માટે બોલ્યા? આ આખી સ્થિતિ જેઠીને માધવરાવ વધારે ગભરાયા. તેમને કાંઈ સૂક્ષે જ નહીં. તેમની ધીરજ ખૂટી પડી અને અસહ્ય પીડાને કારણે તેઓ ભાંગી પડ્યા અને નીચે બેસી ગયા. આમ એમના દેવને જ ગુસ્સે થયેલા જેઠીને માધવરાવના મનમાં બીક પેઢી અને તેમને લાગ્યું કે બધા જ ઉપાય હવે ખતમ થઈ ગયા. બાબાનું આવું ગુસ્સા ભરેલું વર્તન જેઠીને કોણ ન ગભરાય ? ગાળોનો અને બૂમબરાડાનો વરસાદ જેઠીને માધવરાવને આ ઘટના ભયંકર લાગવા માંડી. ‘મસ્નિજદ મારા બાપનું ધર અને હું તો સાઈના પેટનું બાળક હું. તેમ છતાં મા જ આજે પોતાના બાળક પર આટલો બધો ગુસ્સો શા માટે કરી રહી છે ? ‘સાપ કરડયો’ એ દુઃખ મા સિવાય કોને કહેવાય ? પણ એ જ જે લાતો મારે તો બાળકનું મો ઓશિયાણું નહિ થાય ?’ નાના બાળકનો મા સાથે જેવો સંબંધ હોય છે, એવો જ સંબંધ માધવરાવનો બાબાની સાથે રાત દિવસનો હોવા છતાં આજે આવી પરિસ્થિતિ શા માટે સર્જાઈ ? મા જે ગુસ્સામાં તિરસ્કાર કરે તો પછી બાળકને કોણ સંભાળે ? માધવરાવે આ વખતે જીવવાની આશા પર પાણી મૂકી દીધું. પણ આગળ થોડો સમય પસાર થતાં બાબા શાંત પડ્યા. એ જેઠી માધવરાવની ધીરજ વધી અને મસ્નિજદમાં ઉપર જઈને બેઠા. ત્યારે બાબા બોલ્યા, ‘ધીરજ છોડતો નહીં, મનથી જરા પણ હેરાન થતો નહીં. તું સારો થઈ જઈશ ફિર છોડી હે હ્યાણુ ફીર તને સંભાળશે. જ ધરે જઈને સ્વસ્થ બેસ. ધરની બહાર નીકળતો નહીં. ડર છોડીને નિશ્ચિત મનથી બેસ અને મારી ઉપર વિશ્વાસ રાખ.’ પછી માધવરાવ ઘેર પહોંચે એ પહેલા બાબાએ તાત્યા કોતે પાટીલને માધવરાવની પૂછપરછ કરવા માટે એને ઘેર મોકલ્યો અને સાથે સેદેશો પણ મોકલાવ્યો, ‘એને કહેને સૂઈ ન જય, ઉંઘ આવે તો પણ નહિ. ધરમાં ને ધરમાં ફરતો જ રહેને. જે મન ફાવે તે આ, પણ મેં જે આટલું કહ્યું છે તે ન ભૂલતાં કાળજીપૂર્વક સંભાળજે.’ કાકાસાહેબ દીક્ષિતને પણ તે રાતે પાછુ કહ્યું, ‘એને ઘેર ચઢ્યો પણ સૂવા દેતા નહીં.’ આવી સાવધાની વર્તતાં એ ઉપાધિ દૂર થઈ. આંગળીમાં જેરની થોડી જ બળતરા રહી અને થોડા જ સમયમાં તેમાં પણ આરામ થવા માંડ્યો. કાન મરણારી સાઈમાવડી ભક્ત ઉપર કૃપા કરવા માટે વ્યાકુળ થઈ અને તેમનું મન કકળી ઉઠ્યું અને એ ભયંકર પળ ટળી ગઈ. (ઓ. ૩૧-૫૮)

‘ચઢતો નહીં ભટ્ટરડિયા ઉપર’ શ્યામા આ બાબાના શાંદોના પ્રહાર કંઈ માધવરાવ પર થોડા કરેલા ? નહીં આ શાંદો ના બાળ માધવરાવને ઉદ્દેશીને ન હતાં. પણ સર્પદેશથી ચેદ્લા જેરને આપેલ એક કહક આજ્ઞા હતી. ‘ચઢતો નહીં ભટ્ટરડિયા ઉપર’ એટલે ‘શ્યામા ભટ્ટરડયા મસ્નિજદમાં ઉપર ચઢતો નહિ.’ આવો ઉદ્દેશ ન હતો, પણ ચઢતો નહીં ભટ્ટરડયા ઉપર એટલે, ‘શ્યામા

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ભટુરડયા શરીરમાં ઉપર ચઢીશ નહીં.' આ તે પેલા સાપના એરને ઉદ્દેશીને કરવામાં આવેલો અર્થ હતો. 'ચઢીશ તો ખબરદાર' આ શ્રી સાઈનાથના મુખેથી પ્રખર આજ્ઞા સાંભળીને વિષનો સંચાર સ્થગિત થયો, અને તેની આગળની ગતિ રોકાઈ ગઈ. એટલું જ નહિ પણ 'આલ નીકળી જ, નીચે ઉત્તર' આ પાંચ અક્ષરોમાં સાઈના પંચાક્ષરી મંત્રને લીધે તે પુર તરત જ નીચે ઉત્તરી ગયું. લોકોમાં પ્રચલિત એવા માંત્રિક અથવા તો પંચાક્ષરી આવા લાગતા વળગતા કંઈ સાધનોનો ઉપયોગ ન કરતાં, ભક્તોનાં સંકઠો બાબા અનેક સમયે જુદી જુદી રીતે નિવારતા હતા. ન કોઈ મંત્ર બોલ્યા કે ન તો ચોખાનું મંતરેલું પાણી છાંટ્યું. તેમ છતાં આ વિષ ઉત્તર્યું કેવી રીતે ? સંતના મોઢામાંથી નીકળેલા શબ્દોથી માધવરાવને ફરક પડ્યો ! શું આ ચમત્કાર ન કહેવાય ? સંતોની આવી ફૂપાનો કોઈ પાર નથી હોતો. (ઓ. ૬૦-૬૬)

પાછલા અધ્યાયમાં સુચન કર્યા અનુસાર એ સરસ અને અદ્ભૂત કથા હવે શ્રોતાઓ ખૂબ જ ધ્યાન દ્યાન દ્યાન એથથી દૃતિ સુધી સાંભળો. પાછલા અધ્યાયમાં જે કથાનું વર્ણિત થયું છે, તેના કરતાં આ વાર્તાનું કૌતુક અનેકગણું છે. સાઈબાબા કેવી લીલા કરતા હતા. તે હવે કહેવામાં આવશે. આ સુંદર કથા સાંભબ્યા પછી ગુરુચન્યનોનું મન પર પાક્ષું પરિણામ થશે, સારાં કર્મ કરવાં, ખરાબ કર્મ કરવાં, કે કોઈ પણ પ્રકારના કર્મ ન કરતાં, ફક્ત સ્વસ્થ બેસી રહેવું. આ બધી વાતોનું કર્તાપણું નાચ થશે અને ગુરુચરણમાં દદ શ્રદ્ધા વધશે. માયાનો નાશ કરવા માટે સહેલામાં સહેલો ઉપાય એટલે હદ્યથી શ્રીબાબાનાં ચરણ કમળનું ધ્યાન કરવું. આ જ સાગર પાર કરવા માટેનો સરળ ઉપાય છે. સંસારનો ભય ખૂબ જ જબ્બરો હોય છે. આ ત્રાસદાયક વાતની ઉત્પત્તિ માયાનાં બંધનોમાંથી જ થયેલી છે. શ્રી સાઈની કથા સાંભળવાથી આ માયા છિન્નબિન્ન થઈને સાશ્વત આનંદની પ્રાપ્તિ થાય છે. (ઓ. ૬૭-૭૧)

એક વખત શિરડીમાં કોલેરાનો વાવર ચાલ્યો. ગામના ભલાભોળા બિચારા સાદા માણસો મનથી ગબરાયેલા એકમત થઈને, ઢોલ પીઠીને ઘોષણા કરી અને ગામમાં રાહુદારી બંધ કરાવી. કોલેરાને કારણે મોટી દ્યેશત ફેલાઈ ગઈ. ગામના માણસો ભયભીત થઈ ગયા. બીજા ગામના લોકોને ગામની પાસે આવવાની પણ મનાઈ ફરમાવવામાં આવી. તેથી બધા વ્યાપાર ધંધા બંધ પડ્યા. જ્યાં સુધી આ વાવર ચાલે ત્યાં સુધી કોઈએ ગામમાં બકરો હલાલ કરવો નહિ, તેમજ ગામની સીમમાં બહારગામથી આવતી કોઈ પણ ગાડી કે ગાડું આવવા દેવું નહિ એવા નિયમો બધા પાળવા લાગ્યા. ગામ લોકોનું આવું ભોળપણ બાબાના મનને કદાપિ ગમતું નહિ. તેમના મતે આ એક ખોટી ભ્રમણા હતી અને લોકોનું અનાડીપણું હતું. એક બાજુ ગામના માણસો દ્વારા નિયમોનો કડક અમલ કરવો અને બીજી બાજુ આહિયાં બાબા તેને ભંગ કરતા ગયા. કેવી રીતે તે આદર્શપૂર્વક સાંભળો. ગ્રામ પંચાયતનો આ નિર્ણય શિરડીના તમામ લોકો પૂર્ણપણે પાળતા હતા. નિયમનો થોડો પણ ભંગ કરનારાને દંડ ભર્યે જ છૂટકો. પણ બાબાને કોઈ દંડનો ભય ન હતો. બાબા તો સદા સર્વદા નિર્ભય રહેતા. હરિના ચરણમાં મનનો લય કરવાથી કળિકાળ પણ તેમને જુતી શકતો નથી. એક વખત બીજા ગામથી બળતણ માટેનું લાકડા ભરેલું એક ગાડું ગામની સીમામાં આવ્યું અને ધાંધલ ધમાલની પરિસ્થિતિ ઊભી થઈ. ગામના લોકો અંદર અંદર લડવા લાગ્યા. ચૂલામાં બાળવા માટે બળતણના લાકડાની કમી હતી, એ ગામના માણસો જણતા હતા. પણ નિયમોનું ઉલ્લંઘન કરવું તે સારું નથી. માટે એ બધા ગુંગવણમાં પડ્યા. ગાડાવાળાને તે સૌ મબ્બા અને તેનું ગાડું પાછું મોકલવા લાગ્યા. આ વાતની ખબર બાબાને પડી અને તેઓ ત્યાં આવીને ઊભા થઈ ગયા. બાબા પોતે જ ગાડા સામે આવીને ઊભા રહી ગયા એ જોઈને ગાડાવાળાને થોડી હિંમત આવી. ગામના લોકોનો હઠાત્રે તૂટ્યો અને તેમણે ગાડું ગામની હદમાં આવવા દીધું. ત્યાંથી બાબાએ દ્વારકામાઈના સભામંડપના દરવાજે લાવીને તેને ખાલી કરાવડાવ્યું. પણ કોઈનાં મોઢામાંથી એક શબ્દ પણ ન નીકળી શક્યો. ઉનાળો, શરદાતુ, હેમત કે ચોમાસુ હોય અથવા તો વસંતઅતુ હોય, બાબાની પવિત્ર ધૂળી આઢેય પ્રહર પ્રજ્વલિત જ રહેતી. કેવો બાબાનો આ વિચિત્ર નિયમ ? અન્નહોત્ર વ્રત હોય છે. તેવી જ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

બાબાની આ પવિત્ર ધૂણી રાત અને દિવસ પ્રજવલિત રહેતી. ફક્ત આ ધૂણી માટે બાબા બાળવાના લાકડાંના ભારા વેચાતા લેતા હતા અને સભામંડપની સામેની ભીતે એની થપ્પી કરાવતા. બજરનો સમય સાધીને બાબા કાળજીપૂર્વક તેમાંથી લાકડાં ભેગાં કરતા. તેની ઉપર આજુબાજુવાળાઓની પણ નજર રહેતી. પોતાને જેમાંથી ફાયદો થતો હોય ત્યાં નિષ્કાળજીપણું કે ભોળાપણું કોઈ ભાગે જ બતાવતો હોય છે. સ્વાર્થી લોકો મૂળથી જ ત્રાસદ્યક હોય છે. સભામંડપને કોઈ દરવાને ન હતો. તેથી આવા લોકોને સારી ફાવટ મળતી અને ગરજવાળા તેમજ લબાડ બંને લોકોને એનાથી સરખો જ લાભ થતો હતો. સાઈબાબા તો મોટા પરોપકારી જીવ હતા. તેમની મોટાઈનું કેવી રીતે વર્ણન કરવું ! બહારથી જેતાં ભલે તેઓ ઉંગ અને કઠોર દેખાતા પણ અસલમાં તેઓ અંદરથી ખૂબ જ નરમ અને સૌભ્ય હતા. તેમની મહાનતાની કોઈ સીમા જ ન હતી. જે વાણીનું અભિમાન છોડીને નમૃતાપૂર્વક તેમનાં ચરણોનું વંદન કરશે, તે જ તેમની મોટાઈનું વર્ણન કરવા માટે શક્તિમાન છે. (ઓ. ૭૨-૮૧)

વિશ્વંભર (સર્વવ્યાપી પરમેશ્વર) બધી જ ચર અને અચર વસ્તુઓમાં વ્યાપેલા છે. તે હંમેશા ધ્યાનમાં રાખીને તેઓ કોઈની સાથે વેર કરતા નહીં. પરમાત્મા બધીજ સૃષ્ટિમાં, દરો દિવશાઓમાં આગળ પાછળ વ્યાપક છે, તે જાણીને કોઈની સામે કોઈ દુષ્ટભાવથી જેતાં શ્રી બાબાને ખૂબ ત્રાસ અને દુઃખ થતું. તેઓ શરીરથી પૂર્ણ વૈરાગી હતા, છતાં સમજ વ્યવસ્થાના રક્ષણ માટે અને શરણે આવેલાને શિખામણ આપવા માટે તેઓ એક સંસારી માણસની માફક વર્તતા હતા. આ મહાન પુરુષમાં કેટલી નમૃતા ! સાંભળીને પણ આશ્ર્વય થાય છે, ભક્તો ઉપરનો તેમનો પ્રેમ દેખાઈ આવતો અને અવતાર લીધાનું સાર્થક થયું એવું તેમને લાગતું. તેમના હૃદયમાં, દુઃખી અને ગરીબ ગુરુભાઓ માટે અતુલનીય વાતસલ્ય હતું. તે સાદાઈના હિમાયતી હતા અને એમને તે ખૂબ જ ગમતી. આ વાતની સાક્ષી પુરવાર કરવા માટે અનેક વાતો કહી શકાય તેમ છે. તેઓ કથારેય ઉપવાસ વગેરે કરતા નહીં. તેમજ હઠ્યોગમાંની કષ્ટદ્વારા સાધનાઓ પણ કરતા ન હતા. તેમને તેલ, મસાલા, ખાંડ, મીઠું વગેરે ઉત્સેજક પદાર્થોની બિલકુલ રૂચિ ન હતી, તેમજ અન્ન ગ્રહણ પણ ઓછું જ કરતા. તેઓ નક્કી કરેલા ઘરે જઈને લૂંખી સૂક્ષ્મી ભાખરી માંગતા હતા. તો કાયમ બિક્ષા અથવા તો માધુકરી માંગી લાવતા. જ્ઞાના ચટાકા અને કોડ તેઓ કરતા નહીં કે સ્વાદ અને રસને પણ બહુ પ્રાધાન્ય આપતા નહીં. તે કદી મીઠાં પકવાનોની પણ આશા રાખતા નહીં. મળે તો પણ વાહ વાહ અને ન મળે તો પણ વાહ વાહ. જે કોઈ વખતે ઉત્તમ રંધેલો ઓરાક બિક્ષામાં મળી જતો તો તેનો હરખશોક પણ તેમને ન હતો. આવી રીતે ઉદ્દરનિર્વાહ કરીને શાન અને મોક્ષનું સાધન જ પોતાનું શરીર છે, એનું તેઓ રક્ષણ કરતા હતા. આવા બાબાને કેવો અહંકાર ને કેવું અભિમાન ? આત્માની શાંતિ એ જેનું ખૂબણ હતું, તેમને ગળામાં માળા પહેંચવાની, કપાળમાં ચાંલ્સો કરવાની અને શરીરને ભર્સે ચોપડવાની શી જરૂર છે ? શ્રી બાબા તો પૂર્ણબ્રહ્મ જ હતા. આ ખાસ તો બક્તિરસથી પરિપૂર્ણ આખ્યાન છે જે ખૂબ જ પવિત્ર છે. જે એને ધ્યાનથી સાંભળશે એનું સંસારમાંથી ધ્યાન ઓછું થશે. જેમ જેમ શ્રોતાઓની શ્રદ્ધા અને સાદી બોળી વૃત્તિ વધતી જશે તેમ તેમ સાઈનો બંંડાર ખૂલતો જશે. વગર કામના ભળતા તર્ક કરનારાઓને તે સમજનું નથી. ભોળા અને ભલા ભક્તો પ્રેમથી એનો ઉપભોગ કરતા હોય છે. (ઓ. ૮૨-૧૦૩)

હવે આગળની કથા એકાગ્ર મનથી સાંભળીશું તો હૃદયમાં પ્રેમના અંકુર કૂટશે અને આંખોમાંથી આનંદનાં અશ્રુ વહેશે. કેટલો સુંદર બાબાનો ડહાપણ ભરેલો માર્ગ અને કેટલી અનેક જતની એમની યુક્તિઓ ! આ બધાની ખૂબી તેમના અનન્ય ભક્તોને વખતોવખત અનુભવપૂર્વક જાણવા મળતી હતી, આ સાઈચરિત્રિઝી અમૃતનું સેવન ધ્યાનથી અને આદરથી કરવું. પણી ગુરુચરણામાં મન લગાડીને કથામાં જોડાઈને ધ્યાન ધરવું. આ કથા એટલે પહેલાં કદી પણ ન મળ્યું હોય એવું ઉત્તમ અને રસપૂર્ણ જમણ છે. એનું શ્રવણ કરતાં શ્રોતાઓએ ઉતાવળ કરવી નહીં. દરેક પદાર્થની

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ઉત્તમતાનું અને નવીનતાનું મનને ભાવે ત્યાં સુધી પેટ ભરીને પાન કરવું. હવે આ રસપ્રદ કથા અહીં સમાપ્ત કરીએ. એના કરતાં જરા જુદ્દી જ અને વિચિત્ર બકરાની કથા છે. જે સાંભળીને શ્રોતાઓના મનમાં આશ્રય થશે અને ગુરુ ભક્તોને આનંદ થશે. એક વખતે એક મજાની વાત બની. કોઈએ એક દિવસ બકરો આણ્યો. તે ખૂબ અશક્ત હોવાને કારણે ભરવા ખાતર જીવી રહ્યો હતો. તેને જેવા માટે લોકો ભેગા થયા હતા. જેનું કોઈ વાતી કે વારસ નથી અને જેને કોઈ આશ્રય આપનારું નથી, એવા દરેકને સાઈમાવડી જ સંભાળે છે. જે કંઈ બગડેલું કે સડેલું હોય. આધાર વગરનું નીચે પડેલું હોય, અથવા તો દુઃખથી ત્રાસેલું હોય એવા બધા જીવો વિશ્રાંતિ માટે મસ્નિદ્દમાં આવતા તે વખતે ત્યાં મસ્નિદ્દમાં બદેબાબા હતા. એમને જેઠને સાઈબાબા બોલ્યા, ‘એનો બતી આપ (મારીને દેવને અર્પણ કર) એક ઝાટકમાં એનો જીવ લે.’ (ઓ. ૧૦૪-૧૧૨)

આ બદેબાબાનો પણ આદરસ્તકાર ભારે હતો! બાબાના જમણા હથે તેમની બેસવાની જગ્યા રહેતી હતી. બદેબાબા ચલમ ફૂકે પછી જ બાબા તે ચલમ પીતા. તેમના સિવાય બાબાને જલમતું નહીં. તેઓ કોળીઓ ભરે નહિં ત્યાં સુધી બાબા જમતા નહિં. એક વખત દિવાળીનો તહેવાર હતો. બધાં જ પકવાનો સાથે પીરસેલી થાળીઓ તૈયાર હતી. જમણવારની પંગતો પણ બેસી ગઈ હતી. તે સમયે બદેબાબાને કંઈક વાંકુ પડતાં તેઓ રિસાઈને જતા રહ્યા. બદેબાબા જમવાની હરોળમાં ન હોય તો સાઈબાબા અન્ન ગ્રહણ કરતા નહીં. જ્યારે સાઈબાબા જ કોળિયો લે નહિં તો બીજા લોકો કેવી રીતે જમવાના હતા? માટે બધા રાહ જેવા લાગ્યા. જ્યારે બદેબાબાને શોધી લાવ્યા અને પંગતમાં બેસાડ્યા ત્યારે જ સાઈબાબાએ અન્ન ગ્રહણ કરવાની શક્કાત કરી. હવે એવું લાગે છે કે આ ચાલુ કથાને કોઈ વિષય બદલનારી અને સંબંધ વગરની સમજવી નહિં. બદેબાબા સાઈબાબાના જમતી વખતના અતિથિ હતા. રોજ બપોરના જમવાના સમયે નીચે સભા મંડપમાં તેઓ વાટ જેતા અને બાબાની બૂમ સાંભળવા કાન ઢાઈને બેસતા. મસ્નિદ્દમાં જમવા માટેની બે પંગતો પડતી અને સાઈબાબા મધ્ય ભાગમાં ઢાઈથી બિરાજમાન થતા. બદેબાબાની જગ્યા ડાબા હથે ખાલી રહેતી. નૈવેદ્ય થાળીમાં પીરસાઈ જય કે થાળીઓ પંગતમાં ગોઠવાઈ જય અને જમનારા પોતપોતાની જગ્યા ઉપર બેસી જય તે પછી કે જમવાની તૈયારી થતાં જ બાબા જાતે અત્યંત આદરપૂર્વક મોટા અવાજે ‘બદેમિયાં! એવી હાંક પાડતા અને એની સાથે જ બદેબાબા પણ જરાપણ વિલંબ કર્યા વગર નમરસ્કાર કરીને ઉપર મસ્નિદ્દમાં આવી જતા. જે અન્ન ઉપર કારણ સિવાયનો રિસાય તેને વળી આદર કેવો? જેણે અન્નનું અપમાન કર્યું તેને માટે આટલો બધો ભાવ શા માટે? તો આ સર્વ રીતરિવાને ભક્તગણો માટે બાબા પોતે આચરણમાં લાવીને જ દેખાડતા હતા. અતિથિને પંગતમાં પોતાની સાથે લિધા સિવાય જેઓ અન્ન ખાય છે તે યોગ્ય નથી. ગૃહસ્થાશ્રમી માણસને શાસ્ત્રોએ સમજલવેલો નિયમ અને જેને કારણે ભક્તોની આપદાઓ દૂર થાય છે. એનું ઉલ્લંઘન બાબા કયારેય કરતા નહીં તેમજ જાતે ગૃહસ્થાશ્રમી ન હોવા છતાં તે નિયમોનું પાલન કરતા. અતિથિનો સત્કાર કરવાથી ઇચ્છિત વાતોનો લાભ થાય છે અને અપ્રિય અનર્થોનો પણ નાશ થાય છે. આવું ન કરતાં જરૂરથી વિકટ પ્રસંગો તિબા થાય છે. માટે ડાબા માણસો અતિથિની પૂજન કરે છે. જે અતિથિ જમ્યા વગરનો રહે તો પણ, પુત્ર, ધાન્ય આ બધી વસ્તુઓનો નાશ થાય છે. અતિથિને ઉપવાસ કરાવવો તે અનર્થને આમંત્રણ આપવા જેવું છે. બદેબાબાને સાઈસમર્થ દરરોજ જ ૫૦ રૂપિયા દક્ષિણા આપતા અને ‘સો’ ડગલાં એમની જેઠે વળાવતી વખતે વાતો કરતા કરતા જતા. તૈતીરિય ઉપનિષદ, વલ્લી ૧ અનુવાદ ૧૧ ‘અતિથિ દેવો ભવ’ અતિથિને માનવા.’ (ઓ. ૧૧૩-૧૨૭) બાબાની કરણીની બાબાને જ ખબર.

એ બદેબાબા ઉપર જ્યારે પેલા બકરાને હલાલ કરવાનો પહેલો વારો આવ્યો ત્યારે, ‘કેસા બે કાઠના ઈસકું ખાતી’ આને વગર કારણનો શા માટે કાપવો! એવા તેમના મોઢામાંથી શબ્દો નીકલ્યા. માધવરાવ ત્યાં જ હતા. પછી બાબાએ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

તેમને આજ્ઞા કરી, ‘શામા તું જ અને છરો લઈને આવ. બકરાને હવે આપણે કાપીએ.’ માધવરાવ ખૂબ ભરોસા પાત્ર હતા. રાધાકૃષ્ણાભાઈ પાસે જઈને તેઓ છરો લઈ આવ્યા અને બાબાની સામે મૂક્યો. ભલે તે છરો લાવવા માટે માધવરાવને તકલીફ પડતી હતી છતાં તેમણે તે છરા વિના આવતા જેવા તેવું બાબાને લાગતું ન હતું. એટલામાં આ વાતની ઉડતી ખબર રાધાકૃષ્ણાભાઈના કાને પડી અને તેમને હ્યા આવી અને એમણે છરો પાછો મંગાવી લીધો. માધવરાવ તરત બીજે છરો લેવા માટે ઉપદ્યા. કદાચ પોતાના હાથે પેલા મૂંગા જનાવરની હત્યા થયા, એવું ધારીને ત્યાં વાડામાં જ બેસી રહ્યા. પછી કાકાસાહેબ દીક્ષિતનું મન પારખવા તેમને આજ્ઞા કરી, ‘જ તું ! બકરાને કાપવા માટે છરો લઈ આવ અને તેને એની વેદનામાંથી છોડાવ.’ (ઓ. ૧૨૮-૧૩૪)

કાકાસાહેબ દીક્ષિત અતિશય ચોખ્યું સોનું હતા. તે બાબાને ખબર તો હતી જ, છતાં તપાવીને લાલ થઈ જય ત્યાં ચુંધીની તેમની કસોટી કર્યા વિના લોકજનોની આંખોમાં આ વાતની ખાત્રી થઈ શકે તેમ ન હતી. સોનું ચોખ્યું છે કે કસરવાળું છે તેની પરીક્ષા ન કરતાં, અને કાનસ કે કસોટી પથ્થર પર ન ઘસતાં ફક્ત બોલેતા ઉપર લોકો વિશ્વાસ રાખતા નથી. હીરાને પણ પોતાનો વૈભવ પ્રાપ્ત કરવા માટે નાની હથોડીના ઘા વેઠવા પડે છે. પથ્થરને પણ દેવની મૂર્તિનું માનસન્માન અને ડાડમાઠ અમસ્તો ફોગટમાં મળતો નથી. તેને પણ તે માટે ટાંકણાના ઘા સહન કરવા પડે છે. કાકા ભલે બાબાના ગળામાંનું એક તાંદીજ જેવા હતા. તેમ છતાં તેની ખાત્રી લોકોને કેવી રીતે કરવાય ? રત્નની પારખ કરનારા પારખુંઓ હીરાને પણ સુતરના દોરથી બાંધીને કિમત આંકવા માટે અગ્નિમાં નાખે છે. સંતોના શબ્દો પર વ્યેદો શંકા કરે છે તેમનો સંકલ્પ યશસ્વી થતો નથી. તેમને જેઠિતો જેમ તથા જુસ્સો નકામો મોઢાનો બડબડાટ ગણાય છે. તેમને પરમાર્થ જરાયે સાધતાં આવડતો નથી. પણ જે ગુરુનાં વચ્ચનો અભિપ્રાય વંદ્નિય માને છે તેમનો સ્વાર્થ અને પરમાર્થ એ બંને સફળ થાય છે. તેમાં જે નવીનતા અથવા તો દોષ જુએ છે તેનું અધિકતાં પતન થાય છે. જે ગુરુની સેવા કરવા માટે તત્પર હોય છે અને જેને ગુરુની આજ્ઞા પ્રત્યે આદર હોય છે, તે થોરાય અને અથોરાયનો વિચાર કરવાનું ગુરુને શિરે મૂકે છે. ગુરુની આજ્ઞાનો તો એ દાસ હોય છે. તેની પાસે તેનો પોતાનો કોઈ સ્વતંત્ર વિચાર નથી હોતો. નિત્ય ગુરુવચન પાળવા માટે ઉત્સુક એવો એ સાચું નરસું પણ જેતો નથી. તેનું ચિત્ત સાઈનામસ્મરણમાં અને દશ્ટ સાઈસમર્થનાં ચરણમાં, વૃત્તિ સાઈના ધ્યાન ધરવામાં અને દેહ સાઈના જ કામ માટે વપરાય છે. ગુરુની આજ્ઞા થવી અને તેનું પાલન કરવું આ બંનેની વચ્ચે એક ક્ષણનો વિલંબ તેને સહન થતો નથી. કેટલું આશ્ર્યકારક ધ્યાન આપવા જેવું આ છે ! (ઓ. ૧૩૫-૧૪૪)

કાકાસાહેબ દીક્ષિત આ ઔદ્ઘર્ય, સત્ય, ઈમાનદારી જેવા સદગુણોને ગંભીર પણે પાળનારા હતા. નિશ્ચયના મહામેરું જેવા ન ડગનારા પર્વત સમાન હતા. બકરાનો જીવ લેવા માટે તેને કેવી રીતે મારું આ વિચાર પણ તેમને સ્પર્શિતો ન હતો. નિરપરાદી જીવ મરશો, એનો આત્મા તરફડશો, પોતાની સ્વર્ચછ કીર્તિને અપયશ મળશો, કે પોતાને મોટું પાપ લાગશો આ વિચારો ત્યાં ન હતા. આજ્ઞાબંગ જેવું પાપ નથી, અને આજ્ઞા તરત સર્વ પ્રકારે પાળવા જેવું પુણ્ય નથી. જેને ગુરુની આજ્ઞા એ જ સર્વમાન્ય યોગ્ય નિર્ણય લાગે છે. તેને વિચિત્ર પ્રેરણા થાય છે અને તેનું સહજ કોમળ અંત:કરણ પ્રાણ હરવા માટે તૈયાર થાય છે. પછી કાકાસાહેબ દીક્ષિત સાઈના વાડામાં ગયા. તે આજ્ઞા પ્રમાણે શાસ્ત્ર લાવ્યા અને બકરાને મારવા માટે તલમાત્ર પણ ખચ્ચકાયા વગર તૈયાર થઈ ગયા. ગુરુની આજ્ઞાનું પાલન તે જ તેમના મનમાં શૌર્યનું સ્કૂરણ હતું. કાકાએ શાસ્ત્ર હાથમાં લીધું અને મન કઠણ કર્યું. તેમનો જન્મ પવિત્ર બ્રાહ્મણ કુળમાં થયો હતો. જન્મથી જ અહિંસાનું વ્રત ધારણ કર્યું હતું અને એવા માણસ ઉપર આવો પ્રસંગ આવ્યો હતો. તેમનો હાથ કેમ કરીને હત્યા કરવા માટે આગળ વધશો ? ગુરુની આજ્ઞા પાળવા માટે ફરીથી એકવાર તેમણે પાક્ઝો નિર્ધાર કર્યો છતાં તેમની છાતી ધક્કા ઉછળવા લાગી અને પરસેવો છૂટવા માંડયો. કાયા, વાચા અને મનથી જેમણે કોઈને પણ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

તીઆ શબ્દોથી પ્રહાર કર્યો નથી તેમને શક્ત પ્રહાર કરવાની ઘડી આવી ! જે ઘડાઈને આવનારું કઠણ કાર્ય દુર્ઘટના તે આ જી. ગુરુપથનોની જે ઉપેક્ષા કરે છે તેના જેવી દર્દુશા નથી હોતી. તેમના પૂર્વજન્મનાં પૂર્ણકર્મોનો સમૂળગો નાશ થાય છે. ગુરુની પૂર્ણપણે આજાનું પાલન તે કોઈ પણ શોભાયમાન વસ્તુ કરતાં વધારે શોભાયમાન સદ્ગુણ જ છે. એ જ ઉત્તમ શિષ્યની નિશાની છે. ગુરુ આજાનું ઉલ્લંઘન કરવું તે મહાન પાપ છે. ગુરુની આજાનું પાલન એક પણ ક્ષણ ગુમાવ્યા વગર કરવું. જે વિચાર કરવા માટે રોકાય છે તે કાં તો અચકાય છે તેને દૂદૈવી કે હતભાગી જ સમજવો. તેના માણસના ડ્રેમાં શિંગડા વગરનો પશુ જ સમજવો. આજા પાલન માટેની યોગ્ય તક આજા સારી કે ખરાબ હોય પણ તેનું તરત પાલન કરવું. થોડા સમય પછી ચાલશે તેવો વિચાર ન કરવો જેઠાં ઝટપણી ચીકણો અને સુસ્ત હોય છે. (ઓ. ૧૪૫-૧૫૭)

પછી દીક્ષિતે એક હાથે ધોતિયાનો કઠોટો માર્યો અને બીજા હાથો મજબૂત રીતે શક્ત પકડવા માટે પોતાના જભાની બાયો ઉપર ચઢાવી. તે બાંધો ચઢાવતાં ચઢાવતાં જ્યાં બકરો બેઠો હતો તે જગ્યાએ ગયા. ગામના મોટા ભાગના લોકો આશ્રયમાં ગરકાવ થઈ ગયા. ‘કેટલું હૈવી અને અદ્ભુત આ ફૃત્ય ! કાકાના મનની પેલી કુમાર કયાં ગઈ ? ફીરબાબા જતના મુસલમાન અને માંસ મચ્છી ખાનારા, તે પણ પેલા તરફતા બકરાને કાપવા માટે જ્યારે તૈયાર ન હતા, ત્યાં વળી આ કાકાની તૈયારી ! મહાન માણસોનાં હફ્ય વજ કરતાં પણ કઠોર અને ફૂલો કરતાં પણ અતિ કોમળ હોય છે તે ખું.’ પછી છરો હાથમાં મજબૂત પકડીને હાથ ઊંચા કરીને દીક્ષિતે બાબાને પૂછ્યું, ‘આને મારું કે બાબા ? એક વાર મને કહી દો’ ખરેખર તે શક્ત ધારણ કરવાં તે દુઃખી પ્રજના રક્ષણ માટે હોય છે. તેનાથી જ એક નિરપરાધી જીવને મારવો એ કેવું ? પણ ગુરુ સેવા કરતી વખતે જ્યાં પ્રાણની પણ પડી નથી હોતી ત્યાં વળી સંકોચ કેવો ? છતાં ઉતાવળે બકારને બલી આપવા માટે દીક્ષિતના હફ્યમાં હયા ઉપજ અને તેમનો છૂરો ખચકાતા પાછળ જવા માંડ્યો અને હાથ આગળ આવતો રોકાઈ ગયો. એટલામાં, ‘હું... બસ માર હવે, જેથાં શું કરે છે ?’ આવી બાબાની આજા સાંભળીને પ્રહાર કરવાનો આદેશ આપ્યો. તેઓ અહુદા પહુદા ગોળ ફર્યા અને ધૂરા સાથે હાથ અદ્ભુત કર્યો. બિચારા એ જનાવરના મૃત્યુની પળ હવે આવી ગઈ. ત્યાં તે જ કણે એનો રખવાળો ઇશ્વર ત્યાં હાજર થયો. હવે આ ચોક્કસ ખાત્રીપૂર્વક જ ધા કરશો, તેવું સમજીને સાઈમાવડીએ છેલ્લે સુધીની રાહ જેઠ હવે, અનર્થ થશે માટે બાબા બોલ્યા, ‘અરે.... જ, રહેવા..... હે, એ કાકા ! થોભી જ તારા હાથ પાછા લઈ લે... શું.... રે તારી નિષ્ઠુરતા ? શું.... રે તારી કઠોરતા ? બ્રાહ્મણ થઈને પણ હિંસા કરતાં મનમાં જરાય ખચકાટ તને ના થયો ?’ આ સાંભળતાં જ કાકાએ હાથમાંનો છરો ફેરી દીધો અને બાજુ ઉલેલા સૌને ખૂબ આશ્ર્ય થયું. બકરાના પ્રાણ સંકટમાંથી ઉગરી ગયા, તેને જીવતદાન મળ્યું અને બાબાએ ગુરુભક્તિનો મહિમા અતિ ઉચ્ચ શિખરે ચઢાવ્યો. (ઓ. ૧૫૮-૧૬૯)

પછી કાકાએ છરો નાખીને બાબાને શું કહ્યું એ તરફ વ્યવસ્થિત ધ્યાન આપો. ‘બાબા ! તમારાં અમૃત વચન તે જ અમારે માટે ધર્મશાસ્ત્ર. અમારે માટે બીજે કોઈ ધર્મ, નિયમ કે આચરણ અમે જાણતા નથી. અમને લાજ કે શરમ પણ નથી. ગુરુઆજાનું પાલન કરવું એજ અમારું કર્તવ્ય છે, અને એ જ અમારે માટે વેદશાસ્ત્ર પણ છે.’ ગુરુઆજાને પૂર્ણપણે માન આપવું એ જ શિષ્યો માટે શિષ્યપણું છે. અને એ જ અમારું ભૂષણ છે. ગુરુની આજાનો અનાદર કરવો તે અમારે માટે બધી દસ્તી દોષ આપવા યોગ્ય અને નિંદનીય વાત છે. ગુરુની આજા પાળવાથી અમે સુખી થઈશું કે દુઃખી તેના પરિણામ તરફ અમારું ધ્યાન નથી રહેતું. જેવું નસીબમાં હશે તેવું થશે. બાકી બીજી બધી ચિંતા તો પરમેશ્વર જાણો. બાબા ! અમને તો ફક્ત એક જ વસ્તુ ચાદ છે, તમારા નામને નિત્ય ભજવું, તમારા સ્વરૂપને આંખોમાં સંભળી રાખવું, અને રાત દિવસ આપની આજાનું પાલન કરતા રહેવું. હિંસા કે અહિંસા અમને સમજતી નથી. અમને તારનારા તો અમારા

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

સહગુરુનાં ચરણ છે. એમની આજા શાને માટે છે, એનો વિચાર પણ અમે મનમાં કદી લાવતા નથી. તેમની આજાનું બસ પાલન એ જ અમારું કર્તવ્ય સમજાએ છીએ. જ્યાં ગુરુની આજા સ્પષ્ટ હોય ત્યાં યોગ્ય કે અયોગ્ય, લાભકારક કે હાનિકારક આવો વિચાર જે શિષ્ય કરે છે, તેનું પતન થયેલું છે એમ જાણું અને ગુરુની સેવાથી તે ભણ થયેલો છે એવું અમે સમજાએ છીએ. ગુરુઆજાનું ઉલ્લંઘન એ જ અમારે માટે અધઃપતન છે. અને ગુરુની આજાનું પરિપૂર્ણ પાલન કરવું એ જ અમારે માટે મુખ્ય ધર્મનું આચરણ છે. અમારું ચિત્ત સહાને માટે ગુરુચરણમાં જ ધ્યાન નિષ્ઠ છે. અમારા પ્રાણ જય કે રહે, તેની અમને જરાયે પરવા નથી. ગુરુની આજા એ જ અમારે માટે સર્વમાન્ય નિર્જય અને પ્રમાણ છે. એનું પરિણામ કે એનો અંત એ તો ગુરુ જ જાણે. અમે અર્થ કે અનર્થ આ બંને જાણતા નથી. અમને અમારું પોતાનું હિત કે સ્વાર્થ અથવા તો બીજાનું હિત સમજાતું નથી. અમે ફક્ત ગુરુનું જ કાર્ય સિદ્ધ કરવાનું સમજાએ છીએ. એ જ અમારે માટે પરમાર્થ છે. ‘ગુરુ વચનોની સામે અમુક સારું, અમુક ખરાબ, અમુક કરવું, અમુક ન કરવું આ વિષેના નિયમોનો વિચાર કંઈ કામનો નથી. શિષ્યનું લક્ષ્ય ગુરુના વ્યવસ્થિત આજા પાલન તરફ અને કર્તવ્ય તરફ જ હોય, એટલે એનું રક્ષણ કરવાની પૂરેપૂરી જવાબદારી ગુરુના શિરે જ હોય છે. અમે તો તમારી આજાના દાસ છીએ. યોગ્ય અયોગ્ય મનમાં લાવવાના નથી. સમય અને પ્રસંગ જે આવે તો પ્રાણની આહૃતિ આપીને પણ ગુરુવચનનું પાલન અમે છીએવાના નથી.’ (ઓ. ૧૭૦-૧૮૧)

મૂળ સ્વભાવમાં જે મને અતિશાય દ્વારાલ હોય તે જ પાણાણ જેવું કઠણ પણ થાય છે. મ્લેચ્છ પણ જે કરવા તૈયાર થતા નથી, તે કરવા માટે બ્રાહ્મણો તૈયાર થતા હોય છે આ વાત શ્રોતાઓને અશક્ય લાગશે. પણ આ સહગુરુનો જાહુ છે. એકવાર ગુરુનાં વચનો પાળવાં તૈયાર રહે એટલે એનો ગહન અર્થ તરત સમજાશે. એકવાર તેનો સહારો લીધો કે તેના ચરણમાં પૂર્ણ વિશ્વાસ મૂક્યો તે પછી શિષ્યની ચિંતા તેને હોય છે. શિષ્યને કોઈ પણ જાતની વેઠ કરવી પડતી નથી. તેના ચરણોમાં પોતાને વહેવા દો, પછી કોઈ પણ જાતનો ભય રહેતો નથી. ગુરુ તે જ તેનો આત્મવિશ્વાસ છે અને તેને સામે પાર સહારો આપીને પહોંચાડ્યે. શિષ્યો ત્રણ પ્રકારના હોય છે. ઉત્તમ, મધ્યમ અને અધમ. દરેક પ્રકાર ખૂબ જ સ્પષ્ટ કરીને દૂંકાણમાં સમજાવું છું. ગુરુ ના ન કહેતા, તેના મનની દિચણ જાણીને અને જાણ્યા બાદ પ્રત્યક્ષ આજાની રાહ ન જોતાં જ સેવા કરવા માંડે છે તેને ઉત્તમ શિષ્ય સમજાવો. ગુરુએ આજા આપ્યા બાદ તેનો જરાય વિલંબ વગર અક્ષરે અક્ષરનું પૂર્ણ પણ પાલન કરનારાને મધ્યમ શિષ્ય ગણવો. ગુરુ આજા કરતા જ રહે, કરું છું, કરું છું એવું કહેતો રહે અને દરેક પગલે મોટી ભૂલો કરતો રહે તેવા શિષ્યને અધમ જાણવો. જેના શરીરમાં શ્રેષ્ઠ વૈરાગ્ય નથી, જે નિત્ય કર્યું અને અનિત્ય કર્યું તેવો વિચાર પણ કરતો નથી, તેવાનો ભેદેને આખો જન્મ ગુરુના સાનિધ્યમાં ખર્ચી નાખે તો પણ તેની ઉપર ગુરુકૃપા કેવી રીતે થઈ શકે? પણ તે જે ગુરુનાં ચરણમાં અખંડ શ્રદ્ધા મૂકીને બેઠેલો છે, તેવાની દિચણ પરમેશ્વર જ પુરી કરે છે. તેને જલ્દીથી જ નિષ્કામ કરીને પરમેશ્વર તેને શાંત પ્રકૃતિનો કરી દે છે. શ્રદ્ધાનું બળ શુદ્ધ અને નિર્મળ હોવું જેઠાએ, ઉપરાંત બુદ્ધિનું બળ વધારે પ્રબળ જેઠાએ. અને સાથે સભૂરીનો કયારેય ન ખ્યકાય એવો સંગાથ જેઠાએ એટલે પરમાર્થ સબળ હાથમાં આવ્યો એવું સમજાડ્યો. અહીંયા શાસોશ્વાસ ઝંધવો પડતો નથી. અપાન અને ઉદ્દાન વગેરે પ્રાણવાયુની શુદ્ધિ કરવી કે શોધ કરવી નથી પડતી. અથવા તો હઠયોગની સમાવિ અને તેમાંથી ફરી પાછું શુદ્ધ ઉપર આવવું એવું કંઈ પણ કરવું પડતું નથી. આ બધાં સાધનો અમારે માટે સમજવાં કે આચરણમાં મૂકવા અધરાં છે. શિષ્યની ભૂમિકા તૈયાર થતાં જ સહગુરુ દ્વારા થતી ફળપ્રાપ્તિ માટે જરા પણ વાર લાગતી નથી. ગુરુ પણ કૃપા કરવા માટે સહાય તત્પર ઊભા હોય છે. સગુણ ડ્ર્પનો સાક્ષાત્કારનો અનુભવ કે પ્રતીતિ ફક્ત ભક્તોને અનુભવવા મળે છે. ભાવિકોના મનામં જ ભક્તિ ઉત્પન્ન થાય છે. બાકી બીજાં બધાનાં મનમાં માત્ર ઢોંગીપણું અને દંબની કલ્પના જ હોય છે. (ઓ. ૧૮૨-૧૮૫)

પછી તરત શ્રી સાઈબાબાએ કાકાને કહ્યું, ‘આ પાણી ભરેલું ટમ્બલર હાથમાં લે. હું હવે તેને મુસલમાન ધર્મની

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

વિધિ પ્રમાણે હલાલ કરીને એને સદ્ગતિ આપું છું.' એ બકરો તો પહેલેથી જ એક તો મરણતોલ દશામાં હતો. પાસે જ ફીરી લોકોને બેસવા ઉઠવાનું ધર તકીયો હતો. ફીરખાબાને સમયસર એક વિચાર આવ્યો. તે પ્રમાણે તકિયા પર લઈ જઈને એ બકરાને હલાલ કરવાની તેમણે સંમતિ બાબા પાસેથી લઈ લીધી. અને પેલી બીજી જગ્યા ઉપર બકરાને ખસેડવા જતાં જ તે કુદરતી રીતે મરણ પામ્યો. બકારનું મૃત્યુ ચોક્કસ થવાનું જ હતું, તે વાત તો બધા જાણી ચૂક્યા હતા. પણ આ યોગ્ય સમય જોઈને બાબાએ આ આખો ય ખેલ રચ્યો હતો. સદ્ગુરુના શરણે જે જય છે તે સદ્ગુરુ રૂપ જ થઈ જય છે. મીઠાને જે સમુદ્રના પાણીમાં ઓગાળવા માટે નાખવામાં આવે તો એ કદી બહાર આવી શકવાનું છે ? તેવો આ જીવાત્મા એ સંસારનો સુખ દુઃખોનો અનુભવ કરનારો ભોક્તા છે, જ્યારે ઈશ્વર સંસારનાં સુખ અને દુઃખોનો અનુભવ આપનારો ભોગ પ્રદાતા છે. પણ મોક્ષ આપનારો તો સદ્ગુરુ એકલો જ છે. તે આપણા બધા આત્માઓના ઐક્યનો સમુહ છે. હદ્યમાં કૃપા દાખિ ઉપજે તો જ સદ્ગુરુ દિવ્ય દાખિ આપે છે જેને કારણે આખી ચૂષિ એકી વખતે આંખોમાં સમદી જય છે. (ઓ. ૧૯૬-૨૦૨)

હેમાડપંત સાઈબાબાના શરણે આવ્યા છે. અને ત્યાં પોતાના દેહ અભિમાન છોડી દે છે. તે મનમાં કહી રહ્યા છે કે, 'હે મારા મન, સાવધ થા. બાબા ! મારા દેહનું અભિમાન નાચ કરી નાંખો.' હવે આગળના બે અધ્યાયોમાં સાઈ મહારાજ છેઠા વિનોદમાં મિશાનઙ્ઘપી ભોજન તૈયાર કરશે. અને લગતી એક આશ્રયકારક વાત સાંભળો. જેવામાં તે સાધારણરીતે વિનોદી છે, પણ તે અત્યંત ઉપદેશકારક અને બોધદાયક પણ છે. જે ભાવિક ભક્ત તેમાંની શિખામણ પ્રયત્નોથી આચરણમાં મૂક્ષો તેને પુષ્કળ સુખનો લાભ મળશે. (ઓ. ૨૦૩-૨૦૪)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજ્જનોની પ્રેરણા પામેલા ભક્ત હેમાડપંત રચિત.  
શ્રી સાઈસર્વના સત્ય ચરિત્રના 'ગુરુ ભક્ત લીલા દર્શન' નામનો ત્રૈવીસમો અધ્યાય સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણ.



## અધ્યાય ૨૩નું અર્થ વિવરણ

આ અધ્યાયમાં એક યોગ અભ્યાસી, શ્યામા, કાકાસાહેબ દીક્ષિત આ ત્રણેની કથાનો સાર એવો છે કે, સંત અથવા તો ગુરુ ગમે તેવી રીતે વર્તે અને આપણી ઉપર ગમે તેટલો ગુસ્સો કરે, તેમ છતાં તેમની ઉપરની આપણી શ્રદ્ધા અડગ રહેવી જોઈએ. તેમજ તેમનો પીછો ન છોડતાં અને તેમની કોઈ પણ પ્રકારની આજાઓનું અક્ષરસ: પાલન કરવાથી તો છેવટે આપણું જ કલ્યાણ થાય છે. તે દેખાઈ આવે છે અને તે આપણા ભલા માટે જ હોય છે. પેલો યોગ

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

અભ્યાસી બાબાને વાસી ભાખી અને કાંદો ખાતા જોઈને પહેલાં તો મનથી ખચકાયેલો પણ ત્યારબાદ તે નમ્રપણે બાબાને શરણે ગયેલો અને પોતાના આયુષ્યનું મોટું કલ્યાણ સાધી લીધેલું. શ્યામાને સર્વદેશ થતાં ગામનાં લોકો રીતરિવાજ પ્રમાણે વિરોભાની પાસે લઈ જવા માટેનો આગ્રહ કરતા હતા પણ તેઓ ત્યાં ન જતાં મસ્જિદમાં બાબા પાસે દોડેલા. બાબાએ તેમને ગુસ્સાથી લાલપીળા થઈને ‘ભટુરડચા’ કહીને કાઢી મૂક્યા હતા, છતાં તે ત્યાં પગથિયાં ઉપર બેસી રહ્યા અને પછી બાબાએ કૃપાળું થઈને તેમના પ્રાણ બચાવેલા. કકાસાહેબ દીક્ષિતે આયુષ્યમાં કયારેય માંસાહાર કર્યો ન હતો અને શક્તિ તો હાથમાંય પકડ્યું ન હતું, પણ બાબાની આજ્ઞા થતાં તેઓ તરત જ એક બકરાની હત્યા કરવા માટે ખુશીથી તૈયાર થયા હતા. આ કેટલી મહાન ગુરુભક્તિ ! બાબાએ તેમને વ્યાક્ષણ થઈને હિંસા કરે છે । કોઈ વિચાર કે ચિંતા કરતો નથી ॥ આવો પ્રક્રષ્ટ પૂછતા કાકાએ ગુરુની ભક્તિ અને ગુરુઆજ્ઞા પર જે ઉત્તરો આપ્યા એ ઘણા મૂલ્યવાન છે -

‘બાબા આપની અમૃતવાજી । ધર્મશાસ્ત્ર તે જ નક્કી ॥૧૭૦॥  
 અમે ન જાણીએ બીજો ધર્મ । અમને નહીં લાજશરમ ।  
 અમારું તો એ જ વેદશાસ્ત્ર । ગુરુપાલન એ જ ધર્મ ॥૧૭૧॥  
 ગુરુઆજ્ઞાનું પરિપાલન । એ જ શિષ્યનું શિષ્યત્વ ।  
 એ જ અમારું જિનભૂષણ । અવજ્ઞા સર્વાર્થી દૂષણ ॥૧૭૨॥  
 અમે તો દાસ આપની આજ્ઞાના । યોગ્ય અયોગ્ય ન જાણીએ મનમાં ।  
 જીવન દઈએ સમય આવતાં । પણ ગુરુવચન પ્રતિપાણીએ ॥૧૮૧॥’

હેમાડપંતે અમસ્તુ કકાસાહેબને ‘બાવન વખત ચકાસેલું સોનુ’ અને બાબાના ‘ગણનું તાવીજ’ કહીને સંબોધિત કર્યા નથી. બાબાએ પણ તેમને ‘તને તો હું વિમાનમાં લઈ જઈશ’ આવું અભય વચન આપ્યું હતું. એટલું જ નહિ પણ છેક છેલ્લે સુધી તંદુરસ્ત હાલતમાં રાખીને અને એકાશીના પવિત્ર હિવસે તેમને શ્રેષ્ઠ મરણ પણ આપ્યું. અધ્યાય પ૧માં હેમાડપંત વર્ણન કરે છે કે -

રેલગાડીના એક ડિલ્લામાં । અમે બેઠા હતા પરસ્પર ।  
 ચકચૂર હતા સાઈની વાર્તામાં । તવ એકદમ વિમાને ચઠ્યા તે ॥૧૦૪

આ કહેતાં કહેતાં વચ્ચે જ હેમાડપંતે માણસનો જીવ સંસારપાશમાં પોતાને એમાં કેદ કરીને કેવો આનંદ માણતો હોય છે પણ પૂર્વના પૂર્ણયોને હિસાબે અને ઈશ્વરની કૃપાથી તેની સહગુરુની સાથે મુલાકાત થતાં અને તેને પોતાના સ્વર્સ્વરૂપનું ખરું ભાન થતાં તે મુક્તિ કેવી રીતે મેળવી લે છે તે બાબતને આ જીવને પહેલા દુક્કરની અને પછી પોપટની ઉપમા આપીને અત્યંત સુંદર કાવ્યમય રીતે કહ્યું છે કે-

હોય જે કે અલ્પ જલાશય । દુર્ગધવાળું પણ અતિશય ।  
 તેનું જ સુખ નિરતિશય । માને નિઃસંશય દુક્કર ॥૨૨॥  
 જીવ શુકની દશા એક છે । એક દેહે બીજો પીંબરે ।  
 સ્વાતંત્ર્ય તો ખોયું તેણે । પણ પરતંત્રતા તેને ગમે ॥૨૩॥  
 કૂપમંડૂક જેવો આ શુક । પાંજરામાં તેનું સૌ સુખ ।

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

---

જાણો ન સ્વાતંશ્યનું કૌતુક । જીવ પણ એવો સકામ ॥૨૪ ॥  
 સુંદર પીંજરુ મહારુ કેવું । સુવર્ણ દાડીનું આવવું જવું ।  
 સુખી ઊંધો ટાંગતાં પણ હું । ધૂટે ન મહારો પગ અહીંથી ॥૨૫॥  
 બહુાર તો આ સુખ ના મળો । દાડમદાણા ત્યાં ન મળો ।  
 ના કંઈ ભરયાં ખાવા મળો । સ્વસુખ જાતે ઓવું પડે ॥૨૬॥  
 પણ આવતાં શુકની ઘડી । લાધે તે અવટિત ઘડી ।  
 મારે તેને પ્રેમે થાબડી । ને અંજન આંજે આંખમાં ॥૨૭॥  
 તે થાપટના શક્તિપાતે । તે નાસે ને આંખ ઉધાડે ।  
 ઉડવા લાગે પાંખ વડે । કોણ તેને રોકી શકે ॥૨૮॥  
 તેને જગ અફાટ ખૂલે । યથેચું દાડમ પેરુ મળો ।  
 સ્વરચ્છ ગગને મોકણે તે વિહૃરે । સ્વાતંશ્ય સુખ ઉત્સવ માણે ॥૨૯॥  
 તેવી જ આ જીવની સ્થિતિ । ઈશ્વરાનુગ્રહ ગુરુપ્રાપ્તિ ।  
 ઉભય લાભથી બંધન-મુક્તિ । સ્વાતંશ્યસુખ તે અનુભવે ॥૩૦॥

બૃદ્ધભાબાના માર્ગદર્શન અને વાર્તામાં પણ સંસારી માણસને અતિથિઓનું તેની પાત્રતા જેયા વગર જમવાનું આપીને  
 કેવું સ્વાગત કરવું જોઈએ તેનું શિક્ષાણ બાબા દ્વારા આપણને મળે છે. આ વિષય ઉપરની આપણા ધર્મશાસ્ત્રમાંની  
 શિખામણ પણ હેમાઉપંત આપતાં કહે છે કે -

અતિથિપૂજને ઈષ્પ્રાપ્તિ । થાય તેથી અનિષ્ટનિવૃત્તિ ।  
 તેમ ન કરતાં વિધન નક્કી । આવે શિષ્ટ તેથી પૂજે તેમને ॥૧૨૫॥  
 રહે અતિથિ આધા વિષા । પશુ-પુત્ર-ધન-ધાર્ય વિનાશન ।  
 પડતાં અતિથિને ઉપોષણ । આમંત્રણ મળે અનર્થને ॥૧૨૬॥

સારાંશ, આ અધ્યાયમાં બીજી ઘણીબધી બોધપ્રદ વાતો હોવા છતાં ગુરુભક્તિનો મહિમા જ આ અધ્યાયનો મુખ્ય  
 વિષય રહ્યો છે.

પણ જે છે ગુરુપદે નિરંતર । કરે પૂર્ણ ઈચ્છા તેની ઈશ્વર ।  
 નિશ્ચળ નિર્જામ કરે સત્વર । તે પરાત્પર સગો છે ॥૧૬૧॥  
 હોય શિષ્યની લૂભિકા તૈયાર । સહગુરુ સિદ્ધિને ના વાર ।  
 તે તો છે અનુગ્રહતત્પર । ઊભા છે એક પગે ॥૧૬૪॥



## ॥ અધ્યાય ૨૪ ॥

### વિનોદ વિલાસ

(ઠઠા મશકરીનો ઘેલ)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,  
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

પાછલા અધ્યાયમાં દ્વાના સાગર કરુણાનિધિ શ્રી સાઈનાથ મહારાજ ઠઠા મશકરી દ્વારા કેવી શિખામણ આપતા હતા તે કહીશ એમ મેં વચન આપ્યું હતું. ‘કહીશ’ એ પણ હું પણાનો જ પ્રકાર ! ચરિત્રકારે સદાને માટે પોતાનું હું પણ હું ગુરુચરણમાં ત્યલુ દેવું જોઈએ. અને તેનું શરણ લઈએ એટલે કથા આપોઆપ કહેવાઈ જશે. તો શ્રોતાઓએ તેને ફક્ત આદરથી સાંભળવી. સદાય કલંક રહિત અને પાપ રહિત એવા સાધુ સજબન અને મહાપુરુષો વાદળ વગરના નિર્મળ અવકાશ જેવા સ્વચ્છ તથા કોઈપણ પ્રકારના ખરાબ આચરણ વગરના હોય છે. સાઈમહારાજનું ભજન સ્વાર્થ અને પરમાર્થ એ બંને ગ્રાપ્ત કરવાનું સાધન છે તેમજ આત્મસ્વરૂપ તરફ ધ્યાન દોરીને જીવને સમાધાન આપનારું છે. જેના મનમાં પોતાનું હિત સાધવાનો મક્કમ નિર્ધાર છે, આ કથા તેનું જીવન સાર્થક કરશે. આ કથાના શ્રવણથી શ્રોતાઓના આત્માને શાંતિ મળશે અને સંસાર તરફનો કારણ વગરનો ભય દૂર થશે. પરમાનંદનો લાભ મળશે અને મરણોત્તર સમયની અવસ્થામાં સારી દશા ગ્રાપ્ત થશે અથવા સારો જન્મ થશે. સાઈસમર્થ બીજના મનની વાતો જાણનારા હોવાને કારણે ભક્તતોની ભાવનાઓનો હેતુ ઓળખીને તેને માટે જરૂરી પોતાનું કર્તવ્ય પૂર્ણ કરી આપેલાં વચનો પૂરા કરશે. સાઈ સમર્થ જ મારી બુદ્ધિને પ્રેરણા આપનારા છે. તેઓ પોતાનાં વચનોનો આશય મારા દ્વારા બોલાવી રહ્યા છે. મારી બુદ્ધિ પ્રમાણે સ્વાર્થ અને પરમાર્થ સાધી આપનારા તેમના સારાંશનું હું કથન કરીશ. આંદળા કે રતાંધળાં ન હોવા છતાં સારી આંખોએ પણ લોકો આંદળા હોય છે. દેહ બુદ્ધિના યોગે તેમને પોતાનું હિત સમજતું નથી. આ દેહ પણ કેવો છે ? તેનો ક્ષણનો ભરોસો નથી. આપણી સામે હુંના ઉપરાણાંની ચાદર પાથરી આજીજીપૂર્વક વિનંતી કરું છું કે, આ કથાનું પાન અને રસ જરૂર ચાખો. (ઓ. ૧-૧૦)

ઠઠા વિનોદ બધાને જ પસંદ હોય છે. પણ શ્રી બાબાની મજલક કરવાની રીત વિચિત્ર પ્રકારની હતી. ગમ્મત દ્વારા પણ તેઓ સૌના કલ્યાણનો સાર સાંભળનારાંના મનમાં છસાવતા હતા. લોકો સાધારણ રીતે મજલક મશકરી કરનારાના નાહે ચઢતા નથી. પણ બાબાની મજલક મશકરીની રીત માત્ર સારી ટેવ પાડવા માટે અને ર૨ લગાડવા માટે રહેતી. પોતાના હિસ્સામાં એ કથારે આવશે તેની તેઓ હંમેશા રાહ જોતા હતાં. મજલક મશકરી સાધારણ રીતે દેરેકને પસંદ નથી હોતી. પણ બાબાની મજલકની રીત દેરેકને ખૂબ જ ગમતી. તેમાં પણ તેઓને જ્યારે હાવભાવ અને અભિનયનો સાથ મળતો ત્યારે તેનો હેતુ તરત જ સમજતો. સ્વાભાવિક રીતે પ્રયત્નો સિંહાય કરેલો અભિનય હસતો ચેહેરો અને આંખોના ગમતી હાવભાવને કારણે જ્યારે તે પાછા રસ સભર હોય ત્યારે એ મજલકના શ્રેષ્ઠ માધુર્યનું વર્ણન કર્યું અશક્ય થતું. (ઓ. ૧૧-૧૪)

હવે મારા અનુભવની નવીનતાપૂર્ણ અને ઉપરેશવાળી એક વાત કહું છું. મજલકમાંથી પરમાર્થની શિખામણ કેવી રીતે ઉદ્ભબી તેનું ગૌરવપૂર્ણ વર્ણન સાંભળો. દેરેક રવિવારે શિરડીમાં અઠવાડિયાનું એક મોટું બજર ભરાતું. ઉઘાડા મેદાનમાં

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

તંબુ ઠોકીને ખરીદ વેચાણનો વહેવાર શકું થતો. ત્યાંના રસ્તાની બંને બાજુએ જ્ઞતજ્ઞતના શાકભાળના ઢગલા અને ભાલ ખડકાતા. ધાંચીઓ અને તંબોળીઓ વગેરેના સમૃદ્ધાયો ચાર રસ્તા ઉપર બેસ્તા. આવા એક રવિવારે બપોરના હું બાબાના પગ દ્વારાવતો હતો. એટલામાં એક આશ્ર્ય પમાડે એવી વાત બની. બપોરનો એ દરબાર હંમેશાને માટે ખૂબ ખીચોખીય ભરાયેલો રહેતો. અને તેમાં પણ રવિવાર અને બજારનો દિવસ હોવાને કારણે પુષ્કળ લોકોની અવરજનવર અને ગિર્દી વધી હતી. બાબાની સામે જમણી બાજુએ બેસીને નીચી ગરદન કરીને હું ધીમે ધીમે નામસ્મરણ કરતો. તેમના પગ દ્વારી રહ્યો હતો. માધવરાવ ડાબા હાથે, વામનરાવ જમણા હાથેથી દક્ષિણ તરફ અને શ્રીમંત ગોપાળરાવ બુદ્ધી એમની કાયમની જગ્યા ઉપર બેઠા હતા. કાકાસાહેબ દીક્ષિત પણ ત્યાં નણક જ બેઠા હતા. એટલામાં માધવરાવ હસ્યા અને, કહે ‘આણાસાહેબ આ દાણા શાના ચેટેલા દેખાય છે !’ એવું કહેતાં તેમણે મારા કોટની બાંધનો આંગળીથી સ્પર્શ કર્યો. તે વખતે એ કોટની વળમાંથી લીલા ચણાના દાણા પડ્યા. એ શું છે એવું જેવા જતાં ડાબા હાથની કોણી લંબાવતા નીચે તે ગબડતા અને નીચે પડતા દેખાયા અને ત્યાં બેઠેલાઓ તેને ભેગા કરવા લાગ્યા. બેઠેલાઓએ એક એક કરી બધા ભેગા મળીને લગભગ પાંચ પચ્ચીસ દાણા ભેગા કર્યા અને એ એક ગમ્ભતનું કારણ બની ગયું. આમ કેવી રીતે બન્યું તેની ઉપર ત્યાં બેઠેલ મંડળીમાં તર્ક અને વિવાદ ચાલ્યો. જે – તે બધા વિચારમાં ગરક થઈ ગયા. એ ચણાના દાણાનો અને કોઈનો સંપર્ક કેવી રીતે થયો હશે ? એ બાબતનું બધાને આશ્ર્ય થવા લાગ્યું. ખાખી કોટને વળી કરચલીઓ કેટલી અને એમાં આટલા બધા દાણા સમાયા જ કેવી રીતે ? તે કયાંથી આવ્યા અને કેવી રીતે આવ્યા તે કોઈને સમજતું ન હતું. હું નામસ્મરણની ધૂનમાં બાબાનાં ચરણોની સેવા કરી રહ્યો હતો, ત્યાં વળી વચ્ચેથી આ દાણાનું આપ્યાન કયાંથી ઉત્પન્ન થયું હશે ? આટલી વાર સુધી સેવા કરતો હતો ત્યારે જરાય પડ્યા નહિ અને આટલી બધી વાર એ કરચલીમાં રહ્યા કેવી રીતે ? તેનું બધાના જ મનમાં આશ્ર્ય થયું. તે દાણા આચ્યા કયાંથી, અને કોટની બાંધની રહ્યા કેવી રીતે તેનો દેરે જણ વિચાર કરવા લાગ્યા. ત્યાર પછી બાબા શું બોલ્યા તે સાંભળો. (ઓ. ૧૫-૩૦)

શૈક્ષણિક બોધ આપવા માટેની દેરેકની પોતાની જુદી જુદી પદ્ધતિઓ હોય છે. સાઈનાથ મહારાજ જેની જેટલી પહોંચ અથવા તો પ્રગતિ હોય તે જ પ્રમાણે તેને શિખામણ આપતા. તેમની રીત વિચિત્ર હતી. અને તેમની પદ્ધતિ ખૂબ જ મજેદાર અને ચાદ રહી જન્ય તેવી રહેતી હતી. બીજે કશેથી જેવામાં આવેલો કે સાંભળવામાં આવેલો એવો અનુભવ મને થયો નથી. બાબા બોલ્યા, ‘આ હેમાઉપંતને એકલા એકલા ખાવાની અને મજા માણાવાની ખૂબ જ ખરાબ આદત છે. આજે બજારનો દિવસ જેઠને એ પેટ ભરીને દાણા ખાઈ આવ્યો હશે. એકલા એકલા ખાવું સારું નહીં. પણ આની નબળાઈ મને ખબર છે. આ દાણા જ એની સાક્ષી પુરાવે છે. તેને માટે આટલું બધું વગર કામનું આશ્ર્ય કેમ કરો છો ?’ આ સાંભળી (હેમાઉપંત) હું બોલ્યો, ‘કોઈને આચ્યા વગર એકલું ખાવું એની તો મને ખબર જ નથી. માટે આ ખરાબ ટેવની વાત મને લાગુ પડે છે એ કથન ખરાબર નથી અને મને લાગતું વળગતું પણ નથી. બાબા ! મેં આ કાણ સુધી શિરડીમાંનો આ હાટ ભરાયેલો જેયો પણ નથી. હા ત્યાં ગયો હોત તો દાણા લીધા હોત, પણ ખાવાની વાત તો બહુ હૂન્ની રહી. બીજી કોઈને કદાચ એકલું ખાવામાં મજા આવતી હશે, પણ મને તો એવી જરાય ટેવ નથી.’ ત્યારપછી કોઈ એક ચોક્કસ ભક્તતની પોતાનાં ચરણો પર તેની ભક્તિ દઢ કરવા ખાતર ખાવાની યુક્તિ જુઓ. મારો આવો સ્પષ્ટ ઉત્તર સાંભળીને તેઓ શું બોલ્યા તે ધ્યાન રાખો, ‘તારી પાસે જ હોય છે, તેને તો તું જરૂર આપે છે, પણ સમજે કે પાસે કોઈ ના હોય તો તું શું કરવાનો ? હું પોતે પણ આવી પરિસ્થિતિમાં શું કરી શક્યો હોત ? પણ મને તો ચાદ કરે છે ને ? હું નથી કહે તો તારી પાસે છે ? મને તું એકાદો કોળિયો ખવડાવે છે ?’ આ પ્રકારે દાણાનું કેવળ નિમિત્ત બનાવીને બાબાએ એ કાયમ કરનારું તત્ત્વ મારા મગજમાં ઉતારી દીધું. ઇન્દ્રાંગોના અધિષ્ઠિત અને બધા હેવતાઓ, પ્રાણ, અપાન આહિ પંચપ્રાણ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

અને પંચાંગિને ફસાવીને અને વૈશ્વદેવ પછી અતિથિને છોડીને જે લોક બોજન કરી છે, તેમનું આજ્ઞ દૂષિત છે એમ સમજવું. પાંચ આદિ પાપોનો ક્ષય કરવા માટે ગૃહસ્થે કરવા પડતા પંચયજ્ઞ અંગેનું સવિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. એમાંથી બ્રહ્મયજ્ઞને સિવાય બાકી રહેતા બીજા ચાર યજ્ઞ એટલે દેવયજ્ઞ, ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ અને મનુષ્યયજ્ઞનો સમાવેશ ઉપર જરૂર વૈશ્વદેવ કર્મમાં થાય છે. બલિવૈશ્વદેવ કરવાથી મનુષ્યનાં બધાં જ પાપો નાશ પામે છે. આ કર્યા બાદ વધેતા અજ્ઞને ‘યજ્ઞશિષ્ટ’ અન્ન કહેવામાં આવે છે. ગીતામાં અધ્યાય ઉમાં શ્રી કૃષ્ણભગવાને કહ્યું છે કે, યજ્ઞશિષ્ટાશિનઃ સન્તો મુચ્યન્તે સર્વ કિલિબ્યષે: । બુક્રજતે તે ત્વધં પાપ યે પચન્યાત્મકારણાત् ॥૧૩॥ યજ્ઞમાં બચેતા શેષ ભાગનું સેવન કરનારો સદ્ગૃહસ્થ બધાં જ પાપોમાંથી મુક્ત થાય છે. પણ જે લોકો પોતાને માટે જ રંધે છે અને સેવન કરે છે, તે પાપી જીવ પાપનું જ ભક્તાશ કરે છે. આ તો થઈ શાસ્ત્રોક્ત વિધિની શિખામણ. પણ બાબાની શિખામણ ખૂબ જ વ્યવહારું રહેતી. જમવાના સમયે તો આ વિધિ ધ્યાન દઈને પાળી શકાય. પણ બીજી બધી વખતે આપણે જે ખાતા હોઈએ છીએ તેનું શું ? આમ અધીરા થઈને સ્વાર્થપણે, બીજને ન આપતાં આવાનું શા માટે ? આવું કરાવાથી તો આ વિધિનું ખૂબ તત્ત્વ ન પાળવા જેવું જ થયું. માટે બજલરમાંથી લીધેલ ચણા સુદ્ધાં, બીજન બધાને આપીને પછી પોતે ખાવા પણ જ્યારે ન હોય ત્યારે શું કરવું ? આવા પ્રસંગે પરમેશ્વરને અથવા તો ગુરુને યાદ કરીને તેમને અર્પણ કરવું. કેટલી સુંદર અને વ્યવહારિક બાબાની આ શિખામણ ! (ઓ. ૩૧-૪૧)

આ જ્ઞેવામાં ખૂબ નાની વાત લાગે છે, પણ વ્યવહારમાં સ્વિકારાય તો અતિશય મહત્ત્વનું છે એ ધ્યાનમાં આવશે. આ જીભથી સ્વાદ લેવા માટે એટલે કે મોઢેથી કાંઈ પણ આરોગવા માટે કાંઈ કહેવામાં આવ્યું છે, એ તો ફક્ત થોડુંક લાક્ષણીક કહેવાય. ખરો અર્થ તો, આ પાંચે ય વિષયો માટે લાગુ પડે છે. જે માણસને વિષયોનો ઉપભોગ કરવાની વાસના હોય છે તેમને પરમાર્થનો લાલ મળતો નથી. વિષય વાસના ઉપર જે કાખૂ મેળવે છે ત્યારે પરમાર્થ તેનો દાસ બની જય છે. ‘થદા પશ્ચાવતિજ્ઞને શાનાનિ મનસા સહ । બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતિ તામાઙુઃ પરમાં ગતિમ્’ ॥૧૦॥ (યોગ અભ્યાસ કરતાં કરતાં જ્યારે મન સહિત પાંચે ઇન્ડિયો બિલકુલ સ્થિર થઈ જય છે અને બુદ્ધ પણ કોઈ પણ જતની ચેષ્ટા કરવા માટે અટકતી નથી, તે સ્થિતિને યોગની સર્વોત્તમ સ્થિતિ કહેવામાં આવે છે.) આવું જે કઠોપનિષદ્ધમાં અધ્યાય ૨. વલ્લિમાં ઉમાં મંત્રમાં જે કહ્યું છે, તે જ બાબા આ મશકરીમાં વધારે સારી રીતે દસાવવા માંગતા હતા. શબ્દ, સ્પર્શ, ઝ્રિ અને ગંધ આ બાકી ચાર વિષયો જ આ વાત સાથે સંબંધ છે, એ જતાવીને પ્રસ્તુત કથા જેઠે જેઠાં કેટલું બોધપ્રદ બાબાનું આ વ્યાખ્યાન ! બાબા કહે છે, ‘મન બુદ્ધિ વગેરે ઇન્ડિયો વિષયોના ઉપભોગ માટે જ્યારે પણ લલચાવે છે ત્યારે ભક્તોએ પહેલા મારું સમરણ કરવું જેથી કરીને તે વિષયો ધીર ધીર મારામાં જ સમાઈ જશે અને મને અર્પણ થશે. ઇન્ડિયો વિષયો રહિત બની જશે તેવું કદાપિ બનવાનું નથી. પણ તેમને જે ગુરુનાં ચરણોમાં અર્પણ કરી દેવામાં આવે તો તે માટેની આસક્તિ થોડી ઓછી થઈ જશે. કોઈ પણ પ્રકારની ઈચ્છા ઉત્પત્ત થાય તો તે મારા વિષયની જ કરવી. ગુંસ્સો આવે તો તે મારી ઉપર જ કરવો. અભિમાન, ગર્વ કે હથ ઘેદા થાય તો તે પણ ભક્તોએ મારાં જ ચરણોમાં સમર્પણ કરી દેવાં જેઠાં. કામ, કોધ અભિમાન વગેરે વૃત્તિઓ જે જેરથી ઉછાળો મારે તો મારામાં મન પરોવીને તથા મને યાદ કરીને દરેકને છોડી દેવી. કમે કમે આવી વૃત્તિઓનું શ્રી હરિ જ નિકંદ્ન કરશે અને આ કામ, કોધ અભિમાનદ્વારી એરી ત્રિપુટીઓની લહેરોને એ જ ગોવિંદ દૂર કરશે. મોટે ભાગે આવી બધી વિકારવાળી મનોવૃત્તિઓ મારા જ સ્વરૂપમાં લીન થાય છે અથવા તો મારા જ સ્વરૂપની બની જય છે અને મારામાં જ શાંત થાય છે. આ પ્રકારે અભ્યાસ થતાં વૃત્તિઓ પોતાની મેળે જ શક્તિહિન થઈને અને અમુક સમય બાદ એનો નાશ થઈને મોનવૃત્તિ શૂન્ય થશે. ગુરુ હંમેશા સાંનિધ્યમાં હોય છે, એવી જેની ભાવના મનમાં પાકી થયેલ હશે, તેવાઓને વિષય વાસના આ પ્રકારે કયારે પણ ત્રાસ આપી શકતી નથી. જ્યાં જ્યાં આવી સારી

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ભાવના પ્રગટશે ત્યાં જ સંસારનાં બંધનોનો ઉકિલ મળ્યો છે એમ સમજવું. પ્રત્યેક વિષયોમાં ગુરુ જ પ્રગટચા છે, અથવા તો વિષયો રૂપે ગુરુ જાતે જ સજેલો છે. તેથી થોડા પણ વિષયોનો ઉપભોગ કરવા જતા, બાબા સાંનિધ્યમાં છે તે ભાવનાને લીધે એ વિષયો ભોગવવા યોગ્ય છે કે અયોગ્ય તે વિચાર મનમાં ઉઠશે. આમ ભોગવવામાં અયોગ્ય વિષયો સહેજે છૂટી જશે તથા વ્યસની ભક્તોના વ્યસન છૂટશે અને દઢ અભ્યાસથી મનને મૂળ ડેકાણે વાળવાથી અયોગ્ય વિષયો ભોગવવા એને માટે અશક્ય થઈ જશે. પછી તે વિષયોને દ્વારા માટે તત્પર થશે. વેદ એ પેલા સર્વ નિયમોનું મૂળ સ્થાન છે. તેમાં દર્શાવેલા નિયમો અનુસાર વિષયોનું સેવન કરશે અને મન ફાવે તેવું આચરણ કરશે નહિ. આ રીતે મનમાં ટેવ પાડતાં, વિષયો માત્રના વિચાર કીણા થતો જશે અને ગુરુ ભજનો મોહ ઉત્પન્ન થઈને શુદ્ધ જ્ઞાનના અંકુરો ફૂટશે. પછી શુદ્ધ જ્ઞાન વધવા લાગશે કે હેઠ બુદ્ધિનો બંધનોની બેડી તૂટશે, અને પછી એ જ બુદ્ધિ અહ્મૃ બ્રહ્માસ્મિ હું પોતે જ બ્રહ્મ છું અથવા તો પરમેશ્વર છું એવા વિચારમાં દૂબકી મારશે અને અનેક પ્રકારનાં સુખ પ્રાપ્ત કરશે. ભલે આ હેઠ ક્ષણભંગુર છે, પણ તેને કારણે જ પરમ પુરુષાર્થ સાધ્ય થાય છે અને મોક્ષ કરતાં પણ શ્રેષ્ઠ એવો ભક્તિયોગનો લાભ થશે. “મોક્ષ તારો છે એદેવા। હુર્લબ છે તે તમે જ રાખો। પસંગી મારી તો છે ભક્તિની। એના માધુર્યમાં કોઈ ફરક પડવાનો નથી॥” બીજા એક અભંગમાં તો તેઓ ભક્તિ માટે દેવને એક વિનંતી કરી છે કે, ‘ગર્ભવાસમાં સુખેથી અમને પાછા નાખવા।’ એકનાથ મહારાજે કહ્યું છે કે, ‘વારંવાર જન્મ લઈને। ફરીથી જોઈશું પંદ્રપુર।’ ચારેય પુરુષાર્થની ઉપર આ પાંચમા પુરુષાર્થનું એટલે ભક્તિયોગનું પગથિયું જ છે. ભક્તિયોગના માર્ગની બરોબરી કોઈને પણ સમજમાં આવવાની નથી. ભક્તિનો પ્રકાર અલૌકિક છે. ગુરુ સેવાને લીધે હૃતાર્થ થઈને આયુષ્યનો આપણો ધ્યોય સિદ્ધ થયો છે એવું લાગશે, અને તેમને જ તેની ખૂબી વ્યવસ્થિત સમજનશે. તથા તે જ પરમાર્થની પ્રાપ્તિ કરી શકશે. ગુરુ અને દેવ એમાં જેના મનમાં ભેદ જાણાયો છે, તેને સંપૂર્ણ ભાગવતમાં શ્રી કૃષ્ણ ભગવાને જેયા જ નથી, અને સંપૂર્ણ રામાયણ વાંચીને રામની સીતા કોણ એ તેને સમજયું નથી એવું માની લેવું. માટે એ બધામાં ફરક જેવાનું છોડીને ગુરુ અને દેવ એક જ છે એમ જાણવું. દોષરહિત નિર્ભળ ગુરુસેવા પેદા થતાં વિષયો માટેની લાલસા જડમૂળથી નાશ પામશે, ચિત્ત શુદ્ધ પાપરહિત થશે, અને પોતાનું પવિત્ર અને તેજસ્વી રૂપ પ્રગટ થશે. (ઓ. ૪૧-૬૫)

મનમાં જે પ્રબળ ઈચ્છા ઉત્પન્ન થાય તો લીલા ચણાના દાણા કાઢવા, એ તો બાબાના ડાબા હાથનો ખેલ હતો. એટલું જ નહિ પણ કાળ કે સમય ન બગાડતાં તેના કરતાં કોઈ વિચિત્ર ખેલ પણ તેઓ કરી શકતા. લોકોમાં પ્રચલિત હોય એવા નજરબંધીના પ્રયોગ કરનારો જદુગર ફક્ત પેટ ભરવાના આકર્ષણને લીધે, મોહ પમાડનારી હાડકાની લાકડી ફેરવીને જોઈએ તે પદાર્થ કાઢી દેખાડતો હોય છે. પણ સાઈનાથ મહારાજ તો એ એક અલૌકિક જદુગર છે. એમના ખેલનું કેટલું ગજબનું સામર્થ્ય ! મનમાં આવે તો એક ક્ષણમાં અગણિત દાણાઓ તેઓ કાઢી શક્યા હોત. પણ આ કથાનો સાર શું એનો જ આપણે વિચાર કરવો. પાંચ પૈકી ? કોઈ પણ વિષય બાબાને અર્પણ કર્યા સિવાય સેવન કરવો નહીં. આ શિખામણ જે મનને આપવામાં આવે તો વખતોવખત કાંઈ લેતાં હેતાં સાઈનાં ચરણાની ધાર આવશે અને નિયમાનુસાર વિષયોનું સેવન કરવા તરફનું જ લક્ષ રહેશે. આ શુદ્ધ બ્રહ્મની સગુણ મૂર્તિ આંખોની સામે રમતી રહેશે. ભક્તિ, મુક્તિ અને વિરક્તિ આ ત્રણેનો ઉદ્ઘાટન રહેશે અને પરમ શ્રેષ્ઠ અવસ્થાને મોક્ષની પ્રાપ્તિ થશે. શ્રી બાબાનું તે સુંદર સ્વરૂપ ધ્યાનમાં રાખતા સંસારની ઈચ્છાઓ અને વાસનાઓ હતી ન હતી એવી થઈ જશે. આ લોકમાંના સુખોનું ભાન રહેશે નહીં, અને મનને સમાધાન થશે. (ઓ. ૬૬-૭૨)

ગીતની પંક્તિઓ ધાર કરવા ઈતાં ધાર આવતી નથી પણ ધંટીના પદ્ધયર ગોઠવી ફળવા માટે બેસતાં એની ધાર જરૂર આવે છે. તેવી જ રીતે લીલા ચણાનાની મજનક કહેતી વખતે સુદ્ધામાની કથા ધાર આવી. એક વખતે શ્રી કૃષ્ણના મોટાભાઈ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

બલરામ, શ્રી કૃષ્ણા અને સુદામા વિદ્યા મેળવવા માટે સાંદિપની ઋષિના આશ્રમમાં રહ્યા હતા. તે અરસામાં કૃષ્ણા અને બલરામને જંગલમાંથી લકડાં કાપવાના કામ માટે મોકલ્યા. ગુરુપત્નીની આજાંથી કૃષ્ણા અને બલરામ જંગલ તરફ જવા માટે નીકળ્યા અને તરત જ તેની પાછળ સુદામાને મોકલવામાં આવ્યા. તેની સાથે ગુરુપત્નીએ ચણા મોકલાવ્યા અને કહેવડાવ્યું કે જંગલમાં ફરતાં ફરતાં જે ભૂખ લાગે તો તમારે ત્રણે જણાએ આ ચણા ખાવા. એ પછી આગળ જતા સુદામાને જંગલમાં કૃષ્ણાનો બેઠો થયો, કૃષ્ણાએ સુદામાને કહ્યું, ‘મિત્ર તરસ લાગી છે.’ પણ સુદામાએ ચણાની વાત કાઢી જ નહિ. ઉલ્ટાનું કૃષ્ણાને તેમણે શું કહ્યું તે વાત સાંભળો, ‘આતી પેટે પાણી પીવું નહિ. થોડો વિસામો કર્યા, પછી જ પાણી પીવું.’ પણ સુદામા આ ચણા ખાવ એવું બોલ્યા નહિ. થોડીવાર પછી કૃષ્ણા સુદામાની પલાંઠીમાં માથું ટેકવીને આડા પડ્યા અને કૃષ્ણાને ઉંઘ આવી ગઈ. તે જેઠેને, સુદામા ચણા ખાવા લાગ્યા. અચાનક જગી જતાં કૃષ્ણાએ જેયું અને બોલ્યા, ‘મિત્ર આ શું ખાય છે ? તારા મોખમાંથી શાનો અવાજ આવે છે ?’, ત્યારે સુદામાએ જવાબ આપ્યો કે, ‘અહીં ખાવા માટે છે શું ? એ તો ઠંડીથી દાંત કકડી રહ્યા છે, તેનો એ અવાજ છે. મોકામાંથી વ્યવસ્થિત વિષણુ સહસ્રનામના શબ્દો પણ સ્પષ્ટ નીકળતા નથી. ‘આ લોકમાં એક એવા ઉપાસ્ય દેવ કયા અને કયા દેવની સ્તુતિ અથવા મૂળ કરવાથી મનુષ્યનું પરમ કલ્યાણ થશે ?’ આવો યુવિષ્ટે પ્રશ્ન પૂછતાં ભીજી પિતામહે આ સ્તોત્ર તેમને કહ્યું હતું. તે પહેલાં શ્રી કૃષ્ણાના બાળપણમાં ઋષિઓના આશ્રમમાં પણ બાળ શિષ્યોને આ સ્તોત્ર ભણાવવામાં આવતું હતું. તે આ પ્રસ્તુત સુદામાકથામાંથી આપણાને જાણવા મળે છે. આ ઉપરથી આ સ્તોત્રને ભારતમાં પૂર્વેથી ચાતી આવતી પરંપરા વાચકોના ધ્યાનમાં આવશે. પણ આગળ અધ્યાય રહ્યમાં સાઈબાબા પોતાના લાડકા શ્યામાને એ જ વિષણુસહસ્રનામનો બોધ જાણવા ફરજ પાડે છે, તે વાંચીને આ સ્તોત્રનું અપાર મહત્વ વાચકોને વધારે સારી રીતે સમજશે. સુદામાનો આવો જવાબ સાંભળીને સર્વસાક્ષી પરાત્પર કૃષ્ણા બોલ્યા, ‘હા ખરેખર મને પણ એવું જ સ્વભન આવ્યું કે એકની વસ્તુ બીજે ખાતો હોય તેવામાં એને એકાએક પેલાએ પૂછ્યું ‘શું ખાય છે ?’ તેણે જવાબ આપ્યો ‘શું ખાય માટી ?’ એની ઉપર વાઙ્ દેવતાએ કહ્યું ‘તથાસ્તુ’ ‘અરે, આ સ્વભન જ છે, સમજયા તું ? મને મૂકીને તું થોડો કાંઈ ખાવાનો છે ? શું ખાવ છો ? આ પ્રશ્ન પણ મેં સ્વભન અસર ને કારણે જ પૂછી નાખ્યો.’ પહેલથી જ આશ્રમમાં સાથે રહેલા સુદામાણને કૃષ્ણાની આ લીલા જે ખબર હોત તો તેમનાથી આવી ભૂલ થાત જ નહીં, અને તેનું પરિણામ ભોગવંસ પડ્યું જ ન હોત. એ પરિણામ પણ કંઈ સાધારણ હતું. તેમને અઢાર વર્ષ અત્યંત દરિદ્રતા ભોગવણી પડી. માટે જે લોકો એકલા ખાતા હોય છે, તેમણે આ વાત ખૂબ જ ધ્યાનમાં રાખવી. સાક્ષાત કૃષ્ણા જ જેનો સખો હતો એવા સુદામા જેવા ભક્તને પણ આ નીતિ ભંગ કરવાથી સંસારમાં જેરદાર ફટકો પડ્યો. પણ એ જ સુદામાએ આગળ જતાં પોતાની પત્નીએ પોતાના પરિશ્રમથી બનાવેલા મૂઢીભર પૌંચા કૃષ્ણાને પ્રેમથી અર્પણ કરતાં કૃષ્ણે પ્રસન્નચિત્ત થઈને તેમને કેવા ઐશ્વર્યથી તૃપ્ત કર્યા એ બધું તમે શ્રોતાઓ જાણો છો. (ઓ. ૭૩-૮૭)

હવે વધુ એક બોધ આપનારી વાત સંભળાવું છું. પહેલાં એ એક મશકરી રૂપે આનંદ કરાવશે અને ત્યારબાદ અંતે તો તે ઉપદેશ જ ઠર્શે. કોઈને પરમાર્થનો ઉપદેશ ગમતો હોય છે, તો કોઈને તર્કવાહી યુક્તિઓ ગમતી હોય છે, તો ધણાને મજલક મશકરી ગમતી હોય છે. આમ જેવા જઈએ તો દરેકને આનંદ જ આનંદ જેઈતો હોય છે. આ વાતમાં પણ મજલક જ હતી. એક બાઈ અને એક ભજળ અમુક કારણસર જુદે ચદ્યાં અને સાછ દરબારમાં કલ્બિયો કર્યો. પણ કોઈ જતનો ઉક્લ ન આવતા એ વાત પતી ગઈ. આ કથા ખૂબજ રસાળ છે, અને શ્રોતાઓને ખૂબ ચાનંદ આપનારી છે. ભક્તો એક બીજી સાથે લડતા ઝગડતા હતા તેમાંથી પણ હાસ્યરસ ઉત્પન્ન થતો. બધામાં હાસ્યની છોળો ફૂટરો. ભક્ત દામોદર ધનરથ્યામ જેમની અટક બાબરે હતી, પણ અણણા ચિંચણીકર એ જ એમનું પ્રચલિત નામ હતું. તેમને બાબા ઉપર અમર્યાદિત પ્રેમ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

હતો. તેમનો મૂળ સ્વભાવ ગુરુસાવાળો અને તીખો હતો. તેઓ કોઈની પણ મગજમારી સહન કરતા નહીં. યોગ્ય હોય કે અચોગ્ય હોય તેઓ ખુલ્લેઆમ જ પોતાનો અભિપ્રાય કહી દેતા. પછી ભલે તેનું પરિણામ હિતકારક હોય કે હાનિકારક એ તેઓ જેતા નહીં. આણણાનો સ્વભાવ જેટલો કડક અને તામસી હતો એટલો જ સજજન અને સત્ત્વગુણોથી ભરેલો હતો. તેમના માથા ઉપર જાણે કાયમ સગડી જ ચેતેલી રહેતી. સાધારણ કારણો ઉપર પણ એમનું મગજ એકદમ ઉશ્કેરાઈ જતું અને ગુસ્સે થઈ જતા. કોઈ પણ કામ એ તડાકડી વગર કરી શકતા જ નહીં. એમાં જરા પણ ઉધાર રાખતા નહીં. કોઈની પણ પરવા કર્યા વગર જે હોય તે રોકડું સંભળાવી દેતા, એવો એમનો વ્યવહાર હતો. એક વખત હાથમાં અંગારો પકડી શકાય પણ આણણા એના કરતાં પણ વધારે પ્રાય કડક સ્વભાવના હતા. તેમ છીતાં તેઓ બિલકુલ નિર્જપરી હતા. તેથી જ તેમની ઉપર સાઈબાબા ખૂબ પ્રેમ રાખતા. તે અને તેમની ધર્મપત્ની બંને શ્રી સાઈબાબાની ખૂબ જ ભક્તિ કરતાં હતાં. તે માટે તે ઘણા વર્ષો શિરડીમાં જઈને રહ્યાં હતાં. આણણાનાં પત્ની થોડાં વર્ષો બાદ પોતાનાં વતનમાં હતાં, તે દરમ્યાન જ તેમનું નિધન થયું. તે પછી તરત જ લગભગ આણણા પણ પોતાના જ વતનમાં ત્યાં જ અવસાન પામ્યા. તેમણે પોતાની સર્વ સ્થાવર અને જંગમ ભિલકત ખૂબ પ્રેમથી શ્રી સાઈના ખર્ચ માટે શ્રી શિરડી સંસ્થાનને અર્પણ કરી દીધી હતી. ચાવડીનું સમારકામ આણણાના ધર્મપત્ની લક્ષ્મીબાઈ બાબરેના નામથી થયેલું છે, અને સમાધિમંહિરના સભામંડપ માટે આણણાના જ દ્રસ્તમાંથી ખાસી મોટી રકમ ફાળવવામાં આવી હતી. જેને લગતી નોંધ પણ ઈમારત ઉપર કોતરવામાં આવી છે. ચિંચાણી ગામ થાણા જિલ્લામાં આવેલું છે. (ઓ. ૮૮-૮૯)

એક વખતે બપોરના સમયે મસ્જિદમાં ભરાયેલા દરભારમાં કઠેડા ઉપર ડાબો હાથ મૂકીને બાબા બિરજયા હતા. બાબા આમ તદ્દસ્થપણે અને સીધા બેસતા હતા. પછી ન સમજય તેવી રીતે ભક્તોમાં ઝગડો ધૂસાડી દેતા. ત્યાર બાદ ગરમાગરમી, રીસામણાં મનામણાં વરેરે પત્તી જતાં એટલે બંને પક્ષોને સમજલીને શાંત પાડી દેતા. કોઈ બાબાની ફૂલ દબાવી આપતા, તો કોઈ પગ ધીમે ધીમે દબાવી સેવા કરતા, તો કોઈ બરડો અને પેટ ચોળીને બાબાની અનેક પ્રકારે સેવા કરતા હતા. બાબા તો આજીવન બ્રહ્મચારી હતા, ઉદ્વરિતસ અને શુદ્ધાચારી હતા. તેઓ પુરુષ અને સ્ત્રીઓ આ બધાને સેવાચારી કરવાનો મોકો આપતા. આણણા કઠેડાની બહાર આગળ વળીને બાબાનો ડાબો હાથ દાબી રહ્યા હતા, ત્યારે જમણી બાજુની પરિસ્થિતિ કેવી હતી તે હુલે સ્વસ્થ ચિત્તે સાંભળો. એ બાજુ બાબાનાં ચરણોમાં જેની અનન્ય ભક્તિ છે, એવી એક બાદ બેઢી હતી. જેમને બાબા આઈ-મા કહેતા હતા. અને અન્ય સર્વે માત્રીબાના નામથી બોતાવતા હતા. તેમનું મૂળનામ વેણુભાઈ હતું. તેમની અટક કૌજલગી હતી. તેમનો સાઈનાં ચરણમાં અનુપમ ભાવ હતો. આણણા પચાસ વટાવી ચૂક્યા હતા. મોઢામાં દાંત પણ ન હતા. માવશીબાઈ પણ ઉમરલાયક હતાં. આ બંને વચ્ચે વાદવિવાદ અને ઝગડો ઊભો થયો. આણણા પોતાની પત્ની સાથે બાબાની સેવામાં હતાં. માવશીબાઈ વિધવા હતાં. તેઓ બાબાનું પેટ અને ફૂલ નીચેની બે બાજુએ દાખતાં તેમનો શાસ ચઢી જતો. માવશીબાઈ મનનાં નિર્મળ હતાં. તેમજ બાબાની સેવા કરવા માટેની તેમની શક્તિ પ્રબળ હતી. બંને હાથોથી વળ દ્યાને બાબાનું પેટ તેઓ ચોળી આપવા લાગ્યાં. પાછળથી બાબાને બંને હાથે પકડીને છાશ વલોવતા હોય એ પ્રમાણે તેમને દાબીને મળવા માંડ્યા. બાબા પણ હાયલૂય કર્યા વગર ચૂપચાપ બેસી રહ્યા. જાણે કે તેમને કોઈ ત્રાસ થતો જ ન હતો. દાખવાની પદ્ધતિ વિચિત્ર હતી. પેટ અને પીઠ સપાઠ થઈ જય એવી રીતે હતી. આ બધાનું મૂળ કારણ ભલે માવશીબાઈનો બાબા પ્રત્યેનો પ્રેમ જ હતો છીતાં જેનારાના મનમાં હ્યા ઉપજતી હતી. પરંતુ પોતાની ઉપરનો આ નિર્જામ પ્રેમ જેઠને બાબા આવી ઉત્તમ સેવા ભક્તોને હંમેશા પોતાની યાદ રહે અને તેમનું કલ્યાણ થાય માટે સ્વીકારતા હતા. આપણી તો એટલી તે કદ્ય મોટી તપશ્ચર્યા કે જેને હિસાબે આ સંતનો સહવાસ આપણને મળ્યો! પણ સાઈ જ ભક્તો ઉપર નિસંશય પ્રેમ કરનારા હતા. તેઓ ભક્તોની ક્યારે પણ ઉપેક્ષા કરતા ન હતા. શું એ આમ તેમ ડોલવાનું કૌશાલ્ય.

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

બાબા ઉપરનીએ હાલતા તેવી જ રીતે માવશીબાઈ પણ હાલતાં હતાં. સેવાની ખરેખર આ એક આશ્વર્યકારક રીત હતી. અણણા આગળ વળોતા હતા, પણ હાલતા ન હતા, સ્થિર હતા. જ્યારે માવશીબાઈ પોતાની સેવામાં ખૂબ જ મસ્ત હતાં. જેને તીવે એમનું મો ઉપર નીચે થતું હતું, તેવા સમયે શું બન્યું તે સાંભળો. સાઈસેવામાં પેટ ચોળતાં ઉપર નીચે થતાં આ બાઇનું મોઢું અણણાના મોઢા સામે આવ્યું. આ લાગ જેઠને પહેલેથી જ મોટી ગમ્મતિયાળ એવી માવશીબાઈ બોતી, ‘શું... રે... અણણા ઈસ્કબાજ ! શરમ નથી આવતી, પહેલા મારું ચુંબન માંગો છો ? મારું ચુંબન લેતાં પહેલા આ સર્ફ વાળની શરમ નહિ આવી.’ માવશીબાઈ આવું બોલતાં જ અણણા બાંધો ઉપર ચઢાવીને બોલ્યા, ‘શું આટલી ઉમરે પણ હું સાવ મૂર્ખ ગાંડો હોઈશ તું જ મોદાને મોઢું અડાઈને મારી જેઠે ઝગડવા તૈથાર થઈ ગઈ લાગે છે.’ બાબાને મનમાં બંને માટે પ્રેમ હતો. તેમની બોલાચાલી શક્ક થયેલી જેઠને, બંનેને શાંત કરવા માટે તેમણે એક સરસ યુક્તિ અબજમાવી. પ્રેમથી બોલ્યા, ‘અરે અણણા, તું વગર કામનો બૂમાબૂમ કરીને ઝગડે છે, શાનો ? પોતાની માને ચુંબન કરવું એમાં ગેરવ્યાજબી શું છે ?’ આ સાંભળીને બંનેને શરમ આવી. મનક મશકરીના શબ્દો ત્યાંના ત્યાંજ રહ્યા અને પ્રેમપૂર્વક એક રમુજની છોળ ઊડી. આ ગમ્મત બધાંને ખૂબ જ ગમી. આમ જુઓ તો આ વાત એકદમ સાધારણ છે, પણ એનો માર્મિક અર્થ જાણનારા શ્રોતાઓ જ એનો આસ્વાહ લઈ શકશો. તેમને તે જ જગ્યાએ ચૂપ કરીને ડેવી રીતે બેસાડી દેવા એના અનેક પ્રકાર જેવા મળશે. એક મા અને બાળકમાં જેવી પ્રીતિ હોય છે તેવો જે પ્રેમ આ બંનેમાં હોત કે મમતા હોત તો આ કલેશનો ઉદ્ભબ જ ન થયો હતો અને આવી કોધની ભાવના પણ પેદા થઈ ન હોત. ચાખુકના ચાખખા પડતાં જેરથી હસવું આવે અને પુષ્પોની વર્ષા થતાં અસહ્ય રહ્યું આવે, મનમાં ઉઠનાર શોક, આનંદ વગેરેની લહેરો મનની કલ્પના ઉપર અથવા તો સમજૂતી ઉપર જ આધાર રાખતી હોય છે. આનો અનુભવ કોને નથી ? ખરેખર ! બાબાની યુક્તિ પ્રયુક્તિઓ કમાલની હતી. સમયસર ઘોર્ય હોય તેટલું જ બોલીને તેઓ સાંભળનારા મનને શાંત કરતા, અને તેની સાથે સાથે બોધ પણ આપતા. (ઓ. ૮૭-૧૨૪)

આમ એક બીજી વખતે માવશીબાઈ બાબાનું પેટ ચોળતાં હતાં તે વખતે તેમની એ અતિરેકતા જેઠને એક પરમ ભક્તનું મન કકળી ઉઠ્યુ. દ્વા અને ચિંતા ઉત્પન્ન થઈ અને તેઓ બોલ્યા, ‘બાઇ ! જરા તો ધિરિથી કરો ? આ તો કાંઈ શરીરને ચોળવાની રીત કહેવાય ? થોડી મનમાં કરુણા રાખો. બાબાના સ્નાયુઓની શિરાઓ તૂટી જશે.’ આટલા શબ્દો કાને પડતાં જ બબા પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા અને સટકો હાથમાં લઈને તેનાથી ભૂમિ ઉપર જેરથી પ્રહાર કરવાનું તાંડવ ચાલુ કર્યુ. બાબાનો સંતાપ હદ્દપારનો વધ્યો. અંગારા જેવી તેમની બે ચમકતી આંખો સામે ફરવા લાગી. તેથી તેમની સામે ઊભા રહેવાની હિંમત કરે ? જેવી રીતે બિલાડીની આંખો અંધારામાં ચમકે છે તેવી જ રીતે બાબાની આંખો દિવસ દરમિયાન ચમકવા લાગી. જાણે કે આંખોની જવાળાઓથી હમણાં સૂછિને ભસ્મીભૂત કરી નાખશે એવું લાગવા માંડ્યુ, પછી તેમણે સટકાનો એક છેડો પોતાના હાથમાં પકડ્યો અને પોતાના પેટના મધ્યભાગમાં જેરથી દ્વાબાવીને ખૂંપાવી દીધો. અને બીજે છેડો સામેના થાંબલા ઉપર ટેકવીને મજબૂત એવા થાંબલાને બે હાથે બાથ લીડી. એ સટકો સવાહાથનો એટલે કે લગભગ બે થી અઠી કૂટનો લાંબો હતો. તે આખો પેટમાં ઘૂસી ગયો અને જેતનેતામાં એવું લાગ્યું કે એ બાબાનું પેટ ફાડીને એમનો પ્રાણ લેશો કે શું ? થાંબલો જમીનમાં ખાસ્સો ખૂંપેલો હતો, એ કંઈ થોડો જ હાલવાનો હતો ? બાબા ધીરે ધીરે સરકતા ગયા અને થાંબલાને બૂમ પાડીને બાથ ભરી. જેનારાના તો મોઢામાંથી પ્રાણ ઊડી ગયા. હમણાં કંઈક અધિત્ત બનશે એવું સમજુને લોકો મોઢામાં આંગળા નાખીને બેઢા. ‘બાપ રે, આ કેવો કહી ન બને તેવો પ્રસંગ ! કેટલું બયંકર આ સંકટ ! આ અનર્થનો શું ઉપાય કરવો ?’ આમ લોકો કિકર કરવા લાગ્યા. પેલી માવશીબાઈના કારણે આટલું બધું સંકટ ? પણ ભક્તોને આવિન રહેવું એ બાબાનું વ્રત હતું. માટે જ્યારે કોઈ સેવા કરતું

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

હોય તે સમયે વચ્ચે કોઈ, એ સેવાની ટીકા કરે કે, સેવા કરવાવાળા ઉપર કોઈ કટાક્ષ કરે તે બાબાને જરાયે ગમતું નહિ. પેલા પ્રેમાળ ભક્તના મનમાં આવ્યું કે, માવશીબાઇને કોઈ સુચના આપીએ. જેથી કરીને બાબાને ત્રાસ ઓછો થાય. તો એનું પરિણામ તો આવું આટલું બધુ ઉલ્લું અને ભયંકર આવ્યું. આખરે દેવને કરુણા આવી અને ગભરાવી નાખે એવી કલ્પના છોડીને પોતાના આસન ઉપર આવીને બેસી ગયા. પેલો પ્રેમાળ ભક્ત ભલે ન ડગમગનારો હતો, છતાં બાબાનો આવો આકરો સ્વભાવ જોઈને તેણે કાન પકડ્યા અને હવે પછી કેવી રીતે વર્તવું તેનો બોધ મેળવ્યો. તે દિવસથી નિર્ધાર કર્યો કે, જે કોઈ સેવા કરતું હોય તો તેમાં માથાફૂટ કે વિરોધ કરવો નહિ. જેને જે રીતે સેવા કરવી હોય તેને ગમે તેવી રીતે કરવા દેવી પણ વચ્ચે બોલવું નહીં. સાઈસમર્થ પોતે જ સામર્થ્યવંત છે. સેવા કરવાવાળાને કયારે અને કેવી રીતે રેકવો અથવા તો કોના ઉપર કયારે ફૂપા કરીને તેને એના મન પ્રમાણે કરવા દેવી એ તેઓ જાણતા હતા. સેવા કરવાવાળાના ગુણ અથવા અવગુણ આપણે શા માટે જેવા ? કોઈ એકની ચાકરી સાઈબાબાને સુખદાયક લાગે અને બીજની વેહના આપનારી દેખાય તો તે આપણી બુદ્ધિ તથા ભાવનાઓના તરંગો તો નથી ને ? ખરો પ્રકાર કોઈને પણ સમજતો નહીં ! હવે આ ગમત મશકરી બસ થયાં. લેનારાઓ તો આમાંથી યોગ્ય બોધ લઈ જ લેશો. સાઈની કથાનો સ્વાદ ને સુગંધ બ્રમરદ્ધી ભક્ત જ સેવન કરી શકે છે. (ઓ. ૧૨૫-૧૪૨)

હેમાડપંત સાઈનાં ચરણોમાં લીન થયા છે. આગળનો અધ્યાય આના કરતાં પણ કંઈક વિશેષ હશે. દ્વારાના સાગર સાઈબાબા ભક્ત દામોદર દામુઆણા રાસને કે જે અહુમહનગરના સુખસંપત્ત શ્રીમંત કંસારા અથવા તો કાચ ઉપર કામ કરવાવાળા તેમજ જતજતની કાચની બંગડીઓ બનાવી વેચવાનો ધંધો કરાનરા ગૃહસ્થની ઈચ્છા પૂર્ણ કરેલી તે પણ એક મોટો ચમત્કાર જ છે. દમોદર સંકટોથી ઘેરાયેલા અને ખૂબ જ ત્રાસેલા હતા. તેમણે પોતાની સામે બોલાવીને તેના મનની અસ્વસ્થતા બાબા દૂર કરશે. (ઓ. ૧૪૩-૧૪૪)

સર્વનું કલ્યાણ થાઓ, આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પામેલા ભક્ત હેમાડપંત રચિત.

શ્રી સાઈસમર્થના સત્ય ચરિત્રનો ‘વિનોદ-વિલાસ’ નામનો ચોવીસમો અધ્યાય અહીં સમાચાર થાય છે.

## શ્રી સદગુરુ સાઈનાથને અર્પણા.



## અધ્યાય ૨૪નું વિવરણ

(આ અધ્યાયમાં સાઈબાબાની વિનોદવૃત્તિનાં બે ઉત્તમ ઉદાહરણો આપેલાં છે.)

સાઈબાબા તો વિનોદના ભંડાર હતા. નાનપણથી જ તેમને વિનોદ અને ઠઢા મશકરી પ્રિય હતી. હેમાડપંતે શરૂઆતમાં અધ્યાય ૪ ઓવી ૧૩૧માં કહ્યું છે કે, ‘સ્વભાવ છોકરો ગમતી છેક | કથા ભણતી ભણતી જ વાત એણે કહી ॥’ દ્વારકામાઇમાં મહાણસાપત્ર અને તાત્યા પાઈલ રાત્રે સૂવા માટે જતા. તેમની સાથે બાબાની હંમેશા ધમાત મસ્તી રહેતી. આ ત્રણેય જણા પોતાના પગ પરસ્પર એકબીજને લગાડીને તથા માથાં ત્રણેય દિશામાં રાખીને સૂઈ જતા હતા. કયારેક બાબા

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ઓચિતા ઉડી જતાં અને આનો પગ પેલા ઉપર અને પેલાનો પગ આના ઉપર, અને કોઈના પગ પોતાના શરીર ઉપર લઈને સૂઈ જતા. અને સવારે ઉઠતાં તેઓ એક બીજને પૂછતાં કે આવું કોણે કર્યું, તો બાબા જવાબ ન આપતા ખડખડાઈ હસતા. કોઈ કોઈ વખત તાત્યા ઘોરવા લાગતા એટલે બાબા ઉડીને તેમને ઉધાષ્ટતા કરીને એવું માથું દબાવી હેતા અને ત્યારખાદ મહાળસાપતિની મદ્દ લઈ તેને આખો નિયોવી નાખતા અને એની પીઠ ભસળતા. બાબાનો અને તાત્યાનો માભા ભાણેજ જેવો સંબંધ હતો. તેને લિધે તેની સાથે બાબા સૌથી વધારે દીખળ કરતા. બાબા તેને ગતીપચી કરતા, તેના બે હાથ પકડી કુદ્દી ફરતા, કુસ્તી કરતા, અને ધીગામસ્તી પણ હંમેશાં કરતા રહેતા. એ જ પ્રમાણે અદ્યાય ઉદ્ભાવના પોતાના લાકડા ભક્ત શ્યામાને ગાલ પકડી ચૂંટલી ભરેલી એ વિષે તો આપણે બધા જણીએ છીએ.

બાબા કોઈની સાથે બોલતા અને વાત કહેતા, કોઈનો રોગ મટાડતા અને ઉપદેશ કરતી વખતે પણ બાબા સદાને માટે વિનોદ કરતા અને હસતા રહેતા. જાણે કે તેઓ એવું કહેવા માગતા હતા કે સંસારમાં દુઃખો અને સંકટોની તો પરંપરા જ હોય છે. પછી આપણે વગર કામના મૂર્ખની માફક રહતા રહેવાથી કે ચિંતાગ્રસ્ત થઈને વધારે દુઃખી શા માટે થલું ?

ન કરશો ફિકર યંકિચિત । રહેવું સદાઆનંદ ભરિત ।

ન કરવી ચિંતા અમરણાંત । ઉપદેશ નિન્ય એ બાબાનો ॥૧૧૩॥

બાબાની વિનોદ કરવાની રીત ખરેખર જ અલૌકિક હતી. અભિનય સાથે ઓછું સ્વિમિત કરીને તેઓ બિલકુલ જેઠીતા જ શબ્દોમાં પ્રસંગને અનુરૂપ એટલો સરસ વિનોદ કરતા કે ભક્તોનું હસવું રોકાતું નહિ. સાધારણ રીતે જેની મશકરી કરવામાં આવે એને તે ગમતું નથી હોતું, પણ બાબાની આ મજલ મશકરીની ટેવ એટલી પ્રેમાળ હતી કે જેનાથી કોઈ બોધ નહિ તો શિખામણ જરૂર મળી રહેતી, અને જે તે માણસને એ ખરેખર ગમી જતી.

આ અદ્યાયમાં હેમાડયંતની લીલા ચણા ઉપરથી મજલ કરીને ‘એકલા એકલા આવું સારું નહિ’ એવું કહીને બાબાને એમની સાથે જ નહિ પણ ભેગા થયેલા તમામ ભક્તોને કેટલું મહાન તત્ત્વ શિખયું છે !

વિષયની જેને છે ખાજ । પરમાર્થને ન તેની આશ ।

તેને જે કરે પરાજિત । તેનો દાસ પરમાર્થ ॥૪૩॥

‘યદા પંચાવતિઝંતે’ । એ મંત્રથી દે શ્રુતિ કહે ।

ઠણ નિમિત્તે તે જ બાબાએ । કરી દીધું દઢ મહને ॥૪૪॥

એવી જ રીતે આણણા ચિંચણીકર અને માવશીભાઇનો વિવાદએ ‘અનુચિત શું તે સમજે નહીં’ ચુંબન લેતા મા નું તે || આવી મશકરીથી વાતને વાળી લઈ બધાને હુસાવીને બાબા તેનો કેવો અંત લાવ્યા ?’

બાબાની નવલ સહજ યુક્તિ । બોલે બોલ અનુસરી ।

શ્રોતા પામે જેથી શાંતિ । ને બોધ પણ લે તત્કાળ ॥૧૨૪॥

સારાંશ કે બાબાનો આવો વિનોદ શ્રોતાઓને ફક્ત દુઃખી કરવા માટે ન હતો, પણ તેમાંથી બધાને હિતાવહ એવો સાર જ શિખવાડવા માટે હતો. માટે બાબાના અનુભવી ભક્ત તેમના બોલવા ઉપર ખાતી મજલ મશકરી સમજુને છોડી હેતા ન હતા, પણ તેમના મનમાં ખાંતી રહેતી કે –

હોય ન હો વાળી વિનોદ । ન થાય કદી તે નિષ્કારણ ।

બાબાના એકાએક અક્ષરગણ । હોય છે અર્થની ખાણ ॥૧૦॥

અદ્યાય - ૨૦



## ॥ અધ્યાય ૨૫ ॥

ભક્ત, અભીષ્ટ સંપાદન

(ભક્તોની મનોકામના પૂર્ણ કરીને કલ્યાણ કરવું)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળદેવતાને વંદન,  
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

કૃપાના સાગર એવા સાઈમહારાજ સાક્ષાત ઈશ્વર હતા. તે પૂર્ણબ્રહ્મ હોવાથી પણ મહાન યોગેશ્વર હતા. તેમને મારાં  
સાણંગ નમસ્કાર હો. હે સંતોના ભૂષણ ! દેરકના કલ્યાણના નિવાસસ્થાન જેવા અને આત્માનંદ પ્રાપ્ત થયેલા સાઈનાથ !  
તારો જ્યે જ્યેકાર હો. હે ભક્તોના વિશ્વામસ્થાન અને પૂર્ણકામ સાઈસમર્થ તને મારા પ્રણામ હો. પાછળાના અધ્યાયમાં  
સાઈબાબાની મજલ મશકરીની ઓળખ અને તેને લગતું વર્ણન કર્યું. ભક્તભાવન સાઈ ભક્તોને સહાય આનંદ આપે છે અને  
દ્વાની પરમભૂતિ છે. ભક્ત માત્ર શ્રદ્ધાળું અને ભાવથી ભરેલો હોવો જેઠાં તેમજ તેની ભક્તિ એકનિષ્ઠ હોવી જેઠાં. પછી  
એને ઈચ્છિત વસ્તુઓની ઉણાપ રહેતી નથી. ‘સદગુરુ એટલે હું જલે જ છું’ એવું શ્રી કૃષ્ણો ઉદ્ઘાતને ભાગવતમાં કહ્યું છે. સદગુરુ  
એ જ મારી મૂર્તિ ! નિશ્ચયથી એ જાળ નિશ્ચિત ! વિકલ્પ ના રાખવો આ અર્થે. અનન્ય ભક્તિ એ જ એનું નામ. ॥ એકનાથી  
ભાગવત અધ્યાય ૧૨ ઓ. ૪૮૮ આની ઉપર વિશ્વાસ મૂકનારને જ અનન્ય ભક્તિ કહેવામાં આવે છે. મારા મનમાં ઈચ્છા થઈ  
કે, શ્રી સાઈનું ચરિત્ર લખું, અને સાઈએ એમાં અતિ આશ્ર્યકારક સાંભળવા યોગ્ય લીલાઓ લખાવીને મને ચિંતામાંથી મુક્ત  
કર્યો. મારો અધિકાર ન હોવા છીતાં અને શાસ્ત્ર, જ્ઞાનમાં નિપુણતા ન હોવા છીતાં મારા જેવા તદ્દન પામર મનુષ્યને શક્તિ બક્ષી  
અને પોતાના ભક્તોની જગ્યાતિ માટે મારા દ્વારા આ ગ્રંથ લખાવ્યો. ‘કથાનો વ્યવસ્થિત સંગ્રહ કરો એવી આજ્ઞા જ્યારે મારા  
જેવા અજ્ઞાનીને થઈ ત્યારે જ મારી મંહબુદ્ધિ, ધૈર્ય અને જ્ઞાનથી સંપત્ત થઈ અને ત્યારે જ મને ધીરજ આવી કે આ ઉત્તમ  
ગુણોથી યુક્ત સાઈ પોતાના ભક્તોના ઉદ્ઘાર માટે પોતાની જ કથાનો સંગ્રહ કરાવશે. આવું જે ન હોત તો, આ વાણીનો ખેલ  
કરવાનું સાહસ હું કરી શક્યો હોત કે ? આ ચરિત્રાંપી અમૃતનો રસ તે સંત ચરણેના પ્રસાદનું અમૃત છે. આ સાઈચરિત્ર એટલે  
ભક્તો માટે સાઈની કથાંપી અમૃતની પરબ છે. તે યથેચછપીને સાઈકૃપાથી સંસારઝી દુઃખનું નિવારણ કરવું. આ ચરિત્ર નથી  
પણ આતો સોમકાંત ચંદ્રમણી કે જેની ઉપર ચંદ્રનું ડિરણ પડતાં તેમાંથી પ્રકશાપૂંજ ફૂટે છે તેવી માન્યતા છે. એમાંથી  
સાઈકથાનું ચંદ્રમણૂત સતત જરૂર હોય છે. તરસથી વ્યાકુળ થયેલા, ચકોરઝી ભક્તો તે પીને તૂપ થતા હોય છે. હવે ઓ પ્રેમાળ  
શ્રોતાજનો ! કળિયુગમાં ઉત્પત્ત થનારી જે વાસનાઓ છે, તેનો નાશ કરવા માટે આ સાઈની પવિત્ર કથા સંકોચ વગર એક  
ચિંતે અને મન લગાવીને સાંભળો. સાઈબાબા ઉપર જે એકાદ કોઈની અનન્ય શ્રદ્ધા બેસી ગઈ તો તે ભક્તના સર્વ અનર્થો દૂર  
કરીને તથા બધા જ કષેનું નિવારણ કરીને તેની ધારેલી મનોકામના પુરી કરે છે. આ વિષેની એક વાત સાઈની ભક્ત વત્તસલતા  
દર્શાવે છે. તે જે શ્રોતાઓ આદરથી સાંભળશે તો તેમને જરૂરથી આનંદ થશે. માટે શ્રોતાઓઓ નવીનતસભર કથા ધ્યાન  
દઈને સાંભળવી. જેથી ગુરુમાઉલી કેટલા દ્વાના મૂર્તિમંત સાગર છે તેનો અનુભવ થશે. આ કથા ભલે નાની હોય પણ એવા  
તાત્પર્યથી મળનારી શિખામણને લીધે તે કથા ખૂબ જ સારી છે. એક કણ માટે ધ્યાન આપો એટલે તમારાં બધાં જ સંકટો  
બાજુએ ખસી જશો. (અંશ. ૧-૧૭)

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

અહમદનગરના દામુ આજણા દામોદર સાવળારામ રસને નામના એક સુખી ધનવાન કંસારા જતના કે જે કાચનું કામ કરનારા અને બંગડીઓ બનાવીને વેચનારા ભક્ત સાઈ ચરણમાં આસક્ત હતા. એવા શ્રેષ્ઠ ભક્તની આ કથા સાંભળીને શ્રોતાઓને જરૂર આનંદ થશે. તેમજ સાઈબાબાની ભક્તોના રક્ષણ કરવાની તત્પરતા તેમને પ્રત્યક્ષ દેખાશે. દર વર્ષે રામનવમીના ઉત્સવને દિવસે બે મોટાં નવાં નિશાનો શિરડી ગામભાં સરધસમાં ફેરવવા માટે કાઢવામાં આવે છે, જેની સ્થાનિક લોકોને ખબર છે. તેમાનું એક પ્રેમનું અખંડ પ્રતીક સમી ચાલુ જ રહ્યું છે. દામુ આજણાને બે પત્નીઓ હતી છતાં સંતતિ ન હતી. પાછળથી બાબાના આશીર્વાદથી તેમને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો. આ પુત્રરત્ન એટલે શિરડીમાં હમણા સુધી બધા જ ઉત્સવોમાં દેખાનારા અને સાઈબાબા પ્રત્યે અત્યંત નિષા રાખનારા સ્વ. નાનાસાહેબ રસને ઊર્ફ દત્તાત્રેય દામોદર રસને હતા. તેમનો જન્મ અહમદનગરમાં ઈ.સ. ૧૯૦૦ની સાલમાં થયો હતો. અને મૃત્યુ ૨૧ જૂન ૧૯૮૫ના રોજ અષાઢી એકદાશીના દિવસે પવિત્ર તર્થ શિરડીમાં જ ઉમરના ટ્યુમા વર્ષે થયું. આ પુત્રરત્ન નિભિતે દામુ આજણાએ રામનવમીના ઉત્સવ નિભિતે નિશાન ચદાવવાની બાધા રાખી અને ત્યારથી પ્રત્યેક વર્ષે એ નિશાનને સરધસમાં ફેરવવાનો શિરડીમાં રિવાજ શરૂ થયો. આ સરધસની તૈયારી કોંડિભા નામના સુથારાના ઘરેથી શરૂ થાય છે, અને પછી વાજતે ગાજતે આ ઝંડા જેવું નિશાન ગામભાં સરધસાકારે ફેરવાય છે. ત્યારબાદ તે ખૂબ લાંબી પતાક મસ્લિદના બે ખૂણાઓમાં બાંધવામાં આવે છે. આ રીતે બાખપૂર્વક યા ઉત્તમ મહોત્સવ દર વર્ષે શિરડી ગામભાં થાય છે. તે વખતે ત્યાં જે કોઈ ફીર અને સાધુઓ આવતા તેમને ઘરાઠને જમાડવામાં આવતા. આ દામુશેઠ રામનવમીનો નિયમ આ રીતે પાર પાડતા હતા. હાલમાં પણ તે નિયમ તેમના વારસદારો પાળી રહ્યા છે. આ દામુ આજણાની કથા શ્રોતાઓ માટે જ વર્ણવીને કહી રહ્યો છું. તે ધ્યાન રાખીને સાંભળશો તો સાઈબાબાના સામર્થ્યની તેમને કલ્પના આવશે. (ઓ. ૧૮-૨૭)

દામુ આજણાના મુંબઠીમાં રહેતા એક મિત્રે તેમને એક પત્ર મોકલ્યો, ‘ખુલ્લેઆમ ચોખ્ખો ડ્રિપિયા બે લાખનો નફો થાય એવો ફાયદાકારક ધંધો આપણે કરીએ. તેમાં તમારી અને અમારી ભાગીદારી કરીએ. બંનેને એક લાખની ચોખ્ખી કમાણી છે. આ બાબતમાં તમે મને તરત જ જવાબ મોકલી આપશો. રોકડો ધંધો છે એમાં ડરવા જેવું કાંઈ નથી. આ ખેપમાં કપાસની ખરીદી કરી નાંખીએ. ભાવ તો ઉપર જવાનો જ છે. સમયસર જે એ સોદો પાકો કરવામાં નહીં આવે તો પાછળથી જરૂર પસ્તાવાનો વારો આવશે.’ આવો મોકો નકામો જવા હેવા જેવો નથી, આ વાંચી આજણાના મનમાં હુલચલ મચી ગઈ. કેમકે દામુને તેના મિત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો. પણ કોઈ નક્કી વિચાર તેમને સૂઝતો ન હતો. ધંધો કર્યો કે ના કરવો? આ વિચાર આજણાના મનમાં ચકરવા લાગ્યો. શું થશે? હે દેવ! કેમ કરીને આ વાત શક્ય બનશે તે વાતનો મનમાં સંશાય થવા લાગ્યો. દામુ આજણા સાઈગુરુના શિષ્ય હતા. તેમણે બાબાને એક પત્ર લખી મોકલ્યો, ‘મારા જેવા પામર પાસે સ્વતંત્ર બુદ્ધિ નથી, તમે જ અમારા આધાર છો, છત છો. પ્રથમ દાખિએ આ ધંધો કરવો જોઈએ, એવું લાગે છે. છતાં લાભ થવાનો કે નુકસાન તે તે કૃપા કરીને બતાવો.’ પત્ર માધવરાવને મોકલ્યો અને કહેવડાયું કે, તે બાબાને વાંચીને સંભળાવે. તેઓ શું અભિપ્રાય આપે છે તે મને અવશ્ય જણાવશો. મને તો આ ધંધો આંગ તો લાભકારક લાગે છે. બીજી દિવસે ત્રીજી પ્રહરમાં તે પત્ર માધવરાવના હાથમાં પહોંચ્યો. તે તેમણે મસ્લિદમાં જઈ બાબાનાં ચરણોમાં મૂક્યો. ત્યારે બાબાએ પૂછ્યું, ‘કેમ શ્યામા! ઉતાવળ શેની છે! કયો કાગળ પગ પાસે મૂક્યો?’ શ્યામાએ જવાબ આપ્યો, ‘બાબા! પેલો નગરનો દામુશેઠ તેમને કંઈ પૂછ્યવા માંગે છે.’ બાબાએ પૂછ્યું, ‘શું... રે, શું લખે છે? શું બેઠો બેઠો કારસ્તાન કરે છે? મને લાગે છે કે તે આકશને સ્પર્શવા માંગે છે. ભગવાને તેને જે આયું છે તેની તેને કિંમત નથી. તેને તે ઓછું પડે છે. સાંચું, વાંચ વાંચ અનો પત્ર.’ શ્યામા બોલ્યા, ‘બાબા! તમે કહી રહ્યા છો એ જ પ્રમાણેના સચોટ શર્જદો દામુ આજણાએ પત્રમાં લખ્યા છે, હે દેવા તમે અહીંથા સ્વસ્થ બેઠા છો અને ત્યાં પેલા ભક્તોને અસ્વસ્થ કરી ગભરાવી મૂકો છો. પછી તમારા મનને તાલાવેલી લાગતાં તેને તમારાં ચરણોમાં બેંચી લાવો છો. કોઈને

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

જાતે બેંચી લાવો છો તો કોઈને પત્ર લખવા પેરો છો અને એમાં પાછો પત્રનો આશય પહેલેથી જ કહી દો છો. પછી પત્ર શા માટે વાંચવો છો ?' બાબા બોલ્યા, 'અરે શ્યામા વાંચ.... વાંચ, મારું કહેવું બધું સાચું માનતો નહિ. હું તો બસ આવો જ છું અને સ્વાભાવિક પણ જ કહેતો હતો. હું તો મનમાં આવે તેમ વગર કામનું બોલતો હોઉં છું.' પછી માધવરાવ પત્ર વાંચવા લાગ્યા અને બાબા તેને ધ્યાન દઈને સાંભળવા લાગ્યા. સાંભળતા જ બાબા ઉકળીને બોલ્યા, 'પેલા શેડિયાની તો મતિ ભ્રષ્ટ થઈ લાગે છે. આ પત્રના જવાબમાં અને લખ, કે તારા ઘરમાં કઈ વાતની ઉણાપ છે ? આપણાને અહદી ભાખરી પણ ચાલે. લાખ્યોની પાછળ ગાંડો થતો નહિ.' આ બાજુ દામુ અણણા જવાબની કાગડોલે રાહ જોઈને બેઠા હતા. પત્ર મળતાં જ તેઓ વાંચવા માંડ્યા અને તે વાંચતાં વાંચતાં નિરશ થઈ ગયા. તેમના મનના મનોરથોનો કિલ્લો ધસી પડતો લાગ્યો અને આશાનું વૃક્ષ જગ્મૂળથી જ ઉખડી ગયું. 'હવે એક લાખ કમાઉ અને અહદો લાખ બ્યાંજે મૂકું એટલે જલ્દી જ લાખોપતિ શાહુકાર થઈને આનંદથી અહમદનગરમાં રહીશ.' આવો જે મનમાં મોભાનો વિચાર કર્યો હતો, તે તેની જ જગ્યાએ રહ્યો અને દામુ અણણા ખૂબ ઉદાસ થઈ ગયા. તેઓ મનમાં બોલ્યા, 'બાબાએ આ શું કર્યું ? તેમને આ પત્ર લખીને મેં મોટી ભુલ કરી. મારું પોતાનું મેં જાતે જ નુકશાન કર્યું. જેત જાતોમાં સામે આવેલી પીરસેલી થાળીને આપણે લાત મારી છે. પેલા જવાબમાં દામુ અણણાને માધવરાવે એવી પણ સૂચના આપી હતી કે, કાન અને આંખોની વચ્ચે અંતર હોય છે. અર્થાત્ પત્ર દ્વારા સર્દેશો સંભળાવવામાં અને પ્રત્યક્ષ કહેવામાં ઘણો ફરક પડે છે. આ માધવરાવની સૂચના વાંચીને દામુશેઠને જણે બધું યોગ્ય અને ઉચિત લાગ્યું, 'કોણ જાણે ? એમાં જ આપણણું કલ્યાણ હોય. કદાચ પરવાનગી મળશે.' આવો મનમાં વિચાર કરીને, અણણા સીધા જ શિરડી પહોંચ્યા. અને બાબાની સામે દંડવત્ત પ્રણામ કરી સામે જઈને બેસી ગયા. ધીમે ધીમે બાબાના પગ દાબવા લાગ્યા. પણ બાબાને પૂછવાની હિંમત ન ચાલી. એટલામાં તેમના મનમાં એક વૃત્તિ જગ્યા કે બાબાનો નફામાં ભાગ રાખવો. તેઓ મનમાં બોલ્યા, 'હે સાઈનાથ ! જે આ સોદામાં મને મહદ્દુમ થરશો તો નફાનો થોડો હિસ્સો તમારાં ચરણોમાં અર્પણ કરીશ.' આવો વિચાર મનમાં કરીને દામુ અણણા પલભર માટે બાબાનાં ચરણો પરપ માથું મૂકીને બેસી રહ્યા. સંકલ્પ-વિકલ્પ આ મનની વિચિત્ર સ્થિતિ છે. દામુ અણણાના મનમાં તો આંદોલન ચાલી રહ્યું હતું. ભક્ત મનમાં અનેક મનોરથો કરતા હોય છે, પણ તેમને પોતાનો ખરો નફો કે તોટો શામાં છે તે કયારે ય સમજનું નથી. એકલા ગુરુને જ ભક્તનું બિષ્ણુ ભૂત અને વર્તમાન શામાં કલ્યાણકારી છે તેની ખબર હોય છે. પોતાના મનના વિચાર કોઈ કેટલાયે ગુપ્ત રાખે છતાં અંતર્યામી શ્રી સાઈમહારાજ મનના અંતર્ગત વિચારો જણતા હતા. માટે જચરે કોઈ પોતાના મનનાં વિચારો અને હેતુ સાઈનાં ચરણમાં પ્રેમથી નિવેદન કરીને અને પૂર્ણ વિશ્વાસથી તે અંગેની યોગ્ય કાર્યવાહી માટે વિનંતી કરતા, ત્યારે સાઈબાબા તેમને યોગ્ય માર્ગ બતાવતા હતા. આ તેમનું વચન પણ દેરક ભક્તો જણતા જ હતા. જેઓ તેમને અનન્ય પણ શરણે જતા, તેમનાં સંકટો અને આપદાઓને તેઓ દૂર કરતા હતા. ગુરુજ સાચા માબાપ છે. અનેક જન્મોના તે પાલનકર્તા અને રક્ષણકર્તા છે. તેજ વિભણુ, તેજ શંકર અને તેજ પ્રહ્લા છે. બધું કરનારો અને કરાવનારો તે એક જ છે. (ઓ. ૨૮-૬૦)

નાનું બાળક જો કોઈ મીઠાઈ ખાવા માટે જચરે મા પાસે જલ્દ કરે છે ત્યારે મા તેને 'બાળ' નામનું નાનાં બાળકો માટેનું ઔષ્ણ પાય છે. બાળક હાથ પગ પછાડીને રડારડ કરી મૂકે છે છતાં માના પ્રેમનો નિર્ણય બદલાતો નથી. કારણ કે તે દ્વારાની કહવાશ યોગ્ય સમયે ગુણ અને ફાયદો કરનારી છે તેની ખબર માને હોય છે. પણ પેલા બાળકને આ સારાં નરસાં પરિણામોની કોઈ કલ્પના જ નથી હોતી. કઈ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. તે ફક્ત મા જ જણે છે. (ઓ. ૬૧-૬૨)

અણણા ભલેને ભાગીદારી રાખે તેથી કંઈ બાબા તેના મોહમાં થોડા પડવાના હતા ! તેમનો પ્રેમ ભક્તો પાસેથી કંઈ મેળવવાની અપેક્ષાવાળો ન હતો. પોતાના ભક્તોના કલ્યાણ માટે તેઓ સદ્ગૈ તત્પર જ રહેતા. જેમને માટે સંપત્તિ અને સોનું ધરતીની ધૂળ બરાબર હતાં. તેમને ભાગીદારી અને હિસ્સાની શી કિંમત ? ફક્ત દીનદુઃખીઓના ઉદ્ધાર માટે

## શ્રી સાઈનું સત્ય ચાટિત્ર

જ સંતો જગતમાં અવતાર ધારણ કરતા હોય છે. યમ, નિયમ અને શમ, દમ તેનાથી ઘડાયેલું, માયા કે મત્સર જેવા દોષ વીનાનું અને ડેવળ બીજ ઉપર ફૂપા કરવા માટે જ, જેનું જીવન છે તે જ સંત કહેવાય છે. દામુ અણણાની આ ભાગીદારીની વાત તો તેમના મનમાં ગુપ્ત હતી. પણ તે અંગે બાબાએ કેવો ચોખ્ખો જવાબ આપ્યો તે શ્રોતાઓએ આદરપૂર્વક સાંભળવો. જીવ માત્રના મનની ઈચ્છાઓ તેમજ તેમનું ભૂત, ભવિષ્ય અને વર્તમાનની ઘટનાઓથી બાબા સંપૂર્ણપણે વાકેફ રહેતા. પોતાના ભક્તોની ભવિષ્યમાં પેદા થનારી સ્થિતિ બાબા જણતા હોવાને કારણે તેઓ તેમને સમયસર સાવધ કેવી રીતે કરતા હતા એનું સ્પષ્ટ વર્ણન સાંભળીએ. ‘આપણો તો ભાઈ આમાં કશામાં નહિ’ આવું કહીને પોતાને આ ધંધો બરાબર લાગતો નથી. એવી ચોખ્ખી પ્રેમથી સુચના બાબાએ આપી અને દામુ અણણા મનમાંને મનમાં શરમાયા. બાબાના આવા શબ્દો સાંભળીને તેમને આણસાર સમજયો. અને પોતાના મનના બધા સંકલ્પ છોડીને તેઓ નીચું મો કરીને સ્વસ્થ બેસી ગયા. પછી તેમના મનમાં બીજો વિચાર આવ્યો કે, ચોખા, દાળ, ઘઉં વગેરે અનાજનો અન્ય કોઈ વેપાર કરવો. એ અંગેના બાબાના વિચાર સાંભળો, ‘ઝિયાના પાંચ શેરના ભાવથી લઈશ અને ઝિયાના સાતશેરના ભાવથી વેચીશ.’ બાબાના આવા વચ્ચેનો સાંભળીને આણણા ખસિયાળા થઈ ગયા. સાઈની નજરમાં ન પડે એવું કયાંયે કંઈ પણ કયારેય બનતું નહીં. ઉપર નીચે જચાં ત્યાં સર્વત્ર તેમને ખુલ્લે ખુલ્લું અને સ્પષ્ટ દેખાતું હતું. (ઓ. ૬૩-૭૩)

આ બાજુ દામુ અણણાનો મિત્ર ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો. શું કરવું તેની તેને સમજ પડતી ન હતી. અણણા તરફથી કોઈ જવાબ પણ નથી. એવામાં દામુશેઠ તેને એક પત્ર લખીને બનેતી બધી હકીકત જણાવી. તે વાંચીને પેલા મિત્રને બહુ જ નવાઈ લાગી. તે મનમાં બોલ્યો, ‘કર્મની ગતિ કેટલી વિચિત્ર હોય છે ? સોહો સામે ચાલીને થઈ રહ્યો હતો. પોતાના સ્વાર્થનો વિચાર કેમ કર્યો નહીં ? ફકીરના ચાળે શા. માટે ચઢી ગયો અને નકામી તક ગુમાવી દીધી. ‘શશ્વર આપે છે, કર્મો ખેંચી જાય છે । અને અને જેઠી જ બુદ્ધિ પણ થાય છે ॥’ યોગાનુંયોગે જે મળવાનું હોય છે, તેને પણ પહેલાંના કર્મોનાં ફળ પ્રાપ્ત થવા હેતાં નથી. તે કર્મોનાં ફળ અનુસાર જેવું થનાર હશે તેવું જ વર્તન કરવાનું બુદ્ધિને સૂઝે છે. આવો રોકડો વ્યવહાર જ્યારે થતો હતો ત્યારે આ ફકીર વળી કયાંથી આડો આવ્યો ? કામ ધંધો છોડીને જે ગાંડા જેવો બબડાઈ કરી ધેર ધેર જઈ રોટલાના ટુકડા માંગીને પેટ ભરતો હોય તે વળી કહી કહીને શું કહેવાનો છે ? જવા દે, દામુ અણણાના નસીબમાં જ ન હતું. માટે જ તેને આવી બુદ્ધિ સૂઝી છે. હવે મારે બીજો કોઈ ભાગીદાર શોધવો પડશે. યદ્વારાનિ ન તદ્દ્વાપિ । ભાવિ ચેત્ત તદ્દ્યથા ॥ જે થવાનું નથી થનાર પણ નથી અને જે નક્કી થનાર છે તે નિશ્ચિત થાય જ છે તેમાં કોઈ ફરક પડવાનો નથી. આ પ્રકારે દામુશેઠ સ્વસ્થ બેઠા. અને જેમનાં કર્મો બોગવવાનાં બાકી રહ્યાં હતાં એવાં પેલા મિત્રે કોઈની સાથે ભાગીદારી કરી અને તે સંકટમાં પડ્યો. તેઓ સંદો કરવા ગયા, પણ તેમના દિવસો પલટાયા અને પાસા ઊંધા પડ્યા. તેમને દૂંફાનો ફટકો પડ્યો અને મોટું નુકશાન થયું. જણે કે પેલા ફકીરના ઊંડાનો મારો જ પડ્યો. ‘આપણો દામુ અણણા કેટલો નસીબવાળો અને ડાહો ! એનો સાઈ ખરેખર ઉત્તમ દાનવીર માણસ છે. કેટલી બધી એમની ભક્તો પ્રત્યે ચિંતા ! મિત્ર સમજને દામુ અણણા જે મારા ચાળે ચઢ્યો હોત તો તે બરાબર જ ફસાયો હોત. પેલા ફકીરના નાહે લાગીને બિચારો બચી ગયો. ખરેખર કેટલી બધી એની દફ શ્રદ્ધા ! એના ગાંડપણાની મેં કરેલી મશકરી અને મારા ડહાપણનો ધમંડ વ્યર્થ હતો તેનો મને અનુભવ થયો. પેલા ફકીરની મેં વગર કારણે નિંદા કરી, એવું ન કરતાં મેં પણ જો એનું કહ્યું માન્યું હોત તો મને પણ તેમણે સમયસર ચેતવીને આ મોટી અને ખોટી ફસામણીમાંથી ઉગારી લીધો હોત, અને આવો દગો મારી જેઠે ન થાત.’ (ઓ. ૭૪-૮૫)

હવે એક વધારાની વાત કહીને દામુ અણણાના વૃત્તાન્તને સમેટી લઈએ. આ વૃત્તાન્ત સાંભળીને શ્રોતાઓનાં મન

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

શાંત થશે અને બાબાના ચમત્કાર સમજશે. એક વખતે એવું બન્યું કે ગોવાથી એક પાર્સલ આવ્યું. કોઈકે મામલતાદર રાળેના નામથી પ્રસિદ્ધ હક્કૂસ કેરીઓ મોકલાવી અને બાબાનાં ચરણ અર્પણ થાય માટે માધવરાવના નામે કોપરગાંવમાં સ્વીકાર થઈને પાર્સલ શિરડીમાં આવી પહોંચ્યુ. એ પાર્સલ મસ્લિફદમાં બાબાની સામે ઉધાડતાં એમાંથી સુંદર કેરીઓ નીકળી. એ સરસ મધ્યમધતાં દળદાર ફળો લગભગ ત્રણ શેર ઉપર હતાં. બાબાએ જેયાં અને માધવરાવને આપી દીધાં. માધવરાવે તેમાંથી ચાર ફળ કાઢીને માટીની હંડલીમાં નાંખ્યાં. અને બાકીનાં પોતાની સાથે લઈ ગયા. આંબાનાં ફળ માટીની હંડીમાં આવતાં જ બાબા મોટેથી જે બોલ્યા તે હવે સાંભળો, ‘આ કેરીઓ દામુ અણણા માટે છે. ત્યાં જ પડી રહેવા હો.’ ત્યારખાને કલાકે દામુ અણણા પૂજનું સાહિત્ય લઈને મસ્લિફદમાં આવી પહોંચ્યા. આગળ શું બનેલું તેનાથી તેઓ જરાપણ માહિતગાર ન હતા. બાબા મોટેથી બોલવા લાગ્યા, ‘આ કેરીનાં ફળો દામ્યાનાં છે, આપણાં નથી. તોકો તેને ખાવા માટે ટાંપીને બેઠા છે, પણ જેનાં છે, તેણે જ ખાવાં. કોઈની વસ્તુ આપણે શા માટે ખાવી ? જેની કેરીઓ હોય તેમને જ ખાવી, અને ખાઈને મરી જવું.’ આ બાબાનો પ્રસાદ જ છે, એ ભાવનાથી અણણાએ એનો સ્વાભાવિક રીતે સ્વીકાર કર્યો. ભજતા જ અથવા વિપરિત અર્થથી ગભરાવું નહીં, એની અણણાને ખબર હતી. ખરી વાત એ કે ‘ખાઈને મરી જવું’ એવા બાબાના શબ્દો સાંભળીને એ ફળોનો સ્વીકાર કરતાં કોઈ કાચોપોચો ભક્તો હોત તો તે ગભરાયો હોત. પણ દામુ અણણાને બાબા ઉપર અટલ વિશ્વાસ હતો. માટે તેમણે મન કચવાયા વગર સ્વીકાર કર્યો. આગળ ઉપર તેમને પુત્ર સંતતિના રૂપે ફળ મળ્યું. કયારેક બાબા કોઈ એવું વિચિત્ર પ્રકારનું બોલીને કે આજા કરીને ભક્તોની શ્રદ્ધાની પરીક્ષા લેતા હતા. પછી દામુ અણણા બાબાની પૂજનું કાર્ય પતાવીને ગયા. પણ ફરી તેમને યાદ આવ્યું કે ખાસ પૂછવાનું તો રહી જ ગયું. આથી પાછા વધ્યા અને બાબાને પૂછવા લાગ્યા. કે, ‘આ ફળો કોને આપું તે સમજનું નથી. પહેલી સ્લીને કે બીજીને ?’ ત્યાં બાબાએ કહ્યું, ‘નાનીને એટલે કે બીજીને તે આપણે, જેથી તેને આઠ બાળકો થશે. ચાર છોકરા અને ચાર છીકરી, આ કેરીના ખેલમાંથી જન્મશે. આમૃતીલા પ્રસવશે. પેટે સંતતિ ન હોય તો તે માટે ખૂબ જ પ્રયત્નો કરવા, સાધુ સંતોની સેવા કરવી. અને તેમની કૃપા અને આશીર્વાદ મેળવવા માટે દામુ અણણા સાધુ સંતોના સંગે લાગ્યા હતા. તેવી જ ગ્રહોની અનુકૂળતા પ્રાપ્ત થવી એટલે તેમને જ્યોતિષ શાસ્ત્રનો પણ ચસકો લાગ્યો હતો અને તે કારણે તેઓ જને જ સારા જ્યોતિષી બન્યા હતા. નસીબમાં સંતાન સુખ નથી, એવો જ્યોતિષ જાણનારાઓનો આખરી નિર્ણય હતો. એ અણણા જાણતા હતા. માટે તેઓ નિરાશ થઈને બેઠા હતા. પણ શ્રી સાઈબાબા પ્રસન્ન થયા અને તેમના મુખના આ આશાસનનુકૃત શબ્દો સાંભળીને તેમને ફરી આશા જન્મી. થોડો સમય વીતતાં બાબાનાં વચનો સફળ થયાં. અને સંતપ્રસાદ રૂપી આંબાના મોહરને સંતતિરૂપી ફળો લાગ્યાં. બાબાએ જેવું કહ્યું હતું એવું જ બન્યું. દામુ અણણાનું પોતાનું જ્યોતિષ ખોટું હ્યું. બાબાનાં અચૂક વચનો પ્રમાણે જ બાળકો થયાં. (ઓ. ૮૬-૧૦૩)

આ બાબાની વાણી, તેઓ એ દેહધારણ કરેલો હતો ત્યારની હતી. પણ આગળ દેહત્યાગ કર્યા પછી પણ પોતાની આ વાણીનો મહિમા તેમણે જને જ નક્કી કરી રાખ્યો હતો. ‘ગયો ભલે હું છોડી શરીર વાક્ય મારામાંનો પ્રમાણ મારા હાડકાં પણ મારી સમાધિમાંથી કે એની ઉપર કરેલા બાંધકામમાંથી તમને અવશ્ય આશાસન આપશે જ. હું તો શું ? પણ મારી સમાધિ પણ તમારી સાથે બોલતી રહેશે, અને તેને જે કોઈ અનન્યપણે શરણે જશે, તેની સાથે બોલતી પણ રહેશે. હું આંખોથી દૂર થઈ જઈશ એની ચિંતા કરતા નહીં. મારા હાડકાં બોલશે અને તમારી સાથે કાનમાં વાતો કરતાં તમે સાંભળશો. ફક્ત મારું સમરણ કરો, અંત: કરણથી મારી ઉપર વિશ્વાસ કરો, અને નિર્જામણે મારું ભજન કરો. જેથી તમારું કલ્યાણ થશે.’ (ઓ. ૧૦૪-૧૦૮)

બાબાનાં આ વાક્યો યાદ કરીને હેમાદ્રિપંત ગદગદીત થઈ પ્રાર્થના કરે છે કે ‘હે ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવાવાળા,

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કલ્પવૃક્ષ જેવા સર્વ શક્તિમાન સમર્થ સાઈ સદગુરુ ! તમારી પાસેથી અનેક પ્રકારે દ્વાની એટલી જ યાચના કરું છું કે આ હેમાડપંતને તારાં ચરણોનો વિયોગ કરી યે ન નદે. હે ભક્તજનો ઉપર કરુણા કરનાર ગુરુવર્ય ! અમારી મહદે દોડીને આવો અને અમને સામે પાર ઉતારો. આ સંસારમાં જરા પણ વિશ્વાંતિ મળતી નથી. જન્મમરણના ઘક્કા હવે બસ થયા. મનમાં ફાયે તેવું વર્તવા માટે અને સંસારના વિષયોનો જ વિચાર કરનારા એવા અમને આ વિષયભોગથી પાછા વાળો. તમે અમારી દષ્ટિ અંતર્મુખ કરીને નિવૃત્તિના માર્ગે લઈ જાઓ. આ સંસાર સાગરમાં અમે એનાં મોન્ઝાઓના પ્રવાહમાં ગમે ત્યાં વહી રહ્યા છીએ. સમયસર હાથ પકડીને આ સંસાર સાગરમાંથી અમને છોડવો ! ઇન્દ્રિયો સ્વચ્છંદપણે બટકીને અનીતિ અને દુરાચારને રસ્તે જવા માટે પ્રવૃત્ત થઈ જ્યાં થનગની રહી છે. આવી અનિયંત્રીતપણે ધરસમસતી વહેતી નદીને બંધ બાંધીને રોકો અને ઇન્દ્રિય સમૂહને આપની તરફ ફેરવી નાખો. જ્યાં સુધી ઇન્દ્રિયો અંતર્મુખ થતી નથી ત્યાં સુધી આત્મા સન્મુખ હેખાતો નથી. જ્યાં સુધી આત્મા સામે હેખાતો નથી ત્યાં સુધી પેલું સર્વશૈષ્ટ અને શાશ્વત સુખ તે વળી કર્યું ? જન્મ જ નકામો જવાનો. પત્ની, પુત્ર કે મિત્ર પણ છેવેટે કામમાં આવવાનાં નથી. તું.... જ સુખ અને મોક્ષ આપનારો સાથી છે. હે સાઈમહારાજ ! કર્મ અને અકર્મનાં જળાં ઢીલાં કરીને તથા તેને ઉક્તલીને એક વખત અમને દુઃખોના ઢગલામાંથી અલગ કરો. પોતાની કૃપાના બળથી આ દીનદુઃખીઓનો ઉદ્ધાર કરો. હે અન્યંત પવિત્ર સાઈરાયા ! દ્વાના સામર્થ્યની વાદવિવાદ જેવી ખરાબ પ્રવૃત્તિઓનો જહમૂળમાંથી નાશ કરો. અમારી જીબને તારા નામનો ચસકો લાગવા હો. મનમાં એવો પ્રેમ થવા હો કે જેને લીધે સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન થાય જ નહિ. શરીર, ધરબાર વગેરેનું ભાન જ ન રહે અને મારું હું પણું મને છોડીને જતું રહે તેવું કરો. ફક્ત તમારું નામસમરણ થાય, અને અન્ય કોઈ પણ યાદ રહે નહિ, તેમજ મનની ચંચળતાનો સ્વર્ણ પણ ન થાય. તમે જો અમને છાતીએ વળગાડશો તો અમારી અજ્ઞાનની અંધારી રાત દૂર થશો. તમે તમારા પ્રકાશના સુખમાં અમને તરબોળ કરી નાખો. પછી કયાં અમને કોઈ પણ જતની ઉણાપ રહેવાની છે. તેમજ જ અમને પોતાના ચારિત્રક્ષી જે અમૃતપાણી પીવડાવ્યું છે, અને લપદાક મારીને જગૃત કર્યા છે તે પુણ્યકાર્ય શું સીધું અને સામાન્ય થોડું જ છે ?' (ઓ. ૧૦૮-૧૨૧)

આગળનો અધ્યાય આના કરતાં પણ વધારે રસાળ હશે તેમજ સાંભળનારાઓની હોંશ પૂર્ણ કરશે. એમની સાઈચરણમાં શ્રદ્ધા વધુ બળવાન થશે. પોતાના ગુરુનાં ચરણ છોડીને દર્શન માટે શિરડી આવેલા એક ભક્તે બાબાનાં ચરણોમાં વંદન કરતાં બાબાએ તેમને પોતાનાં જ ગુરુનાં ચરણમાં દઢ કરેલા. તેવા જ બીજા એક શ્રીમંત પણ સંતોષી વેરાયેલા ભક્ત, પત્ની અને બાળકો સહિત સાઈના દર્શને આવ્યા હતા. તે સમયે બાબાએ એ ભક્તતના મનનો ઉદ્ય કરી ઇચ્છિત હેતુ કેવી રીતે પૂર્ણ કર્યો, અને વાઈના રોગથી પીડાતા એમના પુત્રને કેવળ દર્શનથી જ રોગમુક્ત કર્યો અને પહેલાં બનેલી હકીકતની પ્રત્યક્ષ યાદ કેવી રીતે કરાવી એ હવે સાંભળો. હેમાડપંત સાઈના શરણમાં આવીને શ્રોતાઓને આદરપૂર્વક વિનવણી કરી રહ્યા છે કે સાઈકથા સાંભળવા માટે આસક્ત થાઓ અને કાનને સાર્થક કરી લો. (ઓ. ૧૧૨-૧૨૬)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પામેલા, હેમાડપંત રચિત શ્રી સાઈસમર્થના.

સત્ય ચરિત્રનો 'ભક્તા ભીષ સંપાદન' નામનો પચ્ચીસમો અધ્યાય અહીંથાં સમાપ્ત થાય છે.

શ્રી સદગુરુ સાઈનાથને અર્પણા.



## અધ્યાય ૨ પનું અર્થ વિવરણ

ઉપરના અધ્યાયમાં ઓવી ૮૪ વચ્ચે બાબાએ દામુ આણણા માટે હંડીમાં મૂકેલ ફળો માટે ‘ખાઈને મરી જવ’ આવું ભળતું જ અને આશ્રૂ પમાડે એવું કેમ બોલ્યા ? તેનો અર્થ શો હોવો જોઈએ તેનો અર્થ મદ્રાસના સ્વ. પ. પૂ. નરસિંહ સ્વામીએ એમના LIFE OF SAIBABA VOL III, CH 3 માં સુંદર રીતે ઉકલ સમજાવ્યો છે. ‘મરી જવું’ આ શારીરિક નથી પણ આધ્યાત્મિક મરણ સમજવાનું છે. આ મરણ એટલે લગ્ન પછી એક પછી એક સંતતિના જન્મમરણના કારણે અને બીજી બધી જવાબદારીઓની ચિંતાના કારણે સંસારમાં ઉંડા ઉત્તરી જવાને લીધે એક ભ્રમ અથવા તો પ્રમાદ પેદા થાય છે. સનતકુમાર તેમના સનતસુજલતિમાં કહે છે કે, ‘પ્રમાદો મૃત્યુરહં બ્રવીમિ’ પ્રમાદને જ હું મૃત્યું કહું છું. હેમાઉપંતે પણ અધ્યાય પર, ઓ. ૧૨-૧૩ વચ્ચે આનો જ અનુવાદ કર્યો છે. ‘પ્રમાદ મિથ્યા જ્ઞાનનું કારણ | આત્મક્રપ અન-અનુસંધાન | જેથી ઉદ્ભલવે જન્મમરણ | સર્વ અનર્થનું કારણ જે ॥૧૨॥ મોહ એટલે મિથ્યા જ્ઞાન | અનાત્મમાં આત્માનિમાન | તે જ ‘મૃત્યુ’ એવું વિદ્જાજન | લક્ષણ કહે છે ॥૧૩॥ સાઈબાબાને પોતાના ભક્તો પ્રપંચમાં ગુંચવાઈને પરમાર્થ તરફ ધ્યાન ન આપે એવું ગમતું નથી. એનો અર્થ એક ધન અથવા તો સંસારનાં બીજાં સુખ સાધનો પ્રાપ્ત કરવા માટે ભક્તિ કરનારા દામુ આણણા જેવા ભક્તોની ઈચ્છાને તેમની જુદને કારણે ભલે તે પૂરી કરતા હતા. છતાં તેની સાથે સાથે ‘ખાઈને મરી જવું’ એવા સૂચક શબ્દો બોલીને તેમને તેઓ ઈશારો પણ કરતા હતા. અથવા તો પોતાની નાપસંદગી પણ દર્શાવતા હતા. આપણા ઘરમાં એક નાનું બાળક ખૂબ જ જુદ પકડીને કોઈ વસ્તુ માંગવા લાગે ત્યારે તેની મા તેને એ વસ્તુ આપીને ગુસ્સાથી કહેતી હોય છે કે, ‘એક વાર લે અને જ મર અહિયાંથી.’

આમાં સ્વ. નરસિંહ સ્વામીની સામે ઠ.સ. ૧૯૭૬માં સ્વ. દામુ આણણાએ નિવેદન કર્યા છે જેને વાંચ્યા બાદ આ અધ્યાયાના પ્રસંગ બાબાને વધારાનો કંઈક ખુલાસો થાય છે. શ્યામાએ માટીની મોટી ઉંડી વાટકી જેવી જે હંડી હતી તેમાં પહેલાં ચાર નહિ પણ આઈ કેરીનાં ફળ મૂક્યાં હતાં. બાબા નાનાં બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા. તેમને માટે તેમને ભાવતી વસ્તુ ભેગી કરીને ખાવા માટે ખાદ્ય પ્રસાદ આપીને તેઓ ખૂબ જ લાડ કરતા હોવા જોઈએ. કોઈ કોઈ વખત બાબાનું ન સાંભળતાં અમુક અમુક ખાદ્ય પદાર્થોં તો તેઓ મસ્નિદમાંથી ઉંડાવી લઈ જતા. પણ બાબા તેમની આ ભૂલ અથવા ભસ્તી પ્રત્યે દુલ્કષ જ કરતા. પેલા મૂકેલા સુંદર મધ્યમધતા હાઙ્ગુસ કેરીના ટોપલા જોઈને બાળકો માંગવા લાગ્યા. માટે બાબાએ તેમને કહ્યું કે, ‘એ તો દામુશોઠ માટે છે’ ત્યારે બાળકોએ જવાબ આપેલો, ‘તેઓ અહિયા કયાં છે, એ તો નગરમાં રહે છે.’ ત્યારે બાબા બોલેતા, ‘તેઓ અહિયા આવવા નીકળી ગયા છે.’ છતાં પેલા બાળકોએ લાગ જોઈને એમાનાં ચાર ફળો ગપચાવી લીધાં અને તેથી જ દામુ આણણા માટે ચાર જ કેરીઓ બચેતી. આ ઉપરના અધ્યાયમાં બાબા દામુ આણણાને કહે છે કે, ‘તારી નાની પત્નીને એટલે બીજી પત્ની બધાં ભળીને આઈ બચ્યાં જન્મશો. એમાંથી ચાર છોકરા અને ચાર છોકરીઓ થશે. આ મારી આપ્રતીલા પ્રસવશે’ એવું શા માટે કહ્યું હશે એનો અર્થ સમજાય છે. પછી આગળ ઉપર એ આઠમાંથી ચાર મૃત્યુના મુખમાં પડ્યા અને ચાર જીવંત રહ્યા. આનું કારણ પણ સમજાય છે.

દામુ આણણાની જન્મકુંડલીમાં પુત્ર સ્થાનમાં એટલે પાંચમાં સ્થાને પાપ ગ્રહ કેતુ આવેલો હતો. અને તેને મારક ગ્રહ ઉપર ગુરુની કૃપાદિષ્ટ પણ ન હતી. તેને કારણે તેમને સંતતિ યોગ બિલકુલ જ ન હતો, તેવો જ્યોતિષીઓનો નિર્ણય હતો. પણ તેમને શ્રી બાબા જેવા સમર્થ ગુરુ મધ્યા હતા. અને એમની કૃપા દિશિથી પેલા પાપ ગ્રહની વક્ત દિશિનું નિવારણ થયું અને દામુ આણણાને ત્યાં સંતતિ પ્રાપ્ત થઈ. તે ઉપરથી સિદ્ધ થાય છે કે, ઈશ્વરના અથવા ગુરુના ભળની સામે ગ્રહેની શક્તિ નિર્ભળ થઈ જય છે. શ્રી ત્યાગરાજ કહે છે કે, ‘ગ્રહોનું બળ મોટું ? શ્રી રામની કૃપાનું બળ બધાએ બળ કરતાં મોટું’. સાચે

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

જ આના સિવાય ગોપાળરાવ ગુંડના નરીભમાં ન હોવા છતાં પણ પુત્રસંતતિ પ્રાપ્ત થઈ હતી કે નહીં ? રધુનાથરાવ તેઝુલકરનો પુત્ર ડૉક્ટરની પરીક્ષા પાસ થયો હતો ને ? સોલાપુરના ઓરંગાબાદકરની પત્ની ર૭ વર્ષ બાદ પુત્રવતી થઈ શકી હોત ખરી ? આને તમે બાબાનું અસામાન્ય સામર્થ્ય કે ઈશ્વરી તત્ત્વ સમજે અથવા તો ત્રિકાળજ્ઞાન કહો કે સત્ય સંકલ્પસિદ્ધ કહો પણ બાબાના શબ્દો આખરે ખરા જ ઠરતા હતા. એ ચોક્કસ પણે સાચું. ‘સાઈમુખેથી બોલાયા જે શબ્દો. તે તો નિર્ધાર જાણો બ્રહ્મ લેખ. ॥૧૧૬॥ અ. ૩૬’

દામુઅણણાની બાબા પ્રત્યેની ભક્તિ પોતાના સંસારિક સ્વાર્થના કલયાણ માટે હતી. માટે જ તેમની આ બે કથાઓમાંથી આપણને આ દુનિયાદરીના સ્વાર્થના ઘણા જ પાઠ શીખવા મળે છે -

(૧) માણસે પૈસા કમાવા માટે અતિ લોભ કરવો નહિ. ‘ઉત્તમ વ્યવહારથી’ ઘન જરૂર કમાવવું. પૈસા વીના આ જગતમાં કાંઈ પણ થતું નથી. અને ચાલે નહિ. ચારે ય પુરુષાર્થોમાં અર્થ આને બીજી કમનો પુરુષાર્થ આપણાં શાખોમાં કહ્યો છે. પણ જેને એક રાતમાં પૈસા કમાઈ લેવા છે તે પુષ્ટ કમાવવાના મોહમાં સહા જેવો જેખમી વ્યવહાર જેમ કે જુગાર અને ઘોડાની રેસ તથા તેને લગતા કોઈ પણ ખેલ બાબાશ્રીને પરંદ ન હતા. ‘પુરતી છે અધી ભાખરી તેમાં સંતોષ માન | લાખની પાછળ પડતો નહીં ॥’

(૨) શ્રી બાબા પાસેથી આપણો કંઈ માંગીએ છીએ અને તેની ખૂબ રાહ જેવાં છતાં ન મળતાં મનથી આપણે બાબા ઉપર ગુસ્સો કરી કયારેય તેમની ભક્તિ કરવાની પણ છોડી દઈએ છીએ. આ સહંતર આપણી મુર્જામી છે. બાબા તો ત્રિકાળજ્ઞાની છે. તેમને તો આપણું અંતિમ કલ્યાણ શેમાં છે, એ ચોખ્યુ દેખાય છે. આપણે પુત્ર પ્રાપ્તિ ઈચ્છિતા હોઈએ પણ તેનું મૃત્યુ જલ્દી થવાનું હોય અથવા તો લગ્ન કરાવ્યા બાદ ઘડપણમાં આપણને તે છોડી હેનાર હોય તો એવી સંતતિ શા કામની ?

(૩) ગુરુને સાંસારિક સ્વાર્થ અંગેની પ્રત્યક્ષ અથવા તેમની છબીની સામે ચિંઠીઓ ફેરફારીને સલાહ સાધારણ રીતે પૂછવી નહીં. પણ જે પૂછ્યું તો તેમની આજ્ઞા પ્રમાણે જ વર્તવું જેઠાએ. પછી ભલેને તે આજ્ઞા આપણી ઈચ્છા વિરુદ્ધની કેમ ના હોય. દામુ અણણાએ બાબાની કપાસના અને અનાજના સોદા કરવાની સલાહ માની માટે તેમની ઉપરની મોટી ધાત ટળી અને મોટા નુકસાનમાંથી ઉગરી ગયા. તેથી એમનું કલ્યાણ થયું.

(૪) સદ્ગુરુ ઉપર અનન્ય શ્રદ્ધા જેઠાએ. તેમને એકવાર કાંઈ પણ કલ્યા પછી ભલે તે ઉપર ઉપરથી જેતાં, ગમે તેટલી વિચિત્ર વાત લાગે તેમ છતાં તે પ્રમાણે વર્તતાં આપણું મન કચવાવું ન જેઠાએ. શ્રી બાબાએ દામુ અણણાને કેરી ખાઈને મરી જવા માટે કહ્યું છતાં તેમણે તે ફળ સ્વીકાર્યા અને બીજી નાની પત્નીને ખવડાવતાં તેમને પુત્ર રત્નની પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થઈને ?



## ॥ અધ્યાય ૨૬ ॥

અપરમાર અને આત્મહત્યા નિવારણ તથા નીજ ગુરુ પદ્થ સ્થિરીકરણ  
 (દર્શને આવેલા પિતળોના છોકરાનો તાણનો રોગ સારો કરવો પૂનાના આંબેડકરને આત્મહત્યાનો વિચાર છોડાવવો  
 અને મુંબદીના પંતને તેમના ગુરુનાં ચરણોમાં સ્થિર કરવા.)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુણાદેવતાને વંદન,  
 શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

આ પંચમહાભૂતોનું બનેલું અને મન તત્ત ઈન્દ્રિયથી સમજવા યોગ્ય એવા બધા જ સળવ અને નિર્જવ પદાર્થોના સમુદ્દરયવાળું આ જગત અરીસામાં પડેલા શહેરના પ્રતિબિંબની જેમ માયાના ગોટાળામાં પાડનારો દેખાવ છે. અસલમાં આત્મસ્વરૂપમાં સમાયેલું પરોવાયેલું આ વિશ્વ ઉત્પન્ન થયેલું નથી, છતાં જે આત્મસ્વરૂપમાં સ્થિત એવું સળવ અને નિર્જવ જગત ઉત્પન્ન થયેલું અદ્ભુત ભાસે છે. જે કાંઈ અરીસામાં દેખાય છે તે વાસ્તવિક રીતે નથી હોતું. જેવી રીતે ઊંઘમાં મનની પ્રવૃત્તિ ચાલુ છે. જેવી રીતે ઊંઘમાં મનની પ્રવૃત્તિ ચાલુ હોય છે, તે પ્રમાણે દર્શય દેખાતાં હોય છે પણ જગત થતાં તેનું અસ્તિત્વ જ રહેતું નથી. એકનાથી ભાગવત અધ્યાય બીજામાં જણાવ્યા પ્રમાણે ‘માણસને જે પ્રપંચ દેખાય છે। એ મિથ્યા આભાસ છે। જેવી રીતે એકલા નિદ્રાવશ। સ્વભન્માં જુદું જ કલ્પનામય જગત દેખાતું હોય છે।’ ॥૫૦૮॥’ જગૃત અવસ્થામાં હું દેહ નથી પરંતુ આત્મા છું એવું જણાવનારી સ્થિતિ પ્રાપ્ત થઈ કે સ્વભન્માં અનુભવેલો સંસાર ઓગળી જય છે. અદર્શ થઈ જય છે. સદગુરુ પાસેથી મહાવાક્યોનો ઉપદેશ થતાં, અભેદ જ્ઞાનના આનંદનો પ્રકાશ પ્રગટે છે. અધ્યાય ૧૦ ઓવી ૬૭માં કહ્યું છે તેમ થતાં અચળ ગુરુનું સખ્ય। જતાં દ્વૈત થાય છે ઐક્ય। ‘તત્ત્વમસિ’ મહાવાક્ય। સાક્ષ એની એ આપે છે ॥ જગતનું અસ્તિત્વ પ્રગટ થનારી સત્તાનું સ્કૂરણ, અને કોઈ પણ બાબત ઉપર અવલંબીને ન રહેનારું સત્તાનું કેન્દ્ર, એવું જે ઈશ્વર સ્વરૂપ ગુરુરૂપી આત્મા, એ જ્યારે પ્રસત્ત થાય ત્યારે ઉપરની વાતની પ્રતીતિ થાય છે. તેથી સાક્ષાત્કાર થાય છે. સ્વયં પ્રકાશિત અને સત્તસ્વરૂપ એવું આ આત્માનું સ્વરૂપ છે અને ત્યાં આ પંચમહાભૂતનો અને માયાના આશ્રયનો ખેલ છે. બ્રહ્મથી માંડીને ઠેઠ ધાસના તણખલા સુધી વિસ્તરેલું આ પંચમહાભૂતોનું વિશ્વ બધું જ કલ્પિત હોવાને કરાણે ફક્ત માયાનો દેખાવ છે. જે તે ખરા સ્વરૂપની જણ નથી તેમને માટે તો જાડી રસ્સી સાપ છે. તે રીતે ફૂલની અથવા તો મણિની માળા, લાકડીનો દંડ અથવા તો પાણીની ધારા તે પણ ભૂલથી સમજય છે. એવી જ રીતે આત્માના યથાર્થ જ્ઞાનના અભાવના કારણે આત્માની જગ્યાએ, આ જગતના ફેલાવાના અસ્તિત્વમાં છે એવું દેખાય છે. ગુરુ ઉપદેશથી જગૃતિનો કાળ આવતાં તત્ત્વજ્ઞાનથી માયામય દેખાવનો નાશ થાય છે. ‘ગુ’ આ ધાતુનું તૃતીયપુરુષ એકવચનના રૂપને એટલે કે ‘ગૃષ્ણાતિ’ એટલે કે ઉપદેશ કરતો અર્થ મનમાં ધારતાં, શિષ્યને તત્ત્વજ્ઞાનનો ઉપદેશ કરવા માટે ગુરુ આ એક જ જગતમાં સમર્થ છે એવું ધ્યાનમાં આવશે. ગુરુ ગીતાએ કહ્યું છે તેમ ગુરુકરં ચ ગુણાતીતં રુકરં રૂપવર્જિતમ્ । ગુણાતીતસ્વરૂપં ચ યો દ્વાત્ સ ગુરુઃસ્મૃતઃ ॥ ગુરુંગીતા શ્લો. ૪૬ ॥ ગુરુ આ શબ્દમાંનો ‘ગુ’ અક્ષર ગુણાતીત સ્વરૂપનો નિર્દેશક હોવાને લીધે ‘રુ’ આ અક્ષર રૂપાતીત સ્વરૂપનો નિર્દેશક છે. ગુણ અને રૂપ પણ પર એટલે નિર્ગુણ અને નિરાકાર સ્વરૂપની જે પ્રાપ્તિ કરાવી આપે

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ઇછે, અથવા તો સાક્ષાત્કાર કરાવી આપે છે, તેને જ ગુરુ કહેવામાં આવે છે. (ઓ. ૧-૧૦)

આપણે સાઈબાબાને વિનંતી કરીએ કે અમારી બુદ્ધિને આત્મપરાયણ, નિત્ય અને અનિત્યનો બેદ જાણનારી બનાવીને વિષયસુખોનો ત્યાગ કરવા માટે તત્પર બનાવો. હું તો સદાય સાર અસારનો વિચાર ન કરનાર મૂર્ખ અને અવિવેકી મૂઢ છું. અજ્ઞાનરૂપી અંધકારમાં અડચણોથી ઢંકાયેલો અને સદા સર્વદા, હંમેશને માટે મૂર્ખપણાની કલ્પના કરતો રહું છું. મારે માટે આ કોયડો ગહન બન્યો છે. બાબા ! ગુરુ અને વેદાંત ઉપર હું દદ વિશ્વાસ રાખતો થાઉં એવું કરો. એટલે મારું મન અરીસા જેવું સ્વચ્છ થઈને એમાં આત્મજ્ઞાનના ઉપદેશની છાપ સ્પષ્ટ ઉપસી આવે. હે સહૃગુરુ સાઈસમર્થ ! આ સમજન્યેલા જ્ઞાનની યથાર્થતા સમજાવો. કરણ કે અનુભવ વગરના મોઢાના બડબડાટને પરમાર્થ ડેવી રીતે સધારો ? માટે બાબા, તમારા પ્રભાવથી આ જ્ઞાન પ્રત્યક્ષ રીતે શરીરને અનુભવવા દો. એટલે સંદર્ભ મુક્તિ સહેલાઈથી પ્રાપ્ત થાય. કૃપા કરીને મને આવું વચન આપો. એ માટે હે દેવ સહૃગુરુ સાઈસમર્થ ! હું તારાં ચરણોમાં મારાં દેહનું અભિમાન અર્પણ કરું છું. હવેથી એને તું જ સંભાળ અને તું જ જે. મારું હું પણું મારી પાસે નથી. મારું દેહાભિમાન લઈ લે જેથી મને સુખ દુઃખની જાણકારી જ ન રહે. તારી ઈચ્છા પ્રમાણો ચલાવીને મારા મનને રોક, અથવા તો મારામાં જે હું પણું છે તે તું જને જ થઈ જ અને સુખદુઃખનું ભોગવાનું પણ તું જ લઈ લે. પછી મને એની કોઈ ચિંતા નથી. હે પુરુષકામ સાઈનાથ ! તારો જયજયકાર થાઓ. તારે માટેની મારી ભક્તિ દદ થાઓ. હે સર્વ શુભવાતોના નિવાસ સ્થાન એવા સાઈનાથ ! મારા આ ચંચળ મનને તારાં ચરણોમાં શાંત કર. તારા સિવાય અમારા હિતોની વાત બીજું કોણ કહેશે અને અમારાં દુઃખોને દૂર કરી અમારા મનનું સમાધાન કોણ કરશો ? (ઓ. ૧૧-૨૦)

બાબા ! એ શિરડીનું ભાગ્ય છે, કે તમે શિરડીમાં પદ્ધાર્યા. ત્યાં જ તમે જીવન પર્યન્ત નિવાસ કર્યો, અને શિરડીને તીર્થયાત્રાનું સ્થાન બનાવ્યું. ધન્ય છે એ શિરડીનાં પુણ્ય કે બાબાએ કૃપાવંત થઈને તે ભૂમિને પોતાનું સ્થાનક બનાવીને, અલંકારિત કરીને તથા શોભાવીને તેને ભાગ્યવંત બનાવી. હે સાઈનાથ ! તું જ મને પ્રેરણા આપનારો અને ચેતવનારો છે. તું જ મારી વાણીની ગતિ આપનારો છે ત્યારે તારા ગુણ ગાનારો વળી હું કોણ ? બધાં જ કાર્ય કરનારો અને કરાવનારો તું એકલો જ છે. તારો દરરોજનો સહવાસ એ જ અમારે માટે વેદ-વેદાંતનો અભ્યાસ, અને તારા ચરિત્રનું શ્રવણ તે જ અમારે માટે પોથી પુરાણ અને પારાયણ છે. એક પણ ક્ષણ ન વેદફિતાં તારા જ નામનો જલ્પ કરવો એ જ અમારું નિત્ય ધ્યાન છે, અને એ જ અમારાં મનનું સમાધાન છે. જેને લીધે ઈશ્વર ભજનમાં અમે પાછા પડીએ, એવું સુખ અમારે નથી જેઠિતું, તે અમારા માટે શું કામનું ? એનાથી વિશેષ પરમાર્થમાં બાધાઙ્કપ અધઃપતન બીજું કયું હોઈ શકે ? આનંદના આંસુ એ જ જાણે કે ગરમ પાણી ! તેનાથી તારા પગ ધોઈને અને શુદ્ધ પ્રેમઝૂપી ચંદન વડે તારા શરીર લેપ કરીને અને ઉત્તમ પ્રકારની શ્રદ્ધા તે જાણે કે ઓફવાનું વસ્ત્ર ન હોય તે આપના શરીર પર પહેરાવીએ. બહારના આવા દેખાવ ઉપયાર અને પૂજન કરતાં માનસિક પૂજન વિધિથી જ અમે તને પ્રસન્ન અને સંપત્ત કરીએ. મનને પૂર્ણપણે એક ચિત્ત કરીને અષ્ટભાવ જેવા કે આઠ પ્રકારની મન અને શરીરની અવસ્થા. પરસેવો છૂટવો, સ્તરધ થઈ જયું, શરીરનાં ઢ્વાટાં ઊભાં થથાં, અવાજ ગળગળો થવો, શરીરમાં કંપ છૂટવો, રંગ બદલવો, આંખોમાંથી આંસુ છલકાવાં અને બેહોશ થવું તેવી આઠ પાંખડીઓનું અતિ નિર્મળ કમલપુણ્ય તારાં ચરણોમાં અર્પણ કરી તેનું ઉત્તમ ફળ અમે પ્રાપ્ત કરીએ. ભોળી ભક્તિ અને શ્રદ્ધા રૂપે અભીલ, ચંદન, કાળા રંગનું અને લાલ રંગનું કંકું વગેરે સુંદર દ્રવ્યોનું તારા કપાળને તિલક કરીએ. દદ ભક્તિરૂપી કમ્મરબંધ તારી કમ્મર પર બાંધીએ અને તારા પગના અંગૂઠા પર અમે અમારું મસ્તક અર્પણ કરીને એટલે કે સર્વસ્વ શરણે આવીને અલૌકિક આનંદધાર્યક મોજ લૂંટીએ. પ્રેમ જાણે કે રત્નોનો અલંકાર તેનાથી તમને સજાવીએ, અમારું સર્વસ્વ એટલે જાણે કે કડવા લીંબડાનાં પાન, અને મીઠા વડે તારી આરતી કરી નજર ઉતારીએ. પાંચ પ્રાણથી તમારી ઉપર ચમ્મર ઢોળીએ,

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

અમારું તન્મય હોવું એ જાણે કે છત જ ન હોય ! જેનાથી તમારું ગરમીથી રક્ષણા કરીએ. આ પ્રકારે ગંધ-અર્દ્ધ સહિત અષ્ટોપચારી સ્વાનંદથી તમને પૂજા અર્પણ કરીએ. હે સાઈરાયા ! અમારા કામકાજ ખાતર તારી આરાધના કરીએ. પોતાનું ઇચ્છિત પ્રાપ્ત કરી લેવા માટે ‘સાઈસમર્થ’ આ નામનો જપ જપી અને એ જ મંત્રથી પરમાર્થ સાધીને આપણી નિષ્ઠા સાર્થક કરીએ. (ઓ. ૨૧-૩૩)

આ પહેલાના અધ્યાયમાં અત્યંત દ્યાળું શ્રી સાઈસમર્થ પોતાના ભક્તોના કલ્યાણ માટે તેમને કેવી શિખામણ આપતા તે કહેવામાં આવ્યું છે. હવે આ અધ્યાયમાં દર્શને આવેલા પોતાના ભક્તોને તેમના મૂળ ગુરુનાં ચરણોમાં કેવી રીતે સ્થિર કર્યા હતા, તે કથા ધ્યાન દઈને સાંભળો. પાછલા અધ્યાયના અંતમાં જે પંત નામના ભક્તને કથામૃતમાંનો જે નિર્દેષ કર્યો તેમાંનો સાર મનમાં નિશ્ચિત કરવા માટે બાબાએ તેમને કેવા કેવા અનુભવો કરાવ્યા ? કેવું નિષ્ઠાદ્વારા અંજન આંપોમાં નાખ્યું ? કેવી રીતે પોતાના ગુરુપદે સ્થિર કર્યા અને કેવી રીતે મન શાંત કર્યું, તે હવે ધ્યાન દઈ શ્રોતાઓએ સાંભળવું. એક વખત એક પંત નામના ભક્ત ભિત્રોની સાથે સાઈના દર્શનની ઈચ્છાથી ઘણા પ્રયત્નો બાદ શિરડી પહોંચ્યા. તેઓ પોતે પહેલેથી જ કૃપાપાત્ર હોવાને કારણે, પોતાનાં ગુરુચરણમાં સ્થિર જ હતા. શિરડી શા માટે જવું એવી શંકા તેમના મનમાં ઉત્પન્ન થઈ. પરંતુ જેવો જેનો યોગ હોય છે, તે પ્રમાણે માણસની કલ્પના બહારના બોગ પ્રાપ્ત થાય છે. પંતને સાઈદરશનનો મોકો સામે ચાલીને આવ્યો અને તે ખરેખર સુખકારક પુરવાર થયો. આપણે કોઈ યોજના તૈયાર કરીએ છીએ પણ પરમેશ્વર કંઈ બીજું જ વિચારતો હોય છે. નસીબની આગળ કંઈ જ ચાલતું નથી. તે કેવી રીતે બન્યું તે સ્વસ્થ ચિંતે સાંભળો. શિરડીના પ્રવાસમાં જવાનું નક્કી કરીને ઘણા લોકો સમુહમાં આનંદથી બેગા થઈને આગગાડી દ્વારા પોતપોતાનાં ઢેકાળેથી નિકળ્યા હતા. આ બધી મંડળી જ્યારે ગાડીમાં ચઢી ત્યારે તેમની સાથે તે ગાડીમાં પંત પણ બેઠેલા હતા. વાત વાતમાં પંતને આ સંધનું શિરડી જવાનું આયોજન સમજાયું. આ સમુહમાં પંતના થોડા સનેહીઓ અને ભાબી તથા એમનાં બાળકોના સાસુ સસરા પણ હતા. પંતના મનમાં આ બાબતનો જરા પણ વિચાર ન હોવા છીતાં મંડળીએ બળજબરીથી તેમની સાથે શિરડી આવવાનો બહુ જ આગ્રહ કરતાં તેઓ તૈયાર થઈ ગયા. પંતને જ્યાં જવું હતું અને જ્યાં જવાનો વિચાર હતો ત્યાં સુધીની તેમણે રિકિટ પણ કઢાવી હતી. પણ પછી તેઓએ વિચાર બદલ્યો. તેઓ વિરાર સેશને ઉત્તરી ગયા અને મંડળી મુંબથી આગળ ગઈ. પછી પંત પણ ખર્ચ માટે ઉછીના પૈસા લઈને મુંબથી પહોંચ્યા. ભિત્રોનું મન તોડવું તેમને ગમતું ન હતું. પોતાના ગુરુની સંમતિ લઈને પછી તે બધા જ મળીને આનંદ કરતાં શિરડી સાઈબાબાના દર્શન માટે જઈ પહોંચ્યા. સવારના અગિયારના સુમારે તેઓ બધા એક જ સાથે મસ્જિદમાં ગયા, અને બાબાની પૂજા માટેની ભક્તોની ગિર્દી જોઈને તેમને આનંદ થયો, તેમજ બાબાનું ઝપ જોઈને તેઓ ઉત્સાહિત થઈ ગયા. એટલામાં પંતને ચક્કર આવ્યા અને તેઓ બેશુદ્ધ થઈને નીચે પડ્યા. તેમને અશક્તિ આવી અને શરીર ઠંડુ પડીને હલનયલન વગરનું થઈ ગયું. આવી તેમની હાલત જોઈને સાથે આવેલા લોકોને ચિંતા થઈ અને તેમનાં મન બિલકુલ જ અસ્વસ્થ થઈ ગયાં. પણ સાઈબાબાની કૃપા દાખિથી અને જેઠે આવેલા લોકોની મહદ્દી માથા ઉપર પાણી છાંટતા પંતની બેશુદ્ધ બિલકુલ નાણ થઈ. તેઓ હોશમાં આવી લથડિયા ખાતા ધીમે ધીમે ઊભા થઈને બેસી ગયા. જાણે કે ઊંઘમાંથી હમણાં જગીને બેઠા ના હોય ! સાઈબાબા તો સંપૂર્ણ અંતર્જાની હતા. પંતે પહેલેથી જ પોતાના ગુરુનું શિષ્યત્વ પ્રાપ્ત કરેલું હતું. બાબાને તે વાતની ખબર પડી ગઈ હતી. માટે તેમને અભય વચન આપીને બાબાએ તેમના પોતાના ગુરુનાં ચરણોમાં સ્થિર કર્યા. બાબા બોલ્યા, ‘પ્રસંગ ગમે તેવો આવે ‘અપના તકિયા છોડના નહીં’ એટલે કે આશ્રમ સ્થાન છોડવું નહીં. હમેશાને માટે પોતાના સ્થાનને ચોટીને જ રહેવું તેમજ એકનિષ્ઠપણે બધા જ ગુરુઓની એકતા ધ્યાનમાં રાખવી.’ પંત આ માર્મિક શબ્દોનો બોધદ્વારા અણસાર તરત સમજ ગયા. પોતાના ગુરુની

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

યાદ આવી અને સાઈબાબાની આ શિખામણની યાદ જન્મભર રહી. (ઓ. ૩૪-૫૬)

એ રીતે એક મુંબઠના હરીશચંદ્ર પિતળે નામના ગૃહસ્થ તેમના છોકરાની તાણાની બીમારીને લીધે દુઃખથી અને પીડાથી ખૂબ જ ત્રાસી ગયેલા. દેશી અને વિદેશી વૈદ, ડૉક્ટરો એ બધાને અજમાવી જેયા પણ કોઈથી ફાયદો થયો નહિ. આખરે થાકીને છેવટે સાધુ સંતોનો સહારો લીધો. સન ૧૯૧૦માં દાસગણુનાં કીર્તનો શરૂ થયાં અને શ્રી સાઈનાથાની કીર્તિ પ્રસરવા લાગી. આથી શિરડી ધસારો વધવા મંડયો. શિરડી આમ તો નાનું ખુણાં ખાચરાનું ગામ છતાં તે મોટું ભાગ્યવાન હતું. તે હવે પંદરપુર થયું હતું. એટલે કે શિરડીને વિષ્ણુલના પંદરપુર જેટલું મહત્વ પ્રાપ્ત થયું હતું. તેમજ યાત્રા સવારીઓ ખૂબ વધવા લાગ્યાં. સાઈબાબા ફક્ત દર્શન માત્રથી કે કેવળ હાથના સ્પર્શથી અથવા કૃપાદિશી રોગમુક્ત કરતા હતા. એવા અનેકને અનુભવ થવા લાગેલા. તેમના શરણે અનન્યપણે જતા ભક્તોનું કલ્યાણ થર્તું હતું. દરેકના મનની ઈચ્છા જાણીને, બાબા તેમની મનોકામના પૂર્ણ કરતા ઉદ્દી લગાડતાં ભૂતપિશાચની વૃત્તિઓ ભાગી જતી. આશીર્વાદથી રોગીઓનો રોગ મટી જતો. અને કૃપાદિશી બધી જ બાધાઓ અને દુઃખો ટળતાં અને ફરી પાસે ફરકતાં પણ નહીં. આવું સાંભળીને લોકો શિરડીમાં દોડી દોડીને આવતાં. આવા સાઈબાબાનો મહિમા દાસગણું મહારાજના કથાકીર્તનોમાંથી, ગ્રંથોમાંથી અને કાનોકાન સાંભળીને પિતળેને એમના પવિત્ર દર્શનની ઉત્કંઠા લગી. બધા બાળગોપાળ સાથે બેટ સોગાડો અને અનેક પ્રકારનાં ફળફળાદી સાથે લઈને તેઓ પોતાનાં પૂર્વનાં પુણ્યના પ્રતાપે શ્રી સાઈનાથના દર્શનાર્થે શિરડી આવી પહોંચ્યા. ત્યાં પહોંચતાં પોતાનાં બાળકોને બાબાનાં ચરણોમાં મૂક્યાં અને જતે પણ બાબાશ્રીની સામે દંડવત્ત પ્રણામ કર્યા. એટલામાં એક જુદા જ પ્રકારનો અનુભવ થયો. તેથી પિતળે મનથી ખૂબ જ મુંજાઈ અને ગભરાઈ ગયા. સાઈનાથાની આંખો સાથે છોકરાની આંખ મળતા જ, પેલો છોકરો એકાએક બેહોશ થઈ ગયો. અને આંખો ચક્કરવકર ફેરવીને નીચે ભૌંય પર પડ્યો. આથી એ છોકરાના માબાપ આવી હાલત જેઠિને ગભરાઈ ગયા. પેલો છોકરો જમીન પર બેભાન પડ્યો, મોઢામાંથી ફીણ ફીણ નીકળી ગયાં અને માબાપને ચિંતા પેઢી કે આ દૈવબોગનો શું ઉપાય કરવો ? એનો શ્વાસોશ્વાસ ઢંઘાતો હોય એવો ભાસ થયો. મોઢામાંથી ફીણ એક જ સરખાં નીકળી રહ્યાં હતાં. અને પરસેવો વળતા ઠંડોગાર થઈ જતાં તેની છેલ્લી ઘડી આવી ગઈ કે શું એવું લાગવા માંડયું. આવા તો વાઈ કે તાણના ઝટકા પહેલાં એ છોકરાને કેટલીયે વખત આવી ગયા હતા. પણ એકેયવખત આવી વિચિત્ર લાંબા ગાળાની બેશુદ્ધિ, અને આવી પરિસ્થિતિ સર્જની ન હતી. આ વખતની તાણનો પ્રકાર ન જેયેલો કે બનેલો એના જેવો હતો. આ વખતે તો તે મરણ પામશે એવી જ પરિસ્થિતિ સર્જની. પોતાના પુત્રની આવી પરિસ્થિતિ જેઠિને માની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં અને તે મનમાં બોલવા લાગી, ‘આપણે આવ્યાં શા માટે અને આ શું થયું ? ઉપાય શોધવા નીકળતા તો અપાય થઈ ગયો. શ્રી સાઈનાં ચરણ આવાં પ્રાણધાતક કેવી રીતે હોઈ શકે ? અમારી બધી ખટપટો વ્યર્થ ગઈ. ચોરના ડરથી ઘરમાં બેઠા. તો ઘર જ શરીર ઉપર ધર્સી પડ્યુ. વાધ ભક્ષણ કરી જશો. એ બીકથી જીવ બચાવવા ગાય ભાગી તો રસ્તામાં જ કસાઈ મળી ગયો. તે રીતે ઉનાળામાં ગરમીથી તપેલો વેમાર્ગુ ઝાડની છાચામાં વિસામો કરવા આડો પડ્યો તો તેની ઉપર ડાળી તૂટી પડી. એવી જ રીતે દેવની શ્રદ્ધાથી પૂજ માટે મંદિરે જતાં તો જાણો મંદિર જ તુટી ને ધર્સી પડ્યું એવો આ ઘાટ થયો.’ (ઓ. ૩૭-૭૬)

બાબાએ પછી પિતળેને આશ્વાસન આપતાં કહ્યું કે, ‘મનમાં થોડી ધીરજ રાખો. તેને સંભાળીને કાળજીપૂર્વક ઉચ્ચકીને લઈ જલ. તે હોંશમાં આવી જ જશો. આ છોકરાને તમે જ્યાં ઉત્તર્યા હો તે નિવાસસ્થાને પાછો લઈ જલ. લગભગ પચીસેક મિનિટમાં એના શરીરમાં પ્રાણ આવશે. હમણાં કોઈ પણ પ્રકારની ઉત્તાપણ કરતા નહીં.’ દુંકા સમયનો વાયદો પણ અચંબો પામડે તેવો બની ગયો, બાબાના બોલેલા બોલ સાચા પડ્યા. પિતળેના કુટુંબમાં આનંદ થયો, તેમજ તેમના મનની બધી જ કુશંકાઓ પિગળી ગઈ. ત્યારબાદ પિતળે પોતાની પત્ની સહ બાબાના દર્શન માટે આવ્યા અને અત્યંત

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

નમ્રપણે તેમણે સાથાંગ નમસ્કાર કર્યા. પોતાના દીકરાને બેઠેલો જેઠિને આભાર માનતા મનમાં આનંદિત થઈને તેઓ બાબા પાસે બેસીને ચરણ સેવા કરવા લાગ્યાં. ત્યાં જ બાબાએ તેમને હસતાં હસતાં પૂછ્યું કે, ‘હવે તો તમારી શંકા કુશંકાનાં તોફાનો શાંત થયાને ? જે વિશ્વાસ અને શ્રદ્ધા મૂકે છે, અને ધીરજ અને સબુરી રાખે છે એનું શ્રી હરિ હંમેશા રક્ષણ કરે છે.’ (ઓ. ૭૭-૮૩)

પિતળે ગર્ભશ્રીમંત હતા, સારા કુળના હતા અને લોકોમાં પ્રસિદ્ધ પામેલા હતા. તેમણે બાબાને ફળફળાદિ અને માન અર્થી તેમજ મસ્ઝિદમાં એકવિત થયેલા સમુહને માબા મીઠાઈ વહેંચી. તેમનાં પત્ની ખૂબ જ સાત્ત્વિક પ્રેમાળ શ્રદ્ધાળું અને ભાવિક હતાં. તેઓ હંમેશા મસ્ઝિદમાં બાબા તરફ એકીએ ધ્યાન ધરતાં અને ત્યાં થાંભવાને ટેકવીને બેસતાં. બાબા સામે જેતાં જેતાં તેમની આંખો ભરાઈ આવતી. આવું તેમનું હેત જેઠિને અને પ્રેમ જેઠિને બાબા પણ પોતાનું ભાન ભુલી જતા. જેવા દેવ તેવા જ સંત, તેઓ પણ ભક્તોના તાબામાં જ રહે છે. તેમને જે અનન્યપણે ભજે છે તેમની ઉપર તે અસીમ કૃપા કરે છે. થોડા દિવસ પછી તે આખી મંડળી જવા માટે નીકળી અને છેલ્લે મસ્ઝિદનાં દર્શન માટે આવી. બાબાની આજા અને ઉદ્દી લીધી અને નીકળવાની તૈયારી કરી. એટલામાં બાબાએ તેમની કફનીના જિસ્સામાંથી ત્રણ ઢાંચા કાઢ્યા અને પિતળને પાસે બોલાવી જે કદ્યું તે સાંભળો. ‘બાપુ ! ખૂબ પહેલાં મેં તને બે ઢાંચા આપ્યા હતા, એમાં બીજા આ ત્રણ મૂકીને એની પૂજા કરતો રહેજે, તારું કલ્યાણ થશે.’ પિતળે એ હાથમાં ત્રણ ઢાંચા લીધા અને એને બાબાનો પ્રસાદ સમજીને આનંદથી સ્વીકાર કર્યો. બાબાનાં ચરણોમાં દંડવત્ પ્રણામ કર્યા અને બોલ્યા, ‘મહારાજ ! મારી ઉપર આપની કૃપા કાયમ રાખજો.’ પિતળે મનમાં વિચાર કરવા લાગ્યા, ‘મારો શિરડીનો તો આ પહેલો જ ફેરો છે. પછી બાબા આ શું કહી રહ્યા છે તે મને સમજતું નથી. મેં બાબાને આ પહેલા કદી જેયા નથી. પછી આ પહેલાં આપેલા તે બે ઢાંચા કેવી રીતે હોઇ શકે ? તેમનો આમ બોલાવાનો ભાવાર્થ કોણ સ્પષ્ટ કહી શકશો ?’ પિતળેની આ જાણવાની જિજાસા વધતી ગાઈ. પણ બાબાએ તેનો અર્થ સમજાયો નહિ. તેમજ આ બાબતની અસ્પષ્ટતા તેમના મનમાં એવી અને એવી જ રહી. સંત સહજ રીતે કંઈક બોલી નાખે તો પણ તેમના એ શબ્દો સાચા જ રહે છે. આ બાબતની જાણકારી પિતળને હતી. માટે તેઓ વિચારમાં પડ્યા. પણ પછી તેઓ જ્યારે મુંબદી પાછા ફર્યા ત્યારે તેમના ઘરમાં એક ડોશીમાં રહેતાં હતાં. જેમણે પિતળેની આ જિજાસા પૂર્ણ કરી. (ઓ. ૮૪-૯૬)

એ વૃદ્ધ બાઈ બીજા કોઈ નહીં પણ પિતળના માતુશ્રી જ હતાં. શિરડીની હકીકત પૂછ્યતાં વાતવાતમાં પેલી ત્રણ ઢાંચાવાળી વાત નીકળી પણ એનો કશાની સાથે સંબંધ લાગ્યો નહિ. ઇતાં ત્યાર પછી ખૂબ જ વિચાર કરતાં, પિતળના માતુશ્રીને કોઈ ખૂબ જૂની વાત યાદ આવી અને બોલ્યા ‘હવે મને સમજાય છે, બાબાએ જે કંઈ કહ્યું છે તે ખરેખર સાચું જ છે. હાલમાં જેવી રીતે તું તારાં બાળકોને લઈને શિરડી સાઈદર્શન માટે ગયો હતો તેવી જ રીતે તારા બાપ પણ તને પહેલાં અક્કલકોટ લઈ ગયા હતા. ત્યાંના મહારાજ પણ એક મહાન પ્રસિદ્ધ સિદ્ધ પુરુષ અંતર્યામી, યોગી, વિદ્જાન અને પરોપકારી હતા. આ મહારાજ એટલે અક્કલકોટના મહાન દત્તઅવતારી સંત ‘સ્વામી સમર્થ’ હતા. તેઓ ઈ.સ. ૧૮૮૮માં મંગલવેદામાં પ્રગટ થયા હતા. ત્યારબાદ થોડા જ સમયમાં અક્કલકોટ આવ્યા અને ઈ.સ. ૧૮૯૮માં તેમણે સમાધિ લીધી ત્યાં સુધી તેઓ તે જ મુકામે રહ્યા હતા. તારા પિતા પણ આચરણથી ખૂબ જ શુદ્ધ હતા. તેમની પૂન્યથી અક્કલકોટના યોગીરાજ પ્રસન્ન થયા હતા. અને તેમણે પ્રસાદરૂપે બે ઢાંચા આપણા ઘર માટે પૂજનમાં મૂકવા માટે આપ્યા હતા. એ બે ઢાંચા આપણા દેવઘરમાં દેવ દેવીઓની પૂજા વચ્ચે રાખવામાં આવેલા. તારા બાપ પુરુષ શ્રદ્ધાથી નિયમિત એનું પૂજન કરતા હતા. તેમની નિષા અને ભક્તિની મને એકલીને જ ખબર છે. તે જ પ્રમાણે છેવટ લગી તેઓ વર્તતા હતા. પણ એમની હ્યાતી બાદ તે બધી પૂજનની સામગ્રીઓ નાનાં બાળકોનાં રમવાનાં

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સાધનો થઈ ગયાં. છોકરાઓની ઈશ્વર ઉપરની શ્રદ્ધા ઓછી થઈ. પૂજનમાં બેસવા માટે પણ શરમ લાગવા લાગી. અને પૂજન કરવા માટે એક નાના છોકરાની નિમણુંક કરવામાં આવી. પછી એ ડ્રિપિયાની સંભાળ લેનાર કોણા ? તેની તરફ કોઈનું પણ ધ્યાન રહ્યું નહિ અને આમને આમ કેટલાંય વર્ષો વીતી ગયાં. અવ્યવસ્થામાં તે બે ડ્રિપિયાની યાદ પણ ભૂંસાઈ ગઈ અને બે ડ્રિપિયાની જેડી પણ ખોવાઈ ગઈ. તમે નસીબવાળા છો કે સાઈના રૂપે અક્ષલકોટ સ્વામી મહારાજનું વિસ્મરણ થયેલું. તેથી પડ્દો પડી ગયેલી વાતને દૂર કરવા માટે અને સંકટોનું નિરાકરણ કરવા માટે તમને બાબા મળ્યા. તો હવે ભૂલ્યા વગર ખોટી કલ્પનાઓ કે તર્ક છોડીને પોતાના પૂર્વજ્ઞેનાં આચરણ તરફ ધ્યાન આપો. આવો ખોટો વહેવાર ન કરતાં આ ત્રણ ડ્રિપિયાને દેવધરમાં પૂજન માટે મૂકી તેને સંતોના પ્રસાદનું ભૂખણ માનો. સાઈસમર્થે આ વાતનો અણસાર આપીને અને તમને સમજલવીને તમારી અંદરની ભક્તિ ફીરીથી જગત કરી છે.' પોતાની માતાના આવા મધુર શબ્દો સાંભળી પિતળેના મનમાં ખૂબ જ સંતોષ અને આનંદ થયો અને શ્રી સાઈબાબાની સર્વવ્યાપકતાનો અંદાજ આવ્યો. મનમાં ખાતરી થઈ અને તેમનાં દર્શન સાર્થક થયાં હોય એમ લાગ્યું. માના શબ્દરૂપી અમૃતથી પિતળેની દબાયેલી અને નષ્ઠ થયેલી ભાવનાઓ ફરી જગૃત થઈ તથા પદ્ધતાતાપ રૂપી પ્રાયશ્વિત થયું. તેમજ હવે પછીના કલ્યાણનો માર્ગ બતાવી દીધો. જે થવાનું હતું તે થઈ ગયું. સંતે આગળના કાર્ય માટે જગૃત કર્યા છે. તેમનો ઉપકાર માનીને પિતળે પોતાના કામમાં જીવનભર સાવધાન થઈ ગયા. (ઓ. ૮૭-૧૧૨)

આવો જ એક બીજે અનુભવ સંભળાવું છું. ભક્તોની મનમોળ અને અવિચારી વૃત્તિને બાબા કેવી રીતે સુધારતા હતા તે હવે સ્વસ્થ ચિત્તે સાંભળો. પૂનામાં રહેનારા ગોપાળ નારાયણ આંબેડકર નામના સાઈબાબાના એક શ્રેષ્ઠ ભક્ત હતા. તેમની કથા આદરથી સાંભળો અંગ્રેજ સરકારના રાજ્યમાં આબકારી-એક્ષસાઈજ ખાતામાં તેમની નોકરી હતી. દરશ વર્ષની નોકરી પૂર્ણ થતાં તેઓ ઘરે બેઢા. તેમનું નસીબ બહલાયું અને પલટો આવ્યો. બધા જ દિવસો કંઈ સરખા નથી હોતા. શ્રહદશા બેઢી. તે ભોગવ્યા વીના કોઈનો છૂટકો થતો નથી. શરૂઆતમાં તેઓ થાણા જિલ્લામાં નોકરી કરતા હતા. પછી નસીબ તેમને જહીર ગામમાં લઈ આવ્યું. તેઓ ત્યાંના અમલહાર બન્યા અને ત્યાં જ તેઓ બેકાર થયા. નોકરી એટલે અળવીના પાતરાનાં પાન ઉપરના પાણીનાં રીપાં જેવી ક્ષાણભંગુર હોય છે. હવે નોકરી પાઈ કયાંથી મળશે ? બીજે પડાવ કયાંનો થશે ? આંબોડકરે ત્યાર પછી ખૂબ જ પ્રયત્નો બાદ હાર માની લીધી. તેમને કોઈ પણ રીતે યશ મળ્યો નહિ. આથી કોઈની પણ ગુલામી ન કરતાં સ્વતંત્ર રહેવાનો તેમણે વિચાર કર્યો. તેમની ઉપર આપત્તિઓનો કળશ ઢોળાયો હોય તેમ તેઓ બધી જ રીતે હતાશ થઈ ગયા. દરેક વર્ષે તેમની પૈસે ટકે પરિસ્થિતિ વણસતી ગઈ. મુશ્કેલીઓ ઉપર મુશ્કેલીઓ આવીને ઘરની સ્થિતિ સહન શક્તિની બહારની થઈ ગઈ. આમને આમ બીજાં સાત વર્ષ નીકળી ગયાં. દર વર્ષે તેઓ શિરડી બાબા પાસે જતા દંડવત્ પ્રણામ કરીને પોતાનું આ દુઃખનું ગાણું રાત દિવસ ગાતા. ઈ.સ. ૧૯૧૬માં તેઓ પોતાની પરિસ્થિતિથી ખૂબ જ કંટાળી ગયા. અને તેમને લાગ્યું કે શિરડીમાં જઈને ત્યાં આત્મહત્યા કરવી. આ પ્રવાસમાં કુદુંબકબીલા સાથે તેઓ બે મહિનાથી ઉત્તર્યા હતા. એક રાતે શું વાત બની તે સાંભળો. દીક્ષિતના વાડાની સામે બળદગાડા ઉપર બેઠેલા આંબેડકરના મગજમાં વિચારની લહેરો દોડવા માંડી. જીવનથી તો તેઓ ખૂબ કંટાળેલા હતા જ અને મનથી તેટલા જ ઉદાસ રહેતા હતા. 'આ ત્રાસ હવે બસ વધારે સહન નહીં થાય. જીવવાની આશા હવે છોડી હેવી જેઠાએ.' આવો મનમાં મક્કમ વિચાર કરીને પોતાના જીવ પર આવી જઈને આંબેડકર ફૂલામાં ફૂદકો મારવા માટે તૈયાર થયા. આજુભાજુ કોઈ જ નથી માટે શાંત સમય જેઠાએ પોતાના મનનું ધારેલું કરવા એને દુઃખી ધૂટકારો મેળવવા માટે તેઓ ઉઠ્યા અને આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું. આત્મહત્યાથી વધારે મોંદું કોઈ પાપ નથી. તેમ છતાં તેઓ એ કરવા માટે તૈયાર થયાં. પણ શ્રી સાઈ તો આ જગતના ચાલક છે અને સૂત્રધાર છે. તેમણે આંબેડકરના મનનો આ વિચાર ટાજ્યો. ત્યાંથી જ ચાર ડગલાં

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ચાલતાં એક વીસી ચલાવનારાનું ધર હતું. તે પણ બાબાનો પરમ સેવક હતો. આ રસોઈધર ચલાવનારાનું નામ હતું સગુણ મેરુ નાઈક. મૂળ ગોવાનો રહીશ. બાબાએ તેમને નાનપણમાં એક સાધુના વેષમાં દર્શન આચાં હતાં. ત્યારબાદ તેઓ હૈદરાબાદ ગયા હતા. ત્યાં તેમની મુલાકાત એક શ્રીમંત સાઈભક્ત જેઠે થઈ અને ઓળખાણ થતાં તેમની સાથે તેઓ શિરડી આવ્યા. બાબાએ તેમને નાનપણમાં આપેલી મુલાકાતની યાદ તાજ કરીને શિરડીમાં કાયમ માટે સ્થાયી કરી તીધા. સગુણે પોતાની આજીવિકા માટે અને દર્શન આવતા ભક્તો માટે એક જમવાની લોજ શરૂ કરી હતી. પાછલા અધ્યાય પમાં ઓ. ૧૧માં લીંબડાના ઝડ નીચે પાદુકાની વ્યવસ્થા કરવા માટે તેમના નામનો ઉલ્લેખ આવેલો છે. સગુણે એ સમયે પોતાના ઘરના ઉંબરામાં આવીને આંબેડકરને પૂછ્યું કે, એક્ઝલકોટ મહારાજની પોથી કદી આ પહેલાં વાંચી છે કે? જેવા દોને કઈ છે એ પોથી. એવું વિચારીને આંબેડકરે તે હાથમાં લીધી અને સહજ પાનાં ઉથલાવી જેથાં અને વચ્ચમાં વચ્ચમાંથી તેઓ વાંચવા લાગ્યા. કર્મધર્મસંયોગ કેવો આવ્યો કે વાંચવા માટે વિષય પણ એવો જ આવ્યો. અને વાંચતાં જ હૃદયમાં વિચારોનો હુમલો થયો. તેનું પરિણામ કેવું આવ્યું એ કથા સાધારણ ધ્યાનમાં આવી છે. તે શ્રોતાઓને વિસ્તારના ભયને લીધે બિલકુલ થોડામાં જ કહું છું. (ઓ. ૧૧૩-૧૩૩)

એક્ઝલકોટમાં આત્મ સ્વરૂપમાં મન્ન એવા મહાન સંત સ્વામીસમર્थ મહારાજ હતા. તે વખતે જ અનેક રોગોનો શિકાર થયેતા તેમના એક ભક્તને સહન કરી ન શકાય તેવું ભયંકર દર્દ શરૂ થયું. રોગથી મુક્ત થઈ જઈશ એવું સમજુને તેમણે ઘણા બધા દિવસ સુધી મહારાજની સેવા કરી હતી. પણ હવે એ સહન ન થતાં તે ભક્ત ખૂબ બયલીત થયો હતો. આત્મહત્યા જ આ દુઃખનું નિવારણ છે એવું સમજુને મનમાં નિશ્ચય કરીને રાતનો સમય જેઠે એક કૂવા ઉપર જઈને તેમાં પહુંચ્યું મૂક્યું. એટલામાં સ્વામીસમર્થ મહારાજ ત્યાં આવ્યા. પોતાના હાથે તેને બહાર જેંચી કાઢ્યો અને ઉપદેશ કર્યો, ‘પ્રારંભમાં આવેલાં ભોગવવાનાં સુખ દુઃખ તમામ ભોગવવાં જ જેઠાએ. આપણાં પૂર્વ કર્મનાં બંધનો પ્રમાણો, વ્યાધિ, મહારોગ, કલેશ અથવા તો રોગ, ભોગવ્યા વગર આત્મહત્યાનો માર્ગ અપનાવવાથી છૂટકો થોડો થાય છે? આ ભોગ જે અપૂરતા રહ્યા તો બીજે જન્મ લેવો પડશે અને ભોગ ભોગવ્યા વગર છૂટકો જ નથી. માટે થોડી તકલીફ વધારે સહન કરી લે. પોતાના આત્માની હત્યા જેતે જ કરનારો થઈશ નહિં.’ આ ભક્ત એટલે સ્વામીસમર્થના પરમભક્ત બ્રહ્મનિષ્ઠ પ. પૂ. વામનબુવા વાંબોરીકર ઉંડે વામન રાજ્ય વૈદ્ય જેમણે સ્વામીસમર્થની ‘શ્રી ગુરુલીલામૃત’ નામની પંચાવન અધ્યાયની વિસ્તૃત પોથી લખીને મરાહીમાં પ્રસાદિક ચરિત્ર લખ્યું છે. આ પ્રસંગ ગુજરાતમાં વડોદરા મુકામે શહેરની મધ્યમાં આવેલા સૂરસાગર નામના તળાવની પચ્છિમ દિશાના કિનારા પર આવેલા એક કૂવા ઉપર તા. ૨૦ એપ્રિલ ૧૮૭૬ના રોજ બન્યો હતો. આ પ્રસંગનું વર્ણન સ્વામીસમર્થના ચરિત્રના અધ્યાય ૪૦ ઓવી ૧૬૫-૧૭૨માં કરવામાં આવેલું છે. જે કૂવામાં વામનરાવે કૂદકો માર્યો હતો તે કૂવો અને જે જગ્યાએ સ્વામી સમર્થ પ્રગટ થયા હતા તે કેકાણે સ્થાપના કરેલી ‘સ્વામીસમર્થની પાદુકા આજે પણ વડોદરા મુકામે જેવા મળે છે.’ ઠેઠ એટલે કે ઈ.સ. ૧૮૬૦માં પ્રસિદ્ધ હત્થભક્ત નારેશ્વર નિવાસી શ્રી રંગ અવધૂત મહારાજશ્રીના વરદ હસ્તે સ્વામીસમર્થ એક્ઝલકોટ મહારાજની મૂર્તિની સ્થાપના કરીને મંદિરની શોભા વધારી છે. પ. પૂ. વામનબુવાનું ઈ.સ. ૧૮૦૧માં નિર્વાણ થયું. તેમની સમાધિ વડોદરા મુકામે રણમુક્તેશ્વર મહાદેવ પાસે છે. આવી સમયોચિત કથા વાંચીને આંબેડકર મનમાં અચંબો પામી ગયા. અરે સાઈની વ્યાપકતાનો વિચાર કરીને તેઓ તેજ સ્થળે બેસી પડ્યા. આંબેડકર મનમાં એટલું ચોક્કસ સમજુ ગયા કે, પ્રારંભ ભોગવે જ છૂટકો છે. આવું શ્રી બાબાએ યોગ્ય સમયે મને તેની સમજ આપતાં મેં કોઈ ભજતું સહસ કર્યું જ નહિં. આ દાંત એટલે જાણે કે આકાશવાણી થઈ હોય એવું આંબેડકરને લાગ્યું અને તેમની સાઈચરણોમાં આસક્રિત સ્થિર થઈ ગઈ. ખરેખર શ્રી બાબા આ બદ્દી અસંલય ઘટનાઓ સર્જે છે. ‘સગુણા મુખેથી આ સાઈનો ઈશારો એ જ પોથી દ્વારા મળવામાં જે થોડું પણ મોદું થયું હોત તો એક જન્મનો

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

નાશ થયો હોત. મારા ગ્રાણને મેં દુઃખી કર્યા હોત. અને કુટુંબનું ભયંકર નુકસાન કર્યું હોત. મારી સ્ત્રી ઉપર અનર્થ થયો હોત, અને સ્વાર્થ તેમજ પરમાર્થ બંનેને હું ગુમાવી બેઠો હોત.' પોથીને નિમિત્તે બાબાએ સગુણને પ્રેરણા કરી કે, આત્મહન્ત્યથી તેનું મન પાછું વાળે. જે આવું ન બન્યું હોત તો બિચારા આંબેડકરે મફતમાં જીવ ગુમાવ્યો હોત. જ્યાં સાઈ જેવો તારણહાર છે ત્યાં મારનારો શું કરી શકે ? આ ભક્તના પિતા પણ અક્ષલકોટ સ્વામીના ભક્ત હતા. તે જ રીતે પુત્રએ આગળ ચલાવવું એવો સ્પષ્ટ નિર્દેશ બાબાએ તેમને આ અનુભવદ્વારે કરાવ્યો. સમય જતાં બધાં જ સારાંબાનાં થયાં. આવા દિવસો પણ નીકળી ગયા. આંબેડકરે ખૂબજ મહેનતથી જ્યોતિષશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો અને તેનાં ફળ પણ પામ્યા. સાઈકૃપાઙ્ગા પ્રસાદ મેળવીને આગળ સારા દિવસો આવ્યા. જ્યોતિષશાસ્ત્રમાં પારંગત થયા અને ત્યારબાદની સાધારણ સ્થિતિ સારી રીતે પસાર થઈ ગઈ. ગુરુનાં ચરણમાં પ્રેમ વધ્યો તથા આરોગ્ય, ખુશાતી અને પરમસુખ પ્રાપ્ત થયું. સંસારના આરામ અને ઉત્કર્ષ મેળવીને ખૂબ જ આનંદિત થયા. બાબાના આવા અગાણિત એક કરતાં પણ એક મૌટા ચમત્કરો કહેવા જઈશ તો આ ગ્રંથનો વિસ્તાર વધશે માટે ફક્ત તેનો સાર જ કહું છું. (ઓ. ૧૩૪-૧૫૧)

હેમાડપંત સાઈબાબનાં શરણે ગયા છે. આગળના અદ્યાયમાં શ્યામાને માધવરાવ દેશપાંડેને-બાબાએ વિષણુસહસ્રનામનું દાન કેવી રીતે આચ્યુતું તેનું મધુર વર્ણન જેઠિશું. શ્યામા ના.... ના. પાડતા પણ તેમની ઉપરના અગાધ પ્રેમને લીધે બાબા બળજબરીથી અને આગ્રહથી વિષણુસહસ્રનામનું સુંદર મહાત્મ્ય કહી સંભળાવશે. હવે ધ્યાનપૂર્વક સાદર થનારી તે કથા સાંભળજે. કૃપાનો યોગ્ય સમય આવતાં શિષ્યોની બિલકુલ ઈચ્છા વિરુદ્ધ બાબા તે આપતા દેખાશે. સદ્ગુરુના આંગણે કૃપા કરવાની રીતો કેટલી અતૌકિક હોય છે તે અદ્યાયમાં દેખાશે. શ્રોતાઓએ તેને આદરપૂર્વક સાંભળવી. બાબા તો બધા જ ગુણોની ખાણ છે. કલ્યાણનું પણ કલ્યાણ છે. તેમનું ચરિત્ર પવિત્ર અને પુણ્યકારક છે. સદ્ગુરુએ જ એ આપણને સાંભળવા મળે છે. (ઓ. ૧૫૨-૧૫૬)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકરે સંત અને સજજનોની પ્રેરણા પામેલા ભક્ત હેમાડપંત રચિત  
શ્રી સાઈ સમર્થના સત્ય ચરિત્રનો 'આપસ્માર આત્મહન્ત્યા નિવારણ તથા નીજ ગુરુ પદ સિથરીકરણ'

નામનો છલ્લીસમો અદ્યાય અહીં સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણા.



## અધ્યાય ૨ ઇનું અર્થ વિવરણ

આ અધ્યાયમાંની ગ્રંથે કથાઓ સંતોની એક બીજ સાથેની એકાગ્રતાનાં દર્શન કરાવે છે.

પંતની પહેલી કથામાં સાઈબાબાએ પંતના ગુરુ સાથે એકાત્મતા સિવાય જ તેમણે પંતના ગુરુનું શિષ્યત્વ પહેલેથી જ પ્રાપ્ત છે તેની જાણ થઈ હતી અને પછી જ ‘અપના તકિયા છોડના નહીં’ એવો ઉપદેશ કર્યો હતો. બીજી હરિશચંદ્ર પિતળેની કથામાં તો સાઈબાબાની અક્કલકોટ સ્વામીસમર્થની સાથેની રહેલી એકાત્મતા બિલકુલ ચોપખી દેખાય છે. બાપુ તને બે પહેલાં દીધાં છે તેમાં ગ્રંથ આ। મૂકી કરને પૂજન એનાં | કૃત કૃત્ય થઈ જઈશ તું ॥૬૦॥ બીજી પૂનાના આંબેડકરની કથામાં પણ બાબાએ તેમને જમવા માટેની લોજ ચલાવનારા સગુણા નાયક અક્કલકોટ મહારાજની પોથીમાંનો જે જરૂરી હતો તે યોગ્ય પ્રસંગ વંચાવીને જાણે કે તેમના વડીલની ‘સ્વામીની ભક્તિ’ હતી માટે, હવે પોતે પણ સ્વામીસમર્થ જ હોવાને કારણે પહેલાં જેમ કોઈ એક ભક્તને કૂવામાં દૂબી ભરીને આત્મહંત્યાના પ્રયાસથી બચાવ્યો હતો. તેવી જ રીતે અહીંયાં આંબેડકરને બચાવ્યો અને પોતાના વડીલની ભક્તિ આગળ પણ ચલાવતા રહેવું, તેની પ્રતીતિ કરાવી.’

શ્રી સાઈબાબાની સ્વામીસમર્થ સાથે રહેલી એકાત્મતા અંગે અધ્યાય પ ઓવી પ્રદ વચ્ચે લીંબડાના જાડ નીચે પાદુકાસ્થાન ઉપરના આખ્યાનમાં આપેલું છે –

એ સિવાય સ્વ. પૂ. નરસિંહ સ્વામીજી તેમના SAIBABA'S CHARTERS AND SAYINGS આ પુસ્તકમાં અનુક્રમ ૭૪માં આવેલ એક ભક્તને આ બાબતમાં અનુભવનું કથન કરેલું છે. તે આ પ્રમાણે છે –

‘મુંબદ્ધ તારદેવમાંના ડેશાવ નાઈક આશરે ઈ.સ. ૧૮૭૮માં અક્કલકોટ ગયા હતા, ત્યારે ત્યાં સ્વામીસમર્થની તે સમાધિસ્થ થવાના છે તેની વાતો ચાલતી હતી, તે જાણ્યું ત્યારે તેમણે શ્રી અક્કલકોટના સ્વામીસમર્થ મહારાજને પૂછ્યું કે, ‘મહારાજ ! તમારા ગયા બાદ અમારા જેવાને કોનો આશરો ? એના જવાબમાં સ્વામીએ તેમની પાદુકા આપીને તેની પૂજન કરવા માટે કહેલું. ‘હવે મારો અવતાર અહમદનગર જિલ્લાના શિરડી ગામમાં થશે, ‘ત્યાં તું હંમેશા જજે, અને ત્યાં જ તારી ભક્તિ ચાલુ રાખજે, જેથી તને મારી યાદ આવશે નહિ અને તું સુખી થઈશ.’ એવું કહ્યા બાદ ડેશાવ નાઈક પછી હંમેશાને માટે શિરડી જવા લાગ્યા હતા.’

સ્વામીસમર્થને તેમના ભક્તો ભગવાન દર્તના સાક્ષાત્ અવતાર માનતા હતા. ત્યારે સાઈબાબાને પણ અમે દર્તનો જ અવતાર માની લઈને તેમની આરતી કરીએ તો એમાં કોઈ આશ્રય નથી.



## ॥ અદ્યાય ૨૭ ॥

દીક્ષા, અનુગ્રહ, દાન

(શ્યામાને વિષ્ણુસહસ્રનામની દીક્ષા આપવી અને આપર્ટે ઉપર કૃપા કરવી)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,  
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

શ્રી સદગુરુનાં ચરણ દદ પણો પકડી રાખતાં બ્રહ્મા વિષણુ અને મહેશ એ ત્રિમૂર્તિને નમન કર્યા બરાબર છે. સાક્ષાત્  
પરબ્રહ્મને વંદન કર્યા જેવું છે. એમ કરવાથી સ્વનો આનંદ સહજ રીતે વિપુલ પ્રમાણમાં પ્રગટ થાય છે. સમુદ્રમાં દૂબકી  
મારી એટલે નાણે કે બધાં જ પ્રકારનાં અને બધાં જ તીર્થક્ષેત્રોની યાત્રા કર્યા બરાબર ગણાય છે. તેવી જ રીતે કોઈ એક  
સદગુરુનાં ચરણોમાં વિશ્વાસથી આશ્રય લેતાં પણ ત્યાં સર્વ દેવો પ્રાપ્ત થાય છે. હે સદગુરુ સાઈનાથ ! તારો જ્યે જ્યકાર  
હો. જે શાશ્વત મુક્તિમાં જીવ ઈશ્વર સાથે એકરૂપ થાય છે. તેની પ્રાપ્તિ કરવાનારા કલ્પવૃક્ષ ! તારો જ્યે જ્યકાર હો. હે  
આત્મજ્ઞાનના સાગર ! તારી જ્યે થાઓ. તું શ્રોતાઓના મનમાં તારી જ કથા અને તારા જ વિષયોનો પૂજ્યભાવ ઉત્પન્ન  
કર. આકાશમાંથી વરસતુ પાણી ચાતક પક્ષી જેટલી આતુરતાથી પીએ છે, તેટલી જ ઉત્સુકતાથી તારો બધો ભાવિક  
ભક્તગણ તારા કથામૂત્તરનું પાન કરે અને સદા સુખી રહે. તારી પવિત્ર કથા સાંભળીને આપ્ત, ઈષ્ટમિત્રો સહિત શ્રોતાઓના  
શરીર ઉપર બધે જ પરસેવો જણાય, આંખોમાંથી પ્રેમાશ્રૂંઓનાં પુર આવે. પ્રાણજાળો કે અધ્વરચ્ચે જ અટકી ગયો હોય,  
મન ભરાઈ આવે અને શરીર પર રોમ ઉભાં થઈ જય. ઘડીએ ઘડીએ જીવ રડી ઉઠ અને દૂસરાં ભરે. એક બીજાનો વિરોધ  
અને નાનામોટાનો બેદભાવ મટી જય એટલે જણાવું કે ગુરુકૃપાની વૃષ્ટિ થઈ છે તેવું મનનું પરીક્ષણ કરતાં ધ્યાનમાં આવશે.  
સદગુરુ સિવાય આ કૃપા બક્ષનારો દાતા નરેણ્ય લોકમાં શોધતાં પણ મળશે નહીં. કામ કોધ વગેરે છ વિકારો શાંત થયા  
સિવાય અને ગુરુચરણોમાં ભક્તિભાવ, સીમાઓ ઓળંગીને થતો પ્રેમ અને શ્રદ્ધા ઉત્પન્ન થયા સિવાય અષ્ટભાવોનો  
ઉદ્ગમ થતો નથી. ભક્તોને સુખ પ્રાપ્ત થાય છે અને ગુરુને તેનો ખૂબ જ હરખ હોય છે. ભક્ત જેમ જેમ પરમાર્થ તરફ  
વળતો જય છે તેમ તેમ ગુરુને તેનું આશ્રય થાય છે. આ શરીર એટલે હું છું અને આ ધરબાર, પુત્ર અને પત્ની વગેરે મારાં  
છે, એવું માનવું પણ શરીર પર નકામી તકચીફ જેવું છે. તે પણ બપોરના છાંયડાની માફક ક્ષાળાભર ટકનારી માયા જ છે.  
આ માયાની આંટીઘૂઠીની પીડા થાય નહિ, એવું મનને લાગતું હોય તો અનન્ય ભાવે ભાબાશ્રીનાં શરણે જવું. માયાનો  
અંત લાવવા માટે વેદ, શાસ્ત્રોએ હાથ હેઠા મૂકી દીધા છે. જે સર્વ સળવ અને નિર્જવ વસ્તુઓમાં ઈશ્વરને જેશે, તે જ આ  
માયાને ખાતીથી પાર કરી શકશે. (ઓ. ૧-૧૩)

નિઝામશાહી છોડીને ચાંદભાઈ પાટીલ સાઈ ફરીરને લઈને પહેલાં અહુમદનગર જિલ્લાના નેવાસ ગામે આવ્યા. જ્યાં  
ગોદાવરી નરીથી બે કોસ ઉપર પ્રવરા નરીના કઠિ આવેલા સ્થાને, જ્ઞાનદેવ મહારાજે પોતાની જાનેશરી અને અમૃતઅનુભવ  
એમ બે ગંથો લખીને પૂર્ણ કર્યા હતા. અહિં અર્ધનારી નટેશ્વરીમોહિની રાજની અર્ધાગિની લક્ષ્મી સાથે શ્રી વિષણુભગવાનનું  
પ્રસિદ્ધ મંદિર આવેલું છે. ત્યાં છ મહિના સુધી કે લગભગ વર્ષ સુધી સાઈ ફરીરનું રહેવાનું થયું. ત્યાં જ તેમની સાથે કાનદ  
ગામના ‘કમા’ ની સંગાથે રહ્યા હતા. પાછળથી આગળ ઉપર પ્રસિદ્ધ ટકળી ગામના દગ્ધ તંબોળીને સાથે લઈને કમા

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

તેમજ સાઈબાબાની સાથે આ મંડળી શિરડીમાં આવી હતી. તે સમયમાં ઓરંગાબાદથી શિરડી પગપાળા અથવા તો બળદગાડામાં આવવા માટેનો આ એક જ માર્ગ હોવો જોઈએ. પરંતુ લગ્નની જનના પ્રવાસમાં વર્ષ અથવા તો છ મહિના નીકળી જવા તે શક્ય નથી. તો પછી સાઈબાબા શિરડીમાં ચાંદભાઈને કારણે આવ્યા તે વાત ખરી. પણ લગ્નની જનમાં ન આવતાં આમ જ આવ્યા હોય એવો અમુકનો મત છે. એવું હેમાઇપંત અહીંથા કહેતા જણાય છે. તે ભલે કંઈ પણ હોય, સાઈબાબા શિરડી આવ્યા અને શિરડી નિવાસીઓ નહીં પણ આપણા સૌનો ભાગ્યોદય થયો તે તદ્દન સો ટચ સોના જેવી સાચી વાત છે. અનેક ઢેકાણે પવિત્ર તીર્થનાં સ્થળો પુષ્કળ અને અગણિત છે. છતાં શ્રી સાઈબાબાના ભક્તો માટે શિરડી તે જ અત્યંત પવિત્રક્ષેત્ર અવશ્ય મનાય છે. જે સૌભાગ્યે આ યોગ બરાબર આવ્યો ન હોત તો આ મહાન ભાગ્ય અમારા જેવાના ભાગમાં કયાંથી આવ્યું હોત ? અમારા જેવા પામરોને આ સાઈનો સુંદર અને પ્રેમાળ સહ્યવાસ કેવી રીતે મળ્યો હોત ? જે ભક્તો પોતાનાં કાર્ય સિદ્ધ કરવા માટે સાઈબાબાનાં શરણે આવે છે, તેમના કલ્યાણ અર્થે બાબા યથાર્થ માર્ગદર્શન આપે છે. શ્રોતાઓએ એકાગ્ર મન કરીને શ્રી સાઈના ચરિત્રનું પારાયણ કરવું. આ સાઈનું પાપનાશક તેમજ પરમ પાવન ચરિત્ર ગુરુકૃપાની પ્રાપ્તિ માટેનું ઉત્તમ સાધન છે. (ઓ. ૧૪-૨૦)

પાછળના અધ્યાયમાં એકને પોતાનાં ગુરુનાં ચરણમાં સ્થિર કર્યો. એકને અક્ષલકોટ સ્વામીનો અણસાર દેખાડીને જગૃત કર્યો અને એકને અકલ્યિત યુક્તિ યોજીને આત્મહત્ત્વા કરતો અટકાવીને અને તેની ઉપર આવેલી મૃત્યુની છાયાને ટાળીને તેને જીવતદાન આવ્યું અનું વર્ણન કરેલું છે. હવે આ અધ્યાયમાં અમુક વખતે પ્રસ્ત્ર થઈને સાઈબાબા પોતાના ભક્તોને કૃપાનું વરદાન આપીને કેવી રીતે સુખી કરતા હતા, એ કહેવામાં આવશે. એ દીક્ષા આપવાનો એક અદ્ભુત પ્રકાર હૃસ્તાં ખેલતાં વિનોદવૃત્તિથી કોના માટે અને કેવી રીતે યોજ્યો હતો, તે વિષે શ્રોતાઓએ સાવધાનીથી એકચિત્તે સાંભળવું. ઉપદેશ કરવાની બાબાની અનેક રીતોનું વર્ણન આ ગ્રંથમાં આગળ પણ કરવામાં આવ્યું છે. જેવી જેની ગ્રહણ કરવાની શક્તિ, અથવા તો અધિકાર તેવા જ માર્ગ બાબા તેમને ઉપદેશ કરતા હતા. એક રોગીના રોગની માહિતી અને નિદાન એ ફક્ત વૈધરાજને ખબર હોય છે અને તેમને જ દ્વાની કેટલી માત્રા આપવી અને કયા ઔષધથી ફાયદો થશે તેની સંપૂર્ણ જાણકારી હોય છે. રોગીને તેની કલ્પના નથી હોતી. રોગી પહેલા ગોળ લાવો એમ કહે છે પણ ગોળ મીઠો હોવા છતાં નુકશાનકારક હોય છે. રોગી તેને માટે જ્ઞાન કરે છે અને ગોળ લીધા વીના ઔષધની વાડકી હાથમાં પકડતો નથી. રોગી ઉપર બળજબરી પણ થઈ શકતી નથી. માટે વૈદ્યો યુક્તિ કરતા હોય છે. પહેલા ગોળ આપે અને પછી દ્વા આપે છે. એમ કરીને પોતાનું કાર્ય સિદ્ધ કરતા હોય છે. ફક્ત ઔષધ જોઈ અથવા તો પાછળથી લેવામાં આવતા પદાર્થમાં ફેરફાર કરવામાં આવે છે કે જેને હિસાબે ગોળનો દોષ નહિ જેવો થઈને આપવામાં આવેલ ઔષધનો ઉપયોગ અને ઉપાય બરાબર થાય. બાબાની પણ આવી જ રીત હતી. પણ તેમનો આ નિયમ બધાને માટે અને દેરેક વખતે લાગુ પડતો ન હતો. આ અંગેની બીજી એક મનોરભ્ય ઉપમા પાછલા અધ્યાય ૧૮માં જે આવી ગઈ તે જુઓ, ‘બાળક માગે મીઠો લાદુ’। માતા પીવાવે કડવો કાઢો। બાળક રે તરફડીને। પ્રેમ કરનાર બ્યાંજિત જ એવું કરી શકે ? ॥૬૧॥ પોળની જે કડવાસ છે। યોગ્ય કાળે તેનો ઉપાય બાળક શું જાણે તે લક્ષણા. ફક્ત માતાને જ હોય એનો અણસાર ॥૬૨॥’ જેવો જેનો અધિકાર, સ્વભાવ હોય છે, જેવી જેની સેવા અને જેવો જેનો ભક્તિ યુક્ત પ્રેમ હોય છે, તે અનુસાર જ તેમની ઉપર બાબાનો કૃપાપૂર્વકનો ઉપદેશ રહેતો. આ બાબતમાં બાબાની રીત ખરેખર જ વિચિત્ર અને આશ્વર્યકારક હતી. તેઓ જ્યારે કોઈ ઉપર પ્રસ્ત્ર થતા, ત્યારે તે વ્યક્તિ ઉપર કૃપા કરીને ઉપદેશ કેવો અને કંઈ પરિસ્થિતિમાં કરતા હતા તે સાંભળો. (ઓ. ૨૧-૩૧)

એકાદ વખત ને તેમના મનમાં આવે તો કોઈના, ધ્યાનમાં પણ ન આવે એવી રીતે આસાનીથી છઠા વિનોદ કરીને ભક્તોને કૃતાર્થ કરતા હતા. ભક્તોને એકાદ કોઈ ગ્રંથ વાંચવાની ઈચ્છા થતી તો તે ગ્રંથ બાબાના હાથમાં આપીને પ્રસાદ

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

સમજુને તે પાછો લઈ લેવો એવું કદાચ ભક્તોના મનમાં આવતું હશે. પછી તેવા ગ્રંથનું વાચન કરતાં પોતાનું હિત સધારે અને શ્રેષ્ઠ મળશે. તેનું મનથી પવિત્રતા પૂર્વક શ્રવણ કરવાથી શ્રોતા અને વક્તા બંનેનું પરમ કલ્યાણ થશે. કોઈ દશાવતારનાં ચિત્રો અથવા તો સ્તોત્ર પવિત્ર પુસ્તકો અને ચરિત્રો અર્પણ કરતા હતા. કોઈ દાસગણના રચેલા સંતતીલામૃત અને ભક્તતાતીલામૃત પણ અર્પણ કરતા હતા. તો વળી કોઈ વિવેકસિંહુ આ ગ્રંથ આધ્યકવિ મુંદુદરાજે ઈ.સ. ૧૧૮૮ની સાલમાં એટલે કે જ્ઞાનેશ્વરીના ૧૦૨ વર્ષ પહેલાં મરાઈ ભાગ્યામાં લખેલ હોવા છતાં મુખ્ય વિષય અદ્વૈતવાદ છે. ‘ઉપનિષદોના કરિ મંથન | કરિને ગ્રંથ કર્યો નિમાણ ॥’ અર્પણ કરતા હતા. પણ બાબા આ બધાં શામાને આપતા હતા. અને કહેતા, ‘શામા ! આ બધાં પુસ્તકો તારી પાસે રહેવા હે અને ઘરે બાંધીને જળવી રાખ.’ શામા એ આજ્ઞા શિરોમાન્ય રાખી આ અમુલ્ય પુસ્તકોને બાંધીને સંભાળીને રાખતા. બાબાના હાથમાં આપીને તેને પ્રસાદ તરિકે પાછા લેવાની મનમાં ઈચ્છા રાખીને ભક્તો ફુકાનમાંથી ગ્રંથ વેચાતો લાવતા હતા. બાબાનો સ્વભાવ ભલે ઉદાર હતો છતાં આમ કરવા માટે ધૈર્ય જોઈએ. માટે ભક્તો માધવરાવને જેડે લઈને તેમને આ કામ માટે આગળ ધરતા. તેમના દ્વારા તક સાધીને ગ્રંથ બાબાના હાથમાં આપતા હતા. બાબાને જેમ ગ્રંથનું મહત્વ ખબર હતું, તેવી જ રીતે ભક્તોની સમજવાની યોગ્યતા કેવી છે તેની પણ ખબર રહેતી. ભક્તો દ્વારા ગ્રંથ હાથમાં આપવો, બાબાનું તે ગ્રંથનાં પાન ફેરવીને જોવું અને ભક્તોએ તે ગ્રંથ પોતાને પાછો મળો તે માટે હાથ લાંબો કરવો એમ બનતું પણ કોઈ વખત બાબા આવા ગ્રંથોને પાછા નહિ આપતા માધવરાવને આપીને કહેતા, ‘શામા આ પુસ્તકોની પ્રત તારી પાસે રાખ, અને હાલમાં તેને તારી પાસે જ રહેવા હે’ ત્યારે શામા બાબાને સ્પષ્ટ રીતે પુછી લેતા, ‘કે આ ભક્તો આતુરતાથી હાથ પ્રસરાવીને પાછા માગી રહ્યા છે તેમને એમની પ્રત આપી દઉ ?’ ત્યારે બાબા, ‘તું જ એને રાખ’ એવું કહેતા હતા. (ઓ. ૩૨-૪૩)

એક વખતે ભક્ત કાકા મહાજની જેમને એકનાથી ભાગવત વાંચવાનો ઘણો રસ હતો તેઓ તેની એક નકલ લઈને શિરડીમાં આવી પહોંચ્યા. માધવરાવ તેમને મળવા માટે આવ્યા. એવામાં એમણે વાંચવા માટે એક પુસ્તક ઉચ્કયું અને હાથમાં પકડીને મસ્ઝિદમાં આવ્યા. બાબાએ તેમને સહજ પૂછ્યું, ‘શામા આ પુસ્તક કયું છે ?’ એ સાંભળી શામાએ તે વિષે જણાવ્યું. બાબાએ તેને હાથમાં લીધ્યું અને જેઠિને તે એમને પાછું આપ્યું. આ જ પુસ્તક અને આ જ એકનાથી ભાગવતની નકલ મહાજનીને પહેલીવાર શ્રી સાઈબાબાના હાથે પ્રસાદ રૂપે મળેલી હતી, ‘આ ગ્રંથ મારા માલિકોનો નથી. એ તો કાકા મહાજનીનો છે. વાંચવાની ઈચ્છા થતાં તત્પુરતો વાંચવા માટે હું લાવ્યો છું.’ આ સ્પષ્ટ શબ્દોમાં માધવરાવે બાબાને કહ્યું હતું, છતાં બાબાએ તેમને કહેલું કે, ‘જે માટે મેં તને આપ્યો છે, તે કામ માટે જ તું તારી પાસે રાખીને સંગ્રહ કર તે કામમાં આવશે.’ થોડા સમય બાદ કાકા મહાજની ફરીથી શિરડીમાં આવ્યા, અને એકનાથી ભાગવત લાવીને સાઈના હાથમાં મૂક્યું. બાબાએ પ્રસાદ સમજુને તે પાછું આપ્યું. અને બાબા બોલ્યા, ‘ખૂબ જીવ લગાડીને પ્રેમથી વાંચ. આસ તો આ જ તારા જીવનમાં ઉપયોગી થવાનું છે.’ એવું કાકાને આશ્વાસન આપ્યું હતું. ‘આ જ તારા કામમાં આવશે. આ ઉત્તમ પુસ્તક કોઈને આપતો નહિ.’ આવું ભારપૂર્વક મોટેથી કહ્યું હતું. ત્યારબાદ કાકાએ બાબાને ખૂબ જ પ્રેમથી નમસ્કાર કર્યા હતા. (ઓ. ૪૪-૫૨)

સાઈબાબા તો સર્વ ઈચ્છા પ્રાપ્ત થયેલા હતા. કોઈ પણ ચીજ વસ્તુનો તેમને લોભ ન હતો. ઈશ્વરની ભક્તિ તે જ તેમની નૈસર્જિક પ્રવૃત્તિ હતી. તો પછી તેમણે કોઈ પણ વસ્તુ ભેગી કરવા કે સંઘરવા માટે શ્રમ શા માટે લેવો ? બાબાના મનમાં શું હતું એ તો એ પોતે જ જણો ! પણ આ ગ્રંથોનો સંગ્રહ એ આ વ્યવહારની દાખિએ જેતાં ભક્તો માટે પાપનાશક ગ્રંથ શ્રવણ કરવાનું સાધન છે. ‘હવે શિરડી એક પવિત્ર યાત્રાનું ક્ષેત્ર થયું છે. દેશ વિદેશથી આપણા છાત્રો વખતો વખત અહીં બેગા થશે, અને જ્ઞાનસત્ર શરૂ કરવામાં આવશે. ત્યારે આ બધા ગ્રંથો ઉપયોગી નિવડશે. આપણે તો સ્વધાર

## શ્રી સાઈનું સત્ય ચિહ્ન

જઈશું. પણ શ્યામા પોતાના ગ્રંથાલયમાંથી આ ગ્રંથ તેમને બતાવશે અને પછી જાણે કે તે મારી પ્રતિમા જ બનશે. અર્થાત् ‘હું જ્યારે દેહધારી હતો અને તે સમયે ભક્તોને જે રીતે જ્ઞાનનો ઉપદેશ આપતો હતો, તેવી જ રીતે આ ગ્રંથો અવશ્ય જ્ઞાન અને બોધ આપશે.’ એવી રીતે અત્યંત પવિત્ર અને પાપનાશક ગ્રંથોનો ભક્તોને શિરડીમાં અથવા અન્યત્ર સ્થાને પણ સમરણ કરવા માટે આ ગ્રંથોનો સંગ્રહ કરવાનો બાબાનો ઉદ્દેશ હોઈ શકે. રામાયણ હોય કે ભાગવત અથવા કોઈ પણ પરમાર્થને લગતો ગ્રંથ હોય, તેમાનું રામનું કૃષ્ણનું અથવા તો અન્ય દેવ કે સંતનું ચરિત્ર વાંચતા આગળ પાછળ સાઈબાબાએ જાતે જ ડૃપ ધારણ કરેલું હોય એવું લાગે છે. શ્રોતાઓને અને વક્તાઓને આ ગ્રંથમાં આંખો સામે એ મહાપુરુષની જગ્યાએ સાઈબાબાની જ મૂર્તિ દેખાય છે. ભક્તોને જે ગ્રંથ ગુરુને અર્પણ કરે છે અથવા તો બ્રાહ્મણોને દાન કરે છે તેમાં પણ દાતાઓનું કલ્યાણ જ હોય છે. આ કથનને શાક્રનો આધાર છે. બાબાની શામાને આજી થઈ કે, આ ગ્રંથ ઘરે લઈ જઈ તારા સંગ્રહાલયમાં સંભાળીને રાખ, આ કાંઈ સીધો સાદો ઉદ્દેશ કહી શકાય ? (ઓ. પત-૬૧)

શામા જેમ બાબાના અસીમ ભક્ત હતા, તેટલો જ બાબાનો પણ તેમની ઉપર ખાસ પ્રેમ હતો. તેમને કોઈક પરમાર્થનો નિયમ આપવો એવી બાબાના મનમાં ઈચ્છા ઉત્પન્ન થઈ. તે વખતે બાબાએ શું કર્યું તે જુઓ. શામાની ઈચ્છા ન હતી, છતાં તેની ઉપર કચો અને ડેવી રીતે અનુગ્રહ કર્યો તે હવે જેઠાએ. એક દિવસે એક રામદાસી બુવા મસ્નિદમાં આવ્યા. તેમનો રામાયણ વાંચવાનો રોજનો નિમય હતો. પ્રાતઃકાળે હિન્દુર્થા પતાવી, ભર્મ વગેરે ચોપડી સ્નાન સંદ્યા પતાવી, ભગવાં વચ્ચે ધારણ કરીને તેઓ વિધિપૂર્વક પોતાના આ નિયમ પ્રમાણે બેસતા હતા. પહેલા વિષણુસહસ્રનામનું પઠન અને ત્યાર બાદ તેમનું આધ્યાત્મ રામાયણનું પારાયણ શ્રદ્ધાપૂર્વક ચાલતું હતું. આવું લાંબા સમય ચાલ્યા બાદ, માધવરાવનો વારો આવતા સાઈ સમર્થના મનમાં શું વાત આવી તે હવે શ્રોતાઓ સાંભળો. માધવરાવની સેવાનું કાર્ય ફરજું છે. તેમના જીવને કોઈ નિયમ આપવવો જેઠાએ. ભક્તિ માર્ગનો તેમને ઉપદેશદ્વારી પ્રસાદ મેળવી આપું અને સંસારમાં તેમનો વિસામો અને શાંતિ મળે તેવું બાબાના મનમાં થયું. (ઓ. ૬૨-૬૮)

બાબાએ પેલા રામદાસીને બોલાવ્યો અને કહ્યું કે, ‘મારા પેટમાં સખત ચૂંક ઉપડી છે. જાણે કે આંતરડા તૂટતા ન હોય ! પેટનો દુઃખાવો પણ ઓછો થતો નથી. હાલમાં તરત જ બજનરમાં જ અને ‘સોનામુખી’ લઈ આવ. એની થોડી અમસ્તી ફાકી લીધા વગર આ પેટની ગરબદ મટવાની નથી.’ રામદાસ બિચારો ભલો ભોળો આજી અનુસાર વર્તનારો. તેણે પોથીના બે પાન વચ્ચે નિશાની મૂકી પોથી બંધ કરીને નીચે મૂકી અને બજનર તરફ જલ્દીથી જવા માટે નીકળી પહુંચો. તે રામદાસી બુવા હજુ તો મસ્નિદમાંથી નીચે ઉત્થયો નથી. અને અહીં બાબાએ શું કર્યું ? તાત્કાલિક બાબા પોતાના આસન ઉપરથી ઉભા થઈ ગયા. અને પેલા રામદાસીએ મૂકેલી પોથી તરફ ગયા. ત્યાં આગળની બધી પોથીઓમાંથી તેમણે વિષણુસહસ્રનામની જે પોથી હતી તેને ઉચ્ચકી લીધી. અને પોતે પાછા પોતાની જગ્યા ઉપર જઈને બેસી ગયા. ત્યાર પછી ત્યાં બેઠેલા માધવરાવને બાબાએ કહ્યું, ‘શામા ! જે આ પોથી છે, તે ખૂબ જ કલ્યાણકારી છે. માટે હું તારે માટે તને આપી રહ્યો છું. એ પોથી તું જરૂરથી વાંચને. એક વખતે મને ખૂબ જ ત્રાસ થયો હતો, કાળજુ ઘડકવા લાગેલું અને જીવ પણ બેચેની અનુભવી રહ્યો હતો. મને મારું જ ડેકાણું લાગતું ન હતું, આવો એ પ્રસંગ શામા તને હું કેવી રીતે કહું ? આ વિષણુસહસ્રનામ પોથીનો લેવો ઉપયોગ કર્યો કે મારો પ્રાણ તેને લીધે બચી ગયો. એક ક્ષણ માટે આ પોથી મેં છાતી સાથે ચાંપી દીધી, અને તરત જ આ જીવ શાંત અને ઠંડો પડ્યો. માટે કહું છું શામા, આ પોથી તું તારે માટે લઈ જ. દરરોજ તું એને થોડી થોડી વાંચ તેમજ રોજ ધીમે ધીમે કરીને એકએક અક્ષર પણ ધ્યાનમાં રાખતા શીખ. આ પોથી ખૂબ આનંદ આપનારી છે.’ આ બાબાનો સરળ ઉપદેશ સાંભળી શામા બોલ્યા, ‘આ પોથી મારે નહિ જેઠાએ. પેલો રામદાસી મારી ઉપર ઘણો જ ગુરુસે થશે, અને સાથે સાથે

## શ્રી સાઈનું સત્ય ચિત્ર

આ ખોટું કામ મેં જ કર્યું છે એવું આળ પણ મારે જ માથે આવશે. એક તો એ માણસ પહેલેથી જ જતનો વિચિત્ર છે અને મગજનો ફરેલો પણ છે અને એના ગુસ્સાનું ડેકાણું નથી. પાઇઠથી કચકચ અને માથાકૂટ કરવાવાળો છે. આવા સાથે વગર કામના ઝગડાનું કારણ શા માટે જેઠાં ? મારે આ કટકટમાં પડવું નથી. તે સિવાય આ પોથીની ભાષા સંસ્કૃતમાં છે, જ્યારે મારી ભાષા તો ગલિચ્છ અને ગામઠી છે. મોઢામાંથી જેડાક્ષરવાળા શબ્દો સુદ્ધાં વ્યવસ્થિત નીકળતા નથી, કે નથી મને એનો સ્પષ્ટ ઉચ્ચાર કરતાં આવડતો.’ બાબાની આ બધી લીલા જેઠને શામાને લાગ્યું કે બાબા અમારી બંને વચ્ચે ઝઘડો કરાવવાની પેરવી કરી રહ્યા છે. તેમને કલ્પના પણ ન હતી કે બાબાને તેમની કેટલી ચિંતા થતી હતી ? ‘મારો શામા તો ગાંડો છે, પંરતુ મને એની ખૂબ જ લાગણી છે. એને પણ મારી ઉપર અપાર પ્રેમ છે, માટે જ મારા હદ્યમાં એને માટે હદ્યાનો મોટો જુવાળ છે. આ વિષણુસહસ્રનામની માળા એના ગળામાં હું મારા હાથે જ બાંધીશ અને એની લુભ ઉપર એની લત લગાવીને એનાં સંસારનાં દુઃખોથી મુક્ત કરીશ.’ (ઓ. ૬૮-૮૪)

‘દેવનું કે ગુરુનું નામ પાપના પર્વત તોડી નાખે છે, નામસ્મરણ દેહનાં બંધનો છોડાવે છે. નામનો જપ કરોડો ખરાબ વાસનાઓને જહુમૂળથી દૂર કરીને નહીં જેવી કરી નાખે છે. નામસ્મરણ કાળની ગર્દન તોડી નાખે છે. અને જન્મમરણની જેંચતાણમાંથી બચાવે છે. એવો આ સહસ્રનામનો મહિમા છે. એની લત શામાને લાગે તે જ મારી ઈચ્છા છે. નામનું રટણ ઈરાદાથી અને જાણી જેઠને લેવામાં આવે તો તે ઉત્તમ જ સમજવું અને જે નામસ્મરણ સાધારણ રીતે ન સમજતાં લેવાઈ જય તો તે પણ તે ખરાબ નથી. મનમાં નહીં પણ લુભ ઉપર પણ આવે તો પણ તેનો પ્રભાવ દેખાડે છે. ઉદાહરણ અર્થે મહાપાપી અજલમિલે મૃત્યુ સમયે પોતાના ‘નારાયણ’ નામના છોકરાને બોલાવ્યો જેથી નારાયણ પ્રભુના નામનું ઉચ્ચારણ થયું. તેમ થતાં તેનો ઉદ્ધાર થઈ ગયો. તેવી જ રીતે વાલ્યો ‘મરા મરા’ એમ રામ નામ ઉલ્લંબ બોલ્યો તેમ છતાં વાલ્યામાંથી વાલ્યીકી ઋષિ થયા. અંતઃકરણની શુદ્ધિ માટે નામઃસ્મરણ જેવું સહેલું બીજું કોઈ સાધન નથી. તુકોબા કહે છે, ‘નામઃસ્મરણ જેવી અન્ય કોઈ વધારે શક્તિશાળી સાધના નથી. ‘એનાથી વધારે કોઈ સાધન નથી। વહે છે આજા વિઠોબાની !!’ નામ જપવું એ જુભનું ભૂષણ છે, એ પરમાર્થના માર્ગ માટે પણ પોષણઙ્ગુપ્ત છે. નામઃસ્મરણ માટે સ્નાન કરવું પડતું નથી અને એને માટે શાસ્ત્રોનાં નિયમો પાળવાની પણ જરૂર નથી. ‘બોલતાં ચાલતાં ધંધો કરતાં। આતાં, પીતાં અને સુઅંધી થતાં। અનેક ઉપલોગ ભોગવતાં। નામ લેવું ભૂલવું નહીં।’ દાસબોધ, દશક ૪, સમાસ ૩, ઓ. ૭ નામ લેવાથી બધાં જ પાપ નાશ પામે છે. નામનું રટણ સદાચે પવિત્ર હોય છે. ‘નામનું સ્મરણ નિરંતર કરે। એ જાણને પુણ્ય શરીર। મહાદોષોનો પર્વત। રામનામથી લાગે છે ॥૨૨॥ દાસબોધ, દશક ૪, સમાર ૩ અખંડ માર્ગ પણ નામ લેતા સંપૂર્ણપણે બેડો પાર ઉત્તરશે. કાર્ય સિદ્ધ થશે. બીજી કોઈ પણ સાધનાઓની જરૂર રહેતી નથી. કેવળ નામઃસ્મરણથી મોક્ષ પ્રાપ્ત થાય છે. જેણે મારા નામનું રટણ કર્યું છે, તે મને ઉત્તમ ગુણસંપત્ત માણસોમાં પણ અત્યંત ગુણવાન માણસ લાગે છે.’ અગાઉ અ. ૨માં કહ્યું છે તેમ ‘એક વાર્તા કહું છું શામા। પ્રેમથી મારું નામ લેતા। પૂર્ણ સઘળાં સઉનાં કામ। કરું છું પ્રેમ ભરતી લાવવા ॥૧૧॥ ‘સાઈ સાઈએ’ નામસ્મરણ। કરશે સકલ કલિયુગનાં પાપોનું દહન ॥૨૦॥’ આજ બાબાશ્રીના મનમાં હતું અને તે જ પ્રમાણે એમનું વર્તન પણ હતું. (ઓ. ૮૫-૮૧)

શામા ના ના કહેતા રહ્યા પણ બાબાએ વિષણુસહસ્રનામની પુસ્તીકા તેમને પકડાવી દીધી. વડિલોપાર્બિત પુણ્યકર્મો સબળ હતાં તેથી સાઈ કૃપાનું આ ફળ શામાને મળ્યું. આ પવિત્ર સહસ્રનામ હવે શામાના સંસારની અસ્વસ્થતા અને અકળામણને દૂર કરશે. બીજાં કર્મોના અથવા તો શાસ્ત્રોના નિયમો પાળવા પડે છે, પરંતુ નામઃસ્મરણ જ્યારે સમય મળે ત્યારે સતત કરવું. સ્વામી રામદાસ-સ્વામી સમર્થે કહ્યું છે તેમ બચપણથી જવાની સુધી। કપરા સમયથી માંડીને વૃદ્ધત્વ સુધી। દરેક સમયે અંતઃકરણ સુધી। નામઃસ્મરણ થવું જેઠાં એ ॥ દાસબોધ દશક ૪, સમાસ ૩, ઓ. ૧૪ નામઃસ્મરણને કોઈ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

બાધા કે પ્રદોશનું કોઈ જ નડતર નથી. નામઃસ્મરણ જેવી અન્ય કોઈ પણ ઉપાસના નથી. ભગવાને જતે જ એકનાથી ભાગવતમાં કહ્યું છે કે, ‘સાધના જ મારી મુખ્ય લક્ષ્ણ। એમાં જ વિશેષ નામ કીર્તિ।’ એ જ પ્રમાણે એકનાથ મહારાજે પણ પોતાના એક નજીકના પાડોશીને વિષ્ણુસહસ્રનામો ગ્રંથ બળજબરીથી સોંપ્યો હતો, અને તે શિષ્યને પરમાર્થના માર્ગ તરફ વાળ્યો હતો. એકનાથ મહારાજને ઘેર દરરોજ પુરાણો અને કીર્તન ચાલતાં હતાં. તેમની પાડોશમાં રહેનારો એક ભાલ્ણા હોવા છતાં સ્નાન સંદ્યા કંઈ જ કરતો નહિ અને તે ખરાબ અનીતિના ફૂત્યો કરવામાં હંમશા જ વ્યસ્ત રહેતો. પુરાણ કે કીર્તન સાંભળવા માટે ક્યારેય પ્રયત્ન ન કરતો. સાથે સાથે આ દુષ્ટ ભાલ્ણા નાથના વાડામાં ક્યારેય પગ મૂકતો નહીં. એકનાથને તેની ઉપર દ્વાય આવી અને તે ભાલ્ણને એક દિવસ બોલાવ્યો. ઉચ્ચ ભાલ્ણા જલતિમાં જન્મ લીધા છતાં તેનો જન્મ એળે જઈ રહ્યો હતો. તેનું રહસ્ય સમજીને એકનાથ મહારાજને તેની ઉપર ખૂબ જ દ્વાય આવી કે કેમે કરીને આનું આવું ખરાબ વર્તન રોકી શકાય માટે તેનો નકાર હોવા છતાં એકનાથ મહારાજે તેને સહસ્રનામના ઉચ્ચાર શિખવાડીને એક એક શ્લોક સમજન્યો અને તેનો ઉદ્ધાર કર્યો. સહસ્રનામનું વાંચન કરવું અથવા મોઢે કરવું તે ચિત્ત શુદ્ધિનો સહેલામાં સહેલો અને સરળ માર્ગ છે. આહિકાળથી ચાલી આવતી આ લોકમાન્ય ઝાંદી છે. માટે જ જાણે કે બાબાને આ ગ્રંથ શામાને વહેલી તક મળે તે માટેની જહેમત હતી. (ઓ. ૮૨-૧૦૦)

એટલામાં જ પેલો રામદાસી બજનરમાંથી સોનામુખીનાં પાન લઈને જલ્દી પાછો ફર્યો. સ્વભાવે નારદ જેવા અણણા ચિંચાણીકર સ્વ. દામોદર ઘનશ્યામ બાવરે, ત્યાં જ ઉભા હતા. તેમણે પેલા રામદાસીને બનેલી બધી જ હકીકત કહી સંભળાવી. એક તો રામદાસી પહેલેથી જ ખૂબ કોઢી હતો, તેમાં પાઈ આ નારદ જેવાની દરમિયાનગીરી. પછી આવા અજાબ પ્રસંગનું યથાસ્થિતિ વર્ણન કોને કરવું ? આમ પણ રામદાસીની ખરાબ તર્કોવાળી પ્રતિભા તો હતી જ અને તેમાં પાછો તેના મનમાં માધવારવ માટેનો સંશય ઉભો થયો અને બોલ્યો, ‘મારી પોથી બળજબરીથી પડાવી લેવા માટે તેં જ જાણી જેઠિને બાબાને આ વાતમાં વચ્ચે નાખ્યા છે.’ તે સોનામુખી પાનની વાત ભૂતી ગયો અને માધવરાવ ઉપર ગુસ્સે થઈ ગયો. તેના મનનો સંતાપ સીમા વટાવી ગયો અને મોટેમોટેથી ખેંચાઈ-ખેંચાઈને એ ગમે તેવા શબ્દો ભાંડવા માંડચો, ‘બાબાના પેટનો દુઃખાવો એ તો ઢોંગ હતો. તેં જ બાબા પાસે આ બધું કરાવ્યું છે. મારી પોથી ઉપર તારી પહેલેથી નજર હતી. તારી આવી બધી ચાલાકી મારી પાસે ચાલશે નહિ. મને ગમે તેવો ન સમજતો, હું એક બહાદુર રામદાસી છું. પોથી જે તેં સીધી રીતે અને ચોખ્યા મનથી મને પાઈ ન આપી, તો હું તારું માણું ફોડી નાખીશા અને લોહીલુહાણ કરી નાખીશ. તારી નજર પહેલેથી જ મારી આ પોથી ઉપર હતી. માટે તેં જાતે જ આ કારસ્તાન રથીને એ બધું બાબા ને માથે ઢોળીને તથા પોતે નિર્દોષ હોય એવો રહીને તેંદેખાવ કર્યો છે.’ માધવરાવે તેમને સમજવવાની ખૂબ જ કોશિશ કરી પણ રામદાસી શાંત થયા જ નહિ. ત્યારે માધવરાવે તેમને ખૂબ જ મૂકું ભાષામાં કહ્યું કે, ‘હું કપટી છું એવો વીના કારણનો આરોપ મારા માથે નાખતા નહિ. તમારી પોથીની આટલી મોટી શી વાત છે ? જેઠિએ એટલી તો બજનરમાં મળે છે. શું તમારી પોથી ઉપર સોનું અને હિરા જલેલા છે કે તમને બાબા ઉપર વિશ્વાસ નથી ? તમારા આવા જીવનને વિકાર છે.’ આ પ્રકારે રામદાસનો આવો વિચિત્ર વર્તાવ જેઠિને બાબાએ તેને મધુર શબ્દોમાં કહ્યું, ‘કેમ રે રામદાસી તું આટલો બધો બગડ્યો છે ? વગર કામની આફક્ત કેમ ઉભી કરી રહ્યો છે ? અરે આ શામા પણ આપણો જ છોકરો છે. તું વગર કામનો વાદવિવાદ શાને વધારે છે અને નકામો ત્રાસ સર્જને દુનિયાને શા માટે તમાશો દેખાડે છે ? આવો તે તું કેવો કબ્જિયાખોર છે ? શું પ્રેમાળ શબ્દોથી તું જવાબ આપી શકતો નથી ? અરે આ પોથીનું આટલું વાંચન કર્યા પછી પણ તારું મન આટલું કલુષિત કેમ ? દરરોજ આધ્યાત્મ રામાયણ વાંચે છે, વિષ્ણુસહસ્રનામનું પારાયણ કરે છે, છતાં સાથ અવિચારી અને ઉદ્ધત સ્વભાવ છોડતો નથી. અને પોતાને રામદાસી કહેવડાવે છે ? એવો તે તું કેવો રામદાસી ? તું તો હંમેશા વૈરાગી હોવો જેઠિએ. તને તો

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પોથીનો લોભ પણ છૂટતો નથી. તારા આવા વર્તનને શું કહેવું ? રામદાસીને કશાની મમતા ન હોવી જેઠાં. નાનામોટા દુરેક સાથેનું વર્તન એકસરખું જ રાખવું જેઠાં. પણ તું તો આ બાળકો સાથે ભેદભાવ રાખે છે અને તેમની સાથે એક પોથી જેવી વસ્તુ માટે પણ આગ ઓકે છે. જ, પોતાની જગ્યા ઉપર જઈને બેસ. પોથીઓ તો એક પૈસામાં જેઠાં એટલી મળે છે. પણ જેઠાં તેવા લાયક માણસો કલ્પનામાં પણ શોધ્યા મળતા નથી. આ ધ્યાનમાં રાખ. તારી પોથીનું તે વળી શું મહત્વ છે ? એ શ્યામા કેવી રીતે સમજવાનો છે ? ગામડાના આ સાધરણ માણસને પોથીમાંનું શું સમજમાં આવ્યું કે તે શ્યામાને આપવી જેથી તે આ પોથી વાંચી શકે અને એનું ધ્યાન કરે એટલે એનું પણ કલ્યાણ થાય.' બાબાના આ પ્રેમાણ શબ્દોમાં કેટલી મોહકતા, કેટલી રસાળતા, મધુરતા, અને બોધદાયક તેમજ આત્મઆનંદદી જગ્યાની શીતલતા હતી ! ખરેખ આ શબ્દોની અપૂર્વતા અને અસાધારણતા જગ્યાની હતી. (ઓ. ૧૦૧-૧૨૦)

રામદાસી મનમાં ગમ ખાઈ ગયો અને માધવરાવને મોહું લાલ તાંબા જેવું કરીને મિજસમાં બોલ્યો, 'આ સહસ્રનામની પોથીના બદલામાં પંચરત્નની ગીતા લઈશ. આ તને કહી દઉં છું.' રામદાસી એટલામાં શાંત થયો તે જેઠાં માધવરાવને આનંદ થયો અને તેઓ બોલ્યા, 'એક શું, હું તમને દુશ પંચરત્ની ગીતા લાવી આપીશ.' પછી એ જગડાનો અંત આવ્યો અને પંચરત્ની ગીતાનો ગ્રંથ જલ્મીન તરીકે રહ્યો. પંચરત્ની ગીતામાં દેવને જેણે ઓળખ્યો નથી તેને શું અર્થ ? પંચરત્ની ગીતામાં પાંચે સ્તોત્રમાં તેમજ ગીતામાં શ્રી વિષણુ ભગવાનની સ્તુતિ, લીલાઓ અને ઉપદેશનું વર્ણન છે. માટે એના દેવ શ્રી વિષણુ છે, અને વિષણુ એ જ શ્રી બાબા એવી અહિયાં ભાવના છે. સાઈબાબાની સામે જે આધ્યાત્મ રામાયણનું વાંચન કરતો હોય તેવા પેલા રામદાસીને સાઈબાબા સાથે જગડો શા માટે કરવો જેઠાં ? પણ હું એ કેવી રીતે કહી શકું ? દોષ કોને દેવો ? જે આ પ્રસંગ બન્યો ન હોત તો આ શ્રીવિષણુસહસ્રનામનું મહત્વ કેવી રીતે સમજયું હોત ? જે વિષણુસહસ્રનામે આટલો જગડો કરાવ્યો અને બાબાને ત્રાસ કરાવીને તેમને મનમાં દુઃખ કરાવ્યું. તે કથા સાંભળીને મારું હેમાઉપંતનું પણ કલ્યાણ થયું. અર્થાત્ વિષણુસહસ્રનામનું વાંચન કરવાની બુદ્ધિ સુજી આ સાઈબાબાની પોતાના ભક્તો માટેની એક અતૌકિક બદ્ધિક્ષા હતી. બાબાને આટલો બધો ત્રાસ થયો ન હોત તો માધવરાવને વિશ્વાસ જ બેઠો ન હોત. તેમની જુબ પર આ પોથીના અક્ષરો ચઢ્યા જ ન હોત, અને મોઢે પણ ન થયા હોત. આવો આ પ્રેમાણ સાઈનાથ પરમાર્થ મેળવી આપવા માટે આવો કઠીન ખેલ પણ કરાવે છે. તેઓ કયારે કેવાં સૂત્રો હલાવશે અને ચાંપ દ્વાબશે એ આપણને સમજનાનું નથી. સમય જતાં શામાની આ પોથી પર શ્રદ્ધા દ્રદ થઈ અને કાકાસાહેબ દીક્ષિત, અને પ્રો. ગાંધોશ ગોવિંદ નરકે જે બાપુસાહેબ બુદ્ધીના જમાઈ અને પૂનાના ઈજનેરી કોલેજના પ્રાધ્યાપક હતા તેમને ઉચ્ચાર સાથે એ શિખવાડી. ત્યારથાદ માધવરાવને તે પોથી વાંચતા આવડી, અને મુખ પાઠ થઈ ગઈ. માધવરાવનો જે વાદવિવાદ એટલે સાઈબાબાના નિર્મળ ઉપદેશનું બીજા શબ્દોમાં સ્પષ્ટીકરણ હતું. આ અત્યંત શ્રેષ્ઠ આનંદ આપનાનું અને સંશય વગરનું સુખકારક અને વિનોદી પ્રયોજન હતું. (ઓ. ૧૨૧-૧૩૦)

જે ભક્ત અધ્યાત્મ વિદ્યા ખ્રલબિદ્યાનો અભ્યાસ કરતા તેમની ઉપર સાઈબાબાને વિરોષ પ્રેમ રહેતો અને પ્રસંગ આવતાં તેમને કેવી રીતે અભિવ્યક્ત કરી બતાવતા હતા તે જુઓ. એક દિવસ બાપુસાહેબ જેગનું શિરડી ખાતે ટપાલમાં એક પાર્સલ આવ્યું માટે તેને છોડાવવા માટે તેઓ ઉતાવળે તે તરફ નીકળ્યા. શું છે એવું જોતાં તો એ લોકમાન્ય ટિળકનું 'ગીતા રહસ્ય' નામનું પુસ્તક છે એવું સમજયું. તે ગીતા રહસ્ય ગ્રંથ બાપુસાહેબ જેગે પોતાની સાથે લીધો અને મસ્નિદમાં દર્શન માટે આવી પહોંચ્યા. નમસ્કાર કરવા માટે માથું નમાવતા તે બગલમાં દ્વાબેલું પુસ્તક બાબાનાં ચરણો પાસે પડ્યું, ત્યારે બાબાએ પૂછ્યું, 'બાબા સાબ ! આ પાર્સલ શાનું છે ? જેગે બાબાની સમક્ષ ખોલતાં અંદર શું છે, એ કહીને પુસ્તક બાબાના હાથમાં મૂક્યું. બાબાએ હાથમાં લીધું. એ પુસ્તક જેથું અને એનાં પાનાં ઉથલાવીને ઉપરથી વાંચી લીધું અને

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

તરત જ કફનીનાં ગજવામાંથી એક ડિપિયો કાઢીને ખૂબ માનથી તેની ઉપર મૂક્યો. પછી ડિપિયા સાથે એ પુસ્તક જેગને પાછું આવ્યું અને બોલ્યા, ‘આ પુસ્તક ધ્યાનથી પહેલેથી છેલ્લે સુધી વાંચજો, એટલે તાંતું કલ્યાણ થરો.’ બાબાએ આ પુસ્તક ન વાંચતા, અને તે અંગે પહેલા કાંઈ ન સાંભળ્યું હોવા છતાં તેનું મહત્વ સમજને તેનાં વખાણ કર્યા. આ ઉપરથી તેમની અંતરજ્ઞાનની શક્તિ કેટલી બધી હશે તે સમજય છે. અને તેને પાછું બાપુસાહેબ જેગને સંપૂર્ણ અને અભ્યાસપૂર્વક વાંચવાનું કહ્યું માટે તેમની ભક્તો પ્રત્યેની ચિંતા આપણા ધ્યાનમાં અવશ્ય આવે છે. આવી ભક્તો ઉપર કૃપા કરનારી બાબાની વાતો અસંખ્ય છે. જેનું વર્ણન કરી શકાય તેમ છે, પણ પછી આ ગ્રંથનો વિસ્તાર ખૂબ વધી જશે માટે સંક્ષિપ્તમાં આ પ્રસંગ સમાવ્યો છે.’ (ઓ. ૧૩૧-૧૩૮)

ઉપર જણાવેલા ફકરામાં લોકમાન્યનું નામ આવ્યું છે માટે એ બાબતનો બીજી એક પ્રસંગનો વિસ્તાર દોષ લઈને પણ કહેવો જેઠાએ એમ લાગે છે. તા. ૧૮-૫-૧૯૧૭ના રોજ લોકમાન્ય ટિણક સ્વ. દાદાસાહેબ ખાપર્ટેની સાથે સાઈમહારાજના દર્શન માટે શિરડી આવ્યા હતા, બાબાએ તેમને માધવરાવને ત્યાં મોકદ્યા હતા. અને જમી પરવારીને તથા થોડો આરામ કરીને પછી આગળ જવા માટે કહ્યું હતું. ટિણકે બાબાને આપણા દેશના સ્વરાજ્યના કાર્ય અંગેની સલાહ પુછી હતી અને અંતર્યામી બાબાએ તેમને ઉત્તર આપ્યો હતો, ‘તમે હવે વધોવૃદ્ધ થયા છો, વિશ્રાંતિની હવે જરૂર છે, તમે હવે આરામ કેમ કરતા નથી ?’ અને ખરેખર ત્યાર બાદ જલદી જ એટલે તા. ૧-૮-૧૯૨૦ના રોજ લોકમાન્ય ટિણકનું નિધન થયું. અને એમનું સ્વરાજ્ય પ્રત્યેનું કાર્ય અધૂરું રહ્યું, જેને મહાત્મા ગાંધીએ હાથમાં લઈને આગળ પડતો ભાગ ભજવીને પૂર્ણ કર્યું.

એક દિવસ શિરડીમાં એવું બન્યું કે, અમરાવતીના દાદાસાહેબ ખાપર્ટે સહકૃતુંબ શિરડી આવ્યા હતા. બાબાની પાસે શિરડીમાં સહકૃતુંબ રહ્યા. તે શિરડીમાં રહ્યા અને બાબાના પ્રેમમાં પૂરેપૂરાં રંગાય જ ગયા. આ ખાપર્ટે કોઈ સામાન્ય ગૃહસ્થ ન હતા. તેઓ અતિ વિદ્ઘાન અને ધારા સંપત્તિ અને વિદ્ઘાન એવા અસામાન્ય માણસ હતા. તેમ છતાં સાઈબાબાની સામે તેઓ હાથ જેડીને પગ પર માથું મૂકીને નમતા હતા. તેમનું અંગેણ ભાષામાં અભ્યાસ અને ભાષા પર અભૂતપૂર્વ પ્રભુત્વ હતું, અને વિધાનસભામાં નામ કમાયેલું હોવાં છતાં પોતાના વક્તૃત્વથી બધાને હલાવી નાખતા હતા. આ બધું જ હોવા છતાં સાઈની સામે તેઓ ચૂપચાપ બેસી રહેતા. બાબાના અસંખ્ય ભક્તો હતા પણ તેમની સામે ખાપર્ટે, પંદરપુરના સબ જજ નુલકર અને નાગપુરના ધનાઢ્ય ગૃહસ્થ બુઝી આ ત્રણને બાદ કરતા બાબાની સામે મૌન વ્રત પાળનારા બીજી કોઈ ભક્ત પેદા થયા નહીં. બીજી બધા બાબા સાથે વાતો કરતા. ધણા તો મોઢે ચઢીને વાતો કરતા. પૂજય ભાવ અથવા તો ડર તેમનામાં હેખાતો નહિ. પણ આ ત્રણેય બાબા સામે એક શબ્દ પણ બોલતા નહિ. બોલવાની તો વાત ક્યાં ? બાબા સામે હંમેશા ગરદન હલાવી તેમની દેરેક વાતમાં પોતાની સંમતિ દર્શાવતા. તેમનું નમ્રપણું વર્ણનશક્તિની બહારનું હતું અને કોઈ પણ વાત સાંભળવા માટે વિનય પણ એટલો જ રાખતા હતા. મહાપંડિત વિદ્ઘાચરણે રચેતી પંચદશી કે જે બધા જ ઉપનિષદ્ધોનો સાર સમજાયે છે તે સંસ્કૃત ભાષામાં રચેતો ગ્રંથ અદ્વૈત મત સમજવતો સર્વમાન્ય ગ્રંથ છે. પરંતુ તે સહેલાઈથી સમજવા માટે ખૂબ અધરો છે. તે ગ્રંથ તે સૌને સમજવતા હતા તેવા દાદાસાહેબ ખાપર્ટે મહિનાદમાં આવે ત્યારે તે મૌન થઈને બેસતા.. શબ્દબ્રહ્મનું તેજ ગમે તેટલું હોય છતાં તે શુદ્ધબ્રહ્મની સામે નિસ્તોજ થઈ જતું હતું. સાઈમહારાજ પોતે સાક્ષાત્ તેજસ્વી પરબ્રહ્મ હતા. વિદ્ઘતા તેમની સામે આવતા શરમાતી હતી. (ઓ. ૧૩૯-૧૪૬)

દાદાસાહેબ ખાપર્ટેનું શિરડીમાં ચાર મહિના રહેવાનું થયું હતું અને તેમનાં પત્ની સાત મહિના સુધી રહ્યાં હતા. બંનેને શિરડીમાં રહેવાથી ખૂબ જ આનંદ મળ્યો. તેમનાં પત્ની પણ ખૂબ જ નિષ્ઠાવાન અને શ્રદ્ધાળું હતાં. તેમને સાઈનાં ચરણોમાં અત્યંત પ્રેમ હતો. તેઓ બાબા માટે નૈવેદ્યનો થાળ પોતે જ રસોઈ કરીને મહિનાદમાં તૈયાર કરીને લઈ આવતાં હતાં. જ્યાં સુધી બાબા નૈવેદ્ય મોદામાં મૂકતા નહીં ત્યાં સુધી તે બહેન ભૂખ્યાં રહેતાં હતાં. મહારાજ તેનો સ્વીકાર કરતા

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

ત્યાર બાદ જ તેઓ પોતે જમતાં. એક સમયે બહેનના ભાગ્યનો સરસ સમય આવ્યો અને તેમની દદ શ્રદ્ધા જોઈને પરમભક્ત વત્તસલ બાબાએ તેમને પરમાર્થનો ઉત્તમ માર્ગ બતાવ્યો. દેરેક સંતોની જુદ્દી જુદ્દી રીત હોય છે. છતાં બાબાની ઉપદેશની રીત સાવ જ જુદ્દી હતી. તેઓ હસતાં હસતાં વાતચીત કરતાં એવી કૃપા કરતા હતા કે તેમને સાંભળનારના મનમાં અને હૃદયમાં તે સજજડ ઠસી જતું. એક દિવસ તે બહેને સાંજે શીરો, પૂરી, દાળ, ભાત, શાક અને ખીર તેમજ પાપડી, પાપડ અમે કચુંબર વગેરેથી ભરેલો થાળ જમવાને માટે બાબા પાસે લાવ્યાં. જેવો તે થાળ પાસે આવ્યો કે બાબાએ ખૂબ મોહ પમાડે તેવી રીતે કફીનીની બાંધો ઉપર ચઢાવીને પોતાના આસન ઉપરથી ઊભા થયા. અને જ્યાં જમવા માટે થાળ મૂક્યો હતો તે તરફ જઈને બેઠા. થાળી પોતાની તરફ ઝેંચી લીલી અને તેની ઉપર ઢાંકેલ વસ્ત્ર બાજુએ ખસેડીને તેઓ અન્ન ગ્રહણ કરવા માટે તૈયાર થયા. જે થાળ આવ્યો હતો, તેના કરતાં બીજનાં અનેક સારાં નૈવેદ્ય આવ્યા હોવાં છતાં તે બધાં તેમને તેમ જ પડી રહ્યાં પછી આ બહેનના નૈવેદ્ય ઉપર આટલો બધો પ્રેમ કેમ હશે? આવી પસંદ નાપસંહની વાતો સંસારમાં હોય છે. સંતોના મનને તે થોડી સ્પર્શ શકે? માધવરાવ પાસે જ હતા. તેમણે સાઈસમર્થને કહ્યું, ‘આ બેદભાવ અને વિષમતા શા માટે કરો છો? કોઈકની થાળીઓ તો બાજુમાં મૂકી દો છો! અમુકના ચાંદીના થાળ પણ બાજુએ કરી નાઓ છો? ફક્ત આ બાઈ જે થાળી લાવે છે કે તરત જ આવતાની સાથે ખાવા લાગો છો. મને એ વાતનું આશ્રમથી થાય છે! તેમનું ભાણું તમે આટલું શા માટે પસંદ કરો છો? દેવા! આ અમને મોટો ન સમજય તેવો ગહન કોયડો છે. શું આ બધા તમારા દાવપેચ છે? આવું પસંદ નાપસંદ તમારા જેવાને શા માટે હોવું જોઈએ?’ તેમની વાત સાંભળીને બાબાએ જવાબ આપ્યો, ‘શું કહું તને આ અન્નની વિશિષ્ટતા? પાછલા જન્મમાં આ ક્રી એક વાણિયાની ખૂબ જ મજબૂત અને પુષ્કળ દૂધ આપનારી ગાય હતી. પછી તે અચાનક નજરથી દૂર થઈ ગઈ અને ત્યારબાદ એક માળીને ત્યાં એનો જન્મ થયો. એ જ પછી ફરીથી એક ક્ષત્રિયને ત્યાં ગઈ અને ત્યારબાદ એક વાણિયાની પત્ની થઈ. આ વખતે એક બ્રાહ્મણને ઘેર જન્મ થયો છે. તે બ્રાહ્મણની પત્ની પણ થઈ છે. ખૂબ જ લાંબા અરસા પછી એ મારી દસ્તિએ ચઢી છે. તેની પાસેથી મળેતા પ્રેમના બે કોળિયા પેટમાં જવા હે અને મનમાં સુખ અને સમાધાન થવા હે.’ આવું બોલીને બાબા મનથી પેટ ભરીને જમ્યા. હાથમોઢું ધોયું અને સંતોષના ઓડકાર આવતાં પોતાની ગાઢી ઉપર જઈને બેઠા. તે બહેને પછી નમસ્કાર કરી બાબાનાં ચરણની સેવાની શરૂઆત કરી. બાબા પણ આ તકનો લાભ લઈ તેને તેના કલ્યાણ માટેની વાત કહેવા લાગ્યા. જે હાથથી બહેન બાબાનાં ચરણની સેવા કરતાં હતાં, તે જ હાથ બાબા પોતાના હાથથી દ્વારાવા લાગ્યા. આવી દેવ અને ભક્તની પરસ્પર સેવા ચાકરી જોઈને શામા તેમની મશકરી કરતાં બોલ્યા, ‘દેવા! સાંદું ચાલ્યું છે આ બધું! શું મજનું દશ્ય છે! એક બીજી ઉપરનો પ્રેમ જોઈને મનમાં નવાઈ લાગે છે.’ બહેનની સેવા કરવાની આસક્તિ જોઈને બાબાના અંતરમાં પ્રસન્નતા થઈ. તેઓએ ધીમેથી તે બહેનને કહ્યું, ‘રાજરામ રાજરામ’ આવું મોટેથી બોલતી રહેલે, એટલે મારી મા! તારું લુવન સફળ થશે. તારું મન શાંત થશે અને તું અગાધ કલ્યાણ પ્રાપ્ત કરીશ.’ શું એ શાખ્દોનો ચમત્કારીક સામનો! તે હૃદયમાં જઈને ખોસાતો હોય એમ તરત શર્ષદોથી જ જણે શક્તિપાત કરતા હતા. આવા કૃપાળ અને શરણે આવેલાઓને સંભાળનાર આ સમર્થ સાઈનાથ સદ્ગુરૂ કરતા અને એમનું કલ્યાણ કરતા હતા. (ઓ. ૧૪૭-૧૬૬)

હવે શ્રોતાઓને ખૂબ નમ્રપણે તલિન થઈને પ્રેમથી તેમની અંગત હિતોની વાતો કહું છું. તે તેમને પોતાના મનમાં છસાવી દેવા માટે અંતરાત્માની વિનંતિ કરું છું. જેવી રીતે ગોળના જ ગળપણથી મોહિત થયેલી કિડીનું માથું તૂઠી જય તેમ છતાં તે ગોળને છોડતી નથી, તેવી રીતે તમે પણ સાઈચરણની શરણાગતિ સ્વીકારો, જેથી તે ભલા સાઈ મોટી કૃપા કરીને તમારું રક્ષણ કરશો. ગુરુ અને શિષ્ય જરા યે જુદ્દા નથી હોતા. જેવામાં ભલે તેઓ બિન્ન દેખાય છતાં તેઓ એકાંગી,

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

એટલે કે શરીરના સરખા ગુણ, બુદ્ધિ અથવા જ્ઞાનવાળા હોય છે. તેમને જે કોઈ પોતાની જીદ્ધિ ધૂઠા પાડવાનો પ્રયત્ન કરશે તે હારી જરો અને તેનું અભિમાન ઓગળી જરો. એ બંને પૈકી એકને છોડીને જે બીજે રહ્યો તો તે ગુરુ પણ કાચો અને શિષ્ય પણ કાચો જ જાણવો. જે કોઈ આત્મજ્ઞાનમાં પૂર્ણત્વને પહોંચેલા ગુરુની ઇત્ત્રવિધાયામાં તૈથાર થાય છે તેવાને જુદાપણું સ્પર્શ કરતું નથી. ગુરુએ એક ગામ રહેવું અને શિષ્ય બીજા ગામ રહે એવું જેને પસંદ છે એ બંને જૂદા ગપ્પીદાસ હોય છે. મૂળમાં જ જે એ બે નથી તો તેમનું જુદાપણું વળી કેવું? એકબીજા સિવાય પળભર દૂર રહી શકાય નહિ તેવા તે બંને એકબીજામાં એકદ્વિપ થયેલા હોય છે. ગુરુ અને ભક્ત તેમનામાં પણ કોઈ અંતર ન હોવાને લીધે નિરંતર સાથે જ રહેલા હોય છે. ભક્તે ગુરુનાં ચરણમાં મસ્તક મૂકવું, એ પણ એક સ્થૂળ બુદ્ધિનો વ્યવહારિક પૂજનો ઉપચાર છે. ભક્ત ગુરુને એકાત્માથી ભજન કરનારો, અને ગુરુ પણ ભક્તને એકાત્મની ભાવનાથી જેનારા હોય છે. જે બંને એક બીજામાં સમરસ થયેલા ન હોય તો એ કેવળ નામ પુરતો જ વહેવાર છે. (ઓ. ૧૭૦-૧૭૭)

તમે ખાવા માટે અન્ન અને પહેરવાં માટે વખ્તાં રીતે મળશે તેની તલમાત્ર ફિકર રાખતા નહિ. આ બધું નસીબ ઉપર જ આધારિત છે અને પ્રયત્ન કર્યા વગર જ મળનાસું હોય છે. પ્રયત્ન કરીને જે તે મેળવવા માટે જેશો તો તે ફોગટનો જ શ્રમ પુરવાર થરો. પ્રયત્ન જ જે કરવાનો હોય તો ફક્ત પરમાર્થ સાધવા માટે જ કરો અને રાત દિવસ તેની જ ફિકર કરો. ‘ઉત્તિજ્ઞત’ અને જગત થાઓ. એવું શ્રુતિ માઉલી જેર જેરથી બોધ આપીને કહી રહી છે, અને ભક્તોને જગાડી રહી છે. કઢોપનિષદ્ધમાં કહ્યું છે ઉત્તિજ્ઞત જગત પ્રાભ્યવરાન્નિબોધત | ક્ષુરસ્ય ધારા નિશિતા દૂરત્યાદુર્ગ પથસ્કવયો વદન્તિ ||૧૪|| હે મનુષ્યો! ઊઠો જગૃત થાઓ! શ્રેષ્ઠ મહાપુરુષો પાસે જઈને તેમના ઉપદેશથી પોતાના કલ્યાણનો માર્ગ સમજુ લો. એ માર્ગ તલવારની તીક્ષ્ણ ધાર ઉપર ચાલવા જેવો મુશ્કેલ છે. માટે જે લોક બધાં અનર્થોનાં બીજ હોય એવા જન્મ જન્માંતરની અજ્ઞાનરૂપી નિદ્રામાં આળોટી રહ્યા છે. તેમણે સમયસર સાવધાન થઈને ગુરુ પાસેથી જ્ઞાનરૂપી અમૃતનું સેવન કરવું. તેને માટે અતિનાનુભૂતિ નાનું હું પણ હોય એવા જીવાત્મા અને સર્વ કંઈ જાણનારો હું પણ વગરનો પરમાત્મા આ બંનેમાં એકાત્માની ભાવના પેદા કરવા માટે ગુરુ એ જ એક ઉત્તમ ઉપાય છે. અજ્ઞાનની ઉપાધિવાળો આત્મા અને માયાની ઉપાધિઓથી ત્રાસેલો આત્મા જે શિબ છે તે બે વચ્ચેનો બેદભાવ ઓછો કરવા એકલા ગુરુરાજ જ સમર્થ હોય છે. મન તો શંકા કુશંકા કરવાવાળું છે. તેને સાઈનાં ચરણોમાં અર્પણ કરો એટલે ત્યાંથી જે કાંઈ કરવાની પ્રેરણા મળશે તેનું અહમપણું તેમની પાસે જ જરો. તેવી જ રીતે કાર્યો કરવાની પોતાની બધી જ શક્તિ સાઈબાબાને સમર્પિત કરો. પછી તેઓ જેવી આજ્ઞા કરે તેવી રીતે જ વર્તો. આ જગતમાં બધી સત્તા સાઈની જ છે, એ ધ્યાનમાં રાખો. માટે તેમની ઉપર તમારી સંપૂર્ણ જવાબદારી નાખીને કોઈ પણ કામ માટે અભિમાન ન કરવાથી, સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થશે. પણ આ કાર્ય હું કરીશ એવું સમજુને લેશમાત્ર પણ અભિમાન રાખશો તો એક જ ક્ષાળમાં વિલંબ વગર તેનું નકારાત્મક પરિણામરૂપી ફળ દેખાવા માંડશે. માયાથી ઉત્પન્ન થયેલા મોહના અજ્ઞાનની રાત્રીમાં આ ઓશિકાથી બીજે ઓશિકે પાસું બહલાતું રહે છે. એવામાં હેમાઉપંતને હરિ અને ગુરુ આ બંનેની કૃપા થઈ એ પણ માત્ર દૈવયોગથી, મહેનત અથવા તો પ્રયત્ન કર્યા સિવાય મળી ગઈ. તેમણે જ પોતાના ઉદ્દેશ્ય માટે મને ગૌરવ આપ્યું હોય તેવું લાગે છે. ભક્તોનો ઉદ્ધાર કરવા માટે, પોતાનું ચરિત્ર પ્રસિદ્ધ કરવાના નિર્ધાર સાથે તેમની પાસેથી બળજબરીથી આ ચરિત્ર સવિસ્તાર લખાવ્યું છે. ત્યારે અખંડ ધ્યાનરૂપી દોરામાં, અનન્ય પ્રેમરૂપી અનેક પ્રકારનાં રંગબેરંગી ફૂલોનો મનોહાર ગુંથીને આદરપૂર્વક સાઈને અર્પણ કરીએ અને આત્મસ્વરૂપી સ્વરાજ્યનું સિંહાસન મેળવીએ. પછી તે સિંહાસન ઉપર સ્થિર થઈને બિરાજમાન થઈ અહંકાર વગરના આત્માનાંના ઉપભોગ કરી અને પોતાના હદ્દયથી સુખી થઈએ. થોડામાંની કહેવાનું હોય તે એ કે સાઈબાબાના અનન્ય

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પ્રેમથી અને પૂજયભાવથી આપણે ધ્યાન કરીએ જેથી કરીને આપણું મન આત્મસ્વરૂપે સ્થિર થઈને પોતાનો આત્માના આનંદનો ઉપભોગ મેળવીને આપણું મન સુખ પામશે. (ઓ. ૧૭૮-૧૬૩)

આવું આ સાઈનું અગાધ ચરિત્ર છે. આગળની કથા તો આના કરતાં પણ આશ્રયકારક છે. શ્રવણેદ્રિય શુદ્ધ કરવા માટે ક્ષાણભર માટે અહીયાં ધ્યાન આપો. આગળ ત્રણ અધ્યાય આવશે. એમાં બાબા પોતાની જગ્યા ઉપર જ બેસીને દાષ્ટાંતની અપૂર્વ નવાઈ બતાવશે. એમાંનો શરૂઆતનો અધ્યાય લાલા લખમીયંદ વિષે છે. તેમના પગને પ્રેમઝૂપી દોરીથી બાંધીને એમને તેમનું આશ્રય સ્થાન બાબાએ બતાવ્યું હતું. મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાના બરહાનપુરના અહીયાં રહેનારી એક બાઈની બિચડી માટે આસકત થઈને બાબાએ તેને પોતાના દર્શન માટે ઉત્સુક કરીને તેના પ્રેમ અને ભક્તિનાં વખાણ કરી બતાવ્યાં. આગળ મેદા નામના એક અસીમ ભક્તને સ્વખનમાં ભીત ઉપર ત્રિશૂળ દોરવાનું દાષ્ટાંત આપ્યું અને તેની સાથે સાથે એકાએક શંકરનું શિવલીંગ તેને પ્રાપ્ત થયું. આવી અનેક કથાઓ આનાથી આગળ હવે આવવાની છે. તો શ્રોતાઓએ તે ભક્તિભાવથી સાંભળવી તેથી એ સાંભળવું સાર્થક થશે. મીઠાનો ગાંગડો જેવી રીતે સમુદ્રમાં દૂબતાં તેની સાથે એકડૃપ થઈ જય છે, તે પ્રમાણે સોહમ્ભૂ ભાવથી અભિજ્ઞપણે હેમાડપંત સાઈને અનન્યપણે નમસ્કાર કરી રહ્યા છે. તે ઉપરાંત પ્રેમની વિનંતી કરી રહ્યા છે કે, ‘અમને સાઈનું રાત અને દિવસ ધ્યાન લાગેલું રહે. તેમના સિવાય બીજું કંઈ પણ મનમાં ન આવે, અને મન હંમેશા સમાધાન વૃત્તિવાળું રહે. તેમજ ભૂતકાળ ભૂંસાઈ જય, ભવિષ્યકાળનો અંત આગળ ઘકેલાઈ જય અને બાકી રહેલો વચ્ચેનો ગાળો વર્તમાનકાળ ગુરુનાં ચરણોમાં સતત રહે. (ઓ. ૧૯૪-૨૦૨)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજ્જનોની પ્રેરણાં પામેલા ભક્ત હેમાડપંત રચિત.  
શ્રી સાઈ સમર્થના સત્ય ચરિત્રનો ‘દીક્ષા, અનુગ્રહ, દાન’ નામનો સત્તાવીસમો અધ્યાય અહીયાં  
સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણ.



## અધ્યાય ૨૭નું અર્થ વિવરણ

આ અધ્યાયનો વિષય, બાબાના ભક્તો ઉપરની કૃપા કરવાની રીતનાં ઉદાહરણ સાથેનું વર્ણન છે. સદગુરુ એકવાર પ્રસત્ત્ર થયા કે એ ભક્તને અનેક પ્રકારની યુક્તિઓ કરીને એનો ઉદ્ઘાર કરવાનો તેઓ પ્રયત્ન કરતા હોય છે. તેવી જ રીતે એકાદ ભક્તને તેમણે જાતે શોધેલો માર્ગ ગમતો હોવા છતાં સદગુરુના મતે તે માર્ગ, તે ભક્ત માટે અયોગ્ય હોવાને લીધે તેને તે બાબતમાં ઉતેજન ન આપતાં તેનાથી દૂર કરે છે. સાઈબાબાની રીત આવી જ હતી.

પહેલાં ઉદાહરણમાં ભક્તો ધાર્મિક પુસ્તકો બજનરમાંથી લાવીને બાબાના હાથમાં આપતા અને પ્રસાદ સમજુને તે પાછાં લેવાની ઈચ્છા દર્શાવતા. તેમને લાગતું કે આમ કરવાથી અને પુસ્તકનું પારાયણ કરવાથી તેઓ અર્થ સરસ રીતે જ સમજશે. પણ બાબા તે ગ્રંથ બધાને પાછો આપતા નહીં. ભક્તને બુદ્ધિ, ગ્રહણ શક્તિ અને સ્વભાવની ખરી પરીક્ષા કરીને જ તેઓ આપતા હતા. બાકીના માધવરાવ-શામા પાસે જમા કરાવી દેતા હતા.

પણ શામાએ વાંચવા માટે લીધેલું કાકા મહાજનીનું એકનાથી ભાગવત, બાબાએ જેવા માટે માગેલું અને તે તેમને પાછું આપ્યું. કદાચ શ્યામાની તે વાંચવાની પ્રબળ ઈચ્છા થઈ છે કે નહિ તે પાંકું કરવા માટે તો બાબાએ આવું નહિ કર્યું હોય ને ? બાબાને કલ્પના હતી કે એ પુસ્તક શામાનું નથી, પણ કાકા મહાજનીનું જ છે. પોતે જ તે તેમને પહેલાં આપેલું હતું. પણ આ સમયે આ પુસ્તકની જડ્ઝ શ્યામાને વધારે હતી. માટે જ બાબાએ શામાને આપ્યું હોવું જેઠાએ એવું લાગે છે. આગળ બીજું ભાગવત બાબાએ કાકા મહાજનીને આપ્યું અને તેને બરાબર સાચવીને રાખવા માટે કહ્યું જ ને !

બાપુસાહેબ જેગના ગીતારહસ્યના પાર્સલ વિષય લો. આ પાર્સલ શેનું છે ? એ જેગ ટપાતમાં ઉત્સુકતાથી જેવા લાગ્યા હતા. આથી જલ્દે થાય છે કે, એ પુસ્તકવિકેતા પાસેથી તેમણે મંગાવ્યું ન હતું. પણ તેમને કોઈએ મોકલાવેલું હોવું જેઠાએ, અથવા તો બાબાએ તો એ વ્યવસ્થા કરી નહિ હોય ને ? નમસ્કાર કરતી વખતે જ બરાબર તેનું બાબાનાં ચરણોમાં પહુંચું, અને બાબાની તે અંગે પૂછીપરછ કરવી. આ ઘટના આશ્રયજનક જ છે ! મને લાગે છે કે, બાબાની ઈચ્છા હતી કે, ટિઝકનું ગીતારહસ્ય એટલે કર્મયોગશાસ્ત્ર ઉપરનું આ પુસ્તક જેગે જડ્ઝ વાંચવું જેઠાએ. કારણ કે જેગનાં પત્ની જીવતાં હતાં તે પહેલાં જ તેમના મનમાં સંન્યાસ લેવાના વિચાર આવતા હતા. સર્વજ્ઞ બાબા જાણતા હતા કે, એ વાતને હજુ વાર છે. ત્યાં સુધી જેગે પોતાનાં સંસારનાં કર્તવ્યો પાર પાડવાં જેઠાએ, માટે બાબાનો આ કીમિયો તો નહીં હોય ને ? પાછળથી જેગનાં પત્નીનું અવસાન થતાં અને આગળ અધ્યાયમાં ૪૪, ઓ. ૧૪૩ થી ૧૪૬માં કહ્યાં પ્રમાણે જે સંન્યાસ ગ્રહણ કર્યો. ગામદિયા શામાને એકનાથી ભાગવત વાંચવા માટે અને સુશિક્ષિત જેગને ‘ગીતારહસ્ય’ વાંચવા માટે કહેવામાં પણ બાબાનો ભક્તો ઉપરનો અધિકાર જેઠાએ. કૃપા કરવાની તેમની પદ્ધતિ જણાઈ આવે છે.

શામાને વિષણુસહસ્રનામની પોથી આપવામાં તો, બાબાની ભક્તો માટેની અત્યંત ચિંતા દેખાઈ આવે છે. એ માટે રામદાસીને પેટમાં ચૂંક થાય તેમ બાબા ખોટું પણ બોત્યા અને તેમની પોથીની ચોરી પણ કરી. સદગુરુ કે દેવ ભક્ત માટે શું નથી કરતા ? મહાબારતના યુદ્ધ પ્રસંગે અર્જુનને બચાવવા માટે શ્રી કૃષ્ણ ભગવાન ભીજ્મ ઉપર સુર્દર્શન લઈને દોડ્યા અને પોતે શાસ્ત્ર હાથમાં ન લેવાની પ્રતિક્ષાનું પણ બંડન કર્યું હતું ને ?

પછી બાબાએ રામદાસીને પણ કોઇ ન કરવા માટે અને કોઈ પણ જતનો લોભ ન રાખવા માટે તથા રામદાસીને પંથને શોભે એવો વ્યવહાર કરવાની શિખામણ આપી. ધન્ય છે બાબાની આ ઉપરેશ કરવાની યુક્તિને !

સૌ. લક્ષ્મીબાઈ ખાપડેને એમની અપૂર્વ ભક્તિનું ફળ બાબાએ આપ્યું. કેટલાએ જન્મોનો ઋણાનુંબંધ હતો ને ?

## શ્રી સાઈનું સત્ય ચિહ્ન

શામાને ઋણાનુંબંધ પણ મહાન એટલે આગળ અ. ૩૬, ઓ. ૧૪૦માં કદ્યા પ્રમાણેનો, બોતેર પેઢીનો બંને વચ્ચેનો સંબંધ, બંનેને નામઃસ્મરણનો સહેલો અને સરળ માર્ગ બાબાએ બતાવ્યો. મોટાભાગે જરા પણ શિક્ષણ લીધા વગરના સૌ. ખાપડે બાઈને ફક્ત ‘રાજ્ઞરામ’ ‘રાજ્ઞરામ’નો મંત્ર આપ્યો. બાબા કોઈપણ ભક્તને ગુપ્ત ગુપ્ત મંત્ર આપતા નહીં. પણ આ ભક્તબાઈ માટે નક્કી કરેલો આ નિશ્વય પણ તેમણે તોડ્યો અને તે પણ કેવી સરસ રીતે ? પોતાનાં ચરણની સેવા કરી રહેલા ભક્તનો હાથ પોતાના હાથથી પ્રેમપૂર્વક દ્વબાવી આપ્યો. આવો ઉપદેશ અથવા તો દીક્ષા ભક્તના મનમાં ઠસ્યા વગર રહેવાની કે ? આ બહેનનો ઉદ્ઘાર કેવી રીતે થયો તે આપણે ઉપરના અધ્યાયમાં, ઓ. ૧૬૮ની આલોચનામાં વાંચ્યો છે.

પોતે અને ખાપડે ખૂબજ શાની અને ધર્મશાસ્કોનો ખૂબજ ઊંડો અભ્યાસ કરેલા એવા વિદ્ધાન હતા. પણ બાબાએ કોઈ કોઈવાર ફક્ત યૌગિક દાસ્તિક્ષેપ કરીને સ્વાનંદનો અનુભવ કરાવ્યો. કારણ એ કે, તે સુખદ અનુભવની આશામાં ખાપડેએ પોતાના ધંધા તરફનું અને મોટાઈ મેળવવા પાછળનું ધ્યાન પરામર્થ તરફ વાખ્યું. પણ શાની માણસ સહેલાઈથી અહૂંકાર છોડીને આ તરફ વળતો નથી. એટલું તો ખરું કે,

હરિ તો નિજ ભક્તે કર્યો । સીધા સાદા ભોળાનો એ ભૂખ્યો ।

પ્રેમ માટે સમૂળ વેચાયો । દાંબિકોથી સદા દૂર ॥૬॥

અધ્યાય - ૩



## ॥ અધ્યાય ૨૮ ॥

### દાનાંત કથનમ्

(શાંતાકૃતના લાલા લખમીચંદને, બહુરાનપુરનાં એક બહેનને અને શિરડીમાં પરમભક્ત મેઘાને ભૂત અને  
ભવિષ્યનો સ્વર્જ દ્વારા સ્વીક તેમજ પ્રત્યક્ષ અનુભવ કરાવવો.)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળદેવતાને વંદન,  
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

શ્રી સાઈબાબા એક જ જગ્યા પૂરતા મર્યાદિત નથી. તેઓ સર્વ સજીવ અને નિર્જીવ પદાર્થોમાં વસેલા છે.  
બ્રહ્મદેવથી માંડીને તે કિડા કીડી અને માખી જેવા નાનાંમાં નાનાં પ્રાણીમાત્રમાં અને દરેક ઠેકાણે વ્યાપેલા અને  
સમાયેલા છે. શ્રી બાબા વેદ વેદાંતોમાં પારંગત અને નિપૂણ છે અને પરબ્રહ્મનાં તમામ લક્ષણો તેઓમાં જણાયાં છે.  
તે તેનો આણસાર આપી રહ્યા છે. આ પ્રકારે બંને વાતોમાં પ્રવિષ્ણ અને પરિપૂર્ણ હોવાથી તેઓ સદગુરુ હોવાને પાત્ર  
છે. જાતે મોટા પ્રખર વિદ્વાન હોય, પણ શિષ્યોને તે જ્ઞાન આપી શકતા નથી. એક બાપ બાળકના શરીરને જન્મ આપે  
છે, પણ તે બાળકના જન્મની સાથેસાથે છેવટે મરણ પણ હોય છે. પણ ગુરુ પોતાના બાળક જેવા શિષ્યોને જન્મ  
અને મરણ આ બંનેમાંથી મુક્તિ અપાવે છે. માટે જ ગુરુના હૃદયનો ઉમળકો અને તેમની કૃપા દાનાંત મહત્વ અધિક  
ગણાય છે. (ઓ. ૧-૪)

હવે પહેલાનાં આવી ગયેલાં વર્ણનોમાં સ્વર્જનોના અધ્યાયનું શ્રવણ કરો તેમજ બાબા ભક્તોના સ્વર્જમાં આવી  
તેમને કેવી રીતે દર્શન આપતા હતા તે પણ જુઓ. કોઈને હાથમાં છઠી લઈને માસ્તરના ઝિપમાં એની પીઠ ઉપર સોળ પાડી  
દેતા, તો કોઈને નિશ્ચળ કાઢવાનું કહેતા તો વળી કોઈની પાસે ભીચડી પણ માંગતા. તો કોઈકને સ્વર્જમાં જઈને મનમાં ડર  
પેસાડીને દાડ જેવા વ્યસનની લતથી છોડાવતા. આ પ્રકારે ભક્તોનાં અનેક સંકટો ટાળીને, તેમને પોતાનાં ચરણોમાં  
લાવીને શાંતિ બક્ષતા. તો વળી કોઈની પીઠ ઉપર માર મારીને સોળ પાડ્યા, ચટણી વાટવાના પથ્થરથી છાતી છુંદી કાઢી,  
આવી વાતો મેં પાછળના અધ્યાય ૧૩માં કહી છે, જે શ્રોતાઓએ પહેલાં સાંભળી છે. તે વિષે ખુલાસો કરવાની જરૂર છે  
કે પોથીમાં દરશમાં અધ્યાયમાં જે લખેલું છે તે ખોટું છે. ભીમાલ પાટીલની, જેમના એક માસ્તરે લાકડી વડે તેમનો બરડો  
મારી મારીને લાલચોળ કરી નાખેલો અને પથ્થરથી છાતી છુંદી હતી, તે કથા અ. ૧૩ ઓ, ૧૬૪-૧૬૬ વર્ષે આવેલી છે.  
હવે જે નવી કથા શરૂ થાય છે તેની નવાઈની તો હું શું વાત કરું? ધન્ય છે એ સાંભળનારને અને ધન્ય છે એ ગાનારને અને  
કહેનારને બંને પોતપોતાની રીતે તલ્લિન થાય છે અને કયારેય ઓછાં અથવા તો નાશ ન થનારાં સુખોનો લાભ લે છે.  
ખોટી અને ખરાબ વાતો અથવા તો નિંદા સાંભળવાનાં પાપોનું નિરાકરણ કરનારા અને સદ્ગ્રાહ પુરુષકારી અને પાવન હોય  
એવી સંતકથા વારંવાર સ્પષ્ટતા કરીને કહીએ. હવે એ જ કથાઓનું વર્ણન હું શ્રોતાઓ માટે રજૂ કરું છું. તેને ધ્યાન દઈને  
સાંભળો તેમાં તેમને સાઈબાબાના કૃપાળુ સ્વભાવનાં ડગલે પગલે દર્શન થશે. (ઓ. ૫-૧૧)

રાલી બંધુ (REILLY BROTHERS) તે એક ગ્રીક વ્યાપારી તે સમયમાં આખા હિન્દુસ્તાનમાં મોટાપાયે  
ખરીદી કરતો હતો. તેમની પેઢીઓ દરેક શહેરમાં હતી. અને તેમાંની એક મુંબઈમાં હતી. ત્યાં અધિકારીના પદ પર

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

લખમીચંદ નોકરી કરતા હતા. તેઓ ખૂબ જ વિશ્વાસુ અને આજાકારક હોવાને કારણે તેમને મુનીમળ તરીકે અને પત્ર વ્યવહારનું કામ કરતા હોવાથી તેઓની પદવી ચિટ્ઠિસની હતી. સર્વ પ્રથમ તેઓ રેલ્વેમાં હતા. ત્યાર પછી વ્યંક્ટેશ નામના છાપખાનામાં કામ કરતા હતા. તે વખતે શ્રી સાઈનો સમાગમ તેમની સાથે કેવી રીતે થયો તે હવે સાંભળો. ‘મારો માણસ પરદેશમાં હોય કે હજરો કીલોમીટર દૂર હોય, હું તેને ચકલીના બચ્ચાની માફક પગને દોરી બાંધીને મારી તરફ ખેંચી લાઉં છું.’ અહીં બાબાએ ચકલીના બચ્ચાને બાંધીને લાવવાનું, જે ઉદાહરણ આપ્યું છે તે ખૂબ માર્ગિક છે. એક વખત ચકલીના પગમાં દોરો બાંધ્યો છે પછી તેનું કંઈ પણ ચાલતું નથી. તે બચ્ચુ કાયમ માટે બંધાઈ જય છે અને ફરી તેમાંથી છુટકારો થતો નથી. બાબાની સંગતમાં ખેંચાઈ આવેલા ભક્તોની પણ આવી જ દરશા થતી હશે. આવું બાબા અનેક વખત બોલ્યા હતા, જે મોટાભાગના લોકોએ સાંભળ્યું છે અને અનુભવ્યું પણ છે. એવી જ બાબાની લીલાઓનું વર્ણન હવે હું કરી રહ્યો છું. દેશવિદેશની અનેક ચકલીઓને તેમનાં બાળબચ્ચાનાં સહિત શિરડીમાં બાબાએ આણ્યાં હતાં. તેમાંનું આ લખમીચંદ પણ બાબાનું ભાવિક બાળક હતું. જ્યારે અનેક જન્મોના પ્રારબ્ધ કર્મનો ઉદ્ઘય થાય છે ત્યારે જ સંતોનો સમાગમ પ્રાપ્ત થાય છે અને મોહથી ઉત્પન્ન થયેલું અજ્ઞાન નાશ પામે છે, બુદ્ધિનો વિવેકદ્વપી અન્ધ્રી પ્રજ્વલિત થાય છે અને સંસારની આશા, આકાંક્ષાઓમાંથી નિવૃત્તિ થાય છે. વૈરાગ્યના ઉત્કર્ષનો સમય પાડે છે ત્યારે ત્યાં સંઘરાયેલા પૂર્વજન્મનાં કર્મોનો ક્ષય થાય છે અને જીવતર સાર્થક અને સફળ થાય છે. શ્રી બાબા એક વખત આંખોમાં વસી જય કે પછી ત્યાં બીજી કોઈનું પણ સ્થાન રહેતું નથી. આંખો ભલે મિંચાયેતી હોય છતાં ચારેબાજુ વ્યાપેલા શ્રી સાઈબાબા તેમાં દેખાય છે. એક વખત લાલા લખમીચંદ અને મારી હેમાડપંતની મુલાકાત થતાં તેમને જે પોતાના સ્વાનુભાવોની વાતો કહી અને મેં તેને પ્રેમપૂર્વક મારી હૃદયદ્વારી તિનેરીમાં સંઘરી રાખ્યી. તે શ્રોતાઓને કહેવાની ઉત્કંઠા જગતાં હું હવે અનું કથન કરું છું. લાલાજીને સાઈબાબાનું કહેણ આવ્યું. તે પણ બાબાની અપૂર્વ અને આતૌકિક લીલા જ છે. કાન અને મનની એકાગ્રતા સાધીને, ભાવિક શ્રોતાઓએ તેને સાંભળે. (ઓ. ૧૨-૨૨)

ઇ.સ. ૧૯૧૦ની સાલ અને નાતાલનો દિવસ હતો. લાલાજીને શિરડી જવાનો યોગ આવ્યો. તે વખતે પ્રથમ વખત જ તેમને બાબાશ્રીના દર્શન થયાં. પણ આ યોગ આવવાનો આણસાર તેમને એક બે મહિના પહેલાં જ આવ્યો હતો. તે કેવી રીતે તેને હવે સાંભળો. મુંબઈના હાતના ઉપનગર શાંતાકુઝમાં તે રહેતા હતા. ત્યારે ધ્યાન મન્ત્ર ન હોવાં છતાં આ લાલાજીને અચ્યાનક સ્વભન આવ્યું અને તેમાં એક આશ્રયકારક અનુભવ થયો. ભક્તગણોથી ચારે બાજુએ ધેરાયેલા, દાઢીવાળા ધરડા સાધુને લખમીચંદ ઊભા રહેલા જેયા અને તેમણે તે સાધુને વંદન કર્યા. લખમીચંદ દાસગણું કે જે ગણેશ દત્તાત્રેય સહસ્રબુદ્ધેનું કીર્તન સાંભળવા માટે દત્તાત્રેય મંજુનાથ બિજૂર નામના ગૃહસ્થ પાસે આવ્યા. દાસગણુએ તે હંમેશા પ્રમાણે સાઈબાબાની છબી સામે મૂકેલી હતી. તે જેતાં જ લખમીચંદને પેલી સ્વભનમાં જેયેલી વ્યક્તિની યાદ આવી. એ જ દાઢી, એટલી જ ઉંમર અને એવા જ અવયવો અને એવાં જ ચરણો જેઠિને લખમીચંદને એ જ આ મારા સ્વભનમાંના મહાત્મા છે તેની ખાતરી થઈ ગઈ અને તેનું મન બહેર મારી ગયું. તેમાં દાસગણુનું કીર્તન, તેમાં વળી તુકારામનાં આખ્યાન, અને તેમાં પેલા સ્વભનમાંના સાધુનું દર્શન. લાલાજી તો એકદમ તલ્લિન થઈ ગયા. તેઓ ખૂબ કોમળ મનોવૃત્તિના માણસ હતા. તેમની આંખોમાંથી પ્રેમનાં અશ્રુ ભરાઈ આવ્યાં. અને મનમાં થયું કે આ પ્રેમાણ મૂર્તિને હું કયારે જેઠ શકીશ ! એવી તેમને તાલાવેલી લાગી. જેવી સાધુની આદૃતિ સ્વભનમાં જેયેલી એવી જ આભેદ્ધબ નકલ તેમને કીર્તનમાં દેખાઈ અને તેમની તરફ તેમનું ધ્યાન કેન્દ્રિત થયું તે સિવાય બીજું મનમાં કાંઈ આવતું નહીં. ‘શિરડી જવા માટે કોઈ મિત્રનો સંગાથ મળશે કે કેમ ? આ સંતના ચરણમાં મારું મસ્તક હું કયારે મૂકીશા ? આ સાધુનું દર્શન મને કયારે થશે અને તેનો પ્રેમાનંદ ભોગવવાનો મને મોકો મળશે કે નહીં ?’ આવી લખમીચંદના

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

મનમાં એકસરખી ઉત્સુકતા જગ્યી. ‘હવે જવા માટે ખર્યનો પ્રબંધ કરવો જોઈએ. હવે શું કરું તો સાધુના દર્શન મને સત્ત્વરે થાય, એનો ઉપાય રોધવો જોઈએ.’ ઈશ્વર હંમેશા પ્રેમનો ભૂષ્યો હોય છે કેવો ચમત્કર થયો એ જુઓ ! એ જ દિવસે રાત્રીના બરાબર આઠના ટકોરે લાલાળુના મિત્રે દરવાજે ખટખટાવ્યો. દરવાજે ઉઘાડતાં જોયું તો તેમના સ્નેહી શંકરરાવ બહાર ઊભા હતા. તેમણે પૂછ્યું, ‘શિરડી આવવું છે કે ? પહેલાં કેડગાંવ નારાયણ મહારાજનાં દર્શને જવાનું મન હતું. પણ હવે થયું કે શિરડી જઈએ. મનમાં જેની ખટપટ ચાલી રહી હતી તે જ વાત જણો કે આપોઆપ સામે ચાલીને આવી હોય એવું લાગ્યું. લખમીચંદના મનમાં આનંદનો પાર રહ્યો નહિ. તેમણે પોતાના કાકાના ઢિકરા પાસેથી પંદર ઇપિયા ઉછીના લીધા. શંકરરાવે પણ એવી જ કોઈ વ્યવસ્થા ગોઠવી અને શિરડી જવા માટે પૂરતી સગવઠ કરી લીધી. તથા બિસ્તરા પોટલાં લઈને નીકળવાની તેથારી કરી. સમયસર પહોંચીને ટિકીટો મેળવી લીધી અને ગાડીમાં જઈને બેઠા. શંકરરાવ તો મોટા ભજનિક હતા. ગાડીમાં બંનેએ મળીને ભજન કર્યા. લખમીચંદ પ્રવાસમાં જિજ્ઞાસાથી પૂછપરછ કરવા લાગ્યા. શિરડી જતા માણસો અથવા તો શિરડી જઈ આવેલા કોઈ જણ મળે તો તેમને નમસ્કાર કરીને પૂછતા, ‘અમને સાઈબાબાનો મહિમા અને સંતોષ થાય તેવા તમારા પોતાના કોઈ અનુભવ કહો. અહમદનગર તરફ સાઈબાબા અતિ પ્રણ્યાત મોટા સંત છે તેમને કોઈ અનુભવ હોય તો અમને નિશ્ચિત જણાવો.’ એ જ ડબ્બામાં શિરડીથી પાસેના ગામમાં રહેનાર ચાર મુસલમાનો હતા. જેમની સાથે વાર્તાવપમાં લખમીચંદને સંતોષ થયો. લખમીચંદ ખૂબ ભાવિક હતા. મુસલમાનને પૂછતા તેનો જવાબ આપતાં તેઓ બોલ્યા કે, સાઈબાબા એક મહાન સંત છે, શિરડીમાં તેમનો કેટલાંય વર્ષથી નિવાસ છે. તેઓ પ્રસિદ્ધ ઓલિયા છે. આમ બાબા વિષેની અન્ય માહિતીઓ તેઓ કહેતા ગયા અને લખમીચંદ અને શંકરરાવ કોપરગાંવ પહોંચ્યા. ત્યાં તેમણે સાંભળેલી વાતો ઉપરથી લખમીચંદ શોઠને યાદ આવ્યું કે સાઈબાબાને જમફળ બહુ જ ભાવે છે અને અહીં કોપરગાંવમાં સરસ મજલનાં પાકેલાં જમફળ મળે છે તથા ગોદાવરીના કંઠે તે વેચાય છે. તે લઈ લઈએ જેથી કરીને બાબાને અર્પણ કરી શકાય. પણ ગોદાવરીના કંઠે પહોંચતાં ત્યાનું રમ્ય વાતાવરણ જોતાં તેમના મનમાં એટલો બધો આનંદ થઈ ગયો કે ટાંગો સામે કિનારે પહોંચ્યો ત્યાં સુધીમાં લખમીચંદ પેલાં જમફળની વાત જ ભૂલી ગયા. ત્યાંથી શિરડી ચાર ગામ દૂર છે. ટાંગો અડધે રસ્તે પહોંચ્યો હશે અને લખમીચંદને પેલાં જમફળની યાદ આવી. પણ ત્યાંતો તેનું કોઈ જ ડેકાણું ન હતું. એટલામાં એક ઊશી માથા ઉપર મોટો ટોપલો લઈને ટાંગાની પાછળ દોડતી દેખાઈ. તેને કારણે ટાંગો રોકાવ્યો તેમને ટોપલામાં સારામાં સારી જાતનાં જમફળ દેખાયાં. આ જેઠે લખમીચંદ આનંદવિભોર થઈ ગયા. તેમણે વીજી વીજીને સારામાં સારાં જમફળી લીધાં અને જેટલાં ટોપલીમાં બાકી બચ્યાં તે પેલી વૃદ્ધ બાઈએ, ‘મારા તરફથી બાબાને અર્પણ કરને’ એવું કહીને લાલાળુને આપી દીધાં. પહેલાં જમફળની યાદ અપાવવી, પછી એ વાતનું વિસ્મરણ થવું અને ત્યાર બાદ આ વૃદ્ધ બાઈની મુલાકાત થવી અને એની સાઈ પ્રત્યેની ભક્તિ આ બધું જોઈને બંનેના મનમાં ખૂબ આશ્રય થવા લાગ્યું. ‘શરૂઆતમાં એક વૃદ્ધ સાધુ સ્વપ્નમાં આવ્યા અને એ જ પાછા કીર્તનમાં નજરે ચઢ્યા. વૃદ્ધા તેની તો કોઈ સગી નહિ હોય ને ?’ તેવો સંશય લખમીચંદના મનમાં આવ્યો. (ઓ. ૨૩-૫૫)

પછી ટાંગો આગળ હંકયો અને જેતબેતામાં તે બંને શિરડી આવી પહોંચ્યા. દૂરથી જ મસ્જિદની ઘજાઓ દેખાઈ અને બંનેએ ભક્તિભાવથી તેમને વંદન કર્યા. પછી તરત જ પૂજની સામગ્રી લઈને તેઓ મસ્જિદમાં ગયા અને સાઈબાબાના દર્શન કરીને આનંદથી તેમના મન તૃપ્ત થયાં. મસ્જિદના આંગણામાં સભામંડપની જગ્યામાં પ્રવેશતાં દૂરથી બાબાની મૂર્તિ જોઈને તેમનો કંઠ ભરાઈ આવ્યો અને તે ગદ્ગદ થઈ ગયા. મનની કલ્પનાની આવી મૂરત જોઈને તેમના દર્શનની લખમીચંદ તલિન થઈ ગયા. તે સાન ભાન ભૂલી ગયા અને આત્માની જાણકારી થઈ તથા આનંદ્ધી ઉત્સાહ પ્રાપ્ત

## શ્રી સાઈનું સત્ય ચિહ્ન

થયો. બાબાની સામે બેસીને તથા હાથમાં સ્વચ્છ પાણી ગ્રહણ કરીને તેમણે બાબાના ચરણકમળ ધોયાં, અને અર્ધ્ય લઈને પૂજન કરીને શ્રીફળ અર્પણ કર્યું. ધૂપ, દીપ, પાનનું બીંગુ, દક્ષિણા વગેરે પૂજાવિધિ પતાવી અને બાબાની બેઠક પાછળ ભીતિ હોવાથી તેમની આજુભાજુ ફરી શકાય નહીં માટે મનોમન પ્રદક્ષિણા કરી. બાબાના ગળામાં ફૂતહાર પહેરાવ્યો, ત્યારખાદ લખમીચંદ બાબાનાં ચરણો પાસે બેઠા. તેઓ ખૂબ જ પ્રેમાળ ભક્ત હતા. તેમને ગુરુકૃપાનો આનંદ મળ્યો અને એક ભમરાની માફક સાઈચરણિક્ષપી કમળમાં તેમનું મન રમી રહ્યું. ત્યારે બાબા બોલ્યા, ‘સાલે ! રસ્તેમે ભજન કરતે હોએ, ઔર દુસરે આદમી કો પૂછ્યે હો ? કયા દુસરોસે પૂછ્યના ? સબકુછ અપની આંખોસે હેખના, કાયકુ દુસરે સે પૂછ્યના ? ઝૂઠ હૈ કે સચ્ચા, સપના કરલો અપના. મિચાર આપ, મારવાડીસે લેકર ઉછીના કયા જરૂર દર્શન કી હોતી ? હું અબ મુરાદ પુરતી ?’ આ સાંભળીને લખમીચંદને મનમાં નવાઈ લાગી. રસ્તામાં કરેલી પૂછ્યપરછની ખખર બાબાને કેવી રીતે જ્ઞાન થઈ ? ખરેખર આ કેવું અંતર્જ્ઞાન ! દર્શનની ઉત્કર્ષા અને પૈસાની ખેંચાયેચ પણ હતી. માટે તો ઉછીના લેવા પડ્યા તેની પણ બાબાને ખખર છે ! લખમીચંદને નવાઈનો પાર ન રહ્યો. સાઈનાં પવિત્ર ચરણિક્ષપી કમળો ઉપર આસક્ત થયેલા અને ભમરાની માફક જામેલા બધા ભક્તોને પણ આશ્ર્ય થયું કે ખરેખર બાબાનું કૌશાલ્ય અતકર્ય છે. ઉધારી કરીને તહેવાર મનાવવો અથવા તો ચાત્રા પ્રવાસ કરવો એવો ઉધારીનો ઘંધો બાબાને જરાયે ગમતો નહીં. એ જ એમાંથી મળતી મુખ્ય શિખામણ છે. (ઓ. ૫૬-૭૦)

બીજી બધા ભક્તોની સાથે લખમીચંદ અને તેમના મિત્ર શંકરરાવ સાહેના વાડામાં ગયા અને બપોરની વેળા થતાં ખૂબ જ પ્રેમથી જમવા માટે બેઠા. એટલામાં કોઈ ભક્તે બાબાને શીરાનો પ્રસાદ લાવીને પતરાળામાં પિરસ્યો અને તે ખાઈને લખમીચંદ તૂંપ થઈ ગયા. બીજે દિવસે જમવાના સમયે લાલાજુને એ શીરાની યાદ આવી. પણ શીરો કંઈ દરરોજ જમવાના સમયે મળતો નહીં માટે તે ન મળતાં લખમીચંદની એ ઇચ્છા મનની મનમાં જ રહી. પણ બીજી દિવસની નવાઈ તો જુઓ ! લાલાજુની આ અપૂરતી ઇચ્છા સાઈમહારાજે કેવી રીતે પૂર્ણ કરી અને શો ઉપાય અજમાવ્યો તે હવે જુઓ. એ દિવસે બપોરના દરરોજની માફક બાપુસાહેબ જેગ, ગંધ, અક્ષત, ફૂલ વગેરે સાથે ઘંટકી, નિરંજન અને પંચારતી લઈને મસ્નિજદમાં આવ્યા અને બાબાને પૂછ્યવા લાગ્યા, ‘આજે નૈવેદ્ય કયું લાવું ?’ એ સાંભળતા મહારાજે આશા કરી, ‘પહેલાં મારે માટે થાળ ભરીને શીરો લઈ આવે, અને પછી જ આરતી અને પૂજન કર.’ જેગ પૂજનની સામગ્રી બાજુ ઉપર મુકીને તરત જ પાછા ગયા અને બધાને પહોંચી રહે તેટલો શીરો લઈને સમય ન બગાડતાં પાછા ફર્યા. પછી બપોરની આરતી પૂરી થઈ અને ભક્તોએ પહેલેથી જ આણેલી નૈવેદ્યની થાળીઓ મસ્નિજદમાં આવવા માંડી. ત્યારે બાબા પોતાના ભક્તોને બોલ્યા, ‘આજનો દિવસ સરસ છે, મને લાગે છે કે આજે જમવાની સાથે શીરાનો પ્રસાદ હોવો જ જોઈએ, શીરો જલદીથી લઈ આવો અને બધા મળીને તે શીરો પેટ ભરીને ખાવ. પછી ભક્તો નીચે જઈને શીરાની બે તપેતીઓ ઉપર લઈ આવ્યા. અહીંથી પેટમાં કકડીને ખૂબ અને પીઠમાં સંધીવાના કળતરને લીધે લખમીચંદ અસ્વસ્થ થયા હતા. પણ તે જ સમયે બાબાના મુખમાંથી શું અને કયા શબ્દો સરી પડ્યા તે શ્રોતાઓએ હવે ધ્યાનપૂર્વક સાંભળવા, ‘ખૂબ લગી હૈ ? અચ્છા હુઅા. કમ્મરમેં હર્દ ? ચાહ્યે દવા ? અબ સાંજે કી-શીરાની ચલી હૈ હવા કરો સવાર આરતી ઉઠ તૈયાર હો.’ લખમીચંદના મનમાં જે કંઈ હતું તે બધું બાબાએ સાફ કહી નાંખ્યું. અંતર્જ્ઞાની મહારાજનાં મનમાં બીજના મનના વિચારોના પડ્યા, તેમણે એક શબ્દ બોલ્યા વીના મનમાં સમજાઈ જતા હતા. આરતી પૂર્ણ થતાં જમવાના સમયે લખમીચંદને શીરો મળ્યો અને તેમની તે બાબતની આસક્તિ પૂર્ણ થતાં તેમને અતિ આનંદ થયો. (ઓ. ૭૧-૮૪)

તે દિવસથી લખમીચંદનો બાબા ઉપરનો પ્રેમ વધુ દઢ બેસી ગયો. તેમણે ફૂલોની માળા, અગરભતી, નારિયેળ વગેરે સામગ્રીસહ બાબાની પૂજન કરવાના નિયમથી શરૂઆત કરી અને મબલાખ માનસિક સુખ-શાંતિ પ્રાપ્ત કરવા

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

લાગ્યા. તેમની સાઈ પ્રત્યેની ભક્તિ એટલી બધી વધી ગઈ કોઈ પણ શિરડી જનારો મળે કે તેમની સાથે હાથોહાથ માળા, કપૂર, અગરબંની અને દક્ષિણા વગેરે શ્રી બાબાને મોકલાવતા. કોઈ શિરડી જઈ રહ્યું છે, બસ એટલી માહિતી લખમીચંદને મળવી જેઠાં કે આ બધી વસ્તુઓ તે નિયમિતપણે દક્ષિણા સહ બાબાને જડરથી મોકલી આપતા. મનની ઈચ્છા પ્રમાણે શીરો જમવાના સમયે મળ્યો. તે જ વખતના શિરડીના ફેરામાં ચાવડી સરઘસનો રાત્રીનો એ સમારંભ જેવા માટે લખમીચંદ ગયા હતા. તે વખતે બાબાને ખૂબ ખાંસી ઉપડી અને તેમનો જીવ પણ ગભરવા લાગ્યો. લખમીચંદ મનમાં બોલ્યા, ‘આ ખાંસી બાબાને કેટલો ત્રાસ આપી રહી છે ? મને લાગે છે કે તેમને લોકોની જડર નજર લાગી હોવી જેઠાં અને એથી જ આવી ખરાબ ખાંસી તેમને ઉપડી છે.’ આપો વિચાર લખમીચંદના મનમાં ઉઠ્યો હતો. પણ બીજ દિવસે સવારે તેઓ મસ્ઝિદમાં બાબા પાસે ગયા ત્યારની મજા જુઓ, બાબા પણ એવું જ કાંઈ બોલ્યાં, માધવરાવ દેશપાંડેની સામે જેઠ બાબા પોતાની મેળે જ કહેવા લાગ્યા, ‘કાલે મને ખૂબ ખાંસી ઉપડી હતી. કોઈની ખરાબ નજરનું તો આ પરિણામ નહીં હોય ને ? એવું મને લાગે છે કે કોઈની ખરેખરમાં ખરાબ નજર જ લાગી છે. એથી જ આ ખાંસી અનેક રીતે મને અને મારા જીવને બેચેન કરી રહી છે.’ આ સાંભળીને લખમીચંદના મનમાં આશ્વર્ય થયું અને બોલ્યા, ‘આ તો મારા જ વિચારોનું પુનરાવર્તન છે.’ બાબાને આની ખબર કેમ કરીને પડી હશે ? બધાના જ હદ્યમાં તેમનો વાસ છે તે વાત તદ્દન સાચી છે. પછી લખમીચંદે બાબાને બે હથ જેડીને વિનંતી કરી કે, ‘આપનાં દર્શનથી ખૂબ જ આનંદ થયો, આવી કૃપા કરીને અમારું સહાયે રક્ષણ કરતા રહેને. મારે તો હવે આપનાં આ ચરણો સિવાય બીજુ કોઈ જગ્યા જ નથી કે નથી કોઈ અન્ય દેવ. આપનાં ચરણોમાં અને આપનાં આ ચરણો સિવાય બીજુ કોઈ જગ્યા જ નથી કે નથી કોઈ અન્ય દેવ. આપનાં ચરણોમાં અને આપનાં જ ભજનોમાં મારું મન સહાને માટે રંગાઈ જાય એવું ઈચ્છણું છું. હે સાઈ સમર્થ ! તમારાં ચરણોમાં મારું મસ્તક ટેકવું છું, તેમજ આપનો આદેશ માંગું છું. અમને અમારા ધરે જવાની આજા આપો. અમારા જેવા અનાથોની આ જ રીતે સંભાળ રાખને. સહાયે રહેમ નજર રાખને, જેથી સંસારમાં અમે દુઃખી થઈએ નહીં. તમારા નામ:સ્મરણાની અમારા મુખેથી વૃદ્ધિ થાય, અને દરેક બાજુથી અમને સમાધાન પ્રાપ્ત થાય.’ આ પ્રકારે આશીર્વાદ સાથે ઉદ્દીપ્રસાદ શ્રી બાબાની પાસેથી મેળવીને તે ભિત્રની સાથે આનંદ પામીને રસ્તામાં સાઈના ગુણગાન ગાતાં ગાતાં લખમીચંદ પોતાના ગામ પાછા ફર્યા. (ઓ. ૮૪-૮૮)

આવી જ એક બીજુ ચકલીને પગે દોરો બાંધીને બાબાએ તેને શિરડીમાં આણી. એ ચકલી એટલે એક પ્રેમાળ બાઈ હતી. એની કથા તો ખૂબ જ આશ્વર્યકારક છે. મધ્યપ્રદેશમાંના બરહાનપુર શહેરની તે વતની હતી. તે દરમ્યાન એક દિવસ તેને સ્વપ્ન આવ્યું. તેમાં તેમણે સાઈબાબાને જેયા. તે પહેલાં તેણે ક્યારેય શ્રી બાબાનાં પ્રત્યક્ષ દર્શન કર્યા ન હતાં. છતાં બાબા તેમના સ્વપ્નમાં આવ્યા અને બારણે ઊભા રહીને ખીચડી આવી છે એવું કહેવા લાગ્યા. બાઈ એકદમ સફાળી જગીને ઉલ્લી થઈ ગઈ, જુએ છે તો ત્યાં કોઈ પણ નથી. પછી તેણે આ સ્વપ્નની વાત બધાને જ લગતગ અદીરાઈથી કહી નાખી. આ બાઈનો પતિ તે જ શહેરમાં ટપાલ ખાતાનો અધિકારી હતો. તે પછી અકોલા ગામે બદલી થતાં તે લોકોએ શિરડી જવાની તૈયારી કરી. આ પતિ-પત્ની ખૂબ જ ભાવિક હતાં. દિવ્યદિશિથી જે જેવા મળેલું તેનું તેમને ખૂબ જ આશ્વર્ય હતું. શ્રી સાઈની આ અજબ લીલા તેમને અલૌકિક લાગી અને તેમના પ્રત્યક્ષ દર્શન કરવા માટે ઉત્સુક થયાં. બધી જ રીતે ફાવે એવો એક દિવસ જેઠાં પતિ પત્ની શિરડી તરફ જવા માટે નીકલ્યાં. રસ્તામાં પવિત્ર ગોદાવરી નદીમાં સ્નાન કરી નમસ્કાર કરી તેઓ શિરડી ધારમાં આવી પહોંચ્યાં. તેમણે પ્રેમથી બાબાના દર્શન કર્યા. અને અતૂટ ભક્તિથી બાબાની પૂજન કરી. પછી દરરોજ બાબાનાં ચરણોની સેવા કરવાનું સુખ પ્રાપ્ત થયું. આમ તે દંપત્તિ આનંદિત મનથી શિરડીમાં બે

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

મહિના રોકાયાં. બાબા પણ તેમના ભક્તિભાવથી અને ખીચડીના બોજનથી સંતુષ્ટ થયા. હકીકિતમાં તે દંપતી બાબાને ખીચડી જમાડવા માટે જ શિરડી આબ્યાં હતાં, પણ ચૌદ દિવસ વિતી ગયા હોવાં હતાં ખીડિનું નૈવેદ્ય ધરાવવાનું રહી ગયું હતું. કરેલા સંકલ્પની પરિપૂર્ણતા ન થતાં અને એમાં લાંબો સમય નીકળી જતાં પેલી બાઇને ગમ્યું નહીં, અને પંદરમાં દિવસે જ બપોરના સમયે એ ખીચડી લઈને મસ્તિષ્ઠદમાં આવી. ત્યાં તેને સમજયું કે, પહ્દા છોડેલા છે અને બાબા પોતાના બધા ભક્તો સાથે અગાઉથી જ જમવા માટે બેઠેલા છે. આવું જ્યારે જમણ ચાલતું હોય ત્યારે તેવા સમયે પહ્દાની અંદર કોઈ જતું નહિ. પણ તે બાઇને ઉતાવળ હતી અને તે કારણથી નીચેના આંગણામાં એ સ્વસ્થ રીતે બેસી શકી નહિ. કેવળ ખીચડીના નૈવેદ્યનો આનંદ લેવા માટે તેમણે અકોલાથી શિરડી સુધીનો ગ્રવાસ ઐડચો હતો. આવા સન્નેગોમાં એની આવી અપૂર્વ ઉત્કંધા ચૂંપચાપ કેવી રીતે રહી શકે? કંઈ પણ નહિ સાંભળતાં પોતાના હાથે પહ્દો ખસેડીને અને કોઈની પણ પરવાનગી કે પરવા કર્યા વગર તેણે અંદર પ્રવેશ કર્યો અને પોતાની ઇચ્છા પૂર્ણ કરી લીધી. બાબાએ આ વખતે કાંઈ અજુગતું જ કર્યું. ખીચડી માટે જ્ઞાણે કે તે એટલા બધા અધીરા થયા હતા કે પહેલા એ જ થાળી માંગવા લાગ્યા અને પોતાના બંને હાથે થાળી પકડી રાખી. તેઓ ખીચડી જેઠિને અત્યંત ખુશ થયા અને એક પછી એક કોળિયો લઈને મોઢામાં મૂકવા લાગ્યા. બાબાની આવી આતુરતા જેઠિને સાથે જ જમવા બેઠા હતા તેઓને ખૂબ નવાઈ લાગી. પણ જ્યારે સર્વેને ખીચડીની આખી કહાણી સાંભળતાં જ સાઈભાબાની અસામાન્યતા બધાના ધ્યાનમાં આવી. (ઓ. ૮૮-૧૧૬)

હવે અહીંથી બીજી કથા ચાલુ થતાં શ્રોતાઓના મનમાં પ્રેમનો ઉભરો આવશે. એક ગુજરાતી ખ્રાણ સાઈભાબાની સેવા કરવા માટે અચ્યાનક શિરડી આબ્યો. શરૂઆતમાં તેણે સ્વ. રાવબહાદુર હરિ વિનાયક સાઠે કે જેઓ ગુજરાતના ઐડા જિલ્લાના પ્રાંત અધિકારી એટલે કે તેખુટી કલેક્ટર હતા. તેમણે શિરડી આવનારા યાત્રાળુઓ માટે લીંબડાના ઝાડની ચારે બાજુથી પહેલો વાડો બાંધ્યો હતો. તેમની ત્યાં નોકરી કરી હતી. તે શુદ્ધ સેવા ચાકરી કરતા હતા, તે દરમિયાન તેમને શ્રી બાબાનો આશ્રય પ્રાપ્ત થયો. તે હકીકિત ખૂબ મધુર છે. જેને ભક્તિ પ્રેમની રૂચિ છે, તેના કોડ અને મનની ઇચ્છા શ્રી હરિ કેવી રીતે પૂર્ણ કરતા હોય છે તે હવે સાંભળો. એ ગુજરાતી ખ્રાણનું નામ મેઘા-મેઘશયામ હતું. સાઈમહારાજ સાથે તેને કંઈક પૂર્વ જન્મનો સ્નેહ સંબંધ હોવો જ જેઠાં, માટે તે શિરડી ક્ષેત્રમાં આવી પહોંચ્યો હોવો જેઠાં. હવે કથા તરફ ધ્યાન આપો. સાઠે સાહેબ ઐડા જિલ્લાના પ્રાંત અધિકારી હોવાને કારણે, અચ્યાનક તેમને મેઘા સાથે ઓળખાણ થઈ. તેમણે મેઘાને તેમના શિવમંહિરની દરરોજની પૂજન માટે નોકરી ઉપર રાખી લીધો. સમય જતાં સાઠે શિરડી આબ્યા અને ભાગ્યનો ઉદ્ઘટ થયો. ત્યાં સાઈમહારાજના સહાવસનો લાભ મળ્યો, અને તેમના ચરણોમાં સાઠેને પૂર્ણ શ્રદ્ધા બેસી ગઈ. બાબાનાં દર્શન માટે આવનારા જનારા યાત્રીકોનો ધસારો જેઠિને તેમના મનમાં પોતાનો એક વાડો બાંધવાનો વિચાર કર્યો. જેથી રહેવા બેસવા ઉઠવાની સગવડ થઈ શકે. આ વિચારે તેમણે ગામના આગળ પડતા કાર્યકરોને ભેગા કરીને વાડા માટેની જગ્યા મેળવી લીધી. બાબા શરૂઆતમાં જે લીંબડાના ઝાડ નીચે પ્રગટ થયા હતા તે સ્થાન વાડા માટે નક્કી કર્યું. આ પવિત્ર જગ્યાના મહિમાનું વર્ણન ચોથા અધ્યાયમાં કર્યું છે. તેથી તેને ફરીથી કહેવાની જરૂર રહેતી નથી. મેઘાનું પૂર્વનું પ્રારંભ ઘણું મોટું હતું, માટે જ રાવબહાદુર સાઠે જેવા સાથે તેનો મેળ પહ્દો અને ત્યારે જ તેના ખાસ પ્રયત્નથી મેઘા પરમાર્થના માર્ગ વાખ્યો. પરિસ્થિતિને વશ થઈને આ મેઘા કર્મભષ થયેલો હતો. સાઠેએ તેને ગાયત્રી મંત્રનો ઉપદેશ કર્યો અને સારા માર્ગ વાખ્યો. મેઘા સાઠેને ત્યાં નોકરીએ લાગ્યો અને ધીરેદીર તે બંનેના એકબીજ ઉપર માન અને પ્રેમ વધ્યા. મેઘા તો સાઠેને ગુરુ જ સમજવા લાગ્યો, અને સાઠેને પણ તેની સાથે એટલી જ માયા થઈ. (ઓ. ૧૧૭-૧૨૮)

એક વખતે સહજ રીતે વાતો કરતાં કરતાં એ પોતાના ગુરુનો મહિમા કહેતી વખતે સાઠેના હદ્યમાં પ્રેમ ઉભરાઈ આબ્યો અને મેઘાને ઉત્સુકતાથી કહ્યું, ‘બાબાને ગંગાનાં ગોદાવરીનાં પાણીથી સ્નાન કરાવવાની મને ઇચ્છા થઈ છે. તે જ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

મુખ્ય કામ માટે હું તને શિરડી મોકલી રહ્યો છું. તે ઉપરાંત તારી બધી સેવા ચાકરીની રીત જોઈને મારા જીવને એમ લાગે છે, કે આ મારા સદ્ગુરુ સાથે તારી પણ સંગત થવી જોઈએ. અને તેમનાં ચરણોમાં તારી ભક્તિ પણ દઢ થવી જોઈએ. જા..... જા.... કાયા, વાચા અને મનથી આ સદ્ગુરુના પગે પડ. તારો આ જન્મ સાર્થક થશે અને આ જન્મમાં તારું પરમ કલ્યાણ જ થશે.' ત્યારે મેધાએ તેમને પૂછ્યું કે સાઈબાબાની જત કઈ? પણ ખરું જેતા સાઠેને પણ તે વિષે વધારે કોઈ જ માહિતી ન હતી. સાઠે બોલ્યા, 'સાઈબાબા તો મસ્નિજદમાં રહે છે. તેમને અમુક લોકો કાન વીધ્યા વગરના મુસલમાન પણ કહે છે.' બસ આ શબ્દ કાન ઉપર પડતા જ મેધાનું મન ડગુમગુ થવા લાગ્યું. તેના મનમાં વિચારો ઉમટ્યા. 'મુસલમાન કરતાં પણ નીચ બીજે કોઈ ગુરુ હોઈ શકે? પણ જો સાઠે સાહેબને ના પાડીશા તો તેઓ ગુરુસે થશે અને હા પાડીશા તો મારી દુર્ગતિ નક્કી.' મેધાને હવે મનમાં ધર્મસંકટ પેદા થયું. શું કરવું તે સમજાતું ન હતું અને વગર કામની ચિંતામાં પડ્યો. તેની તો દશા એક તરફ ઊંડી ઝીણ અને બીજી તરફ તરફ ઊંડા કુવા જેવી થઈ ગઈ. તેનું મન બિલકુલ જ અસ્થિર અને ડોલાયમાન થઈ ગયું. પણ સાઠેનો ખૂબ આગ્રહ હોવાના કારણે એણે શ્રી બાબાનાં દર્શન કરવા માટે નક્કી કર્યું. પછી મેધા શિરડીમાં આવ્યો, અને મસ્નિજદના આંગણામાં આવીને ઊભો રહ્યો. જેવો એ પગથિયાં ચઢવા લાગ્યો, ત્યાં જ બાબાએ પોતાની લીલાઓ શરૂ કરી. ઉગ્ર સ્વરૂપ ધારણ કરી હાથમાં પથ્થર પડીને બૂમ મારી, 'અભરાર! પગથિયા ઉપર ભૂલેચૂકે જો પગ મૂક્યો તો ધ્યાન રાખ. આ જગ્યા તો મુસલમાનોને રહેવાની છે. તું તો એક ઉચ્ચ કોટીનો બ્રાહ્મણ છે અને હું તો એક નીચમાં નીચ એવો મુસલમાન છું. મારો ને તારો મેળ જ ક્યાં થાય? તું અભડાઈ જઈશ જ, તું અહીંથી પાછો ચાત્યો જા!' આવું બાબાનું વિચિત્ર ગુસ્સાવાળું સ્વરૂપ જાણે કે પ્રલયકાળનું ત્રિનેત્ર ભગવાન શંકરનું રૈદ્ર સ્વરૂપહતું. જેનારા તો થરથર કાંપી ઉઠ્યા. મેધા પણ ધૂલ ઉઠ્યો. પણ બાબાશ્રીનો આ ગુસ્સો માત્ર ઉપર ઉપરનો જ હતો. હથ્યમાં તો દ્યાનો સાગર વહેતો હતો. મેધા વિચારેમાં છક્ક થઈ ગયો કે મારા મનના વિચારો બાબાએ જાણુંાં કેવી રીતે? ક્યાં એડા જિલ્લાનો અને ક્યાં આ અહુમનગર પાસેનું શિરડી ગામ. આ બંનેની વચ્ચે માઈલોનું અંતર, મારા મનમાં જે સંશય હતો તેને પ્રગટ કરવા માટે જ બાબાએ કોઈ દર્શાવ્યો છે. બાબા જેમ જેમ મારવા દોડતા હતા, તેમ તેમ મેધાનું ધૈર્ય ખચ્છકાતું હતું. તે એક ડગલું પાછળ ખસવા માંડ્યો અને આગળ વધવાની તો વાત જ ક્યાં? ત્યારબાદ આમને આમ જ થોડા વધારે દિવસો શિરડી મુકામે રોકાયો. બાબાના રાગરંગ જોયા અને બને તેટલી તેમની સેવા ચાકરી કરવા લાગ્યો. પણ દઢ વિશ્વાસ બેઠો નહીં. ત્યાંથી તે પોતાને ઘેર પાછો વખ્યો. ત્યાં એ તાવમાં સપદાયો, પીડાયો અને પથારીવશ થઈ ગયો. પણ બાબાની એક સરખી યાદ તેને આવવા માંડી અને ફરી પાછો શિરડી આવ્યો. (ઓ. ૧૨૮-૧૪૫)

આમ મેધો શિરડીમાં પાછો આવ્યો અને ત્યાં જ કાયમ માટે રહી ગયો. તેનો સાઈબાબાનાં ચરણમાં પ્રેમભાવ દ્રઢ થયો. સાઈનો તે અનન્ય ભક્ત બન્યો. બાબા જ તેને માટે દેવસ્વરૂપ થયા. મેધો પહેલેથી જ ભગવાન શંકરનો ઉપાસક હતો. સાઈનાં ચરણમાં આસકત થયાં બાબાને જ ભગવાન શંકર માનવા લાગ્યો. બાબા જ તેના ઉમાનાથ થયા. મેધો રતદિવસ મુખેથી 'સાઈશંકર'નો ધોષ કરતો હતો. તેની અંત: કરણની પ્રવૃત્તિઓ પણ સાઈશંકર સ્વરૂપમાં સંપૂર્ણપણે એકરૂપ થઈ અને ચિત્ત એકદમ નિર્મળ અને પાપરહિત થઈ ગયું. મેધો હવે સાઈનો અનન્ય ભક્ત બની ગયો હતો. શ્રી બાબા પ્રત્યક્ષ શંકર ભગવાન જ છે. એવી બાવના તેના મનમાં પાકી થઈ ગઈ હતી. તે હંમેશા 'શંકર....શંકર' એવું જ મુખથી બોલ્યા કરતો હતો. બીજા કોઈ દેવહેલીઓમાં તે માનતો નહીં. સાઈની પૂજા તે જ તેના માટે બધા જ દેવોની પૂજા બરોબર હતી. સાઈ જ એના ગિરિજલરમણ હતા. આ જ વિચાર મનમાં પાકો કરીને મેધો સદાને માટે પ્રસાદ ચિત્ત રહેતો. ભગવાન શ્રી શંકરને બીલીપત્ર ખૂબ જ ગમે છે. શિરડીમાં એક પણ બીલીનું વૃક્ષ ન હતું. માટે મેધો બીલીપત્ર લાવવા માટે કોસ, દોઢ કોસ ચાલીને જતો અને તે લઈ આવતો. દોઢ કોસ એટલે કે ત્રણ કિ.મી. ચાલવાની તેને કોઈ પરવા ન હતી.

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

બીલીપત્ર માટે તો મેધો પર્વત પણ પાર કરી ગયો હોત. પણ પોતાના પૂજના કોડ અને મનની હોંશ તેને જરૂરથી પૂરી કરી હોત. ખૂબ દૂરદૂર સુધી પગપણો તે બીલીપત્ર લેગા કરવા જતો, અને પૂજની બધી સામગ્રી એક થાળમાં લઈને બધા ગ્રામદેવતાઓના મંદિરે નક્કી કકરેલ સમય મુજબ વિધિપૂર્વક પૂજન કરી ચઢાવતો. પછી તરત જ મસ્જિદમાં જતો અને પ્રેમપૂર્વક બાબાની ગાદીને નમસ્કાર કરતો, બાબાનાં ચરણની સેવા કરતો, ચરણો ઉપર અભિષેક કરી ચરણતીર્થનું આચમન કરતો. એવો એનો નિત્યક્રમ હતો. (ઓ. ૧૪૬-૧૫૪)

મેધાની બીજી એક કથા સાંભળતા શ્રોતાઓના મનને આનંદ મળશે. તેમજ સાઈબાબાનો ગ્રામદેવતા માટેનો આદરભાવ અને વ્યાપકતા વિશેની ભાવના સમજશરો. મેધા શિરડીમાં ઈ.સ. ૧૯૧૨માં તેના મૃત્યુ સુધી રહ્યો ત્યાં સુધી દરરોજ બપોરની આરતી કરતો હતો. પણ પહેલાં ગામનાં સમસ્ત મંદિરોમાં બિરાજેલા સર્વ દેવો જેવા કે ખંડોબા, ગણપતિ, શાનિ, શંકર, પાર્વતી, મારુતિ, લક્ષ્મીમાતા વગેરેની પૂજન કરીને જ તે મસ્જિદમાં જતો. આવો એક નિત્યક્રમ તે એક દિવસ ચૂક્યો. પ્રયત્ન કરવા છતાં ખંડોબાની પૂજન બાકી રહી ગઈ. પૂજન કરવાના અનેકો પ્રયત્નો કર્યા, ખટપટ કોશિષ કરી છતાં દરવાજા ઉધાડ્યા નહિ. કારણ કે તે સમયેચંદ્ર બેઠેલા ઉપાસની મહારાજે તે અંદરથી બંધ કરી દીધા હતા માટે ખંડોબાની પૂજન આમ જ છોડીને મેધો આરતી લઈને મસ્જિદમાં આવ્યો. ત્યારે બાબાએ તેને કહ્યું ‘આજે તેં પૂજનમાં ખાડો પાડ્યો. બંધ દેવોને પૂજન પહોંચી પણ એક દેવ પૂજન વગરના જ રહ્યા છે. જ એ કરીને ફરી પાછો આવ.’ મેધાએ બાબાને કહ્યું, ‘દરવાજા બંધ હતા, ઉધાડતાં ફાવે એવું ન હતું માટે પૂજનમાં આવો ખાડો પડ્યો.’ આ સાંભળતા બાબા બોલ્યા, ‘જ તું જે ! હવે દરવાજા ખુલ્લા છે.’ મેધો તરત જ એકપણ ક્ષાણનો વિલંબ કર્યા વગર ગયો, અને ખરેખર બાબાના શબ્દોનો તેને અનુભવ થયો કે દરવાજે ખુલ્લો હતો. મેધાએ ખંડોબાની પૂજન કરી અને તેના મનની અસ્વસ્થતા પણ દૂર થઈ. ખંડોબાની પૂજન થયા પછી જ બબાએ પોતાની પૂજન મેધાને કરવા દીધી. મેધો સંપૂર્ણ પૂજન સામગ્રીથી અને આદરપૂર્વક બાબાની પૂજન કરતો અને યથાશક્તિ દક્ષિણા આપીને હાર અને ફળ અર્પણ કરતો હતો. (ઓ. ૧૫૫-૧૬૩)

એક વખત મકરસંકરિના દિવસે ગોદાવરી નદીનું પાણી લઈ આવીને બાબાને તેલ, ગંધ અને ચંદ્નનો લેપ લકરીને તેમને સ્નાન કરાવવું એવું મેધાના મનમાં આવ્યું. પોતાને મનની તે માનતા પૂરી કરવા માટે તે બાબાની આજા લેવા માટે તેમનો પીછો કરતાં ‘તારા મનમાં ફાવે તેવું કર’ એવું બાબા બોલ્યા તેથી મેધો પાણી ભરવાના મોટા તાંબાના દેગડા લઈને નીકળ્યો. સૂર્યોદય થતાં પહેલાં જ મેધો હાથમાં આલી દેગડા લઈને અને ભડભડતા તકડાથી બચાવે તેવાં કોઈ પણ સાધન વગર તે પગમાં વગર જેઠે પાણી લાવવા માટે ગોદાવરી નદી તરફ જવા માટે નીકળી પડ્યો. આવવા જવાના મળીને આઠ કોસ એટલે કે પચીસ કોસ રસ્તો કાપવો પડશે, ખૂબ કષ્ટ અને મહેનત પડશે એ વિશે તેણે સ્વઘનામાંય વિચાર કર્યો જ ન હતો. આ બાબતની તો ચિંતા તેને જરા પણ ન હતી. આજા મળતાં જ તે નીકળી પડ્યો. દીરાદો પાકો હોય તો કામ કરવામાં પણ ઉત્સાહ એટલો જ રહે છે. ગંગાના ગોદાવરીના પાણીથી સાઈનાથને સ્નાન કરાવવું એટલું જ તેના મનમાં હતું. પછી તેને ત્રાસ કેવો અને થાક કેવો ? દઢ મનોભળ જ કાર્ય સિદ્ધિ માટેનો આધાર હોય છે. આ પ્રકારે મેધો એ પાણી લાવ્યો અને તાંબાના બીજી દેગડા ભર્યા. બાબા પાસે જઈને મેધાએ સ્નાન માટે આવવા આગ્રહ કર્યો. પણ બાબાએ જરા પણ ધ્યાન આપ્યું નહિ. પછી બપોરની મધ્યાન આરતી થઈ. ભક્ત મંડળી પોતપોતાના ઘર તરફ જવા માટે નીકળી ગઈ. લાગ જેઠિને મેધો બોલ્યો, ‘બાબા ! બપોર થઈ ગઈ છે અને સ્નાન માટેની બધી જ તૈયારી થઈ ગઈ છે.’ આવો મેધાનો અતિ આગ્રહ જેઠિને લીલા અને ઝીડા કરવા માટેનો દેહ ધારણ કરનારા સાઈએ મેધાનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, ‘નહિ જેઠિએ મહારે ગંગા સ્નાન, મૂર્ખ આવો તું કેવો નાદાન ! મારા જેવા ફીરિને વળીં ગંગાનું પાણી શા માટે ? મને એનો શું ઉપયોગ ? પણ મેધો તો કંઈ પણ વાત માનવાને તૈયાર હતો નહિ. બાબાને તો એ સાક્ષાત્ ભગવાન શંકર જ માનતો

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

અને ગંગા સ્નાનનો શંકર ભગવાનને હરખ હતો. બસ તે એટલું જ જણાતો હતો. મેધાએ બાબાને કહ્યું આજના આ મકરસંકાતિના પવિત્ર દિવસે ભગવાન શંકરને ગંગાના જળ વડે સ્નાન કરાવવાથી તેઓ પ્રસન્ન થાય છે.' પછી તેનો પ્રેમ, અને શુદ્ધ મન અને અટલ વિશ્વાસ જેઠિને બાબા બોલ્યા, 'સાંદું, તો તારી ઈચ્છાને પુરી થવા હે.' એવું કહીને બાબા ઉઠ્યા અને સ્નાન માટે તૈયાર કરેલ પાટલા ઉપર જઈને બેસી ગયા તથા મેધા સામે મસ્તક ધરીને બોલ્યા, 'આની ઉપર થોડું પાણી રેડ. બધાં અંગોમાં માથું પ્રમુખ હોય છે. એના ઉપર થોડું પાણી છાંટ જેથી કરીને પૂર્ણસ્નાન કર્યા જેવું થશે. આટલું તો તું માંદું સાંભળ !' મેધાએ સાંદું કહીને પાણીનો ભરેલો દેગડો ઉંચક્યો અને બાબાના મસ્તક ઉપર રેડતાં રેડતાં તેને એટલો બધો પ્રેમ ઉલ્લાસ આચ્યો કે, 'હર.... હર.... ગંગે' બોલતા તેણે તે બાબાના શરીર પર આઓ જ ખાલી કરી નાંખ્યો. મેધાના આનંદનો પાર ન રહ્યો કે મેં મારા શંકરને વખ્તો સાથે નવડાવ્યાં. પછી મેધાએ ખાલી થયેલો દેગડો નીચે મૂક્યો અને બાબા સામે નજર કરતાં જ તેને ચમત્કાર દેખાયો. એણે તો મસ્તક સાથે આખા શરીર પર પણ પાણી રેડયું હતું, છતાં બાબાનું તો ફક્ત મસ્તક જ ભીનું હતું અને બાકીનું શરીર અને અવયવો વખ્ત સાથે બિલકુલ કોરાકટ હતાં. તેમણે પહેલેલાં વખ્તોમાં પાણીનું ટીપુ પણ ન હતું. મેધાનું અભિમાન પીગળી ગયું અને પાસે ઉલ્લેખ લોકો પણ આશ્રયમાં ગરકાવ થઈ ગયા. આ પ્રકારે શ્રી સાઈમહારાજ ભક્તોના લાડકોડ બધી જ રીતે પૂરા કરતાં. 'તારા મનમાં નવડાવવાની ઈચ્છા હોય તો કરાવ, પણ તેમાં મારા ગુપ્ત રહસ્યનો આણસાર તને સહેલાઈથી સમજશે એટલું તું ધ્યાનમાં રાખજો. આમ કહેવાનું કારણ એ હતું કે મેધાને અભિમાન થયું હતું કે, બાબાની વિરુદ્ધ મેં એમને આખા શરીર ઉપર પાણી રેડીને નવડાવ્યા. પણ બાબાએ તેને ચમત્કાર બતાવ્યો. પોતાનું માથું જ એકલું ભીનું રહેવા દીધું અને જણે કે તેને સમજવી દીધું કે તેમની પોતાની ઈચ્છા વિરુદ્ધ કોઈ કાંઈપણ કરી શકતું નથી. તેવી જ રીતે મેધાએ રેલા પાણીને માથા ઉપર જ રોકી રાખી પોતે બાબાએ મેધાને પ્રતીતિ કરાવી આપી કે તે જણે સ્વર્ગમાથી નીચે ઉત્તરનારી ગંગાને પોતાની જટામાં સમાવી લેનારા સાક્ષાત્ ભગવાન શંકર જ છે. આ જ સાઈની ભક્તિનું તત્ત્વ અને સાર. સદ્ભાગ્યે માત્ર એ ભક્તિનો સમાગમ થવો જેઠાં, પછી એ ભક્ત માટે કાંઈ પણ પ્રાપ્ત કરવું અશક્ય નથી. ક્રમે ક્રમે બધું જ મેળવવું સહેલું બની જય છે. બેસતાં ઉઠતાં, વાતો કરતાં, સવારે, બપોરે, આમ તેમ ફરતાં ભક્તો જે શ્રદ્ધા અને સબુરી મનમાં ધરશે તો સાછ ચોક્કસ જ તે ભક્તના મનોરથો પૂર્ણ પાર પાડે છે. તેઓ વ્યવહારમાં આવો આણસાર આપીને ક્રમેક્રમે તેમની પ્રીતિ લગાડીને સાછ ભક્તોને પરમાર્થનો બોધ તો અવશ્ય આપતા હતા. (ઓ. ૧૬૪-૧૮૬)

આવી જ મેધાની અનેક કથાઓ સાંભળીને શ્રોતાઓને આનંદ આવશે અને એમાંથી સાઈના ભક્ત પ્રત્યેનો પ્રેમ જેઠિને તેમના મનમાં સુખનો અનુભવ થશે. નાનાસાહેબ ચાંદોરકરે મેધાને બાબાની એક મોટી નવી છબી આપી હતી. સાહેના વાડામાં પોતાની ઓરડીમાં મૂકીને તેની પણ તે ભક્તિપૂર્વક પૂજન કરતો હતો. મસ્નિદ્રમાં પ્રત્યક્ષ મૂર્તિ અને વાડામાં તેમનું આબેહૂબ ચિત્ર, બંને ઢેકાણે પૂજન અને આરતી રાત અને દિવસ ચાલુ જ રહેતી. આવી નિઃસ્વાર્થ સેવા કરતાં કરતાં આરામથી એક વર્ષ પૂરું થઈ ગયું. અને એક દિવસે મેધાને વહેલી સવારે જગૃત અવસ્થામાં પ્રત્યક્ષ એક અનુભવ થયો. બિછાનામાં મેધા ભલે આંખો બંધ કરીને પહુંચો હતો છતાં પણ મનથી તે સંપૂર્ણ સ્વસ્થ અને જગૃત હતો. આવા સમયે બાબાની સ્પષ્ટ આકૃતિ તેને દેખાઈ. બાબાએ પણ એ જગેલો છે, એ જેઠિને એની પથારી ઉપર ચોખાના દાણા નાખીને, 'મેધા, ભીત ઉપર શંકરના ત્રિશૂલનું ચિત્ર કાઢ' એવું કહીને બાબા ત્યાંથી અલોપ થઈ ગયા. બાબાના શબ્દો મેધાના કાને પડતાં જ મેધાએ અતિ આનંદથી આંખો ઉધાડી. પણ બાબા અદશ્ય થયેલા જેઠિને તેને નવાઈ લાગી. પછી મેધાએ જેયું તો બિછાના ઉપર જયાં ત્યાં ચોખાના દાણા વેરાપેલા હતા. અને વાડાનો મુખ્ય દરવાજે સહંતર બંધ હતો. મેધાના મનમાં મોટો એક પ્રશ્ન ઉભો થયો. તરત જ તે મસ્નિદ્રમાં ગયો અને બાબાનું દર્શન કરતાં તેણે ત્રિશૂલની વાત કહી અને ભીત

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ઉપર ચિત્રવાની આજી માંગી લીધી. મેધાએ જ્યારે પોતાનો અનુભવ વર્ણવ્યો ત્યારે બાબા બોલ્યા, ‘દષ્ટાંત કેવું ? મારા શબ્દો નહિ સાંભળ્યા ? દોરી જે એ ત્રિશૂલ ભીત ઉપર. દષ્ટાંત સમજુને મારા શબ્દો ખોટા છે કે ભરાતે કરવા જાય છે. મારા શબ્દોનો અર્થ ખૂબ જ ઊંડો હોય છે. એમાંનો એક અક્ષર વ્યર્થ નથી હોતો.’ મેધા બોલ્યો, ‘તમે મને જગાડ્યો એવું મને પહેલા લાગ્યું. પરંતુ એક પણ દરવાજે ઉઘાડો હતો નહિ, માટે મારી આવી ગેરસમજ થઈ.’ એ સાંભળીને બાબાએ જવાબ આપ્યો, ‘મને પ્રવેશવા દરવાજની જરૂર રહેતી નથી. મને આકાર નથી કે ઝૂપ નથી, વિસ્તાર નથી અને કયાંય જવું આવવું પણ પડતું નથી. હું સદ્ય સર્વ ડેકાણે વસતો હોઉં છું.’ મારી ઉપર બધો ભાર મૂકીને જે ખરેખર મારી સાથે એકરૂપ થયેલો હશે. અને મારું સતત ચિંતન કરતો હશે તેના સર્વ શરીરના કારબારનો હું સૂત્રધાર છું અને હું જ તને ચલાવતો હોઉં છું. ત્રિશૂલ દોરાવવા માટેનો બાબાનો હેતુ કેટલો કૌશલ્યપૂર્ણ અને આશ્ર્યકારક હતો. તે હવે, કાળજીપૂર્વક સાંભળો એટલે તેના સંબંધે અવશ્ય ખાત્રી થશે. (ઓ. ૧૮૭-૨૦૧)

અહીંયા મેધો જેવો વાડામાં પાછો આવ્યો કે તરત જ તેણે ત્રિશૂલ ચીતરવાની શરૂઆત કરી. ભીત ઉપરની બાબાની છબી પાસે લાલ રંગથી ત્રિશૂલની આકૃતિ દોરી. બીજી દિવસે મસ્નિદ્વારમાં એક રામદાસી પંથનો બાબાનો ભક્ત પૂનથી આવ્યો અને બાબાને નમસ્કાર કરીને તેણે એક શંકરનું લિંગ બાબાને અર્પણ કર્યું. એટલામાં જ મેધો પણ ત્યાં આવ્યો અને તેણે બાબાને દંડવત્ પ્રણામ કર્યા. ત્યાં બાબાએ તેને કહ્યું, ‘આ તારા શંકર આવ્યા, હવે તું તેમને સંભાળ.’ આમ ત્રિશૂલના દષ્ટાંતની સાથે સાથે જ ભગવાન શંકરનું લિંગ પણ પ્રાપ્ત થતાં મેધો ચકિત થઈ ગયો અને ફૂતુહલથી તે લિંગ જેતો રહ્યો. આવો અદ્ભુત અનુભવ થતાં તેનો કંઠ ભરાઈ આવ્યો. આવો જ લિંગનો ભીજે એક અપૂર્વ અનુભવ કાકાસાહેબ દીક્ષિતને થયો. તે વાતને પણ શ્રોતાઓ આદરપૂર્વક સાંભળો. જેથી સાઈચરણમાં તમારી શ્રદ્ધા દઢ થશે. અહીંયાની લિંગ જેઠિને જેવો મસ્નિદ્વારમાંથી મેધા નીકળ્યો, ત્યારે ત્યાં વાડામાં કાકાસાહેબ દીક્ષિત નાહી ધોઈને નામઃસ્મરણમાં ભન્ન હતા. ધોયેલાં વસ્ત્રોથી પોતાનું શરીર લૂછીને એક શિલા ઉપર ઊભા રહીને માથા ઉપર દુવાલ લપેટીને સાઈબાબાનું સ્મરણ કરતા હતા. દરરોજજના નિયમ પ્રમાણે માથું ઢાંકીને નામઃસ્મરણ કરતી વખતે તેમને લિંગના દર્શન થયાં. નામઃસ્મરણ ચાલુ હતું એ અરસામાં આજે જ આમ લિંગ દર્શન શા માટે થયું હશે એનું તેમને આશ્ર્ય થતું હતું. તે સમયે આનંદિત અને સમાધાન યુક્ત ચહેરામાં તેમણે મેધાને ઊભો રહેલો જેયો. મેધો બોલ્યો, ‘જુઓ કાકા ! બાબાએ મને આ શિવલિંગ આખ્યું છે !’ કાકાસાહેબને એ લિંગની વિરોધતા જેઠિને આશ્ર્યની સાથે સાથે ઘણો આનંદ પણ થયો. એક ક્ષણ પહેલાં જે ઝૂપ, આકાર અને અણસાર ધ્યાનમાં આવ્યો હતો, એવું જ લિંગ નજરે જેઠિને મનમાં ખૂબ જ આનંદ થયો. દીક્ષિત સાઈબાબાનું નામઃસ્મરણ કરતા હતા, પણ તેમને દર્શન થયાં. શિવલિંગના તેથી બાબાએ એ જ ભગવાન શંકર છે એવી પ્રતીતિ મેધાને કરાવી તેવી જ ફીરીથી કાકાસાહેબને પણ કરાવી કે નહિ ? આમ આ પ્રકારે ત્રિશૂલની આકૃતિ ભીત ઉપર ચિત્રાવિને પોતાના છબીની બાજુમાં જ તે શિવલિંગની સ્થાપના બાબાએ કરાવી. મેધો શંકરનો જ ઉપાસક હતો, માટે તેને ભગવાન શંકરનું શિવલિંગ આપીને તેની શિવભક્તિ બાબાએ પાડી કરી આપી. ખરેખર શ્રી સાઈનું કૌશલ્ય અદ્ભૂત લાગે છે. (ઓ. ૨૦૨-૨૧૪)

આવી તો કેટલીય કહી શકાય તેવી બાબાની કથાઓ છે ! જે અગણિત છે. પણ ગ્રંથનું લંબાણ વધી ન જાય માટે શ્રોતાઓએ ક્ષમા કરવી. હજુ પણ તમે તે કથાને સાંભળવા ઉત્સુક છો માટે એક બીજું કથન કરીશ. આગલા અધ્યાયમાં સાઈબાબાની લીલાનાં વખાણ આ કરતાં પણ અલૌકિક રીતે જ જેવા મળશે. હેમાડપંત બાબાને શરણે આવીને તેમનું ચરિત્ર શ્રોતાઓને કહી રહ્યા છે. તેથી બધાને સંસારનો ભય દૂર થશે અને આવી પડેલા સંકટોનું નિવારણ પણ થશે. (ઓ. ૨૧૫-૨૧૭)

---

### શ્રી સાઈનું સત્ય ચરિત્ર

---

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રમાણે સંત અને સજજનોની પ્રેરણા પામેલા ભક્ત હેમાડપંત રચિત  
શ્રી સાઈસમર્થના સત્ય ચરિત્રનું 'દષ્ટાંત-કથનમ' નામનો અઠચાવીસમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે.

શ્રી સદગુરુ સાઈનાથને અર્પણ થાગો.



### અધ્યાય ૨૮નું અર્થ વિવરણ.

કે. હ. બ. પ. દાસગણુ મહારાજે પોતાના ભક્તિસારામૃતમાં પદમાં અધ્યાયમાં મેધાનું ખરેખર આબેહૂબ યથાસ્થિત વર્ણન કરેલું છે.

અધ્યાય માથા ઉપર મોટી જટા રહેતી | બાંધો ઊંચો મજબૂત ખૂબ |  
બોલે શિવહરના નારા | આઠે પ્રહર જેના ॥૭૧॥  
આ મેધો વ્યક્તિયારી | કર્મયોગની પ્રીતિ મારી |  
આપ્યો સાઠેની સાથે | શિરડી ક્ષેત્રે એ કારણે ॥૭૨॥  
દરરોજ વહેલી સવારે સ્નના કરે | ઠંડા પાણી વહે |  
શરીર ભસ્મ લગાવી | મૃગ ચર્મ પર તે બેસે ॥૭૩॥  
કપાળે કરે આંદું ત્રિપુંડ | ચંદન કપાળે લગાવીને મેધો |  
લાગે બીજે જલંધરનાથ જ | તપોબળ એના શરીરનું ભાસે ॥૭૪॥

ખરેખરમાં તે મેધાની તપશ્વર્યા અલૌકિક અને વખાણ કરવા જેવી હતી. કહેવાય છે કે તે બાબાની આરતી એક પગ ઉપર ઊભો રહીને કરતો હતો. ચોક્કસ બાબાની સાથે એનું ઋણાનુંબંધ હોવું જ જેઠાએ. નહિ તો કર્મભ્રષ્ટ થયેલા ને સ્વ. રાવખણાદુર સાઠે શિરડી ખેંચી લાવ્યા. યેનકેન પ્રકારે શ્રી બાબા પોતે એકમેવ દેવ સાક્ષાત् શંકર જ છે એવું તેના મનમાં ઉતાર્યું. તથા એની ભક્તિથી અને તેની તપશ્વર્યથી પ્રસન્ન થઈને શિરડીમાં પોતાની પાસે જ રાખીને તેનું મૃત્યુ થતાં બાબા પોત સ્મરણનયાત્રામાં હાજર રહીને અને તેના દેહ ઉપર ફૂલ ચઢાવીને બાબાએ એને સહગતિ આપી હતી. મેધો ખરેખર જ ભાગ્યવાન હતો. તેનું તકદીર એવું કે જે એના માલિક રાવખણાદુર સાઠેને ના મળ્યું તે મેધાને મળ્યું. સાઠેને બાબાના આશીર્વાદથી પાછલી ઉમરે પુત્રનો જન્મ થયો, અને પેન્શન પણ વધી ગયું. પણ પરમાર્થની પ્રગતિ એવી ને એવી જ રહી. બાબાએ પોતાના તરફથી તેમની કામવાસના કાખૂમાં કરવા સાઠે એક ખરાબ ચા લચલગત વાળી સ્વીના ઘરે જઈને

---

### શ્રી સાઈનું સત્ય ચિહ્ન

---

એકાંતમાં કંઈ અનૈતિક આચરણ કરવાના વિચારમાં હતા તે વખતે બાબાએ અચાનક પ્રગટ થઈને એમને રોકી લીધેલા. (C and S 206) તેમજ એમના કોઈને કાબૂમાં કરવા માટે સાઠે કોઈ કારણોસર ગુરુસામાં પોતાની પત્નીને ચાંબકા મારવાની તૈયારીમાં હતા (C and S 547) બાબાએ બરાબર તે જ ક્ષાળે તેમને બોલાવવા માટે મેદાને મોકલીને એક ખરાબ પળને ટાળવા પ્રયત્ન કર્યો હતો. પણ સાઠે સુધ્યાં ન હતા. તે કારણે આ પ્રકારે હતા કે સાઠેના મનમાં પોતાની મોટાઈનો અહંકાર હતો. તેમને શિરડી ગામના માણસો સાથે તેમજ બાબા સાથે અને ત્યારબાદ મુંબઈથી આવેલા ચાંદોરકર, દીક્ષિત જેવા સુશિક્ષિત અને મોટા ભક્તોની સાથે વધારે ફાવતું ન હતું એવું લાગે છે. ઠ.સ. ૧૯૧૮ની શરૂઆતમાં બાબાની હૃદાતીમાં જ તેઓ શિરડી છોડીને પૂના પોતાના ગામ ગયા તે પાછા આવ્યા જ નહીં. મેદાએ પોતાનું આયુષ્ય સાર્થક કર્યું. આ વાત ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે ગુરુની ફૂપા હોય તો પણ સાધકે પોતાનું કલ્યાણ પોતે જ સાધી લેવું પડે છે. ગુરુ તો ફક્ત માર્ગદર્શન કરે છે અને શિષ્યને સાધના માટે રસ્તો બતાવે છે. બાબાએ જાતે નથી કહ્યું કે :-

તમો કષ્ટ વેઠવા લાગો । દૂધની કાળજી સર્વ છોડો ।  
વાડકી લઈ હું છું ઊભો । તમારી જ પાછળ નક્કી ॥  
હું કષ્ટ વેઠું એવું કહો । દૂધનો ઘાલો તમે ખાતવો ।  
એવું તો હું નથી જાણતો । કાર્યર્થી સદા સાવધ રહો ॥

અધ્યાય - ૧૯



## ॥ અધ્યાય ૨૯ ॥

### સ્વર્ણ, કથા, કથનં

(શિરડીમાં મદ્રાસી ગૃહસ્થને, મુંબઈમાં તેંડુલકરના પત્નીને અને ગ્વાલિયરમાં ડૉક્ટર કેઝન હાટેને  
બાબાએ સ્વર્ણમાં સાક્ષાત્કાર કરાવ્યો તે કથા.)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળદેવતાને વંદન,  
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

પાછલા અધ્યાયમાં જે કથન કર્યું છે, તેનાં કરતાં પણ વધારે આ અધ્યાયમાં શ્રી સાઈબાબાની કલ્પાનું કૌશલ્ય હું કહી રહ્યો છું. કથાનો સાર પાછળના અધ્યાયની માફક જ છે. ઠ.સ. ૧૯૧૬ની સાતમાં બાબાની અગાધ લીલાઓ સાંભળીને તે વર્ણે અનેક ભજનિકોનો સંઘ શિરડીમાં બાબાનાં દર્શન માટે આવ્યો. આ બધાં મંડળના સભ્યો જ્યાં ત્યાં આ રીતે ધાર્મિક પ્રવાસ કરતા હતા. તેમણે મદ્રદેશ-મદ્રાસ, તામિલનાડુમાં બાબાની કીર્તિ ખૂબ સાંભળી હતી, અને તે સૌ કાશીની જત્રાએ જતી વખતે બાબાની કીર્તિ ખૂબ સાંભળી હતી, અને તે સૌ કાશીની જત્રાએ જતી વખતે બાબાની કીર્તિ સાંભળીને રસ્તામાં શિરડી મુકામે રોકાયા હતા. શ્રી બાબા ! ધીર, ઉદ્ઘાર અને દાનવીર એવા મહાન સંત હતા. યાત્રાળુઓ પર કૃપાવંત થઈને તેઓ ખૂબ જ પૈસા વહેંચતા હતા. તેઓ દોઢ પાવલી એટલે કે આજના લગભગ આડત્રીસ નવા પૈસા સરળતાપૂર્વક આપતા કિંમતનું નાણું. ૪ પૈસા=૧ આનો અને ૧૬ આના=૧ ઇપિયો એકદમ સહેલાઈથી હાથના મેલની અને અધેલો અને પાવલી એટલે ચાર કે આઠ આના, એટલે આજના ૨૫ અને ૫૦ પૈસાનો વરસાદ વરસાવતા હતા. એટલે ઘણું જ વહેંચતા હતા. બાબા કોઈને દસ, વીસ તો કોઈને વળી પચાસ ઇપિયા પણ આપતા હતા. એ સિવાય કોઈ તહેવાર કે ઉત્સવના દિવસે અથવા કોઈ વિશેષ કાર્ય હોય ત્યારે અને સારો સમય હોય કે ન હોય તેમ છતાં દરરોજ ઉપર જણાવ્યા પ્રમાણે ખૂબ ખુશીથી તેઓ પૈસા વહેંચતા. તમાશો કરનારા બજાઝિયા અને ભવાઈ કરવાવાળાઓ પણ આવતા અને નાચગાન કરતા હતા. ગવૈયા ગાવા માટે આવતા, ભાટ ચારણ સ્તુતિ કરતા હતા. મુજરા થતા, હરિભક્ત ભજન કરવામાં રંગાઈ જતા હતા. મહારાજની આવી ઉદ્ઘારવૃત્તિ અને દાનધર્મ કરવાની છૂટા હાથની કીર્તિ કાનોકાન સાંભળીને આ લોકોમાં દર્શનની ઈચ્છા રાખીને આવતા હતા. કયારેક મનમાં આવતા બાબા પ્રવાસીઓને પણ પૈસા વહેંચતા હતા. સાઈનાથ દયાની મૂર્તિ હતા. તેમજ તેમને મદદ પણ કરતાં. એક પુરુષ, પણ ક્રીઓ કે જે પુરુષ પોતે, તેની પત્ની તથા ભાણીઓ અને દીકરી આમ ચાર જણાનો શંભુમેળો સંત દર્શનાર્થે ઉત્સુકતાથી આવ્યો. શ્રી બાબાનું દર્શન કરીને આ લોકોને ખૂબ જ સંતોષ અને સમાધાન થયું. તેઓ નિયમ પ્રમાણે બાબા સામે પ્રેમથી ભજન કરવા લાગ્યા. તેમનો સંપ્રદાય પણ રામદાસી હતો. તેઓ અત્યંત ઉત્સાહથી ભજનો ગાતાં અને બાબા પણ મનમાં આવે એવી રીતે, ઇપિયો આઠાણા તેમને આપી હેતા. કયારેક બરફી ખવડાવતા તો કયારેક ખાલી હાથે પાછા મોકલી આપતા હતા. બાબાની તો આ કાયમની રીત હતી. પણ નક્કી કાંઈ પણ નહીં. પૈસા વહેંચતા હતા એ તદ્દન સાચું છે. તેમાં જરા પણ શક નથી. પરંતુ પૈસા તેઓ બધાને જ આપતા હતા એવું પણ ન હતું. તેમના મનનો કોઈને જ અંદાજ આવતો ન હતો. ફકીરો, ફોગાઠિયાઓ, બિખારીઓ, બાબાના દરવાજે હુંમેશા જ આવતા હતા. બાબા ભલે દયાળુ હતા પણ દાનધર્મ બધાને કરતા

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

નહીં. જેની શુભ ઘડી આવી હોય તેને જ આવી સંતોની સ્પર્શોલી ભાગ્યવાન વસ્તુઓ કે પૈસા મળતા હોય છે. આ વિષયને લગતી એક વાતને સાંભળીને શ્રોતાઓ સંતુષ્ટ થશે. તે તેમની સમક્ષ મૂકીને પછી આપણે આગળની વાટ પકડીશું. (ઓ. ૧-૧૭)

પ્રાતઃકાળની દૈનિક કિયા પતાવીને બાબા જ્યારે મસ્જિદમાં ધૂણી પાસે થાંભલાને ટેકવીને બાજુમાં બેસતા હતા ત્યારે ‘અમની’ કે જે કોંડાળ નામના ભક્તની છોકરી હતી તે ત્યાં આવતી. ત્રણ વર્ષની ખુલ્લા શરીરે હાથમાં જુન્તાનની ગોળીઓની ખુલ્લી ડબ્બી હાથમાં લઈને ફાવે તે સમયે દોડી દોડી આવી જતી. અમની બાબાના ઘોળામાં બેસતી અને ડબ્બી બાબાના હાથમાં આપીને, હાથ ધરીને, ‘બાબા ઇન્દ્રિયો.... ઇન્દ્રિયો એમ બોલતી’ આમ તો બાબાને નાનાં બાળકો ઘણાં જ વહાલાં હતાં. અને આ અમની પણ ગોળમટોળ અને સુંદર દેખાવડી હતી. બાબા તેને વહાલ કરતા, લાડ લડાવતા, ગાંઠે ઝીણી ઝીણી ચુંટલી ભરતા અને પેટથી પકડીને અદ્ધર કરતા. પણ આ અમનીનું ચિત્ત ઇન્દ્રિયા તરફ જ રહેતું. બાબાના બિસ્સા તરફ જેઠિને તે બોલતી, ‘બાબા આપને મને આપને’ અમનીનો તો બાળ સ્વભાવ પરંતુ ઉંમરમાં મોટાઓને પણ પૈસાનો એટલો જ લોભ હોય છે. તથા પ્રપંચનો લાભ મેળવવા માટે સ્વાર્થની દોડાડોડ કરે છે. પરમાર્થ માટે ભાગ્યે જ કોઈ પ્રયત્ન કરે છે. પેલી બાળકી બાબાના ઘોળામાં બેઠેલી હોય, અને તે અમનીની મા કઠેરાની બહાર દૂર ઊભી ઊભી અમનીને ઇશારો કરતી કે ઇન્દ્રિયો મળે નહિ ત્યાં સુધી ત્યાંથી ઉઠતી જ નહિ. પણ બાબા તે છોકરીને વહાલ સાથે ગુસ્સો દર્શાવીને કહેતા કે, ‘તારા બાપનો શું લાગું છું તે મારી પાછળ આમ લાગી પડી છે ? કામ વગરનાં મફતનું ખાનારા સાતા !’ પણ આ ગુસ્સો તો એક માત્ર બાબ્ય દેખાવ જ હતો. અંદરથી તો હદ્યમાં પ્રેમનાં મોઝ જ ઉછળતાં હતાં. પછી કહે છે કે બાબા પોતાની કફીના બિસ્સામાંથી ઇન્દ્રિયો બહાર કાઢતા અને તે છોકરીની આવી જુન્તાનની ડબ્બીમાં મૂકી બરાબર બંધ કરીને આપતા. જેથી અંદર મૂકેલો ઇન્દ્રિયો અખડાવી શકાય. જેલી ડબ્બીને બંધ કરીને અમનીના હાથમાં મૂકૃતાકે તરત જ તે પોતાના ઘર તરફ દોડી જતી. આમ લગભગ સવારના નાસ્તાના સમયે જ થતું તેમજ જ્યારે બાબા લેંડીબાગ જવા માટે નીકળતા ત્યારે પણ તે અમનીને એક ઇન્દ્રિયો આપતા. અને જેવું સવારે બોલતા અને ગુસ્સો કરતા એવું બપોરે પણ કરતા. આવી રીતે દેરેક દિવસે અમનીને બે ઇન્દ્રિયા મળતા, છ ઇન્દ્રિયા અમનીની મા જમલીને મળતા. પાંચ ઇન્દ્રિયા દાઢા કેળકરને આપતા તથા બે ઇન્દ્રિયા ભાગોળ શિંદેને અને બે ઇન્દ્રિયા રાધાકૃષ્ણાબાઈને આપતા. રાધાકૃષ્ણાબાઈ એટલે સુંદરીને કે જેમનું નામ સુંદરાબાઈ ક્ષીરસાગર હતું. પરંતુ આ બહેને દરેકને બોલાવતી વખતે, ‘રાધાકૃષ્ણા’ કહીને બોલાવતા માટે, ‘રાધાકૃષ્ણાબાઈ’ નામ પહુંચું હતું. દશથી પંદર ઇન્દ્રિયા તાત્યા કોતે પાટીલને, પંદરથી પચાસ ફીલ બાબાને અને લગભગ આઠ ઇન્દ્રિયા ગરીબ ગુરબાંને નિયમિત વહેંચી દેતા. આ ઇન્દ્રિયાનો સરવાળો કરીએ તો લગભગ ૮૦/- ઇન્દ્રિયા થતા હતા. આટલા બધા ઇન્દ્રિયા બાબા દરરોજ આ રીતે વહેંચી દેતા હતા. આ કેવું રાજશાહી ઉદારણું ! તે સમયે સરકારે બાબા ઉપર આવકવેરો લગાવવા માટેની દાખિથી તપાસ કરવા એક અધિકારીની નિમણુંક પણ કરી હતી. (ઓ. ૧૮-૩૦)

આ રીતેનું ઉદારપણું અને દાની વૃત્તિ તથા બાબાના આવા સ્વભાવની કીર્તિ મદ્રાસી મંજીએ સાંભળેલી. માટે સાહિબ્લિક રીતે પૈસો મેળવવાની આશાથી જ બાબાની સામે તેમણે ભજન કરવાની શકૃઆત કરી. આ દરરોજનો ઉપકમ થયો. બહારથી આ ભજનો ભાવ અને ભક્તિથી સુંદર લાગતા હતાં. પણ અંદરથી તેની પાછળ પૈસો કમાવવાની મેલી મુરાદ જ હતી. બાબા પૈસા આપશે એ આશા ઉપર તે મંડળી શિરડીમાં જ રોકાઈ. તેમાંથી પેલા મદ્રાસીની પત્નીનો સાઈચરણમાં ભજન કરવાનો શુદ્ધ ભાવ હતો. આકાશમાં વરસાદનાં વાદળોને જેઠિને જેલી રીતે મોર આનંદથી નાચે છે તેમજ ચંદ્રને જેઠિને ચકોર આનંદિત થઈ જય છે તેવી જ રીતે બાબાની સામે નજર કરતાં પેલી બાઈને ખૂબ જ આશ્રમ્ય

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

થયું અને બાબા પ્રત્યે પ્રેમ ઉભરાઈ આવ્યો. એક દિવસે બાપોરની આરતી ચાલતી હતી, તે સમયના અરસામાં કૃપામૂર્તિ સાઈએ એની શુદ્ધ ભાવની અવસ્થા જેઠને તેને પ્રભુ રામચંદ્રજીના સ્વરૂપમાં દર્શન આવ્યા. બીજાઓની દાખિમાં દરરોજના સાઈનાથ દેખાતા હતા, પણ પેલી બાઈની નજરમાં જનકીનાથ એટલે સીતાપતિ શ્રી રામ દેખાયા. એ બાઈની આંખોમાંથી ખળપળ આંસુ વહેવા લાગ્યાં. તે બંને હાથ તાલી પાડતી હતી અને તેની સાથે સાથે આંખોમાંથી આંસુ ટપકતાં હતાં. આ દશ્ય જેઠને બધાને ખૂબ નવાઈ લાગી અને બધાના મનમાં એક બિજાસા ઉત્પન્ન થઈ કે, તેને એકલીને જ આવાં પ્રેમનાં પુર અને આટલો આનંદ શા માટે થયો? પછી ત્રીજી પહોરે પોતાના પતિને પોતે ખૂબ આનંદમાં આવીનેતે બાઈને થયેલા રામદર્શનનો ચિત્તાર અને સાઈબાબાની અદ્ભુત લીલાનાં વર્ણન કરવા લાગી. ‘ગુલાબી ભુરા રંગના, કમળની પાંખડીઓ જેવા, ભક્તોની મનોકામના પૂર્ણ કરવાવાળા, કલ્પવૃક્ષ જેવા, ભરતના મોટાભાઈ, સીતાને આનંદ આપનારા, દશરથ પુત્ર રામ મને દેખાયા. માથા ઉપર મુગટ, કાનમાં કુંડળથી અલંકૃત, વન્ય પુષ્પોનાં હારથી શોભાયમાન, પીળા રંગનાં વખ્યો ધારણ કરેલા, ચાર હાથવાળા જનકીજીના પતિ મને દેખાયા. શંખ, ચક્ર, ગઢા ધારણ કરેલા, છાતી ઉપર શ્રી વત્સની નિસાની કે જે શ્રી વિષણુ ભગવાનની છાતી ઉપર સફેદ વાળના ભમરા રૂપે જાળાય છે. તેને જ બૃગુત્રાણિની લાતના પ્રહરની નિશાની કહેવામાં આવે છે. તે નિશાનીવાળા અને કૌસ્તુભ મણિ કે જે સમુદ્ર મંથનમાંથી ૧૪ રતનો નીકદ્યા હતાં તેમાંનું એક રતન ગળામાં ધારણ કરેલા એવા, આ મનોહર રૂપવાળા સર્વશ્રેષ્ઠ પુરુષોત્તમને મેં જેયા. મનુષ્યનું રૂપ ધારણ કરેલા, વિષણુના અસામાન્ય અવતાર એવા સીતાના પ્રાણ પુરુષ, ચેતન શક્તિવાળા, ધનુષ ધારણ કરેલા શ્રી રામ મને દેખાયા. સાધારણ રીતે જેતાં તો બાબા એક ફકીર અથવા તો ઓલિયા જ દેખાય છે. તે ઘરે ઘરે બિક્ષા માંગનારા એ રીતે બીજાઓને જે દેખાતા હશે તે પણ મને તો બાબામાં રામનાં દર્શન થયાં. પેલી બાઈ મોટી ભાવિક હતી, પણ તેનો પતિ ખૂબ જ સ્વાર્થી હતો. સ્ત્રીઓની જત મોળી જ હોય છે. આવા સ્થાને રધુપતિ કચાંથી અને કેવી રીતે આવવાના છે? મનમાં જેવો ભાવ હોય તેવું જ ભોળા ભાવિકોને દેખાય છે. અમને બધાને સાઈ જ દેખાય છે અને તેને એકલીને રામનું રૂપ કેવી રીતે દેખાયું? આવા અનેક પ્રકારનાં વાંકાચૂંકા આરોપ મૂકીને તેણે તે બાઈની અનાદરની મશકરી કરી. છતાંથે એ બાઈને જરાયે ખેદ થયો નહિ. તેને એવી ઘોટી કલ્પનાઓ કરવાની ખબર ન હતી. તે પહેલાં તે ખૂબ મોટી અધિકારી સી હોવાને લીધે તેની મોટી જ્યાતિ હતી. કહેવાય છે કે તેને એક વખતોવખત સુખદાયક રામનાં દર્શન થતાં હતાં. સમય જતાં તેને દ્રવ્યનો લોભ જાગ્યો પરંતુ દ્રવ્ય પાસે ઈશ્વર નથી હોતો, માટે રામનાં દર્શનનો અભાવ થયો. લોભ અને મોહનો આ રીતે નૈસર્ગિક ગુણ છે. સાઈબાબાને તેની બાબતે બધી જ હકીકતોની માહિતી હતી. એ બાઈની ખરાબ વૃત્તિઓનો અંત આવતાં જ બાબાએ તેને ફરીથી રામનાં દર્શન કરાવ્યાં અને તેની ઈચ્છા પૂર્ણ કરી હતી. (ઓ. ૩૧-૫૧)

પછી એ જ રાત્રે કેવી એક આશ્રમયકારક ઘટના બની તે જુઓ. ઊંઘમાં પેલા ગૃહસ્થને કે જે બાઈના પતિ છે તેમને એક બયંકર સ્વર્ણ આવ્યું. આપણે જાણે કે એક શહેરમાં છીએ. ત્યાંની પોલીસે આપણને પકડ્યા છે, અને હાથ પાઇળ વાળીને સખત બાંધી દીધેલા છે. બાંધેલા હાથનાં હોરડાં બરાબર જકડીને તે પાછળ ઊભો છે. ત્યાં એ જ જર્યા ઉપર એક પિંજરું છે. જેની બહારની બાજુએ સાંનિધ્યમાં સાઈ મહારાજ ગુપચ્યુપ સ્વસ્થ ઊભા છે. જાણે કે બધું જેવા માટે ન ઊભા હોય? આમ શ્રી બાબાને પ્રત્યક્ષ ઉભેલા જેઠને પેલો ગૃહસ્થ એ બે હાથ જેડી આજીજ કરીને દ્વામણા મોઢે બોલ્યો, ‘બાબા! તમારી કીર્તિ સાંભળીને અમે તમારી પાસે તમારા ચરણોમાં આવ્યા હતા. તો પછી તમારી સામે જ અમારી ઉપર તમે હોવા છતાં આવો પ્રસંગ કેમ આવ્યો છે?’ મહારાજે જવાબ આંખો, ‘કરેલાં કર્મોનું ફળ બોગવવું જ જેઠાએ.’ તે સાંભળતા પેલો ગૃહસ્થ વિનગ્રાપણે બોલ્યો, ‘મેં તો આ જન્મમાં આવું કાંઈ પણ કર્યું જ નથી કે જેને લીધે આવાં સંકટોમાંથી પસાર થવું પડે.’ ત્યારે મહારાજ બોલ્યા કે, પહેલાંના જન્મમાં કંઈ ગરબડ કરી હશે. ફરી પાછો પેલો

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ગૃહસ્થ બોલ્યો, ‘પાછલા જન્મની મને શી ખબર ? એવું કોઈ ખરાબ કામ કર્યું પણ હોય તો પણ આપનાં દર્શન થવાથી તો તે ભર્ષમ થઈ જવું જોઈએ. અમને તો તમારા દર્શન થતાં અગિનમાં જેવું સુકાયેલું ધાસ જ ભર્ષમ થઈ જાય છે. તેવી જ રીતે કરેલા કર્મથી હું કેમ મુક્ત ન થઈ શકું ?’ ત્યારે સાઈ મહારાજે પૂછ્યું, ‘આવો વિશ્વાસ છે ખરો કે ?’ ગૃહસ્થે હા કહેતા બાબાએ તેને આંખો બંધ કરવા માટે કહ્યું. આજીશ અનુસાર તે આંખો બંધ કરીને ઊભો રહ્યો એટલામાં ધર્બ દઈને કોઈનો પડવાનો અવાજ આવ્યો. એ પેલા ગૃહસ્થે સાંભળ્યો અને તે ચમક્યો અને ડોળા ફાડીને જેવા લાગ્યો તો તે બંધનોમાંથી પૂર્ણપણે જ છૂટી ગયેલો દેખાયો અને પોલીસોએ લોહીમાં ખરડાએલો જોયો. આવું જોઈને પેલો ગૃહસ્થ ખૂબ જ ગમચ્છાઈ ગયો અને મહારાજ તરફ જેવા લાગ્યો. મહારાજ હસતાં હસતાં તેને બોલ્યા, ‘હવે તું ખરાબ જરૂર જરૂર આવ્યો છે. પોલિસ અધિકારીઓ હમણાં જ આવશે અને આ બધી અહીંની હકીકત જોઈને તને સંભાળવામાં અઘરો અને રીઢો ગુન્હેગાર સમજુને ફરી પાછો ગિરફ્તાર કરશે.’ પછી પેલો ગૃહસ્થ નિઃસંશય મનથી બોલ્યો, ‘બાબા ! આપ ખરું જ બોલો છો. હવે ગમે તેમ કરી મને છોડાવો તમારા વગર તેમાંથી ઉગારનારો હવે કોઈ મને દેખાતો નથી.’ આ સાંભળીને સાઈ મહારાજે તેને કહ્યું, ‘પાછી ફરીથી તારી આંખો બંધ કર.’ એ પ્રમાણે કરીને, પેલા ગૃહસ્થે આંખો ખોલી તો વળી વધારે આશ્વર્ય પમાડે એવી પરિસ્થિતિ થઈ. પોતે જાતે પિંજલાની બહારની જગ્યા ઉપર અને બાબા પોતાની નજીદીમાં જ ઊભા હોય એવું દેખાયું. તરત જ તેણે સાણ્ણાં નમસ્કાર કર્યા. તેની સાથે જ બાબાએ પૂછ્યું, ‘આ હમણાના તારા નમસ્કાર અને આ પહેલાં હંમેશા તું જે નમસ્કાર કરતો હતો તે બંને વચ્ચેનો શું ફરક છે ? તે વિચાર કરીને મને કહે.’ એ સાંભળતાં પેલા સહગૃહસ્થે જવાબ આપ્યો, ‘જમીન આસમાનનો ફરક છે. પહેલાના નમસ્કાર ફક્ત પૈસા માટે જ કરતો હતો, પણ હવે જે કર્યા તે આપ સાક્ષાત્ પરમેશ્વર છો એ ભાવનાથી કરેલા છે. પહેલાં આની ઉપર મને જરા પણ પ્રેમ કે ભક્તિ ન હતી. એટલું જ નહિ પણ એક મુસલમાન થઈને અમને હિન્દુઓને વટલાવતા હો અથવા તો શાંકો વિરુદ્ધ આચરણ કરાવતા હો તે માટેનો તમારી ઉપર મનમાં રોષ હતો.’ એ સાંભળીને બાબાએ પૂછ્યું, ‘તારા મનમાં મુસલમાન દેવો માટેની ભક્તિ નથી?’ ગૃહસ્થે ‘ના’ કહેતાં બાબાએ તેને પૂછ્યું, ‘તારે ઘેર પંજે જે પાંચ પવિત્ર પૂરુષ દર્શાવતો મુસલમાન લોકોનો એક ધાતુમાંથી જનાવેલો હાથ છે તે નથી કે ? જેની તું મહોરમના દિવસોમાં પૂજા કરે છે તેમજ તારે ઘેર ‘કાઈ-બિબી’ નામની મુસલમાની દેવી નથી ? જે લગ્ન કાર્યોમાં પૂજન અને માનપાન આપીને શાંતિ નથી કરતો ?’ ‘હા,’ તે ગૃહસ્થે વાતને માન્ય રાખીને કહેતાં, મહારાજે તેને પૂછ્યું કે, ‘બોલ તારી બીજુ કોઈ દીચણા છે ? અને જે હોય તો કહે,’ એવું પૂછતાં પોતાના ગુરુ સમર્થ રામદાસ સ્વામીનાં દર્શનની દીચણા દર્શાવી. ત્યારે તેને બાબાએ કહ્યું કે મારી તરફ તારી પીઠ ફેરવીને દિવાલ સામે મોહું રાખીને ઊભો રહે. તે બાબાના કહ્યા પ્રમાણે ઊભો રહ્યો ત્યાં બાબાએ કહ્યું ચાલ ફરી પહેલા ઊભો હતો તેવો ઊભો થઈ જ, એને જેવું પાછું વળીને જેયું તો સ્વામી સમર્થ રામદાસ મૂર્તિમંત સનમુખ ઉભેલા દેખાયા. ગૃહસ્થે તેમનાં ચરણોમાં પડીને નમસ્કાર કર્યા અને તે જગ્યા ઉપરથી પાછા અદરથ્ય થઈ ગયા. પછી પેલો ગૃહસ્થ જિજાસાપૂર્વક બીજું વધારે કંઈક મહારાજને પૂછ્યા લાગ્યો, ‘બાબા ! હવે તમારી ઉંમર થઈ છે. આપનું આ શરીર ધર્દું દેખાય છે. આપને આપની આયુષ્ય મર્યાદાની, એટલે કે બીજાં કેટલાં વર્ષ આપ જીવંત રહેવાના છો એની ખબર છે ?’ ‘શું કહે છે હું ધરડો છું ? મારી સાથે દોડીને તો જો !’ આવું કહીને સાઈ મહારાજ દોડવા લાગ્યા, પેલો ગૃહસ્થ બાબાની પાછળ પાછળ દોડવા લાગ્યો. મહારાજ ખૂબ જ વેગથી દોડતા હોવાના કારણે જે હવામાં ધૂળના ગુબારા ઉઠ્યા, એટલામાં એને અનુકૂળ લાભ ઉઠાવીને બાબા અદરથ્ય થઈ ગયા. અને પેલા ગૃહસ્થની ઉંઘ ઊડી ગઈ. (ઓ. પર-૮૦)

તે બાઈનો પતિ જયારે જગ્યો ત્યારે તેને સ્વખનમાંની સ્થિતિનો વિચાર કર્યો. તેથી તેના મનની ભાવનાઓમાં પહ્યો આવ્યો. તે બાબાના મહિમાની પ્રશંસા કરવા લાગ્યો. સાઈની આવી આશ્વર્યકારક કરણી જોઈને તેમનાં ચરણોમાં તેની

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ભક્તિ દદ થઈ. પહેલાંની સ્થિતિ બદલાઈને બાબા તરફની જે સંશયાત્મક ભાવના હતી તે નાશ પામી. જોવા જઈએ તો આ એક સાધારણ જ સ્વભન હતું. પણ પેલા પ્રશ્નો અને તેના જવાબોના સંવાદ સાંભળીને શ્રોતાઓને એમાં રહેલો ગૂઢાર્થ અથવા તો ભાવાર્થ ધ્યાનમાં લેવો. આવી રીતે પ્રશ્નો ઉત્તરો અને સંવાદોમાં તથા પેલા મદ્રાસી ગૃહસ્થને ખાસો બોધ મળ્યો. તેમજ એના મનમાંથી સાઈબાબા પ્રાણે જે વિરોધ હતો તે રહ્યો નહિ. (ઓ. ૮૧-૮૩)

બીજ દિવસે સવારે આ આખી મંડળી મસ્જિદમાં દર્શન કરવા આવી, ત્યારે સાઈનાથે કૃપા કરીને તેમને બે ઇપિયાની બરફી આપી. એ ઉપરાંત પોતાની પાસેથી બે ઇપિયા આપીને તે બધાને થોડા દિવસ માટે ત્યાં જ રોકી લીધાં. તે બે ઇપિયા શ્રીદ્વા અને સભૂરી તો નહિ હોય ને? તે મંડળીનું આવું નિયમિત ભજન અને પૂજન ચાલતું રહ્યું અને થોડા સમય બાદ તે લોકો બાકીની યાત્રા માટે નીકળી પડ્યા. બાબા પાસેથી ભલે વધારે પૈસા તો ન મળ્યા પણ આશીર્વાદ તો ખૂબ જ મળ્યા. ‘અલ્લા માલિક બાહોત હેગા, અલ્લા તુમ્હારા અચછા કરેગા.’ આગળ ઉપર આ જ શબ્દો તેમના ઉપરોગમાં આવ્યા. સાઈના આશીર્વચનો રસ્તામાં ચાલતી વખતે અને તેની યાદ રાત અને દિવસ ધ્યાનમાં રાખીને તેમને તલમાત્ર તેટલું દુઃખ નહ્યું નહીં. આશીર્વાદ પ્રમાણે કોઈ પણ પ્રકારનો ત્રાસ અથવા તો ઉણાપ ન લાગતાં યાત્રાઓ થઈ. માર્ગમાં કોઈપણ જલતની મુશ્કેલી ન પડતાં તેઓ સુઅદ્ધ પાછા પોતાને ઘેર આવી પહોંચ્યા હતાં. મનમાં જેટલી ધારેલી હતી, એના કરતાં પણ વધારે બીજી અનેક યાત્રાઓ પણ થઈ. દરેકને એક ઉત્તમ પ્રકારના આનંદનો અનુભવ થયો અને તેઓ સાઈની સ્તુતિ ગાવા લાગ્યા. સાઈ સંતના આશીર્વચન, ‘અલ્લા અચછા કરેગા’ એ બોલેલા શબ્દો અક્ષરે અક્ષર સાચા પડ્યા. યાત્રા પુરતા અને યાત્રા બાદ તે મંડળીના અનેક મનોરથો ખૂબી થયા. એવા આ તીર્થયાત્રાએ નીકળેલા સદાચારી અને સાત્વિક ભગવંત ભક્ત આ મદ્રાસી લોકોને, સાઈબાબા સંસારનાં બંધનોમાંથી છોડાવનારા સાબિત થયા. (ઓ. ૮૫-૮૩)

આવી જ અન્ય એક સરસ કથા હું તમને કહું, જેને શ્રોતાઓએ કાળજીપૂર્વક અને ભક્તિભાવથી સાંભળવી. ભક્તોના મનોરથ ખૂબી કરનારા, કદ્પવૃક્ષ પરમ કૃપાળું સાઈ, ભક્તોની ઇચ્છાઓ કંટાળો ન કરતાં હંમેશા પ્રેમથી કેવી રીતે ખૂબી કરે છે તેનું શ્રોતાઓને જરૂરથી આશ્રૂર્થ થશે. હાલનું મુંબદીનું ઉપનગર વાંદરામાં રધુનાથરાવ તેઠુલકર નામના એક ખૂબજ ચતુર અને ગંભીર સ્વભાવના તથા અનેક બાબતોનું જ્ઞાન ધરાવનારા એક ભક્ત હતા. તે હંમેશા નિજનંદમાં જ રહેતા. અને સાઈનાં ચરણકમળમાં સ્થાન ગ્રહીને ઉપદેશઝીપી મધની આશાથી સાઈનામનો અંદર જય કરતાં કરતાં ભક્તિમાં ઓતપ્રોત થઈને તેના રંગે રંગાઈ ગયા હતા. જાતે રચેલા અભંગોના સંગ્રહમાં, ‘શ્વાનાથ સાવિત્રી ભજનમાતા’ નામના પુસ્તકનું ઝ્રિ આપીને તેમાં તેમણે સાઈબાબાની અપાર લીલાઓનું વર્ણન કરેલું છે. તે જે કોઈ વાંચશે તેને એમાં ડગલેને પગલે શ્રી સાઈનાં જ દર્શન થશે. તેમનાં પત્નીનું નામ સાવિત્રીબાઈ હતું. તેમજ તેમના મોટા દીકરાનું નામ બાબુ હતું. આ બંનેનો વિચિત્ર અનુભવ સાંભળો અને સાઈના ચરિત્રની નવાઈ જુઓ. વૈદ્યકીય પાઠશાળામાંથી પરદેશી વૈદ્યકીય શિક્ષણ લઈ રહેલો બાબુ ઉત્તીણ થવાની ખાત્રી અંગે મનમાં શંકા સેવતો હતો. તે જ કારણે પરીક્ષામાં નહિ બેસવા વિચારતો હતો. તેણે રાત દિવસ એક કરીને ખૂબ જ અભ્યાસ કર્યો હતો. તેને એક દિવસ એક જ્યોતિષી મળ્યો. તે પરિચિત હતો આથી બાબુએ પ્રશ્ન કર્યો કે હું પણ થઈશ કે નાપાસ ત્યારે તે જ્યોતિષીએ પંચાગનાં પાના ઉથલાવીને એક કાગળ ઉપર કુંડળી દોરી અને આંગળીનાં વેઢા ગણતાં, રાશિ, નક્ષત્રોનો હિસાબ જાણી ચિંતિત ચહેરાથી બાબુ તરફ જેઠાને કહ્યું કે, ‘તે ખૂબ મહેનત કરી છે, પણ આ વર્ષે તને ગ્રહોનું પીઠભળ નથી. આવતા વર્ષે એનું શ્રેષ્ઠ ફળ મળશે. માટે આવતા વર્ષે પરીક્ષા કોઈ પણ શંકા વગર આપવી.’ આ વાત સાંભળી વિદ્યાર્થી બાબુના મનને આધ્યાત્મ લાગ્યો. તેના મનમાં ભય ધર કરી ગયો. જે મારો પરિશ્રમ નકારો જ જવાનો હોય તો પરીક્ષામાં બેસવાનો શો અર્થ? સફળતા તો મળવાની નથી. આ બધું થયા બાદ થોડા દિવસો પછી બાબુના મા શિરડી ગયાં હતાં અને બાબાનાં ચરણોમાં મસ્તક ઝૂકાવી નમસ્કાર કરતાં હતાં તે સમયે જ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કુશળ મંગળની વાતો નીકળી. તે વખતે આ છોકરાની પરીક્ષા બાબતની વાત પણ નીકળી. માએ ખૂબ જ દ્વામણા સ્વરે બાબાને કહ્યું, ‘ગ્રહેનું જેર હોતો છોકરો પરીક્ષામાં બેઠો હતો, જ્યોતિભીએ એની કુંડળી જોઈ અને આ વર્ષે યોગ સારો નથી એવું કહ્યું છે માટે આપણા બાબુએ પરીક્ષાની બધી જ તૈયારી કરી હોવા છતાં પરીક્ષા માટે બેસવાનો નથી. બાબા આ આવી ગ્રહદશા શા માટે બેઠી ? આ જ વર્ષે આવી નિરાશા કેમ મળી ? એક જ વખતે પરીક્ષા આપીને તે પાસ થઈ જય તેવી અમારા બધાની ઠચ્છા હતી.’ તે બાઇની દુઃખી મનથી કરેલી પ્રાર્થના સાંભળી બાબા બોલ્યા, ‘એને કહેજે કે માંડું માનીને, કુંડળીને વીટાળીને બાજુ ઉપર મૂકી હે અને સ્વસ્થ ચિત્તે જઈને પરીક્ષામાં બેસે કોઈના નાદે લાગતો નહિ. જન્મપત્રિકા પર વિશ્વાસ રાખે નહીં. પોતાનો રોણું હો અભ્યાસ ચાલુ રાખે. બાબુને કહેજે કે તને યશ મળશે. સ્વસ્થ મનતી પરીક્ષા આપે. નિરાશ થાય નહિ અને મારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખે.’ બાબાની આવી આજ્ઞા અને આશીર્વાદ લઈને મા પોતાના ઘરે પાછી ફરી. બાબુને બાબાશ્રીનો સંદેશો આપીને ઉત્સાહપૂર્વક આશ્વાસન આપ્યું. આથી બાબુ પણ સાઈના વચ્ચનોથી આનંદિત થઈને પરીક્ષામાં બેઠો અને નિયતિ સમયમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબો પણ લખ્યા. લેખિત પરીક્ષા પૂર્ણ થઈ, બધા જવાબો પણ લખાયા, પણ પોતાની ઉપર અવિશ્વાસ હોવાને કારણે એની સ્થિર બુદ્ધિ ચલિત થઈ. સારી રીતે પાસ થઈ શકાય એવી ઉત્તમ ઉત્તરવાહીઓ લખી હોવા છતાં તેને મનમાં ઉચાટ હતો. તેણે ધીરજ છોડી દીવી. ખરેખર તો તે લેખિત પરીક્ષામાં પાસ થઈ ગયો હતો. પણ તેને એવું લાગતું હતું કે તે નાપાસ છે. એમ ઓટું સમજુને ઉદાસ થઈને મૌખિક પરીક્ષામાં પ્રેક્ટીકલ્સ બેસવાની આનાકાની કરવા લાગ્યો. આ તરફ મૌખિક પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ, પહેલો દિવસ એમ ને એમ જ ગયો. ભીજે દિવસે તેનો એક મિત્ર ઘરે આવ્યો ત્યારે બાબુ જમવા બેઠો હતો. મિત્ર બોલ્યો, ‘શું આશ્રમની વાત છે ! કે પરીક્ષાને તારી ચિંતા ? તેમણે મને કહ્યું છે, જ જોઈ આવ તેનુંકર કાલે પરીક્ષામાં કેમ નથી આવ્યો ?’ ત્યારે મેં એમને કહ્યું, ‘એ લેખિત પરીક્ષામાં નાપાસ થયો છે, તો મૌખિક પરીક્ષાનો શ્રમ શા માટે લેવો જોઈએ? એટલે જ તે ઉદાસ થઈને ઘરે બેઠો છે. એ સાંભળી પરીક્ષાકે કહ્યું કે તું તેને ઘેર જ અને તેને અહીંયા લઈ આવ. તેને ખર્બર આપે કે તે લેખિત પરીક્ષામાં પણ પાસ છે. આવી ખર્બર મિત્ર તરફથી મળતાં તો બાબુના આનંદનો પાર રહ્યો નહિ. અને ત્યાં જ એણે સાઈબાબાનું સ્મરણ કરીને નમસ્કાર કર્યા અને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વીના ખૂબજ ઉત્સાહથી તે દોડ્યો અને મૌખિક પરીક્ષા આપી. આગળ બધું જ સારું થયું. એની પરીક્ષામાં પાસ થવાની તમામ હોંશ પૂર્ણ થઈ, મનના કોડ પૂરા થયા અને બાબાએ પોતાનાં ચરણોમાં લીન કરી લીધો. (ઓ. ૬૪-૧૨૨)

દળવાની ઘંટીના પથ્થર ઉપરનો હથો જેવો એક સરખો મજબૂત પકડીને ફેરવામાં આવે છે, તેવી જ ગુરુનાં ચરણની નિષ્ઠાની વાત છે. સાઈબાબા નિષ્ઠાને પણ એક સરખી જંઝોળીને સરસ મક્કમ કરીને ચોખવટ કરતા હતા. કોઈને પણ કયારેય એવું કહેતા નહિ કે જેને લઈને તેના મનની ભાવનાઓ હાલી જય નહીં. આ તો બાબાની હુંમેશની રીત હતી. આવી જ રીતે તેઓ પોતાના ભક્તોની શ્રદ્ધા મક્કમ કરતા હતા. તેમણે આંગળી ચિંદેલો માર્ગે જવા લાગતાં, શરૂઆતમાં ધણુ સારું લાગતું પણ પાછળથી એવા સપાટા પડતા અને જ્યાં ત્યાં કાંટા જ ભોકાતા. પછી આપણી શ્રદ્ધામાં તિરાડ પડી અને મનમાં થોડો સંશય પણ પેઢા થવા લાગતો. તેમજ એવું લાગવા માંડતું કે આવા આડકતરા રસ્તે સાઈબાબા શા માટે લાવે છે ? પરંતુ આવું જ્યારે લાગવા માંડે છે ત્યારે જ પ્રયત્નપૂર્વક શ્રદ્ધાને અવશ્ય વળગી રહેવું. આ સંકટોમાં મોઢેથી અખંડ સાઈનું નામ:સ્મરણ કરતા રહેવાથી લગભગ તમામ સંકટો નાશ પામે છે. સાઈના નામ:સ્મરણમાં આવી પ્રયંક શક્તિ છે. અ. ૨૭માં જણાવ્યું છે નામ પાપ પર્વત ફેડો. નામ દેહબંધન તોડો. નામ કોઈ દુર્વાસનાને। ઉષેડી મૂળથી ફેડી દે ॥૧૮॥ નામ કણ ગરદન થગેં । જન્મ સ્મરણ ફેરી ચૂકવે ॥૧૯॥ આવા અંતરાયોનું આ જ પ્રયોજન હોય છે, અને તે સંકટો પણ સાઈ પોતે જ નિર્માણ કરતા હોય છે. (ઓ. ૧૨૩-૧૨૯)

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

અગાઉ જણાવેલા તબીબી વિદ્યાર્થી બાબુના પિતા જે બાબાના પરમ પ્રેમાળ ભક્ત હતા અને સ્વભાવથી ગંભીર ઉદ્ધાર અને નીતિથી જીવનારા હતા. તેમનાં ગાત્રો ઢીલાં પડવાથી તે નિર્બળ થઈ ગયા હતા. મુંબદી શહેરમાં આવેલી ગ્રેહેમ નામની પ્રસિદ્ધ વ્યાપારી પેઢીમાં તેમણે ખૂબ જ ખંતથી અને ઈમાનદારીથી નોકરી કરી હતી. વૃદ્ધાવસ્થા થતાં તેમની આંખો પર ઝાંખ વળવા લાગી હતી. ઇન્દ્રિયો પોતાના કામમાં અસમર્થ થતાં સ્વસ્થ બેસીને તેઓ આરામની ઈચ્છા કરવા લાગ્યા. હવે કામ કરવાની શક્તિ રહી ન હતી. માટે શારીરિક પ્રકૃતિને સુધારવા માટે રધુનાથરાવને રજ મૂકી અને સ્વસ્થતાથી આરામ કરવા લાગ્યા. બધી રજ પૂરી થતાં અને સંપૂર્ણ આરામ ન મળતાં, ફરીથી તેમણે અરજી લખી અને રજનો ગાળો વધારવા વિનંતી કરી. પણ તે પેઢીના મુખ્ય અવિકારી ખૂબ વિચારશીલ અને દ્વારા હતા. પોતાના એક પ્રમાણિક કામ કરનારને જેઠિને ઉદ્ઘાર મનના માલિકો તેમને આગળ ઉપરના નિર્વાહ માટે પ્રેમથી અહદી ભાખરી-પેન્શન આપતા હોય છે. આવી આ સરકારી પદ્ધતિ ઉત્તમ પેઢીઓ પણ પ્રસંગ અનુસાર પ્રમાણિક સેવકો માટે અને તેમને ઉત્તેજન આપવા માટે નક્કી કરતા હોય છે. પણ તેઓ વિચારવા લાગ્યા કે, આ મારો માલિક આવી રીતે અહદું પેન્શન આપીને મદદ કરશે કે? હું બેકાર તો નહિ થઈ જાઓને? એવી ચિંતામાં તેમને થવા લાગ્યી. દોઢસો ડ્રિપિયા મારો પગાર, એટલે પંચોસેર ડ્રિપિયાના પેન્શન ઉપર દરરોજનું જીવન ચલાવવાનો ભાર પડવાનો. આવો વિચાર સતત તેમના મનમાં ધેરાવા લાગ્યો. પણ ત્યાં એક સરસ મજા થઈ. બાબાની અશ્વર્થકારક કરામત તો જુઓ! રધુનાથરાવ માટે હુકમ થવાના પંદર દ્વિવસ પહેલાં બાબાએ સાવિત્રીભાઈના સ્વર્જમાં આવીને હિતાવહ પેન્શન માટેનો મત પૂછ્યો કે, ‘સો ડ્રિપિયા મળવા જેઠિએ એવી મારી ઈચ્છા છે, તારા મનની અપેક્ષાઓ પૂર્ણ થશેને?’ તે સાંભળીને બાઇ બોલ્યા, ‘આ શું પૂછ્યો છો? અમને તો માત્ર તમારા ઉપર જ પૂરેપૂરો ભરોસો છે.’ આ તરફ ટૂંક સમયમાં તેમની અરજી ઉપર દરાવ પસાર થયો કે રધુનાથરાવ એક ઈમાનદાર કર્મચારી છે તેમણે પુષ્કળ સેવા કરી છે. તો તેમને અહદા પગારથી વધારે પેન્શન તરીકે આપવા. બાબા મોઢેથી ભલે સો ડ્રિપિયા બોલ્યા હતા, છતાં તેની ઉપર બીજી વધારાના દશ ડ્રિપિયા આપાવ્યા. એવા આ દ્વારા સાગર સાઈસમર્થ છે. ભક્તો ઉપરનો અતિશય પ્રેમ તેઓ રોકી શકતા જ નથી. (ઓ. ૧૩૦-૧૪૪)

હવે એક વધુ સુંદર, મનોરંજક, ભક્તો માટે ઉલ્લાસકારક અને શ્રોતાઓને પણ આનંદ આપનારી કથા સાંભળો. કેપન હાટે નામના એક ડૉક્ટર બાબાના ખૂબ મોટા શ્રદ્ધાળું ભક્ત હતા. બાબાએ તેમને મળસ્કે સ્વર્જમાં દર્શન આપ્યાં. તેની આ એક સુંદર કથા છે. હાટે મધ્યપ્રેદેશના જ્વાલિયરના રહેવાસી હતા. હવે બાબાની સ્વર્જમાં પ્રક્રષ્ટ પૂછ્યવાની રીત અને હાટેનો તે અંગેનો ખુલાસો સાંભળીએ. બાબા બોલ્યા, ‘મને ભૂલી ગયો કે?’ ત્યાં હાટે એ તરત જ એક સરસ જવાબ વાય્યો, ‘બાળક જે માને ભૂલી જય તો એના સિવાય એને જીવવા માટે બીજું કોઈ સાધન હોય છે?’ પછી ઊઠીને જટપટ હાટે બાગમાં ગયા. તાજી વાલપાપડી તોડી, રસોઈ બનાવવા માટે વપરાતા ચોખા, દાળ, લોટ, ધી, તેલ, મરી મસાલા સાથે રોકડી દક્ષિણા પરબિલિયામાં મૂકીને ખાસ પદ્ધતિથી આ બધું ભક્તિપૂર્વક તૈયાર કર્યું. તૈયારી પૂર્ણ થયેલી જેઠિને હાટે સીધાંનો થાળ અર્પણ કરવા લાગ્યા. એટલામાં જ અચાનક તેમની આંખો ખુલી ગઈ અને જે અનુભાવું હતું તે સ્વર્જ હતું તેનું ભાન થયું. હાટેના મનમાં તરત જ આભ્યું કે આ બધા પદાર્થો બેગા કરીને શિરડી જઈ પ્રત્યક્ષ અર્પણ કરવા. પણ તે સમયે પોતે જ્વાલિયરમાં હતા. માટે મુંબદી એક પત્ર લખીને આ બધી હકીકત વિસ્તારપૂર્વક પોતાના મિત્ર સ્વ. કાકાસાહેબ દીક્ષિતને જણાવી અને તેમને શિરડી જવાની વિનંતી કરી અને વધારેમાં એ પણ જણાયું કે, ‘ટપાલ મારફતે પૈસા મોકલાવું છું. યોગ્ય સીધું ધરાવવું, પણ વાલપાપડીની સુંદર શિંગો ખાસ કોઈની પાસેથી મેળવી લાવવી. તેમાંથી વધેતા પૈસા સાથે લઈ જવા અને સીધાની સાથે દક્ષિણા ગળીને બાબાને જ સુપ્રત કરવા. પછી બાબાનાં ચરણ વંદન કરીને પ્રસાદ માગીને લેવો અને મને અહીં જ્વાલિયર મોકલી આપવો.’ પૈસા ટપાલ મારફતે મળતાં જ દીક્ષિત નીકળ્યા. શિરડી

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

જઈ સીધું સામગ્રી ખરીદી પણ વાલપાપડીની વ્યવસ્થા થઈ નહિ. એટલામાં એક બાઈ અચાનક માથા ઉપર ટોપલો લઈ ત્યાં આવી. તેને બોલાવીને જેયું તો વાલપાપડીની શિંગો જ મળી. તેથી બધીને ખૂબ જ આશ્ર્ય થયું. તેઓ બધી સામગ્રી લઈ મસ્ઝિફામાં ગયા અને બધું સાઈ મહારાજને અર્પણ કર્યું. બાબાએ તે બધી વસ્તુઓ નાનાસાહેબ નિમોણકરને આપી અને નિમોણકર બીજે દિવસે રંધીને તેનું નૈવેદ્ય તૈયાર કરીને લઈ આવ્યા. ત્યાં બાબા જમવા બેઠા ત્યારે દાળ, ભાતને હાથ ન લગાવતાં તેમણે વાલપાપડીના શાકને જ ઉંચકી લીધું. તે જેઠિને બધાંને ખૂબ જ નવાઈ લાગી. એમાંથી ફક્ત શાક જ ખાદું. આ વાત જ્યારે હાટેએ જાણી ત્યારે તેમને પુજ્ઞ આનંદ થયો. (ઓ. ૧૪૫-૧૬૦)

હવે આગળ ઉપરની કથાનો ચમત્કાર જુઓ. સાઈનું ભક્તોને લાડ કરવું એ કેટલું સુખદાઈ હોય છે. એક વખતે હાટેના મનમાં ઇચ્છા થઈ કે, શ્રી સાઈસમર્થના હાથના સ્પર્શથી પાવન થયેલો એક નગદ ઇપિયો ઘરમાં પૂજલમાં હોવો જેઠાંએ અને તેમની એ ઇચ્છા શ્રી સાઈએ પૂર્ણ પણ કરી. મનની વૃત્તિઓ અને ભાવનાઓ હજરો અને લાખ્યો હોય છે. તેમાંની ખરાબ વૃત્તિઓને છોડી દઈને જે સારી વૃત્તિઓ છે, તેનો સ્વીકાર કરવો અને તે પ્રમાણે આચરણ કરવું. હવે સાઈની કલાકસબી કેવી રીતે હૃતી તે જુઓ. તેઓ તો પછી પાઇળ ઊભા જ હોય છે. આવા પ્રકારની ઉત્તમ ઇચ્છાઓ ઉત્પન્ન થઈ કે તેની સફળતા મળવામાં જરા પણ વાર લાગતી નથી. તેમનો એક સ્નેહી તરત જ સાઈબાબાનાં દર્શન માટે ઉત્સાહપૂર્વક શિરડી જવા માટે નીકબ્યો. વૃત્તિ માત્ર સુદૃઢ હોવી જેઠાંએ, તે સાઈ હોંશ હોંશ કૌતુકથી પાર પાડે છે. જેમનામાં સદ્ગુણોના વર્તનની જ વૃત્તિ હોય છે. તેમના લાડ પુરા કરવાની પૂર્ણપૂરી જવાબદારી સાઈ પાસે છે. પેલા સ્નેહીને હાટેએ ખૂબ પ્રેમથી એક ઇપિયો આખ્યો અને કહ્યું કે ભૂલ્યા વગર આ બાબાના હાથમાં મૂકજે. સ્નેહી જ્યારે શિરડી ગયો ત્યારે બાબાના દર્શન કર્યા. બાબાનાં ચરણો ઉપર માથું નમસ્કાર કર્યા. અને બાબાની સામે જઈને બેઠા. દક્ષિણા માટે બાબાએ હાથ લાંબો કરતાં પહેલાં તો પોતાની દક્ષિણા તેમણે આપી, જે બાબાએ તરત જ ગજવામાં મૂકી દીધી. પછી તેમણે હાટેનો ઇપિયો કાઢ્યો અને તે પણ નમસ્કાર કરીને બાબાની હથેળીમાં મૂક્યો અને બોલ્યા કે, બાબા આ દક્ષિણા હાટેએ મારી સાથે તમારે માટે મોકલાવી છે. સાઈબાબા તો સર્વના હદ્યમાં વાસ કરનારા છે. હાટે ભલે જ્વાલિયરમાં રહેતા હતા છતાં તેમના મનની ઇચ્છા જાણીને પેલા ઇપિયા સામે તેઓએ ધ્યાન દઈને જેયા કર્યું. હદ્યમાં પ્રેમ ઉભરાઈ આવ્યો, બાબાએ તે ઇપિયો હાથમાં જાત્યો અને ફરી પાછા એકીટસે એને જેવા લાગ્યા, ત્યાં જેગા થયેલા લોકો પણ આ જે બની રહ્યું હતું તે ચકિત થઈને જેવા લાગ્યા. જમણા હાથના અંગુઠાથી તે ઇપિયાને ઉપરાઉપરી ઉછાળવા માંડ્યા અને પોતાના હથમાં જીલવા લાગ્યા. આ કીડા થોડો સમય ચાલી અને ત્યારબાદ એ ઇપિયો તેમને પાછો આપી દીધો અને હાટેના સ્નેહીને બાબા બોલ્યા, ‘આ જેનો છે તેને જ પાછો આપને. જેઠે આ પ્રસાદ પણ લઈ જને, અને કહેને કે અમારે એનું કંઈ જ જેઠિનું નથી. ફક્ત તું સ્વરસ્થ અને આરામથી રહે.’ પછી પેલા સ્નેહીએ બાબાને દંડવત્ પ્રણામ કર્યા, ઊંઠી પ્રસાદ વ્યવસ્થિત મૂકી દીધો અને બાબાની આજા મેળવીને જ્વાલિયર પોતાને ઘેર પાછા કર્યા. તે જ્વાલિયર જઈને ડૉક્ટરને મળ્યા અને ઇપિયો આપતાં બધી હકીકત કહી સંભળાવી. તે સાંભળીને હાટેનું હદ્ય પ્રેમથી ભરાઈ આવ્યું અને તે બોલ્યા, ‘મનમાં જેવી ઇચ્છા કરી હતી અને જે પ્રમાણે ઘાર્યું હતું તેમ સમજીને જ બાબાએ મારી ઇચ્છા પૂર્ણ કરી છે.’ આ તો હાટેના મનનો વિચાર હતો. અને તેમની પોતાના મનની કલ્પના હતી. સંતની યોજના અને તેમના ઉદ્દેશની કોઈને ક્યાંથી ખબર પડે ? (ઓ. ૧૬૧-૧૭૩)

હાટેને જે લાગ્યું એ ખરું માનવું પડે, તો એક બીજે અનુભવ જુઓ. એ તો આના કરતાં પણ તદ્દન વિરુદ્ધનો છે. સંતોના મનની વાતની તેમને જ ખબર ! એકનો ઇપિયો પાછો આપે તો બીજાનો ગજવામાં સરકાવી દેતા બાબાનાં મનમાં એનું કારણ શું હોઈ શકે એ કોને ખબર ? તેમનાં કારણોની તેમને જ ખબર ! આપણે ફક્ત એની મજા જ સેવી

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

અને આવો લાગ ન જવા દેતાં તે વિષયની કથા સાંભળવી. એક વખત બાબનો જેની ઉપર અપાર પ્રેમ હતો તેવા વામન નાર્વેકર નામના ભક્ત એક સુંદર મનુનો સિક્કો બાબાને ભક્તિપૂર્વક અર્પણ કરવા માટે લાવ્યા. એ સિક્કાની એક બાજુએ રામ, લક્ષ્મણ અને સીતા હતા. બીજી બાજુએ હાથ જેઠેલા હનુમાનજીની સુંદર મુદ્રા હતી. તે અર્પણ કરતી વખતે તેના મનમાં એવું હતું કે તેને બાબાના હાથનો સ્પર્શ કરાવીને તથા ઉદ્દીપ્રસાદ સાથે એ સિક્કો આપણને મળે માટે તેમણે બાબાના હાથમાં મૂક્યો. કોના મનમાં કષ વાત છે એ જાણવા છતાં બાબાએ ડ્રિપિયો હાથમાં આવતા જ એને તરત ખિસ્સામાં નાંખી દીધો. માધવરાવે-શામાએ વામનરાવના મનનો વિચાર બાબાને જણાવ્યો, અને એ ડ્રિપિયો પાછો આપવા માટે ખૂબ વિનંતી પણ કરી. પણ બાબાએ વાનમરાવની સાથે તેમને કહ્યું, ‘એને શા માટે જેઠાએ છે ? આપણે જ એ રાખવાનો છે.’ બાબાએ વધુમાં કહ્યું કે, ‘જે એ પચ્ચીસ ડ્રિપિયા આની કિંમત આપે તો એના બદલામાં આ ડ્રિપિયો પાછો આપીશ.’ વામનરાવે આમતે ફરીને લોકો પાસેથી જલ્દીથી તે ડ્રિપિયા ભેગા કર્યા. પણ બાબાએ તો પચ્ચીસ પણ ખિસ્સામાં નાંખી દીધા અને બોલ્યા, ‘ડ્રિપિયાઓનો મોટો ઢગલો કરી નાંખશો તો પણ આ રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીની છાપવાળા સિક્કા જેઠે એની તુલના ના થઈ શકે. એની સામું તો આ પણ ઓછા પડરો. શામા ! આ તું જ લે. પોતાની પાસે સંગ્રહ કરીને રાખ. દેવધરમાં મૂકીને એની પૂજન કરનો.’ આવું કેમ કરી રહ્યા હતા એ પૂછવાની કોઈની પણ સત્તા ન હતી. સાઈ યોગ્ય અને અયોગ્ય શું તે બરાબર જાણતા હતા. અને તે લેવા માટે કે આપવા માટે માત્ર તેઓ પોતે જ સમર્થ હતા. (ઓ. ૧૭૭-૧૮૮)

હવે આ કથન પુરું કરીને શ્રોતાઓના મનને વિશ્રાંતિ આપીએ, કે જેથી કરીને સાંભળેલી આ કથાનું મનન, ચિંતન કે તેની ઉપરનો ફરી ફરીને કરેલો ઊંડો વિચાર તેમને આવે. કોઈ પણ કહેલી અથવા તો સાંભળેલી વાતનો વ્યવસ્થિત વિચાર કર્યા વગર આત્મશાંતિ મળતી નથી. અને તેનો ફરી ફરીને ઊંડાણથી વિચાર ન કરતાં તે સાંભળેલું વ્યર્થ જલ્દી છે. હેમાડપંત બાબાનાં શરણે આવ્યા છે અને દેશેક સાધનાઓનાં સાધન એવા બાબાનાં ચરણ ઉપર માથું ધરી રહ્યા છે. હવે એનું આગળ ઉપરનું વર્ણન આવશે. (ઓ. ૧૮૧-૧૮૩)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે અને સજજનોની પ્રેરણા પામેલા, ભક્ત હેમાડપંત રચિત શ્રી સાઈ સમર્થના.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણ.



## ॥ અદ્યાય ૩૦ ॥

### નવસાદિ, કથા, કથનમું

(માધવરાવની માની બાધા એટલે કે પોતાની કોઈ મનમાં ધારેલી વસ્તુ થાય તો ઈશ્વરને એકાદ કૃત્યું કરીને અથવા એકાદ વસ્તુ અર્પણ કરીને પ્રતિજ્ઞા પુરી કરવી તથા સ્વભન દર્શનોની કથા વિશે કહેવું.)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળદેવતાને વંદન,  
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

હે ભક્ત વત્સલ, કરુણાલય, દ્વાવાન સાઈનાથ ! તમને અમારા નમસ્કાર. ફક્ત તારાં દર્શન માત્રથી ભક્તોના સંસારના ભયને તું દૂર કરે છે, અને તેમની આપદાઓનો તું નાશ કરે છે. હે સંતોના મસ્તક ઉપર ધારણ કરેલા રત્ન જેવા સંતશ્રેષ્ઠ સાઈનાથા ! પહેલાં તું ગુણ અને આકાર વગરનો હતો, અને પછી ભક્તોના ભાવ અને ભક્તિના દોરામાં ગુંથાઈને આકાર અને ગુણ સાથેનો થયેલો છે. અહીં ગુણ આ શબ્દનો શ્લેષ થતાં ‘સ્વભાવ અને દોરો આમ બે અર્થ થાય છે’ પોતાના ભક્તોનો ઉદ્ઘાર કરવાનું કાર્ય કર્યા વીના સંતોની પાસે બીજે કોઈ ઈતાજ જ નથી હોતો. તું તો સંતોના વૃન્દનો પણ આચાર્ય છે. ત્યારે તારે માટે તે કાર્ય છોડી દેવું શક્ય નથી. જેણે તારાં બંને ચરણોનો આશ્રય કર્યો અથવા તો તારા શરણે ભયરહિત અને અવરોધ વગરનો થયો છે. તારાં ચરણોની યાદ આવતાં કાશી જેવાં મોટાં ક્ષેત્રોમાં સ્થાઈ થયેલા બ્રાહ્મણો પણ શિરડીમાં આવતા હોય છે અને ‘ગાયત્રી મંત્રની’ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે શાસ્કોકત અનુષ્ઠાન કરતા હોય છે તથા પોથી પુરાણો વાંચતા હોય છે. આવા સતકૃત્યો તીર્થક્ષેત્રે કરવાથી તે જલહીથી સફળ થતાં હોય છે. પરંતુ આ બ્રાહ્મણોને ભહાન તીર્થક્ષેત્રો કરતા શ્રી સાઈબાબાના ચરણ વધારે પવિત્ર લાગતાં હતાં, માટે ત્યાંથી તેઓ આ અનુષ્ઠાનો કરવા માટે શિરડી આવતા હતા. શુદ્ધિકરણની વિધિ ન થયેલા અને સાધારણ શક્તિ વગરના એવા અમને ભક્તિની શી કલ્પના ? બધા જ અમને છોડી દેવા અથવા તરછોડવા લાગે તેમ છતાં સાઈબાબા અમને તેમનાથી જુદા પાડવાના નથી. જેની ઉપર તેમની કૃપા થાય છે તેમને કલ્પના બહારનું મહાન સામર્થ્ય પ્રાપ્ત થાય છે અને આત્મા અને અનાત્માથી આ બે વચ્ચેનો ફરૂક સમજવાનો મોક્ષ મળે છે. સાથે સાથે આત્મજ્ઞાનનો પણ લાભ મળે છે. સાઈના મુખેથી વહેલા શબ્દો સાંભળવા માટેની લાલસાથી ભક્ત-જન ગાંડા થઈને તેમના શબ્દે શબ્દ પોતાના મનમાં દ્વારા અદ્વાતી તે શબ્દોના અક્ષરે અક્ષરની સચ્ચાઈનો અનુભવ પામે છે. પોતાના ભક્તોની મનની ઈચ્છા સાઈનાથ સંપૂર્ણપણે જાણતા હોય છે, અને તેને પૂર્ણ કરવા માટે પણ તેઓ સમર્થ છે. માટે જ તેમના ભક્ત કૃતાર્થ થતા હોય છે. ‘હે સાઈનાથ ! જલહીથી આવો અને અમને તમારો પ્રેમ પામવા હો. તમારાં ચરણોમાં હું મારું માથું મૂરું છું. મારા બધા જ અપરાધ માફ કરો. અને આ આપના દાસની ચિંતા દૂર કરો.’ આ પ્રકારે અનેક પ્રકારનાં સંકટોથી ઘેરાયેલા ભક્તો જે સાઈનાથનું સ્મરણ કરશે તો તેના ભયગ્રહણ ચિત્તને શાંતિ આપનારા તેઓ એકલા જ છે. દ્વારાના સાગર એવા સાઈનાથ મારી ઉપર કૃપાવંત થતાં જ હું આ કલ્યાણકારક ગ્રંથ વાંચકોની સામે મૂકી શક્યો છું. નહીં તો આ ગ્રંથ લખવાની મારી કઈ યોગ્યતા ? કોઈએ આ કાર્ય પોતાને માથે લીધું હોત કે ? તેમની પોતાની વ્યવસ્થા પોતે જ કરનારા હોવાને કારણે મારા માથા ઉપર વળી ભાર શેનો ? મારી વાળી પ્રકાશિત કરનારા અને મારા અજ્ઞાનઝીપી અંદ્રકારનો નાશ કરનારા સાઈ સમર્થઝીપી જ્ઞાનનો દીવો મારી પાસે હોવાને

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

લીધે મારે મનમાં શંકા શા માટે રાખવી ? એ અત્યંત દ્વાળું પ્રભુનો મને સંપૂર્ણ ભરોસો હોવાને લીધે મને લેશમાત્ર પણ ત્રાસ થયો નહીં અને મારા મનની ઈચ્છા પૂર્ણ થઈ. આ ગ્રંથ એટલે તેમનો જ કૃપાપ્રસાદ છે. આ ગ્રંથડીપી સંતસેવા એટલે મારા પૂર્વના જન્મોનાં પુણ્યોનો સંગ્રહ છે માટે આ સેવા મને પ્રાપ્ત થઈ છે. હે પ્રભુ ! આ સેવા આપે મારી પાસે ખૂબ જ સુંદર રીતે કરાવી છે, આથી હું ભાગ્યવાન અને ધન્ય થયો છું. (ઓ. ૧-૬)

પાછલા અધ્યાયમાં અત્યંત દ્વાળું એવા સાઈનાથ ભક્તોને અનેક પ્રકારનાં દાણાં આપીને કેવી શિખામણ આપતા હતા તે તમે સાંભળ્યું. હવે આ ચાલી રહેલા અધ્યાયમાં નાસિક જિલ્લાના વાણી ગામ પાસે ઉદ્દોષની ઊંચાઈએ, ઊંચા શિખર પર પહોંચાની ગુજરાના ખડકોમાં કોતરેલી મૂર્તિ જેને સિંદ્ર લગાડેલું છે તથા જેના હાથ અદાર છે, અને અંદાજે ૧૦ ફૂટ ઊંચી છે. દેવીની જે સાડા ત્રણ શક્તિપીઠો છે તે મનની આ અર્ધપીઠ માનવામાં આવે છે. તે સમશૃંગી માતા એક ઉપાસકની ચમત્કારી અને આનંદ પમાડનાર કથા હવે સાંભળો. દેવ-દેવીઓ પોતાના ભક્તોને, સંતોને સ્વાધીન કેવી રીતે કરે છે. એ પણ એક ચમત્કારિક રીત જ છે. એ ભાવપૂર્વક જુઓ. સાઈમહારાજની પુષ્ટિ કથાએ છે જે એક થી એક ચાઢિયાતી છે, તેમાંની આ પણ એક કથા સાંભળવા યોગ્ય છે તે ધ્યાનથી સાંભળો એટલે તમને સમાધાન થશે અને તમને સાઈબાબાનો મહિમા અને સર્વવ્યાપકતા સર્વ ઠેકાણે અને દરેક કાર્યમાં હાજર રહેવાની શક્તિનો ઘ્યાલ આવશે. ભળતા ભળતા સંશય કરનારા અને તર્કવાહી એ આ બાબતમાં નાદે લાગવું નહીં. અહીંથા વાદ-વિવાદની જરૂર નથી પણ અપાર અને ગાઢ પ્રેમ જેઠાએ. આ કથા સાંભળનારા જ્ઞાની હોવા છતાં ભાવિક, શ્રદ્ધાવાન અને નિષ્ઠાવાન તો અવશ્ય હોવા જેઠાએ. જે સંતોની ભક્તિ આદરપૂર્વક કરી શકે. અન્યને આ કથા ખોટી લાગશે. સાઈનાથની લીલાઓનું આ કલ્પવૃક્ષ નિશ્ચિતપણે ફળ અને ફૂલ ધરાવનાનું છે. જે કોઈ ભક્ત સભળ ભાગ્ય લઈને જન્મ્યો હશે, તે જ આ ફળ ફૂલોને આ વૃક્ષ પરથી નીચે ઉતારી શકશે. આ પરમ પાવન કથા પરમાર્થની ઈચ્છા કરવાવાળાઓને મોક્ષ પ્રાપ્ત કરી આપવાના બધાં જ સાધનોમાં મુખ્ય સાધન છે. તે બધાનું કલ્યાણ કરનારી છે. જડ જીવોનું એટલે કે મતિમંદ પ્રાણીઓનો સહેતાઠી ઉદ્ધાર કરનાર આ સાઈ કથાડીપી અમૃતનું પીણું સંસારી લોકોને સમાધાન આપનારું અને મોક્ષની ઈચ્છા કરનારાને માટે જે મોક્ષનું સાધન છે. અહીં એક કથાનું મંડાણ કરતાં બીજુ અનેક કથાઓ યોજનાઓ અને પ્રસંગોની યાદ તાજ થાય છે. માટે હેમાઉપંત નમૃતાથી શ્રોતાઓને સાંભળવા માટે આમંત્રણ આપી રહ્યા છે. આવી એક એક કથાઓ કહેતાં કહેતાં સાઈલીલાઓની રસની મીઠાસ વધશે. તેમજ સંસારદીપી દાવાનાની ત્રાસેલાઓને સમાધાન થશે. શ્રી સાઈની કાર્યક્રમતા અને સમર્થતા તે આ જ છે. (ઓ. ૧૭-૨૮)

નાસિક જિલ્લાના વણી નામના ગામમાં કાકાળ વૈદ્ય નામના સપ્તશૃંગી દેવીના મંદિરના પૂજારી રહેતા હતા. આ દેવીનું નામ ‘સપ્તશૃંગી’ હતું કારણ કે તે સાત પર્વતોનાં શિખર ઉપર નિવાસ કરતા હતાં. આ કાકાળ વૈદ્ય મનથી અસ્થિર થયા હતા. અનેક ઉપાધિઓ અને આપત્તિઓથી સંસારમાં હેરાન થયેલ હતા. જ્યારે કાળયકનો ફેરો શરૂ થયા કે મન ભમરાની માફક ગોળગોળ ફરવા લાગે છે. શરીર અને મન અહીં તહીં દોડવા લાગે છે. તેમજ શાંતિ ક્ષણવાર મળતી નથી. આવી રીતે દુઃખી થયેલા કાકાળ ચિંતામાંથી મુક્ત થવા માટે દેવીના મંદિરમાં જઈને કરુણાની ભીખ માંગવા લાગ્યા. તેમજે મનથી કરેલી પ્રાર્થના સાંભળી. અને તેમનો ભક્તિભાવ જેઠાને સપ્તશૃંગી દેવી કાકાળ વૈદ્ય ઉપર પ્રસંગ થયા. તે જ રાત્રે તેમણે એક એવો અનુભવ થયો એ શ્રોતાઓ ધ્યાન દઈને સાંભળો. સપ્તશૃંગી મા કાકાળના સ્વપ્નમાં આવ્યાં અને કહ્યું કે, તું શ્રી બાબાની પાસે જી તો તારું મન સ્થિરતા અને શાંતિ અનુભવશે. આ બાબા એટલે કોણ અને કયા ? એનો ખુલાસો દેવી કરશે માટે પૂછ્યું નહીં. દેવીએ ખુલાસો ન કરતાં વૈદ્યણું મન વધુ ઉત્સુક થયું અને ત્યાં જ તેમની આંખો ખુલી ગઈ તેઓ જાગી ગયા અને તેમની જિલ્લાસા મનની મનમાં જ રહી ગઈ. અને સ્વપ્ન પુરું થઈ ગયું. માતાજી જે બોલ્યા તે બાબા

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કોણ તે અંગે કાકાળએ પોતાની બુદ્ધિ ચલાવી કે એ બાબા એટલે ‘અંબકેશ્વર’ હોવા જેઠાએ. કાકાળએ મનમાં એ જ પાકો નિશ્ચય કર્યો, અને અંબકેશ્વરના દર્શન માટે તરત જ નીકળી ગયા. પણ તેમના મનની અશાંતિ દૂર થઈ નહીં. કાકાળ ત્યાં લગભગ દરા દિવસ રહ્યાં. પણ છેવટ સુધી તેઓ ઉદાસ જ રહ્યાં. તેમના મનની પરિસ્થિતિમાં કંઈ જાઓ ફરક પડ્યો નહિં. ઉલ્ટાનું તે દિવસો દિવસ નિરુત્સાહી જ થતા ગયા. રોજ વહેલી સવારે સ્નાન કરીને રુદ્ર અધ્યાત્મનો પાઠ વારંવાર પુનરાવર્તન કરીને તેઓ શિવલિંગ ઉપર સતત અભિષેકની જગધારાઓ વહાવતા હતા, છતાં તેમના મનની સ્થિતિ બિલકુલ જ અશાંત હતી. માટે કાકાળ વણી પાછા ફર્યા અને માતાલુના દ્વારે ફરી જઈને અત્યંત કરુણાથી કાકલુદી કરીને કહેવા લાગ્યા કે, ‘મને તમે અંબકેશ્વર શા માટે મોકલ્યો ? હું ત્યાં જઈ આવ્યો, હવે તો મારું મન શાંત કર ! આવા વગર કારણના ઘક્કા મારાથી થઈ શકે તેમ નથી.’ સપ્તશૃંગી માતાલુએ તે રાત્રિના ફરીથી દર્શન આપીને કહ્યું, ‘મૈં જે બાબા પાસે જવાનું કહ્યું હતું એ તો ‘શિરડીના સમર્થ સાઈબાબા’ છે. અંબકેશ્વર તું આમ નિરર્થક જ ગયો, શા માટે ત્યાં ગયો તે સમજતું નથી.’ કાકાળ મનમાં વિચાર કરવા લાગ્યા. ‘આ શિરડી વળી કયાં આવ્યું ? ત્યાં કેવી રીતે જવું ? આ સાઈબાબા કોણ છે તે પણ મને જરાયે ખબર નથી. હવે ત્યાં જવાનું કેવી રીતે બનશે ? કંઈ જ સમજતું નથી.’ પણ જે સંતનાં ચરણમાં આસકત થઈને અભિલાષા રાખે છે તેની તે ઉત્તમ ઈરણ સંત નહિં, પણ જાતે પરમેશ્વર જ પૂર્ણ કરે છે. દેરેક સંત બધા જ ઈશ્વર હોય છે, બંનેમાં લેશમાત્ર પણ ફરક હોતો નથી. તેમને બંનેને જુદા માનવા એ જ દેત છે. સંતોની ઈશ્વરની સાથે હંમેશા એકરૂપતા હોય છે. હું મારી પોતાની ઈચ્છાથી સંતોનાં દર્શને ચાલીને જઈશ અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરીશ એવું કહેવું પણ કેવળ અહંકાર અને બડાશ મારવા જેવું છે. સંતોનાં કાર્યોની યોજના કલ્પના બહારની હોય છે. સંતોનાં મનમાં આવ્યા સિવાય તેમના દર્શને કોણ જઈ શકે ? આશ્ર્ય તો તે વાતનું છે કે, તેમની પરવાનગી વગર જાણાં પાણ પણ હાલતાં નથી. જેવી જેની દર્શન કરવા માટેની ઉત્કંઠા જેવો જેનો ભાવ અને નિષ્ઠા તેવો જ તે ભક્ત શ્રેષ્ઠને સ્વઅનંદનો પરાકાષ્ઠાનો અનુભવ થાય છે. (ઓ. ૨૮-૪૮)

સાઈબાબાનાં દર્શન માટે કેવી રીતે જવું તેની કાકાળને ફિકર થઈ રહી હતી. તે દરમિયાન જ ત્યાં તેમનું દેકાણું શોધતો શિરડીનો મહેમાન આવી પહોંચ્યો. આવેલો એ કોઈ સામાન્ય માણસ હતો ! જે બધા કરતાં બાબાને વધારે માનીતો હતો. જેમનું નામ માધવરાવ - શામા હતું. જેમની દેશાપાંડે પણાની વતનમાં વંશપરંપરાની નિમણૂંક હતી. જેમના વીના બીજા કોઈની બાબા પાસે લાગવગ ચાલતી ન હતી. જેની સાથે બાબાનો હંમેશા માટેનો પ્રેમનો ઝઘડો રહેતો, અરે... તુરેનો સંબંધ અને એકબીજાની સાથે બોતાવાનું આવું જ કંઈક હતું. બાબા સાથે તેમનો પોતાના દીકરા કરતાં પણ વધારે પ્રેમ હતો. એવો એ મહેમાન એ વખતે જ વાણી આવી પહોંચ્યા. માધવરાવ નાના હતા ત્યારે બીમારીથી કંટાળેતી તેમની માએ સપ્તશૃંગી માતાલુની બાધા રાખેલી. ‘તારા હાથમાં મારું બાળક અર્પણ કરું છું તેને તારવું કે મારવું તારા હાથમાં છે. મારું બાળક સારું થશે તો તેને નિશ્ચિતપણે તારા ચરણોમાં સૌંપી દઈશ અને તારાં દર્શન માટે જરૂરથી લઈ આવીશ.’ આવી બાધા રાખતાં બાળકને આરામ થયો હતો. વૈદ્ય શું કે દેવ શું, એનું કામ પતી જતા તેઓ ભૂલી જવાય છે. બાધાની યાદ તો સંકટ ટળતું નથી. ત્યાં સુધી જ હોય છે. જે તેને પૂરી ન કરાય તો એક ભયનું કે બીકનું કારણ બનતું હોય છે. કેટલાયે દિવસો અને વર્ષો વીત્યાં અને માધવરાવની મા તેણે લીધેલી બાધા વિસરી ગઈ. છેવેટે મૃત્યુના સમયે તેમણે માધવરાવને વિનવ્યા. ‘ઘણાં વર્ષો પહેલાંની આ બાધા છે પૂરી કરતાં કરતાં મારો આ દિવસ પણ આવી ગયો. આટલું બધું મોહું કે આળસ સારી નહીં. દેવીનાં દર્શને જલ્દીથી જઈ આવજે.’ તેમની માના બંને સ્તનો ઉપર કોઈ ચર્મ વ્યાધિને લીધે ભીગડા થયેતા આથી એ ખૂબ ત્રાસી ગયેલાં. સહન ન થવાને કારણે તેમણે માતાલુની એક બીજી પણ બાધા રાખી હતી. ‘તને હું દંડવત્ પ્રાણમ કરું છું. આ બીમારીમાંથી મારો છૂટકારો કરાવશે તો ચાંદીનાં બે સ્તનો તારા ઉપરથી ઉતારીને તને અર્પણ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કરીશ.' તે બાધા પૂરી કરતાં કરતાં રહી ગઈ હતી. તે પણ માધવરાવની માને અંત સમયે યાદ આવી. તેની પણ યાદ દેવડાવી બાધા પૂર્ણ કરાવવાનું વચ્ચેન લેવડાવીને અને પોતે ઈચ્છારહિત થઈને હરિચરણમાં વિતીન થઈ ગયા. જરૂર, જરૂર કરતાં દિવસો અને મહિના અને વર્ષો વીતી ગયાં. માધવરાવ પણ તે વાતને ભૂલી ગયા. અને તેમની માની બંને માનેલી બાધાઓ પૂર્ણ કર્યા વગર જ રહી ગઈ. (ઓ. ૫૦-૬૩)

આમ ત્રીસ વર્ષ વીતી ગયાં અને શિરડીમાં શું બન્યું તે હવે જુઓ. એક જ્યોતિષી પ્રવાસ કરતો કરતો ત્યાં આવી પહોંચ્યો. તે એ શાસ્ત્રનો ખૂબ જ ઉંડો અભ્યાસી હતો. સંપૂર્ણ જ્ઞાની હોવાને કારણે તે ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણતો હતો. વિવિધ પ્રક્રિયા પૂર્ણનારાઓના મનનું સમાધાન કરીને તેણે સારી એવી વાહવાહ મેળવી હતી. શ્રીમંત કેશવરાવજ બુઝી તે જે નાગપુરના શ્રીમંત બાપુસાહેબ બુઝીના ચિરંજલી હતા તેમને તથા પુષ્કળ માણસોને ભવિષ્યમાં બનનારી વાતોનું ભવિષ્ય કહીને, ઘણા બધાને એ જ્યોતિષીએ સમાધાન કરાયું હતું. માધવરાવના નાના ભાઈ બાપાજીએ પોતાનું ભવિષ્ય પૂર્ણતાં, પેલા જ્યોતિષીએ કોઇ દેવીની તેમની ઉપર નારાજગી થઈ છે એવું કહ્યું. તેમણે ખુલાસો કરતાં બીજું પણ કહ્યું કે, 'તમારી માચે મૃત્યુ સમયે લીધેલી બાધા તારા મોટાભાઈને પૂર્ણ કરવાની આજા કરી હતી. જે આજદિન સુધી પૂર્ણ ન કરવામાં આવતાં તને આ ત્રાસ ભોગવવો પડે છે. તેમજ એ જ તને નડી રહી છે.' માધવરાવ ઘરે આવતાં જ બાપાજીએ વાત કહી સંભળાવી. તે સાંભળીને માધવરાવને એની યાદ આવી. સોનીને બોલાવીને ચાંદીનાં બે સ્તનો ઘડાવી લીધાં, અને તે લઈને તેઓ મસ્જિદમાં ગયા. બાબાને પ્રણામ કરીને એ બંને ચાંદીનાં સ્તનો આગળ મૂકી દીધાં, અને બોલ્યાં, 'આ બાધા પૂરી કરી આપ. તું જ અમારી સપ્તશૃંગી છે, તું જ અમારી દેવી છે. આ લે... કબૂલ કર્યા પ્રમાણે સ્વીકાર કર ને અમારું નડતર દૂર કર.' શ્યામાની વાત સાંભળતા જ બાબાએ જવાબ આપ્યો, 'સપ્તશૃંગીના મંદિરમાં જઈને તારા હાથે જ આ સુંદર સ્તનોને એમનાં ચરણો ઉપર મૂકી આવ.' બાબાનો આવો આગ્રહ જેઠને માધવરાવે પણ મનમાં એ જ પ્રમાણેનો વિચાર કરીને, દેવીનાં દર્શને જવાનો વિચાર કર્યો. તેમણે બાબાનાં દર્શન કર્યા અને આશીર્વાદ માગ્યા. શામાએ આજા લીધી, બાબાએ તેમને ઉદ્દીપ્રસાદ આપ્યો અને તેઓ શિરડીથી સપ્તશૃંગી આવ્યા. ત્યાં પહોંચતા જ પોતાના પૂર્વજેના સમયથી ચાતી આવતા ઉપાધ્યાયની શોધ કરવા લાગ્યા. સારા નસીબે અચાનક જ તેઓ કાકાળના ઘરે આવી પહોંચ્યા. સાઈબાબાની જલદીમાં જલદી મુલાકાત લેવી એવી કાકાળના મનમાં ઉત્સુકતા તો હતી જ. એમાં પાછી માધવરાવની મુલાકાત થવી તે કંઈ સીધી સાદી વાત છે ? કાકાળની પાસે તેઓ અચાનક પહોંચ્યા, ત્યાં જ તેમણે પૂછ્યું, 'આપ કોણ અને કયાંથી પદ્ધાર્યા છો ! શામાએ કહ્યું, 'હું શિરડીથી આવું છું.' તેવું જાણતાં તેમને આનંદનો પાર ન રહ્યો. તેઓ બંને પ્રેમથી બેટી પડ્યા. આમ તેઓ બંને પ્રસત્તાચિત્તે સાઈબાબાની લીતાઓનાં ગુણગાન ગાવા લાગ્યા. તેમજ બાધાનું કામ પૂર્ણ થતાં કાકાળ વૈદ્ય માધવરાવ સાથે શિરડી જવા નીકળ્યા. માધવરાવ જેવાનો સંગાથ અને તે પણ આવી અજાધારી રીતે મળતાં ઉપાધ્યાય બુવા ખૂબ જ આનંદમાં આવી ગયા. એમનું બધું જ ધ્યાન શિરડી કયારે પહોંચાય છે એમાં લાગી ગયું. બાધા પૂર્ણ થયા બાદ પહેલાં જેવી મનની તૈયારી હતી એવા જ ઉતાવળે કાકાળ નીકળ્યા અને ત્યાં ગોદાવરીના કિનારે નાસિક આવી પહોંચ્યા અને તરત શિરડી તરફ પ્રયાણ કર્યું. શિરડી આવતાંની સાથે જ ખૂબ પ્રેમથી અને ઉત્સુકતાથી સાઈબાબાના દર્શને, મસ્જિદમાં આવ્યા અને કાકાળએ બાબાનાં ચરણમાં વંદન કર્યું. અશ્રુપૂર્ણ આંખોને ધોઈ નાંખી અને દર્શનનું સુખ સંપત્ત થયું. જે કારણસર દેવીએ સ્વપ્ન આપ્યું હતું એવા એ સાઈસમર્થને નજરથી નિરખતા કાકાળ ખરા અર્થમાં સુખી થયા. તેમના મનોરથ પૂર્ણ થયા. સાઈદર્શનથી કાકાળ સુખ સંપત્ત આનંદચિત્ત થયા. તેમજ બાબાની અત્યંત કૃપાની વર્ષથી તેમનું મન નિશ્ચિત થયું. તેમના મનની જે ચંચળતા

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

હતી, તે શામી ગઈ. કાકાળને તેની નવાઈ લાગી. પોતે જ પોતાની જતને પ્રશ્ન કર્યો, ‘કેવી વિચિત્ર આ કરણી ! નથી એક શબ્દ બોલ્યા, કે નથી એક પણ પ્રશ્ન પૂછ્યો, નથી કોઈ આશીર્વાહ આપ્યો. ફક્ત એમના દર્શન માત્રથી જ મારા મનની ચંચળતા શાંત થઈ અને એક પ્રકારની અતૌકિક સુખ સમૃદ્ધ પ્રાપ્ત થઈ. આને જ કહેવાય છે સાઈનાં દર્શનનો ભહિમા.’ કાકાળની દષ્ટિ બાબાનાં ચરણોમાં ઝીલી ઊઠી અને તેમના મુખમાંથી એક પણ શબ્દ નીકળી શક્યો નહિ. બાબાની વાતો કાને પડતાં જ પોતાના આનંદનો પાર ન રહ્યો. કાકાળ વૈદ્ય ઉપાધ્યાય બુવા ભક્તિભાવથી સાઈસમર્થના શરણે ગયા અને પોતાના મનની શાંતિ પાઈ મેળવી. આ પ્રકારે કાકાળ શિરડીમાં બાર દિવસ સુધી રોકાયા અને સ્થિર મન સાથે સખણુંગી પાછા ફર્યા. (ઓ. ૬૪-૬૧)

સ્વર્ણો સાચા પઢવા માટે પ્રાતઃકાળનો સમય હોવો જરૂરી છે. આ સમયે આવનાર સ્વર્ણાં જ સાચા પડતાં હોય છે, અને બાકીના સમયમાં દેખાતાં સ્વર્ણો સાર્થક થતાં નથી. એવી એક જગપ્રસિદ્ધ વાત છે. પરંતુ શિરડીમાંનાં સ્વર્ણો કોઈ પણ સ્થાને અને કોઈપણ સમયે આવે તો પણ ભક્તોને તેનો વિના અવરોધ અનુભવ થાય છે જ. આવી એક કથાની સંપૂર્ણ હકીકત હવે શ્રોતાઓને કહું છું. એ સાંભળીને નવાઈ લાગશે. તેમ જ બાબાની બીજી બધી કથાઓ પણ સાંભળવાનો ઉત્સાહ વધશે. એક દિવસે ભર બપોરે બાબા કાકાસાહેબ દીક્ષિતને બોલ્યા, ‘ટાંગો કરીને રહતા જા, અને ખુશાલભાઉને લઈ આવ. ‘ઘણા દિવસો થયા તેમને મળવાની મારા મનમાં ઇચ્છા થઈ છે, માટે તેમને મળવાને બોલાવ્યા છે. એવું એમને કહેજે.’ દીક્ષિતે બાબાની આજ્ઞા શિરોમાન્ય રાખી, ટાંગો કરીને તરત જ રહતા ગયા. ખુશાલભાઉ મળતાં જ પોતાનું આવવાનું કારણ કહ્યું. બાબાનો સંદેશો સાંભળીને ખુશાલભાઉને ખૂબ આશ્ર્ય થયું અને બોલ્યા, ‘હમણાં જ એક ઊંઘ કાઢીને ઊભો થયો છું. ઊંઘમાં પણ બાબાએ મને સ્વર્ણમાં આવીને આવું જ કહ્યું. હમણાં જ શિરડી આવ’ એવું બોલ્યા. મને પણ પ્રબળ ઇચ્છા થઈ પણ શું કરું, ઘોડો પાસે ન હતો માટે છોકરાને મેં બોલાવ્યો છે. પણ છોકરો ગામની ભાગોળે પહોંચ્યો હશે એટલામાં જ મારે ત્યાં ટાંગો આવ્યો અને ખરેખર જ સ્વર્ણમાં જેમ ટાંગો આવ્યો, તેવું આ હકીકતમાં બન્યું.’ ખુશાલભાઉની વાત સાંભળતા દીક્ષિત ગમ્ભત કરતાં બોલ્યા, ‘માટે જ બાબાએ મને ટાંગો લઈને જ મોકલ્યો છે. તમે જે આવવા તૈયારી બતાવતા હો તો ટાંગો બહાર જ ઊભો છે.’ પછી ખુશાલભાઉ આનંદિત મનથી દીક્ષિતની સાથે શિરડી આવ્યા. એનો ભાવાર્થ કહેવાનો કે, ખુશાલભાઉને પણ બાબાનાં દર્શનની ઇચ્છા હતી તે પૂર્ણ થઈ. ખુશાલભાઉનું મન પણ બાબાની આવી લીલા જેઠિને ઘણાં જ ખુશી પામ્યું. (ઓ. ૮૨-૧૦૩)

એક દિવસ મુંબઈમાં વસતા રામલાલ પંલભી નામના એક બ્રહ્માણને સ્વર્ણમાં બાબાએ દર્શન આપ્યાં. આકાશ-વાયુ-રવિ-વર્ણણ તેમની કૃપાના પ્રભાવથી બાધ્ય અને આંતરિક વિષયોનું જે જ્ઞાન થાય છે તેને જગૃત અવસ્થા એવું કહેવામાં આવે છે. બધી ઠન્દિઓ જ્યારે વિરામ કરતી હોય છે ત્યારે જગૃત અવસ્થાનો મન ઉપર ઉપસેલો સંસ્કાર જગી જઈને ગ્રાધ્ય અને ગ્રાહક એને સ્વીકારનારો તેના ઇપે મનમાં એનું સ્કૂરણ થાય છે તેવું જ આ સ્વર્ણ લક્ષ્ણ છે. પણ તે રામલાલનું સ્વર્ણ વિચિત્ર હતું. કેમ કે તેમને બાબાના ઇપે કે ગુણની ખબર જ ન હતી, કે તેમણે બાબાનાં દર્શન પણ કરેલાં નહીં છતાં તેમને કહ્યું કે, ‘મારી પાસે આવી જા.’ એવું તે બોલ્યા. આકાર ઉપરથી તો તેઓ કોઈ સાધુ જ જણાતા હતા. પણ તેઓ ક્યાં રહેતા તેની ખબર રામલાલને ન હતી. રામલાલ જગી ગયા અને બેઢા થઈ ગયા. વિચારમાં દૂબી ગયા. તેમજ તેમને સ્વર્ણમાં આપેલ દર્શનવાળા સાધુ પાસે જવાની મનમાં ઇચ્છા થઈ. તેમના નામ ડામની ખબર તો એમની પાસે ન હતી. છતાં જેને તે દર્શન માટે બોલાવે છે, એની ચુક્તિની તેને જ ખબર હોય છે. પછી એ જ દિવસે બપોરે રસ્તા ઉપર લટાર મારતાં એક દુકાનમાંની છબી ઉપર તેમની ઓંચિંતી નજર પડતાં રામલાલ ચમક્યા. તેમને સ્વર્ણમાં જે ઇપે દેખાયું હતું તે આ જ છે, એવું તેમને સમજાયું. તે તરત જ પેલા દુકાનદારની પાસે જઈને પૂછપરછ કરવા લાગ્યા. ધ્યાન

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

દઈને તે છબી જેતાં તે કોણ અને ક્યાંના છે એમ પૂછતાં તેઓ સાઈ સમર્થ શિરડીમાં રહેનારા એવી જાણ થતાં રામલાલ સ્વસ્થ થઈ ગયા અને નામ ઠામ વગેરે મળતાં તે ઓ શિરડી પહોંચી ગયા. બાબાના તેઓ પરમ ભક્ત બની ગયા અને જીવનના અંત સુધી શિરડીમાં જ રહ્યા. (ઓ. ૧૦૪-૧૧૩)

પોતાના ભક્તોની ઈચ્છા પૂરી કરાવી, તેમને દર્શન માટે શિરડી બોતાવવા અને એમના સ્વાર્થ અને પરમાર્થ સાધી આપવા એ જ બાબાનો ઉદ્દેશ રહેતો. આમ પણ તેઓ હરહંમેશને માટે સર્વ ઈચ્છા પૂર્ણ થયેલા હતા. નિષ્કામ, નિસ્વાર્થ, નિરઅહંકાર અને કોઈપણ વસ્તુના મોહ વગરના હોવા છતાં ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે જ એમનો આ અવતાર હતો. કોથે જ્યાં પવનની માફક ફૂકાતો નથી, દ્વેષને જ્યાં સ્થાન નથી, અને ભત્તલબી માણસો તરફ પાછું વાળીને પણ જે જેતા નથી અને જેમનો બધા ઉપર નિઃસ્વાર્થપણે પ્રેમ છે, ને એ જ જીવનનો શેષ અને અંતિમ દ્યેય છે. જે ધર્મ વિષે વિષય સિવાય કાણ પણ વાચાને છૂટો દોર આપતા નથી તેમને ખરેખરમાં ‘સાધુ સમજવા’ ટૂંકાણમાં મારો હાથ પકડીને બાબાએ જે મારી પાસે ચરિત્ર લખાવ્યું છે, તેના ઉદ્દેશમાં ભક્તોએ બાબાનાં સમરણોની યાદમાં રંગાઠ જઈને મળન થઈ જવું તે જ છે. માટે હેમાઉપંત ખૂબ જ વિનયથી શ્રોતાઓને એક સરખી રીતે વિનવી રહ્યા છે કે તેમણે સાઈનું સચ્ચારિત્ર હંમેશા શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સાંભળવું અને સમય કાઢી વંચાય તેઠલું અવશ્ય વાંચવું. અવાજનવાર તેમના ચરિત્રગાનના પઠનથી દરેક વખતે અલગ અલગ કંઈ ને કંઈ નવું જ જાણવા મળશે. જેથી મન શાંત થશે. દુરાચરણો તરફ ઉદાસીનતા ઉપજશે અને સંસારમાંથી સંપૂર્ણ મુક્તિ અપાવનારાં એવા સાઈના પાવન ચરણોમાં ભક્તિ દફ થશે. (ઓ. ૧૧૪-૧૨૦)

હવે આગલા અધ્યયામાં સંન્યાસી વિજ્ય આનંદ જેમને માનસરોવર જતી વખતે, બાબાનાં શરણમાં મુક્તિ મળી તેમની કથા આવશે. ભક્ત બાળારામ માનકર તેમને પણ એવો જ વિસામો આપ્યો હતો. તેમજ તાત્યાસાહેબ નુલકર અને મેઘાની પણ ઈચ્છા સાઈનાથ યથેચ્છ પૂર્ણ કરશે. એટલું જ નહિ પણ વાધ જેવો ફૂર પ્રાણીને પણ બાબા પોતાનાં ચરણમાં જગ્યા આપશે. આવી સાઈબાબાની અગાધ લીલાઓ સાંભળવાનો દુર્લભ લહાવો અને આનંદદાયક પ્રસંગ યોજશે. (ઓ. ૧૨૧-૧૨૩)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનની પ્રેરણા પામેલા, ભક્ત હેમાઉપંત રચિત.

શ્રી સાઈસમર્થના સત્ય ચરિત્રના ‘નવસાદી-કથા-કથનમ્’ નામનો ત્રીસમો અધ્યાય સમાપ્ત થાય છે.

શ્રી સદગુરુ સાઈનાથને અર્પણા.



## અધ્યાય ૩૦નું અર્થ વિવરણ

આ અધ્યાય અને આ પહેલાનાં બે અધ્યાયો ભક્તોને આપેલાં દશાંતર્ઝી સ્વખો વિષેના છે. આવાં સ્વખ અને વ્યવહારમાં હંમેશા આવનાર સ્વખ, આમાં શો ફરક છે તેનું વિવેચન આ ડેકાણે કરવું ચોગ્ય જ ઠરશે.

જાગૃત અવસ્થામાં આપણે જે વાતો જોઈએ છીએ, અનુભવીએ છીએ અને તેનું જ આપણા મન પર, સ્વભાવ પર અને વિચારો અનુસાર જે પરિણામ થાય છે તે જ આપણે સ્વખોમાં જેતા હોઈએ છીએ. મુખ્ય એ કે સ્વખમાં આવનારા અનુભવોનો આપણા મૂળ સ્વભાવ સાથે અને સ્વખમાં દેખાનારી વ્યક્તિનો અથવા તો પદાર્થનો આપણી તે અંગેની ભાવના સાથેનો સંબંધ હોય છે. દાખલા તરીકે, આપણો કોઈ એક વ્યક્તિ ઉપર પ્રેમ હોય તો તેનું સ્વર્ણપ સ્વખમાં આંખો સામે આવીને તેનો આપણને આનંદ આવતો હોય છે. તેવી જ રીતે કોઈ એક વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર, વેર કે ભય લાગતો હોય તો સ્વખમાં આપણે તેની સાથે લડતા હોઈએ છીએ. અમુક વખતે તો કલ્પનાના ઊંચા કૂદકા મારીને સ્વખમાં આપણે ભળતી જ ઘટનાઓ અને વ્યક્તિઓને જેતાં હોઈએ છીએ. આ બધાનો ત્યાર બાદ તેનો જાગૃત અવસ્થા સાથે કોઈપણ સંબંધ હોતો નથી. કહેવાય છે કે, વહેલી સવારે આવેલાં સ્વખો સાચા જ ઠરે છે. પણ યોગાનુયોગ બનેલ અમુક ઘટનાઓ ઉપરથી અમુક લોકોએ માની લીધેલી આ વાત છે. એ સોચે સો ટકા ખરું જ ઠરે છે એવું નથી.

દશાંતની માત્ર એક જુદી જ પરિસ્થિતિ હોય છે. પ્રથમ દશાંત આપણા આરાધ્ય દેવતા, સદ્ગુરુ અથવા એકાદ સંત પાસેથી મળતાં હોય છે. સાધારણ માણસ તરફથી નહીં. દશાંતના સ્વખમાં પણ જેની ઉપર આપણી શ્રદ્ધા અને પ્રેમ છે, તેવી વ્યક્તિ સામે દેખાય છે. એમાં શંકા નથી, પરંતુ કોઈ કોઈવાર આપણે પહેલાં ન જેયેલી વ્યક્તિ પણ આપણી સામે આવીને કોઈ આદેશ આપી જતી હોય છે. આ અનુભવનો અથવા તો દર્શનો આપણી પહેલાંની જાગૃત અવસ્થા સાથે સંબંધ હોય છે જ, એવું નથી. માત્ર ફરીથી જાગૃત થતાં સ્વખમાં જેયેલી ઘટનાની અથવા આદેશની સો ટકાની પ્રતીતિ થાય છે.

શાંતાકુળના લખમીચેદે સ્વખમાં દાઢીવાળા મોટી ઉભરે પહોંચેલા સાધુને જેથા અને ત્યારબાદ એમની છબી એમણે દાસગણુના કિર્તનમાં જોઈ અને એ જોઈને તેઓ બાબા પાસે શિરડીમાં ગયા અને સુખી થયા. બહરાનપુરની બાઇના સ્વખમાં પહેલાં કદાપિ ન દર્શન થેયેલા એવા, સાઈ મહારાજ આવ્યા અને ખીચડી માગી. તે બાબા બનતાં તે પોતાના પતિને લઈને શિરડી ગઠ તેમજ ખીચડીનું નૈવેદ્ય ધરતાં બાબાએ તે થાળી બે હાથથી ખેંચી લઈને ખીચડીના કોળીયા પર કોળીયા મુખમાં મુક્યા. શંકર ભક્ત મેધાને સ્વખમાં બાબાએ ત્રિશૂળનું ચિત્ર ભીત ઉપર દોરવાની આજા કરી અને તરત જ બીજા દિવસે તેને પૂનાથી અચાનક આવેલું શંકરનું લિંગ બાબા પાસેથી મળ્યું.

મદ્રાસી ભજનિક ગૃહસ્થને સ્વખ આવ્યું અને તેમાં સાઈબાબા સાથે, ‘પ્રશ્નોત્તર અનુવાદ રચાયો’ અને જાગૃત થતાં સાઈબાબા માટેની સંશયવૃત્તિ નાશ પામી. અને તેમનાં ચરણોમાં તેની ભક્તિ દઠ થઈ. આ કોઈ સાધારણ સ્વખ ન હતું કે ? રધુનાથ તેંદુલકરને અર્ધા પગરા જેટલું પણ પેન્શન મળશે કે નહીં તેની ખાત્રી ન હતી. તેની તેને ચિંતા હતી. સાઈબાબાએ તેની પત્નીના સ્વખમાં જઈને સો ડ્રિપિયા પેન્શન મળે તો પુરતું છે ને ? એમ પૂછ્યું અને ‘આ શું પૂછો છો અમને તમારો જ ભરોસો ॥’ આવો પૂર્ણ શ્રદ્ધાયુક્ત જવાબ આપતાં પ્રસંગ થઈને વધારાના દસ ડ્રિપિયા બાબાએ અપાવ્યાનો મધુર અનુભવ તેમને થયો.

ડૉક્ટર કેન્ટન હાટેને સાઈબાબાએ જવાલિયરમાં મળસ્કે સ્વખમાં દર્શન આપ્યાં અને કહ્યું કે ‘મને ભૂલી ગયો કે ?’ એવું પૂછ્યું. હાટેએ બાબાના પગ તરત પકડી લીધા અને ‘બાળક જો માને ભૂલી જાય । તો એનો તરણ ઉપાય શો ॥’ માટે

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

બાગમાં તાજુ વાલપાપડી તોડી સીધું સામગ્રી ભેગી કરી અને દક્ષિણા સાથે એ છાબડી અર્પણ કરતા હતા. એવામાં એમની આંખ ઉઘડી ગઈ અને એ સ્વભનું એમ જ સમજયું. છતાં તેમણે પોતાના મિત્રને ઉતાવળે પત્ર મોકલાવીને સીધું વાલપાપડી અને દક્ષિણા શિરડી પહોંચતાં કરીને બાબાને અર્પણ કરવા માટે વિનંતી કરી. તે મિત્રે તે જ પ્રમાણે કરતાં નિમોણકરે બીજી દિવસે એની રસોઈ બનાવીને નૈવેદ્ય લઈ જતાં બાબાએ બીજી કોઈપણ વસ્તુને હાથ ન લગાડ્યો અને વાલપાપડીનું શાક ફક્ત લઈ લીધું અને ખાયું.

સપ્તશૃંગીના પુલારી કાકાળ વૈદ્યને સાઈબાબાનું નામ પણ ખબર ન હતું, તેમજ શિરડી કયાં આવ્યું છે તેની પણ ખબર ન હતી. સ્વભનું સપ્તશૃંગી દેવીએ મનની અસ્વસ્થા દૂર કરવા માટે, બાબા પાસે જવા કહ્યું અને સાચેસાચ બીજે દિવસે કલ્પના પણ નહીં હોય કે, તેમને માધવરાવ દેશપાંડે જેવાનો સંગ્રામ મળશે. અને કોઈપણ જતનો પ્રયાસ કર્યા વીના શિરડી જવા મખ્યું અને તેમને સાઈનાં સહેલાઈથી દર્શન થયાં. આથી મન શાંત થઈ ગયું. રાહતાના ખુશાલભાઉ બપોરે જમીને આરામ કરતા હતા, તેવામાં તેમની આંખ બંધ થઈ અને બાબાએ સ્વભનું આવીને તેમને કહ્યું, ‘હવે શિરડીમાં આવીજા.’ તેમને જગતાની સાથે શિરડી જવા માટેની પ્રબળ ઈચ્છા થઈ પણ ઘોડો પાસે ન હોવાને કારણે સગવડ થઈ નહીં. એ આશ્વર્ય તો એ થયું કે બાબાની આજાથી કાકાસાહેબ દીક્ષિત ટાંગો લઈને રાહતા તેમને લેવા આવ્યા. પંન્જબી ખ્રાલણ રામલાલ મુંબઈમાં રહેતા હતા. તેમને બાબાના ઢપની કે લક્ષ્ણાંની કોઈપણ ખબર ન હતી. કેમ કે તેઓ પહેલા કદાપિ શિરડી ગયા ન હતા. તેમને બાબાએ સ્વભનું ‘મારી પાસે આવી જ’ એવો હુકમ કર્યો. એ જ દિવસે આપોઆપ બજરમાં લટાર મારવા જતાં એક હુકાનમાં બાબાની છબી ટાંગલી જેઠિને વિગત પૂછતાં તેઓ શિરડી ગયા અને જીવન પર્યંત શિરડીમાં જ રહ્યા. દાબોલકરને હોળીના દિવસે વહેલી સવારે ઊંઘમાં સ્વભનું આવ્યું. ‘જુઓ સાઈની લીલા। સુંદર વેશ સંન્યાસી હતા। મને દર્શન આપીને જગાડે છે। આવું છું હું ભોજન માટે આજે ॥૧૧૪॥’ અને ખરેખર બપોરે સો જમવાની શરૂઆત કરતા હતા એટલામાં દાબોલકરના બે મુસલમાન મિત્રો અચાનક જ શ્રી બાબાની સુંદર તસ્વીર લઈને આવી પહોંચ્યા. જણે કે બાબા જ સાક્ષાત જમવા માટે આવ્યા ન હોય ?

ઉપર જણાવેલા દાખલા ઉપરથી વાંચકોએ વ્યવહારિક સ્વભનું કરતાં દશાંત થોડાં જુદાં પડતાં હોય છે તે સમજશે. કેટલાયે ભાવિક ભક્તોને બાબા સ્વભનું દેખાયા અને તેમની સાથે વાતો પણ કરી એવો ભાસ થયો, માટે એમાં ભરમાઈ જઈ ઓતપ્રોત થઈને મોટી આધ્યાત્મિક પ્રગતિ થઈ છે. એવું સમજણે અથવા પોતાને બાબાશ્રીનો સાક્ષાત્કાર થયો છે એવું માનીને તેઓ બધાને કહ્યા કરતા હોય છે. હકીકતમાં રાત-દિવસ બાબાનું જ ધ્યાન અને સ્મરણ ચાલતું હોવાને લીધે અને બાબાએ આપણે દર્શન આપવા જેઠિએ. અને અમારી સાથે વાતો કરવી જેઠિએ એવું મનમાં સતત લાગતું હોવાને કારણે એવું જ સ્વભનું પણ દેખાતું હોય છે. પણ આ બધો મનનો ખેલ છે અને કલ્પનાનાં જણાં છે. અર્થાત્ પેલા ભક્તને બાબા માટેની ભક્તિની ઘેલણા જરૂર છે. પણ આ વાત કાંઈ ઓછા મહત્વની નથી ? પરંતુ આ સ્વભનું આવ્યા તેથી બાબાશ્રી જાતે જ આપણી સમક્ષ પ્રગત થયા અને આપણને તેમનો સાક્ષાત્કાર થયો, એવું સમજ લેવામાં માલ નથી. તે માટે જગૃત થયા બાદ કોઈ પણ પ્રકારનો પ્રત્યક્ષ અનુભવ થયો જેઠિએ.

આ બધું કહેવા પાછળનું ધ્યેય એટલા માટે કે અસલમાં ગેરસમજથી કોઈ ભક્તે અહંકારનો સહારો લઈને ગર્વમાં ગરકાવ થવું નહીં. અથવા તો જેને લીધાએ આપણી પોતાની આગળ ઉપરની પ્રગતિ અને સાધના ઝંઘાઈ જય એવું પણ કરવું નહીં.



## ॥ અદ્યાય ૩૧ ॥

### દર્શન મહિમા

(મરણ સમયે સંતના દર્શનનો મહિમા)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,  
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

દષ્ટિ સામે સંતચરણ । થતાં જે પ્રાણીનું મરણ ।  
ધન્ય દેહ તે કૃષણાર્પણ । પુનર્જન્મ ના તેને ॥૧૪૮॥  
સંતની દષ્ટિ સન્મુખ । મરણ નહીં તે વૈકુંઠ સુખ ।  
જીત્યો તેણે મૃત્યુલોક । ન ફરી તેને જન્મનો શોક ॥૧૪૯॥  
સંત દેખતાં દેહ છોડે । ન તેને ફરી આવવું પડે ।  
સર્વ પાપ નષ્ટ થાયે । ઉદ્ધારગતિ પામ્યો અચિત તે ॥૧૫૦॥  
\*આનભાગ્ર સંત અવલોકન । કરતાં કરતાં જે દેહપતન ।  
તેને કેમ કહેવાય મરણ । એ તો સાચું નિજ ઉદ્ધારણ ॥૧૫૧॥

(\*આનભાગ્ર - પગના નાખથી માથા સુધી)

પાછલા અદ્યાયમાં સપ્તશૃંગી દેવીના ભક્તની કથા કહેવામાં આવી. માધવરાવની બાધા બાબાએ કેવી રીતે પૂર્ણ  
કરી તથા ખુશાલશેઠને અને રામલાલને સ્વર્ણમાં કેવાં દર્શન આપ્યાં તેમજ રામલાલ પંજબીને જીવન પર્યાત કેવા પોતાની  
પાસે રાખ્યા તે બધાનું વર્ણન પુરુ થયું. તેનાથી પણ અપૂર્વ આ બાકી રહેલી કથા શ્રોતાઓએ ખૂબ જ ધ્યાન દઈને  
સાંભળવી. એક સંન્યાસી હિમાલયમાં આવેલા માન સરોવરમાં જતાં મુક્કિત કેવી રીતે પામ્યા. બાલકરામ માનકર, તાત્યાસાહેબ  
નૂલકર અને મેઘાને પણ હેતુ કેવી રીતે પાર પડ્યો, આ તો મનુષ્યો હતા પણ એક ફૂર ઉગ્ર હિંસક વાધ જેવાને પોતાનાં  
ચરણોમાં સ્થાન કેવી રીતે આપ્યું તે બધી કથા ખૂબ વિસ્તૃત છે, તેમજ ગ્રંથનો વિસ્તાર વધે માટે એનો પણ સંક્ષિપ્ત સાર  
કહી રહ્યો છું. જે કલ્યાણકારક થશે. (ઓ. ૧-૫)

મૃત્યુ સમયે જેવી બુદ્ધિ વિચાર અને ભતિ હોય છે, તે જ પ્રમાણે પ્રાણી માત્રને આગલા જન્મની ગતિ મળતી હોય  
છે. ભગવદ્ગીતા, અ. ૮માં તે બાબાને આ પ્રમાણે જણાવ્યું છે. યં યં વાપિ સ્મરનભાવ ત્યજન્યને કલેવરમ્. તં તમેવૈતિ  
કૌત્યેય સદા તદ્દ્બાવભાવિત: ॥૬॥ અંત સમયે મનુષ્ય જે જે બાવોનું સ્મરણ કરીને દેહ છોડે છે, એ જ ભાવમાં સદાય  
રૂગાયેલો હોવાને લીધે એને જ પામે છે. દાખલા તરીક કીડાઓ ભમરીના ઊંખ ડરથી સ્વયં ભમરી થાય છે. એક હરણી  
જેનું મન ચોટેલું અને તેની પ્રીતિને લીધે સંસારનો સંપૂર્ણ ત્યાગ કર્યો હોવા છતાં જરૂર ભરત રાજને ફરીથી હરણીની જ  
યોનિમાં જન્મ લેવો પડ્યો. (ઓ. ૬)

અખભદ્રેવનો દીકરો પોતાના પિતાની નિવૃત્તિ બાદ અનેક પ્રકારે ઉત્તમ રીતે રાજ્ય ચલાવીને અને સંસાર ભોગવીને  
નિવૃત્ત થયો. તે વનમાં જઈને ઈશ્વરભક્તિમાં પોતાનો સમય પસાર કરવા લાગ્યો. એક વખતે વંડકી નદી પર જય કરતો

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

હતો તે દરમિયાન તરસથી વ્યાકુળ થયેલી એક હરણી આવી અને પાણી પીવા લાગી. એટલામાં તે હરણને સિંહની બયંકર ગજ્ઝના સંભળાઈ. તેથી ત્યાંથી ભાગી જવા માટે બીજુ જગ્યા ન મળતાં તેણે નદીની પેલેપાર જવાની ઈરછાથી ગભરાટમાં પાણીમાં કુદકી માર્યો. તેના પેટમાં ગર્ભ હતો તે તેના ફૂદવાથી નદીમાં ગર્ભ પડી ગયો. કુદવાના અગાધ પરિશ્રમને કારણે તે તરત જ મરણને શરણ થઈ ગઈ.

અહીંયા ભરતરાજને પેલા નિરાધાર હરણીના બચ્યાને નદીમાં વહેતું જેયું તેથી તેમને ખૂબ દ્વારા આવી. તેમણે તે બચ્યાને ઊંચકી લીધું અને આશ્રમમાં લઈ આવ્યા. ત્યાં આગળ પોતાના બાળકની માફક તેની ખાવા પીવાની સગવડ, બીજાં જંગલી જનાવરોની રક્ષણ અને પ્રેમથી એને લાડ લડાવવામાં તેઓ પોતાનો વધારાનો સમય જાળવા લાગ્યા. હરણના બચ્યાને તેમની માયા લાગેતી હોવાથી સદાયે તેમની પાસે જ રહેતું હતું, તેના વિના તેમને પણ ગમતું નહિ. આગળ ઉપર સમય જતાં ઈશ્વર તરફનું દ્યાન ઓછું થતું ગયું અને રાત દિવસ તેઓ બચ્યાનો જ વિચાર કરવા લાગ્યા.

શું આશ્રય છે એ જુઓ? યોગ માર્ગમાં વિદ્ધન આવે માટે જેણે રાજપાટ, સ્વી, પુરુષ વગેરેનો ત્યાગ કર્યો હોય એવા એક સાધારણ હરણીના બચ્યાના મોહમાં આસક્ત થયા? કહ્યું છે કે, ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ!'

કાળ કોઈના માટે થોભતો નથી. ભરત રાજનું મૃત્યુ પાસે આવ્યું. છેલ્લો થાસ તેઓ લઈ રહ્યા હતા તે વખતે જણે કે પેલા બચ્યાને બધું જ સમજાઈ ગયું હોય એમ હરણીનું બચ્યું ગરીબું થઈને શોકતુર અવસ્થામાં સામે આવીને બેસી ગયું. ભરત રાજ તેની આ સ્થિતિ જેતા હતા, અને એ જ સ્થિતિમાં તેમનો પ્રાણ નીકળી ગયો. ‘અંતે ભતિ: સા ગતિ?’ આ ન્યાય પ્રમાણે તેમને મુક્તિ તો મળી જ નહિ. અને મનુષ્ય યોનિ પણ ન મળતાં પણ યોનિમાં હરણીના પેટે જન્મ લેવો પડ્યો. એટલું જ નહિ પણ ફરી પાછો એક જન્મ બ્રાહ્મણ કુળમાં લેવો પડ્યો. અર્થાત્ તેમની પૂર્વની તપશ્વર્યાને લીધે તેમને આ યોનિમાં પણ પાછલા જન્મોની યાદ હતી. માટે હવે પછી તેમણે કોઈ પણ પ્રકારના મોહીની તદ્દન અલિન રહીને પોતાનો ઉદ્ઘાર કર્યો. છેવેઠે યોનિમાં તેઓ સદા એક જડ, મૂર્ખ અને એક બહેરા મૂંગા જેવા વર્તતા હતા, માટે લોકો તેમને ‘જડભરત’ કહીને સંભોધીત કરતા હતા.

અંત:સમયે જે જે સ્વરૂપ અથવા દ્યાન આંખોની સામું હોય છે, તે જ રૂપે ફરી જન્મ મળે છે. પ્રભુનાં ચરણમાં લીન થયેતાઓને ફરીથી જન્મ લેવો પડતો નથી. ભગવદ્ ગીતા અધ્યાય ૮માં શ્રી કૃષ્ણભગવાને પણ આ પ્રમાણે કહ્યું છે. ‘અંત:કાલે ચ માભેવ સ્વરન્યુક્ત્વા કલેવરમ્ । ય: પ્રયાતિ સ મદ્દભાવં યાતિ નાસ્ત્ય સંશય: ॥૫॥’ અંત સમયે જે કોઈ મારું સ્મરણ કરતાં કરતાં દેહ છોડે છે, તે મારા જ સ્વરૂપને પામે છે. મતલબ એને ફરી જન્મ હોતો નથી. આમાં કોઈ સંશય નથી. માટે જ ઈશ્વરનું નામ:સ્મરણ કરતા રહેવાની ટેવ પાડવી જેઠી કરીને અંત સમયે ગુંગળાઈ ન જતાં તે ન ગૂંચવાતા ભગવાન યાદ આવે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું છે, ‘તરમાત્સર્વેષુ કલેષુ મામનુસ્મર યુદ્ધ ચ । મધ્યાર્પિત મનોબુદ્ધિમાંવૈષ્યસ્યસંશયમ્ ॥૭॥’ અર્જુન ! તુ હર હંમેશા દેરેક ક્ષણે મારું સ્મરણ કર અને મને અનુસરીને યુદ્ધ કર. મારામાં તારી બુદ્ધિ અને મન દદ કરીને તથા અર્પણ કરીને વર્તીશ એટલે તું મને જ પામીશ. એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. જીવનભર જે જગ્યાત અને સાવધ રહ્યો છે, પણ અંત સમયે જે સ્થળ જય છે, એવાનો મોક્ષ મેળવવા માટેનો કરેલો સત્તસંગ અને સંતોનો સહિવાસ પણ નિઝળ જ જય છે. માટે જ ભાવાર્થી ભક્તો પોતાના મૃત્યુ પછીની આગતી ગતિની વ્યવસ્થા સંતોના હાથમાં સોંપી છે. કારણ કે મૃત્યુ પછી જન્મ લેવાની કે ન લેવાની વાતની તેમને જ ખબર હોય છે. અંત ઘડીમાં તેઓ એકલા જ હોય છે. આ વિષયો પર સાઈભાબુની સામે બનેલી એક મધુર વાત સાંભળવાથી શ્રોતાજનોને સાઈના ભક્તો માટેનો પોતાના સગા દીકરાઓ જેટલો પ્રેમ અને વાતસત્ય દેખાઈ આવશે. (ઓ. ૭-૧૧)

ક્યાં મદ્રાસ અને ક્યાં શિરડી તથા ક્યાં માનસરોવરનું ઊંચુ પથરિલુ કષ્ટદાયક ચઢાણ ! પણ ભક્તની ઘડી આવી કે

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

બાબા તેને પોતાના ચરણોમાં ખેંચી લાવે છે. એક વખતે વિજયઆનંદ નામનો મદ્રાસી સંન્યાસી માનસરોવરના પ્રવાસ માટે મદ્રાસથી ખૂબ જ ઉત્તસાહભેર નીકળ્યો. એક જાપાની પ્રવાસી પાસેથી માનસરોવરનો નકરો જોઈને તે સરોવર જેવાને અને દર્શન કરવા માટે વિજયઆનંદે મનમાં પાકો નિર્ધાર કર્યો. રસ્તામાં શિરડી આવ્યું. સાઈબાબાની હૈવી શક્તિની અને કીર્તિની વાત સાંભળી અને બાબાથી પ્રભાવિત થઈ તેમનાં દર્શનની ઉત્કૃષ્ટ ઈચ્છાથી તે સાધુ ઠેકાણું શોધતો શોધતો શિરડી ગામમાં આવ્યો. સાઈમહારાજ એક મોટા સંત છે અને તેમની કીર્તિ જગપ્રસિદ્ધ છે. એ સાંભળીને એમનાં દર્શન કરવાની ઈચ્છાથી પેલો સંન્યાસી તે રસ્તે જતાં શિરડી મુકામે રોકાયો. એ સમયે શિરડીમાં હરિદ્વારના સોમદેવલું સ્વામી શિરડીમાં આવ્યા હતા. તેમની અને સંન્યાસીની ભક્ત મંજળી સાથે એકસાથે મુલાકાત થતાં તેમને માનસરોવર કેટલું દૂર છે એ પૂછ્યું. એ સાંભળતાં સ્વામીજીએ જણાવ્યું કે, ‘ગંગોત્રીથી એટલે કે ગંગા નહીના ઉગમથી ઉપરના ચઢાણે લગભગ ૫૦૦ માઈલ અર્થાત് ૮૦૦ કિ.મી. દૂર છે. ત્યાં ખૂબ જ બરફ પડે છે. દરેક પચાસ ૧૦૦ માઈલમાં અર્થાત് ૧૬૦ કિલોમીટરે ભાષા બદલાતી રહે છે. ભૂતાનના રહેવાસીઓને શંકા આવતી હોવાને કારણે પરદેશના પ્રવાસીઓને ખૂબ ત્રાસ પડે છે.’ સ્વામીના મુખે આ હકીકિત સાંભળતા તે સંન્યાસી નિરુત્સાહી થઈ ગયો. તેનું મન ડામાડોળ થવા લાગ્યું અને ચિંતામાં પડ્યો. (ઓ. ૧૨-૨૦)

સંન્યાસીએ પછી બાબાનાં દર્શન કર્યા અને પગમાં પડ્યો તથા ચિત્તથી સુપ્રસન્ન થતાં તે આસન જમાવીને બેસી ગયો. એટલામાં બાબાની વૃત્તિ ખળભળી ઊઠી, અને ત્યાં બેઠેલા સમૂહને બોલ્યા, ‘કાઢી મૂકો પેલા સંન્યાસીને એની સંગત કામની નથી.’ આમ તો આ સંન્યાસી શિરડીમાં નવો જ હતો. બાબા આમ જેરથી કહેતા એ શર્મિદો થઈ ગયો. અન્ય ભક્તો બાબાની સેવા કરતા હતા. તે જોઈને ત્યાં જ બેસી ગયો. પ્રાતઃ સમયનો એ દરબાર હતો. મસ્જિદમાં લોકોની ખૂબ બીડ જન્મી હતી. ભક્તોએ લાવેલી પૂજની સામગ્રી અને બાબાની થઈ રહેલી વિધિપૂર્વકની પૂજન જોઈને તે હંગ થઈ ગયો. કોઈ બાબાનાં ચરણો ધોતાં હતાં, તો કોઈ દોડીને આવીને પગના અંગૂઠાનું તીર્થ લઈને શુદ્ધ ભાવનાથી તેનું સેવન કરી રહ્યા હતા. તો કોઈએ તીર્થને પોતાની આંખો પર લગાવી રહ્યા હતા. કોઈ એમને અષ્ગંધ લગાવી રહ્યા હતા, તો વળી કોઈ સુગંધિત દ્રવ્યો તેમના શરીરે ઘસતા હતા. દરેક ભક્તો, બ્રાહ્મણ હોય કે શૂદ્ધ વગેરે પોતાની જતના અંદરોઅંદરના ધૂત અધૂતનાં બંધનો ભૂતી ગયા હતા. બાબા ભલેને સંન્યાસી ઉપર ગુસ્સે થયા હતા, છતાં સંન્યાસીને બાબા માટે પ્રેમ ઉભરાઈ આવ્યો. તેના પગ પાછા વળતા ન હતા. બેઠેલી જગ્યા ઉપરથી, તે ઊભો પણ થઈ શકતો ન હતો. આ રીતે તે સંન્યાસી શિરડીમાં બે દિવસ રોકાયો. એવામાં તેની મા ગામમાં મરણ પથારીએ છે એવો પત્ર તેના હાથમાં આવ્યો. તે વાંચીને તે ખૂબ જ દુઃખી થયો. માને મળવાનું મનમાં આવતાં પોતાના દેશમાં પાછા ફરવાનો તેને વિચાર આવ્યો. પરંતુ બાબાની આજી વગર ત્યાંથી તેને પાછા જવાનું ગમ્યું નહિ. તે જ કારણથી તે આવેલો પત્ર હાથમાં લઈને મસ્જિદમાં ગયો. અને બાબાને તેની માની પ્રકૃતિ અંગેની વાત કરતાં કરતાં વિનંતી કરવા લાગ્યો, ‘સમર્થ સાઈ મહારાજ ! મારા મનમાં માને જેવાની અને મળવાની ઉત્કંધા જગ્યી છે. માટે આપ પ્રસન્ન થઈને મને જવાની આજી આપો અને પ્રવાસે નીકળેલા મારા જેવાને માર્ગમાં કૃપા કરો.’ તે સંન્યાસીએ દોડી જઈને બાબાના પગ પકડ્યા અને ફરીથી બોલ્યો, ‘કૃપા કરીને મને આજી આપો. પ્રાણ ગળામાં અટકાવીને મારી મા જમીન ઉપર પડીને મારી રાહ જોતી હશે. તેની સાથે મારી નજર મળવા હો. જેથી કરીને તેનો અંત સુખદાયક થાય !’ (ઓ. ૨૧-૩૩)

પરંતુ સાઈસમર્થ તો અંતર્જાની હતા. સંન્યાસીનું આયુષ્ય પુરું થવા આવ્યું હતું તે તેમણે જણી લીધું હતું. માટે તેને બાબાએ શું કહ્યું તે દધાન દઈને સાંભળો, ‘આટલું જે મા માટે ગાંડપણ હતું, તો આ સંન્યાસીનો પોશાક શા માટે ધારણ કર્યો ? આ વેશને મારું તારું અથવા તો માયા મભતા શોભતાં નથી. આ પ્રકારે તું ભગવાં વસ્ત્રોને કંલંકિત કરે છે. દુઃખી થતો

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

નહિ. જ જઈને સ્વસ્થ બેસ, થોડા દિવસ જવા દે, પછી આગળ ઉપરનો વિચાર કરીશું મનમાં થોડી ધીરજ રાખ. વાડામાં ખૂબ ચોર આવે છે, બારીબારણાં વ્યવસ્થિત બંધ રાખીને સાવધ રહેવું. નહિતર તે ચોરો બંધુ જ લૂટી હશે, અને જોરથી તારી ઉપર હુભલો કરશે. ઐશ્વર્ય અને વૈભવ કાયમ ટકનારા નથી. આ શરીર નાશવંત છે. મૃત્યુ હંમેશને માટે પાસે જ હોય છે. એવું જાણીને શાસ્ત્રોમાં કહ્યાં પ્રમાણે આચરણ કરવું જોઈએ. આ લોકમાં પોતાનું શરીર પત્ની બાળકો વગેરે વિષયો પર હું અને મારું જે અભિમાન છે અને તેને કારણે ત્રણ પ્રકારનાં દુઃખો ઉત્પન્ન થાય છે. જેને આ લોકમાં અનર્થ અથવા આપત્તિ કહેતા હોય છે, એ પરલોકમાં પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રતિબંધક હોય છે તથા સહાને માટે અધોમુખ અર્થાત્ પૂઢ્યી ઉપર ફરીથી જન્મનારા હોય છે. પરલોકમાં પુણ્ય બેગુ કરી શકાતું નથી. પરલોકની પ્રાપ્તિ નિર્ભય નથી હોતી. કારણ કે, ત્યાંથી પણ પુણ્યોનો જથ્થો વપરાઈ જતાં નિયે આ લોકમાં પાછા ફરવાનો ભય રહેલો છે. એવું આ લોક અને પરલોક બંનેમાં ભોગ અને આપત્તિ લાવનાર હોય છે, માટે જ તે બધાનો બધી જ રીતે ત્યાગ કરે તો જ આનંદ પ્રગટવાનું મુખ્ય કારણ બને છે. સંસાર ઉપર જેને તિરસ્કાર ઉપજ્યો હશે અને જે હરિનાં ચરણોમાં ચલિત થયા વગર રંગાઈ ગયેલો હશે, તેવાઓને સંસારના બંધનની ગાંઠ ઉકેલે છે અને માયાનાં બંધનો છૂટી જય છે. એમ સમજવું. ઈશ્વર ભક્તિમાં અને ભજનમાં તથા નામ:સમરણમાં ચિત્ત લાગતાં, પાપ, તાપ, દુઃખ, દૈન્ય ગરીબી વગેરે બંધું નાસી જય છે. ખૂબ પ્રેમથી ઈશ્વરનું ધ્યાન ધરીને મનમાં લેતાં, એ સંકટોમાં દૂલ્ભી મારીને આપણને બચાવે છે. તારા પૂર્વ જન્મનાં પુણ્યો ખૂબ મોટા પ્રમાણમાં છે, માટે જ તું આ ડેકાણે મન દઈને આવ્યો છે. હવે મારા કહેવા ઉપર ધ્યાન આપીને પોતાનું જીવન સાર્થક કરી લે. આવતી કાલની શ્રીમદ્ ભાગવત પુરાણનો ખરો અભ્યાસ શરૂ કર. આ ગ્રંથનું કાયા, વાચા અને મનથી સપ્તાહમાં વાંચન પૂરું કર, એટલે પરમેશ્વર પ્રસન્ન થશે. તારાં બધાં જ દુઃખોનો અંત આવશે અને સંસારની માયા શાંત થઈ જઈને તને સુખ મળશે. દરરોજની નિત્ય ડિયા પતાવીને સ્નાન કરીને શુદ્ધ થઈને શ્રી હરિનાં ચરણમાં મન લગાવીને આ વ્રત યથાસ્થિત પૂરું કર, તેથી તારી સંસારમાંથી આસક્તિ નિર્ભળ થશે.' સાઈબાબાએ પોતે પણ, પોતાના દેહનું મરણ પાસે આવેલું જોઈને એ જ ઉપાય યોજયો હતો. અને શ્રીધર સ્વામીના, 'રામવિજ્ય' ગ્રંથ કે જેને વાંચવાથી મૃત્યુંજય એ વંચાવ્યો હતો. (ઓ. ૩૪-૫૦)

બીજે દિવસે વહેલી સવારે સંન્યાસી વિજ્યાનાંદે પોતાની દૈનિક ડિયાઓ પતાવીને, બાબાને ખોબો ભરીને ફૂલો અર્પણ કર્યાં અને તેમની ચરણ રઘુ માથે ચ્યાદાવી. પછી ભાગવત વાંચવા માટે એકાંત જોઈએ માટે લેંડીભાગની શાંત વાતાવરણવાળી જગ્યા પસંદ કરી ત્યાં જઈને આસન પાથરી પારાયણ શરૂ કર્યું. મૂળ સંન્યાસી અને તેમાં પાછો ઈશ્વરની ભક્તિ કરનાર ! તેણે બે અઠવાડિયામાં ભાગવત પૂરું કર્યું. ત્રીજું અઠવાડિયું શરૂ થયું હશે ત્યાં જ, તેનામાં અસ્વસ્થતા વધવા માંડી, અશક્તિ લાગવા માંડી પારાયણ અધૂરું છોડીને વાડામાં તે પાછો ફર્યો. મહામુસીબતે બે દિવસ પસાર કર્યાં અને ત્રીજી દિવસે વહેલી સવાર થતાં જ સંન્યાસીએ પ્રાણ છોડી દીધા. ફીરબાબાના ખોળામાં પોતાનું માથું મૂકીને તે સંન્યાસી શાંત થઈ અને દેહમુક્ત થઈને શારીરિક અથવા તો આ લોકના વિષયોની આસક્તિથી વિમુક્ત થઈને વિદેહી થયો. સંન્યાસીના મૃત્યુની બાબાને જાણ કરતાં તેમણે તેનો દેહ દિવસભર તે પ્રમાણે જ મૂકી રાખવાની આજ્ઞા કરી અને બોલ્યા, 'તેને હમણાં દાટી દેતા નહિ.' બાબાએ આવું કહ્યું આથી એકત્રિત લોકોના મનમાં એવું લાગ્યું કે, કદાચ સંન્યાસીનું પ્રેત ફરીથી જીવનું થશે. તેમણે મનમાં મોટી આશા સાથે લોકોએ તે શબની બહુ જ કાળજી રાખી. એક વખત નીકળી ગયેલો પ્રાણ પાછો આવતો હશે કે ? પરંતુ બાબાના શબ્દો એટલે તેમને માટે બ્રહ્મવાક્ય હતા. તે સમજને તે મૃત દેહનું ખૂબ જતન કર્યું, પરિણામે તે ઉપરોગી સાહિત થયું કે તે સંન્યાસિના બિનવારસી મૃતશરીરની પોલિસે ચકાસણી કરી, અને પોલિસનો સંશય પણ દૂર થયો. જે એક વખત મરી ચૂક્યો છે,

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

એનું ફરીથી અસ્તિત્વ કયાં ? મરેલાને કેવી રીતે જીવતા કરવા એ બાબાને કંઈ ખબર ન હતી એવું થોડું છે ? હા ! તેમનું એટલું સામર્થ્ય હતું પરંતુ આ ઠેકાણે એ મહદ્વાની યોગ્ય તપાસ વગર જમીનમાં દાટાઈ જાય નહિ તે જ બાબાનો હેતુ હોઈ શકે. બિનવારસી વસ્તુઓની માલિકી સરકારની હોય છે. તેથી તે પૂછપરછ પહેલાં મૃતશરીર જમીનમાં દાટાઈ જાય નહિ માટે બાબાનું આ બહાનું હતું. આકસ્મિક મરણની સરકાર દ્વારા ફોજદારી તપાસ થાય છે. આ બધી ઘામલનો અંત આવ્યો. વિધિવત્ શબના સંસ્કાર થયા, યોગ્ય સ્થળો તેને જમીનમાં ઉંડો ખાડો કરીને જ દાટવામાં આવ્યું અને સાઈબાબાનું એક સંન્યાસીને સદ્ગતિ આપવાનું કાર્ય પૂર્ણ થયું. (ઓ. ૫૧-૬૩)

હવે એક બીજી વાત શ્રોતાઓને વર્ણન કરીને કહી રહ્યો છું. ક્ષણભર કાળજીપૂર્વક મન લગાડીને સાંભળો. જેથી કરીને સાઈબાબાની સર્વ વ્યાપકતા બાળારામ નામનો બાબાનો એક મોટો ભક્ત હતો. એની અટક માનકર હતી. તે એક ગૃહસ્થાશ્રમી, પત્ની અને બાલબચ્ચાઓવાળો હતો. તેની પત્ની ગુજરીજતાં ગૃહસ્થાશ્રમમાં કર્તવ્યો પાર પાડવામાં મુશ્કેલીઓ ઊભી થતાં તેના મનની શાંતિ ભષ થઈ હતી. પણ તેને કારણે એક અતિ ઉત્તમ એવા શ્રેષ્ઠ ભાગ્યની પ્રાપ્તિ થઈ. પૂર્વ જન્મનાં પુણ્યનાં ફળનો લાભ ગણીને સાઈનાં ચરણોનો સહવાસ તેમના નસીબે મળ્યો અને તેમનામાં ભક્તિ દદ થતાં સંસાર માટેનો પૂર્ણ વૈરાગ્ય તેમને ઉત્પન્ન થયો. સંસારની અપેક્ષાઓ, હેતુઓ, દીઢાઓ વગેરેનાં જળાં અને બાલબચ્ચાઓનાં સર્વ બંધનોને ફગાવીને અસામાન્ય એવા ભાગ્યથી આ માનકર સંસાર સાગરમાંથી નીકલ્યો. જુઓ પરમાર્થનાં બારણામાં અડચણ જે પારકી સેવાનો મોહ અને માયાની માળા પોતાના છોકરાઓનાં ગળામાં નાખીને, તેમને નોકરી ધંધે લગાડીને આ લોકનાં કર્તવ્યને તેણે તાજું મારી દીધું. આ પણ એક પ્રકારનો સંન્યાસ જ છે. સંન્યાસના અનેક પ્રકારો છે. પરંતુ જેમાં પ્રયત્નો કરીને પણ બ્રહ્મજ્ઞાન મેળવ્યું જતું નથી, તે આગળ ઉપર ઘણીવાર ડગલે ને પગલે પુષ્ટળ જ ત્રાસ ઉત્પન્ન કરે છે. માટે જ આ મૂર્તિમંત ઉદાર એવા સાઈનાથે માનકરની અનન્ય ભક્તિ જોઈને તેની ઉપર ફૂપા કરવાનું નક્કી કરીને તેમણે તેનો વૈરાગ્ય પાકો કર્યો. અનંત જન્મોના સંસ્કારોનાં આવરણો હેવાને કારણે માનકરનું ચંચળ મન સ્થિર રહેતું ન હતું. મનોરંજનની પ્રબળ દીઢાઓ ઉત્પન્ન થઈને, તેમને વૈરાગ્ય કામય ટકતો ન હતો. શિરડી તે જ મારું સ્થાન નથી, હું તો દેશ અને કાળની મર્યાદાથી પર છું, એ વાત પુરાવા સાથે બતાવવા માટે બાબાએ માનકરને આજ્ઞા કરી, ‘શિરડીમાં રહેવાનું હવે તાજું ભાગ્ય પુરું થયું છે. આ રસ્તાના પ્રવાસ કાર્ય પુરતા બાર રૂપિયા લે અને મચ્છિદરગઢ પર તપ કરવા માટે જઈને સુખ પ્રાપ્ત કરવાના નિશ્ચયપૂર્વક સ્વસ્થ બેસ.’ સાઈબાબાના આ શબ્દો સાંભળીને માનકરે તેમની આજ્ઞા શિરોમાન્ય રાખી. દંડવત્ પ્રણામ કરી બાબાનાં ચરણોમાં નમસ્કાર કર્યા. પછી તેમણે અતિ નમ્ર થઈને વિનંતી કરતાં બાબાને કહ્યું કે, ‘જ્યાં તમારાં દર્શન થતાં નથી એવી જગ્યા ઉપર જઈને મારે શું કામ છે ? અહીં તો તમારાં ચરણોમાં દરરોજ નિયમિત દર્શન થાય છે અને તીર્થનું સેવન થાય છે. આમ રાતદિવસ તમારું ચિંતન થાય છે. ત્યાં ક્ષુદ્ર નાદાન એવો હું એકલો જ હોઈશ. તેમ છતાં બાબા ! તમે પાસે ન હોવાને લીધે ત્યાં મારું કયું કલ્યાણ થવાનું છે ? એવી જગ્યા ઉપર તમે મને શા માટે મોકલી રહ્યા છો એ સમજવા માટે હું સમર્થ નથી.’ પણ પછી તરત જ માનકરના મનમાં વિચાર આવ્યો કે ભક્તે પોતાના ગુરુનાં વચ્ચો વિષે જરા પણ શંકા મનમાં લાવવી નહીં. માટે તેઓ સંશય રહીત થઈને ફરીથી બોલ્યા, ‘બાબા ! મને ક્ષમા કરો. મારી બુદ્ધિના તે નક્કામાં વિચારો હતા જેને લીધે હું શંકાશિલ થયો હતો. મારી મને જ શરમ આવે છે. આવો સંશય મને શોભા આપતો નથી. હું તો તમારી આજ્ઞાનો ચાકર છું. તમારા નામ : સ્મરણમાં તત્પર થઈને હું તમારા પ્રભાવથી ગઢ ઉપર પણ રહેવા તૈયાર છું. ત્યાં પણ હું તો તમારા જ ધ્યાનમાં લીન થઈને બેસવાનો છું. તે જ મારું નિરંતર તપ છે. અનન્ય પણ હું તમારાં શરણો આવેલો છું. મારી કોઈ પણ જગ્યાએ આવવા જવાની સ્થિતિ તમારા હાથમાં સોંપી

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

દીધી છે. માટે મારા મનમાં વિચાર શા માટે આવવો જોઈએ ? તમારી આજાની સત્તાના પ્રભાવથી મને ત્યાં પણ શાંતિ જ મળવાની છે. તમારું આવું સામર્થ્ય હોય પછી વગર કામનો હું શા માટે ચિંતા કર્યા કરું ?' (ઓ. ૬૪-૮૪)

સાઈસમર્થ એ અનાદિ ખ્રલ છે. તેમના શબ્દો એટલે ખાત્રીના અને નિશ્ચયનાં સંભાપણો હતાં. જે ધ્યાનપૂર્વક વિશ્વાસ મુક્શો તેને પૂર્ણ અનુભવ થશે. પછી બાબાએ માનકરને કહ્યું, 'મારા શબ્દો વ્યવસ્થિત રીતે જગૃત થઈને સાંભળ. શંકા કુશંકાની રામાયણમાં પડતો નહીં. તરત જ મચિછંદ્રગઢ ઉપર જઈને દરરોજ ત્રણ સમય તપ્ય કર. થોડા દિવસો સુધી આમ કરતાં સ્વઅનંદ પરિપૂર્ણ થશે.' આવું સુંદર આશ્વાસન સાંભળતાં હવે આગળ શું બોલવું તે ન સમજતાં માનકર ચૂપ થઈ ગયો અને મચિછંદ્રગઢ જવાની તૈયારી કરી દીધી. ફરી સાઈનાં ચરણોમાં વંદન કરીને ઉદ્દી, પ્રસાદ અને આશીર્વાદ લઈને સ્વસ્થ ચિંતે ગઢ તરફ જવા માટે નીકળી પડ્યા. શુદ્ધ નિર્મણ જળ હોય એવા અને મંદ મંદ્ર મધુર પવન વહેતો હોય એવી રમ્ય જગ્યા ઉપર પહોંચીને તેમના મનને ખૂબ સંતોષ થયો. સાઈબાબાએ મોકલેતા છિતાં સાઈની જુદાઈ ભોગવી રહેતા એવા માનકર ત્યાં ગઢ ઉપર રહીને બાબાશ્રીના કહ્યા પ્રમાણે નિયમપૂર્વક તપનું આચરણ કરતા થયા. બાબાનો સાક્ષાત્કાર જુઓ ! માનકર તપમાં લીન હતા એવામાં બાબાએ ગઢ ઉપર જ તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યાં, અને તેનો અનુભવ માનકરને થયો. ધ્યાનમાં મશ્ન એવા સમાધિસ્થ, પોતાના ધ્યેયના સાક્ષાત્ દર્શન થાય એમાં કંઈ નવાઈ નથી. પણ માનકરે તો જગૃત અવસ્થામાં પદ્માસનમાં બેઠા હતા ત્યારે શ્રી સાઈસમર્થને જેયા. ફક્ત આંખોમાં જ નહીં પણ બાલકરામે બાબાને સામેથી પૂછ્યું, 'બાબા ! મને અહીં શા માટે મોકલ્યો ?' તેના જવાબમાં બાબાએ શું કહ્યું તે જુઓ ! 'તું જ્યારે શિરડીમાં હતો ત્યારે તારા મનમાં અનેક પ્રકારનાં તરંગો ઉઠવા લાગ્યા હતા. માટે તારા ચંચળ મનને સ્થિર કરવા માટે અહીંથા ગઢ ઉપર જવાની મેં તને આજા આપી. પૂછ્યી પાણી વગેરે પંચમહાભૂતના મિશ્રણના થર ઉપર થર મૂકીને ઊભા રહેવા આ સાડાત્રણ હાથની લંબાઈવાળા શરીરથી વધારે કાંઈ તારી દાખિમાં હું ન હતો. તો હવે જે હું ત્યાં હતો તે જ હું આજે અહિંયા તારી સામે પણ છું. તું જે ! મને તું સારી રીતે જોઈ લે. અને મેં જે તને શિરડીથી અહિંયા મોકલ્યો હતો, તેનું કારણ પણ હવે તું જાણી લે.' (ઓ. ૮૫-૮૭)

પછી સમય જતાં માનકરે મનમાં નક્કી કરેલો સમય પૂરો થતાં પોતાના મુકામ પર જવા માટે મચિછંદ્રગઢથી વાંદરા પોતાનું રહેઠાણ હતું ત્યાં જવા માટે મન થતાં પૂનાથી દાદર સુધીનો આગગાડીનો પ્રવાસ કરવાનું તેમણે નક્કી કર્યું. તેઓ પુનામાં સ્ટેશન પર ગયા, અને સમયસર બારી ઉપર હાજર થઈ ટિકિટ લેવા ગયા. એટલામાં એક ચમત્કાર થયો. તેમણે ટિકિટબારી પાસે કર્મશર્થી લંગોટી જેવું અડધું અંગ ઢંકેલો, ખભા ઉપર એક કામળો નાખેલો ખેડૂતના પોષાકમાં એક ઓળખાણ વગરના પ્રવાસીને જેયો. દાદરની ટિકિટ લઈ તે વ્યક્તિ પાછી ફરી અને તે માનકરની સામે જેતાં એકબીજાની આંખોમાં આંખો મળી. તે માનકરની પાસે આવીને ઊભો રહ્યો. તેણે આ માનકરને પૂછ્યું, 'તમે ક્યાં જલ છો ?' તો માનકરે જવાબ આપ્યો કે, 'મારે તો દાદર જવું છે, આવું સાંભળતાં તે વ્યક્તિએ જે ટિકિટ લીધી હતી તે તેમને આપી દીધી અને કહ્યું, 'હું પણ દાદર જવા માટે આવેલો પણ અહીયા બીજું એક મહત્વનું કામ યાદ આવતાં જવાનું મોકૂફ રાખ્યું છે. તમે નાહકના પૈસા ખર્ચતા નહીં.' ટિકિટ લેવાનું કામ ગાંઠના પૈસાથી પણ કઢાવવું અધરું જ હોય છે. તે વગર મહેનતે મળી જતાં માનકરના મનમાં સંતોષ થયો. આ બાળરામ માનકરે પેલી વ્યક્તિને આપવા માટે પૈસા કાઢવા ગજવામાં હાથ નાખ્યો ત્યાં તો પેલી વ્યક્તિ ખૂબ જ ચિક્કાર ગિર્દી વર્ચ્યે કયાં ઓવાઈ ગઈ તે સમજયું નહીં. તે વ્યક્તિને શોધવા માટે બાળરામે ખૂબ પ્રયત્નો કર્યો પણ તે બધા નિર્ઝણ ગયા. એવામાં ગાડી પ્લેટફોર્મ ઉપર આવી પહોંચી. 'પગામાં જેડા નહીં, માથા ઉપર જૂનો કકડો વીઠાળોલો, ખભા ઉપર કામળો અને કર્મરે અલ્પ વખત ધારણ કરેલ આ ખેડૂત જેવો લાગતો ભાઈ કોણ હોઈ શકે ? ટિકિટ ભાડું પણ કંઈ ઓછું નથી ? તે પણ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પોતાની ગાંઠનું કાઢીને મારી ઉપર આવો ઉપકાર શા માટે કર્યો હશે ? આ કોયડો મારાથી ઉક્લાતો નથી. અંત:કરણથી ઉદાર અને પૈસા પાછા મેળવવાની અપેક્ષા પણ ન કરનારો અને બહારથી એક સાધારણ ઐડૂત જેવો દેખાતો તે કોણ હશે તે મારા મનમાં વણઉકલ્યો સવાલ રહી ગયો. જેનો માનકરને ખૂબ જ ખેદ હતો. આ રીતે નવાઈ પામેલા માનકર ફરીથી તે વ્યક્તિની સાથે મુલાકાત થાય તે આશાએ, જ્યાં સુધી ગાડી ઉપડી નહીં ત્યાં સુધી દરવાજામાં ઊભા રહીને રાહ જેવા લાગ્યા. જ્યારે એ આગગાડી ઉપડી અને મળવાની આશા રહી નહીં ત્યારે તેમણે ગાડીનાં બારણાનો દંડો પકડીને તે ગાડીના ડબામાં બેસી ગયા. ગઢ ઉપર બાબાની આવી પ્રત્યક્ષ મુલાકાત અને અહીંયા આવી જુદ્દી જ ઘટના, અને ઉપરથી આવો ઐડૂત જેવો લાગતો વિચિત્ર વેષ જેઠને માનકરના મનમાં તાલાવેલી લાગી. ‘આ પણ કદાચ બાબા પોતે તો નહિ હોય ને ? ગઢ ઉપર જતી વખતે રસ્તામાં હાથખર્ચના બાર રૂપિયા આપ્યા હતા. તેવી જ રીતે આ રિકિટ ભાડાના પાછા ફરતી વખતના ભાડાના પૈસા આપવા માટે તો બાબા પાછા નહીં આવ્યાં હોય ને ? કારણ કે તે ફાવે તે વેષ લે. ફાવે ત્યાં પ્રગટ થાયે. ભક્તોને એકેક અનુભવ દાખવે. ફક્ત જેઠાં શિષ્ય ભાવાર્થી ॥ અ. ઉત્ત ઓ. ૧૪૦॥ પછી આગળ ઉપર શ્રદ્ધા અને ભક્તિની સાથે સાઈચરણોમાં પૂર્ણ પણે આસક્ત એવા આ શુદ્ધ અંત:કરણાણા ભક્ત માનકર શિરડીમાં ફૂતાર્થ થયા. તે સાઈબાબાનાં ચરણદૃપી કમળને ચોટીલી ધૂળદૃપી પરાગકણોની જેમ સાઈનામનો ગુંજરવ કરતા ભમરા જેવા ભક્ત બાળકરમજી શિરડીમાં જ રહ્યા. કયારેક તેઓ બાબાની આજા લઈને, મુક્તારામને તેમની સાથે લઈને શિરડી છોડીને બહાર કરતા હતા. પરંતુ શિરડી એ જ તેમનું કેન્દ્રસ્થાન હતું. ત્યાં જ તેઓ વારંવાર પાછા આવતા હતા. અને ત્યાં જ તે પવિત્ર શિરડીમાં ઈ.સ. ૧૯૧૫ના ડિસેમ્બર માસમાં તેમનો દેહ વિલય થયો.’ (ઓ. ૮૮-૧૧૭)

ધન્ય છે તેમનાં પૂર્વ જન્મોનાં બાકી રહેલાં ભાગ્ય કે જે શ્રી સાઈની દાસ્તિનો વિષય બનીને તેમનાં ચરણોમાં લીન થઈને કોઈ પણ પ્રકારના ડર સિવાય મરણ પ્રાપ્ત કરે છે. ધન્ય છે તાત્યાસાહેબ ઉર્ફ લક્ષ્માજી કૃષ્ણાજી નુલકર કે જેઓ પંદરપુરમાં સખ જજ હતા ત્યારેકે. નાનાસાહેબ ચાંદોરકરની સલાહથી ઈ.સ. ૧૯૦૮માં બાબા પાસે શિરડીમાં સર્વપ્રથમ આત્મા અને આવતાની સાથે તેમને કંઈક અનુભવ થવા લાગ્યા. આ અનુભવોને લીધે તેમની બાબા ઉપર શ્રદ્ધા દઢ થઈ ગઈ અને તેઓ શિરડીમાં વસી ગયા. એક વખત નુલકર સાહેબને આંખોમાં ભયંકર વિકાર ઉત્પન્ન થયો તેથી તેમને ખૂબ વેદના થતી. તે કારણે તેમણે બાબાની સહાય માંગી. એ કારણે તેમની વેદના બાબાએ પોતાની આંખો ઉપર લઈને તેમની આંખો સારી કરી. શિરડીમાં હતા તે અરસામાં જ ખૂબ જલદી ઈ.સ. ૧૯૧૧ની શક્તાતીર્થ લાવીને તેમને પીવડાવવામાં આવ્યાં હતું. બાબાના જ ધ્યાનમાં રહીને એમણે દેહ છોડ્યો હતો. તેમના મૃત્યુ બાદ બાબા બોલ્યા હતા કે, ‘તાત્યા તો આપણાથી સૌથી વહેલો મરી ગયો. મારી જ આજા પ્રમાણે તે અહીં રહ્યો અને તેણે પોતાના આયુષ્યનું ધ્યેય સાધી લીધું. એનો પૂનર્જન્મ નથી.’ ધન્ય છે તે પ્રાર અને શ્રેષ્ઠ મેધાને કે જેણે શિરડીમાં ભજન કરતાં કરતાં દેહ ત્યાગ કર્યો. જ્યારે ૧૯-૧-૧૯૧૨ને દિવસે મેધાનો દેહવિલય થયો, તે સમયે તેની ઉત્તરકિયામાં માન અને બાબાનો ભક્ત અંગને સ્નેહ તો જુઓ. મેધો તો પહેલેથી જ ફૂતાર્થ હતો. મેધાના મૃત્યુના એક મહિના પહેલાં બાબાએ એની પાસેથી ગાયત્રી મંત્રનું પુરશ્વરણ કરાવ્યું હતું. તે નિમિત્તે મેધાએ તા. ૩-૧-૧૯૧૨ના રોજ કરાવેલા બ્રહ્મબોજનનો ઉત્ક્રિય સ્વ. ખાપડેએ પોતાની નોંધપોથીમાં કર્યો છે. ગામડાના લોકો બધા મેધા જેવા ભક્તની સમરાનયાત્રામાં ગયા હતા. તે સમરાનયાત્રામાં બાબા પણ જેડાયા હતા. તેમજ બાબાએ મેધાના શખ ઉપર ફૂલ ચઢાવ્યાં હતાં. અભિસંસ્કાર વિધિ શક્ત થતા માયા મોહમાં સપદાયેલા એક સાધારણ માણસની માફક બાબાની

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

આંખમાંથી પાણી આવ્યું હતું. બાબાએ પોતાના હાથે શબની ઉપર ફૂલોની ચાદર ઓડાડી હતી અને અત્યંત કુરણ સ્વરોમાં શોક કરતા કરતા પાછા ફર્યા હતા. ત્યારબાદ મેધાના તેરમાના દિવસે દાઢા કેળકર પાસેથી બાબાએ શાસ્કોકત વિવિથી શાદ્દ કિયાઓ કરાવી અને તે નિમિતે જમણાવારનો જે કાંઈ ખર્ચ થયો તે બાબાએ જતે ભોગવેલો. મેધા રાવખાદૂર સાડેની આજાથી જ શિરડીમાં આવ્યો હતો અને થોડાં જ વર્ષોમાં એટલે કે તા. ૧૯-૧-૧૯૧૨ના રોજ શિરડીમાં મરણ પામ્યો હતો. તાત્યાસાહેબ નુલકર તો શિરડીમાં આવ્યા પછી દોઢથી બે વર્ષના ગાળામાં જ મરણ પામ્યા હતા. આ બંનેનું મૃત્યુ પાસે આવેલું છે તે જાણીને બાબાએ તેમને સદ્ગતિ આપવા માટે જ શિરડીમાં પોતાના સ્નેહથી જેંચી લાવ્યા હતા એવું લાગે છે. વિજ્યાનાંદ સંન્યાસીને પણ માનસરોવર ન જવા દેતાં વચ્ચે જ શિરડીમાં તે કારણે જ રોકી રાખ્યો હતો. અરેખર ભક્તોના ઉદ્ધાર માટે બાબાને કેટલી ચિંતા હતી ! (ઓ. ૧૧૮-૧૨૩)

માનવ જતનો ઉદ્ધાર કરનારા સંતો તો પુષ્કળ જોયા છે, પણ આપણા સાઈબાબાનો મહિમા કેવી રીતે વર્જાવી શકાય ? વાધ જેવું ફૂર જંગતી પ્રાણી એ કંઈ મનુષ્ય જેવું જ્ઞાની થોડું હોય છે ? પોતાના જન્મની સાર્થકતા શોમાં છે, તે જનવર થોડું જ જણતું હોય છે ? છતાં એ છેલ્લી ઘડીએ બાબાનાં ચરણોમાં શરણો આવ્યું. અરેખર બાબાની કરણી અપૂર્વ હતી. આ બાબતે એક સુંદર કથા ધ્યાન દઈને સાંભળો જેને લીધે બાબાની વ્યાપકતા અને બધા વિષયોમાંની રામચિતતા દેખાઈ આવશે. શિરડીમાં એક દિવસ ચમત્કાર થયો. બાબાના દેહત્યાગના સાત જ દિવસ પહેલાં એક બળદગાડું આવ્યું અને મસ્નિદ્દાના દરવાજન પાસે આવીને ઊભું રહ્યું. તેની ઉપર પાછલી બાજુએ ગળામાંથી સાંકળે બાંધેલો અને આકળવિકળ થયેલો વિકરાળ મુખવાળો પ્રચંડ વાધ હતો. તે કોઈ શોગથી પીડાતો હતો. વાધ, વડુ, વાનર વગેરે પાસે ખેલ કરીને પૈસા કમાનારી જતજતના ઉપાયો કરીને થકેલા છીવટે તેમને સંતના દર્શને લઈ જવાનો ઉપાય સૂર્યેલો. તે ત્રણ દરવેશી હતા. અને આ બિચારો વાધ તેમજ આજીવિકાનું સાધન હતું. ગામેગામ ખેલ કરીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા. તે બાજુ ફરતાં ફરતાં બાબાની લીલાઓની વાતો તેમના કાને પડી. તેઓ અંદરોઅંદર બોત્યા, ‘ચાલો એમના દર્શન કરીએ, અને વાધને પણ ત્યાં લઈ જઈએ. એમનાં ચરણો જણે કે ચિંતામહિની છે. આહેઆઠ સિદ્ધિઓ એમનાં ચરણોમાં પ્રણામ કરે છે. નવનિધિ તેમની સામે જમીન ઉપર આળોટીને એમનાં ચરણનું તીર્થ લે છે, એવા આ સાઈબાબાનાં ચરણોમાં માથું મુકીને વાધ માટે દુઆ માંગીએ. સંતોનાં આરીવર્યનોથી દરેકનું કલ્યાણ જ થતું હોય છે. આમ કહીને અને આ હેતુથી પેતા દરવેશીઓએ વાધને ગાડામાંથી ઉતારીને સાંકળ અને દંડથી તેને સખત રીતે પકડીને તેઓ દરવાજનમાં રાણ જેતા ઊભા રહ્યા. એક તો પેલો વાધ ખૂબ ભયાનક અને ફૂર હતો અને તે શોગથી પીડાતો હતો. તેથી તે ખૂબ જ અસ્વસ્થ હતો. બાબાની પાસે બેઠેલા ભક્તજનો તો તેને કુતૂહલથી જેવા લાગ્યા. પછી પેતા દરવેશીઓએ વાધને લગતી બધી જ વિગતો બાબાને કરી. તેમની સંપત્તિ મેળવીને તેઓ દરવાજન પાસે આવ્યા. વાધની સાંકળ મજબૂત જેંચીને અને તે ભાગી ન જય, એ માટે તેને સાંભળીને બાબાની સામે લાવ્યા. મસ્નિદ્દાના પગથિયાં ઉપર લાવતાં જ અત્યંત તેને મય સાઈસ્વર્પને જેઠિને કે કેમ પણ પેતા વાધે મનથી ખચકાઈને અને અતિઆદરથી પોતાની ગરદન નીચે નમાવી દીધી. પછી તે પગથિયાં ઉપર પગ મૂકતાં જ બીજે એક ચમત્કાર થયો. એકબીજાની નજર મળતાં જ પેલા વાધે બાબાની સામે ખૂબ પ્રેમપૂર્વક અને ધ્યાન દઈને જેયું. તે પછી તરત જ તેણે પોતાના પૂછિદાનો ગુચ્છો ફૂલાવ્યો અને ત્રણ વખત તેણે તેને જમીન પર પછાડ્યો અને પોતાનો દેહ સાઈનાં ચરણોમાં મુકીને એ નિઃસહાય અને ચેતનહિન દિશામાં ફળી પડ્યો. વાધે એક જ રાઠ પાડી અને ત્યાં જ દેહ છોડ્યો. આ બધું જેઠિને આજુબાજુ બેઠેલા લોકો નવાઈમાં દૂબી ગયા. એક રીતે જેતાં દરવેશીઓને દુઃખ તો થયું, પણ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પછીથી તેઓ આનંદિત દેખાયા. કેમ કે પેલા રોગથી પીડાતા અને મૃત્યુનાં કારે પહોંચેલા પ્રાણીનો છુટકારો થયો. સાધુ સંતોની દષ્ટિ સામે પ્રાણ જેવો એ પુણ્ય મેળવ્યા જેવું કાર્ય છે. પછી તે જીવજંતુ હોય, કીડો હોય કે વાધ હોય એ બધાં પાપોથી મુક્ત થયાં એવું જ સમજવું. કોઈ પાછલા જન્મોના ઋણ ફેડીને પેલો વાધ કરજથી મુક્ત થયો અને સાઈચરણોમાં પોતાનો દેહ મૂક્યો. વિધિની કરણી અતકર્ય હોય છે. સંતોનાં ચરણોમાં જેને માથું મૂકીને ભરણ આવે છે, તેનો ઉદ્ધાર જ થાય છે. તે જ તેના જન્મની કમાઈ હશે. ખૂબ મોટા નસીબવાળો હોવા સિવાય કાંઈ અમસ્તો આવા સંતોની નજર સામે એનો દેહ પડે અને ઉદ્ધાર થાય? સાધુની નજર સામે દેહ છોડ્યો એટલે કે જાણે ઝેરનો ખાલો પીતાં જેમ એનું મીઠું અમૃત થઈ જય છે એવી જ રીતે તે ખૂબ મોટું સુખ પ્રાપ્ત કરે છે. તેને ભરણનો હરખ કે શોક રહેતો નથી. સંતોનાં ચરણ જેની નજર સામે હોય અને પ્રાણીનું મૃત્યુ આવે, તે ઘન્ય થઈ જય છે. તે શરીર કૃષણને અર્પણ થયું તેથી દહેને ફરીથી જન્મ ધારણ કરવો પડતો નથી. સંતોની નજર સામેનું ભરણ તે મૃત્યુ નથી પરંતુ તે તો વૈકુંઠનું સુખ છે. તેના વડે મૃત્યુલોક પર વિજય પ્રાપ્ત થાય છે અને ફરી પાછા સંસારનાં દુઃખોનો શોક અને સામનો કરવો પડતો નથી. સંત જેતા હોય અને જે લોકો દેહનો ત્યાગ કરે છે, તેમને ફરીફરીને જન્મના અને ભરણના ફેરામાં પડવું પડતું નથી. તે જ તેમને માટે એમનાં પાપોનું પ્રયાચ્ચિત હોય છે અને એ જ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે. નખના ટેરવા સુધી એટલે કે ઉપરથી નીચે સુધી આખા શરીર સાથે સંતો સામે જેતાં જેતાં જે દેહનું પડવું તેને કાંઈ મૃત્યુ થોડું કહેવાય? એ તો અસલમાં પોતાનો ઉદ્ધાર જ ગણાય. પૂર્વજન્મની આગાહી જેવા જતાં કોઈ એક પુણ્યશાળી જીવ પોતાની વિદ્યાનું અભિમાન થતાં અથવા કોઈ હરિના ભક્તનું અપમાન કરવાને લીધે કે તેના શાપથી આ વાધ જેવી કૂર થોનિમાં જન્મ પામ્યો હશે અને તેના જ પ્રાપ્ત થયેલા શાપની તીવ્રતા ઓછી કરનારાં વચ્ચનોને લીધે તે બાબાનાં ચરણે આવ્યો હશે. ખેરખર ભક્તોનું પણ આચરણ જુદું જ હોય છે. મનને લાગે છે કે, એ સમય પાકતાં એને સાઈનાં દર્શન થયાં અને એના પાપ શમી ગયાં, બધાં જ બંધનો નાશ પામ્યા અને આપોઆપ જ એનો ઉદ્ધાર થયો. પૂર્વના કોઈ સદ્ગતિ હોવા સિવાય, સંતોની દષ્ટિ સામેનું ભરણ શક્ય જ નથી. પેલા વાધના ઋણ પ્રકારનાં દુઃખો ત્રિપુટીનો નાશ થઈને તે ઝ્યુ અને ગુણરહિત બનીને બ્રહ્મમાં એકિઙ્ય થઈ ગયો. આ રીતે પૂર્વકર્માના પ્રભાવને લીધે તેનો કૂર દેહથી સંબંધ છૂટ્યો અને સાથે સાથે લોખંડની સાંકળોનું બંધન પણ તૂટ્યું. એવો આ એક ઈશ્વરનો નિયમ છે. સાધુસંતોનાં ચરણો સિવાય બીજે કયાંચ ઉદ્ધાર થવાનો ખરો કે? તે આ વાધને થયો માટે પેલા દરવેશીઓ મનથી આનંદિત થયા. પણ વાધ એમનું આજીવિકાનું સાધન હતું તેને કારણે તેમના કુટુંબનું પણ ભરણપોષણ થતું હતું માટે તે વાધનું મૃત્યુ થતાં પેલા દરવેશીઓનો ચહેરો ઉત્તરી ગયો અને મનથી ઘણા જ દુઃખી થયા. તેમણે મહારાજને પૂછ્યું કે, ‘હવે આગળ અમારે શું કરવું? વાધના સંસ્કાર કેવી રીતે કરવા? કૃપા કરીને તમારે જ હાથે તેને સદ્ગતિ આપો.’ એ સાંભળીને સાઈમહારાજ બોત્યા, ‘ખોટું ન લગાડતા પણ તેનું મૃત્યુ અહીંયા જ લખેલું હતું. તે મોટો પુણ્યશાળી આત્મા હતો, તેને કારણે આખરમાં તેને મોટું સુખ પ્રાપ્ત થયું છે. પેલા તકિયાવાળી જગ્યાની બાજુએ શંકરનું મંદિર છે, ત્યાં લઈ જઈને તેને નંદીની પાસે જમીનમાં દાટીને એના સંસ્કાર કરો. ત્યાં દાટવાથી તેને સદ્ગતિ મળશે. તે તમારા હાથથી ઋણમુક્ત અને બંધનમુક્ત થયો છે. પાછલા જન્મમાં એ તમારો દેણાદાર હતો. પોતાનું ઋણ ચુકવવા તેણે આ જન્મ ધારણ કર્યો હતો. એ માટે જ તે તમારાં બંધનોમાં આજ સુધી રહ્યો હતો.’ પછી પેલા દરવેશીઓ વાધને ઉચ્ચકીને શંકરના મંદિર સામે લઈ ગયા અને નંદીની પાછળના ખાડામાં તેને દાટી દીધો. આ વાધની સમાધિ શિરડીમાં ભક્તનિવાસ સામે આવેલા શિવમંદિર સામે નંદીની પાછળની

---

### શ્રી સાઈનું સત્ય ચરિત્ર

---

બાજુએ વાધની પ્રતિમા જેવા મળે છે. કેવો આ ચમત્કાર ! વાધ કેમ કરીને બાબાની સામે તત્કાળ મરણ પામ્યો ! આટલેથી જ આ પ્રકરણ જે પૂરું થયું હોય તો કદાચ બધાથી એ ભૂતાઈ ગયું હોત. પરંતુ તે દિવસથી માંડીને બરાબર સાતમા દિવસે જ બાબાએ પોતે પણ આ ભૂમી ઉપર પોતાનો દેહ છોડ્યો. માટે તેની યાદ મનમાં ફરીફરીને આવે છે. (ઓ. ૧૨૪-૧૬૧)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પામેલા, ભક્ત હેમાડપંત રચિત

શ્રી સાઈસમર્થના સત્ય ચરિત્રનો ‘દર્શન-મહિમા’ નામનો એકત્રીસમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે.

**શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણા.**



### અધ્યાય ત૧નું અર્થ વિવરણા

સ્વ. તાત્યાસાહેબ નુલકરનું શિરડીમાં સાઈબાબાનાં ચરણોમાં ડેવી ઉત્તમ સ્થિતિમાં મરણ થયું તેનું વર્ણન ઉપરની ઓવી. ૧૧૮ની આલોચનામાં આપ્યું છે. તે ઉપરાંત હાલમાં જ તેમના પૌત્ર શ્રી રઘુનાથ વિશ્વનાથ નુલકર પાસેથી મને કંઈ અગત્યની માહિતી મળેતી તે એમના જ શબ્દમાં નીચે રજૂ કરું છું.

‘અમારા દાદાજી શિરડીમાં ૧૮૧૧ની સાલમાં ૫૦ વર્ષની ઉભરે ગયા હતા. ત્યાર બાદ અમારા દાદી સ્વ. શ્રીમતી જનકીભાઈની ઈચ્છાથી વડીલશ્રીએ એક લોકેટ કરાવ્યું હતું. તેમાં એકબાજુએ શ્રી સાઈબાબાનો અને બીજી તરફ અમારા દાદાજીનો ફોટો હતો, એ તેને પૂજામાં મૂકવો હતો. એથી જ આ લોકેટ શિરડી રવાના કરીને બાબાના હાથે પાછું મેળવવાનો એમનો આશય હતો. એ પોસ્ટ પાર્સલ શિરડી પહોંચતા શું બન્યું તે સ્વ. માધવરાવ દેશપાંડે-શામા એ અમારા વડીલશ્રીને પત્ર મારફતે જ ણાવ્યું હતું. તે પત્રને છાપવા માટે એનું નાનું કરેલું છાયા ચિત્ર (zerox) આ સાથે જોડેલ છે.

માધવરાવ દેશપાંડે શિરડી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. તેમનું મરાઠી શિક્ષણ પણ સર્વ સાધારણ અને જેઈતું જ હતું. તે સમયની ગામઠી ભાષા પણ થોડી જુદી હતી, માટે આ પત્રનું આજકાલની મરાઠી ભાષામાં શુદ્ધિકરણ કરીને એ વાંચકોની સુખ સગવડ માટે ફરી નીચે આપ્યું છું.

॥શ્રી॥

શિરડી

તા. ૨૦-૧૨-૧૯૯૨

સાણંગ નમસ્કાર વડીલાને,

આપના તરફથી ગઈકાલે એટલે કે તા. ૧૮ને ગુરુવારે મહારાજની આરતીના સમયે મહારાજની પાસે ટપાલીએ તમારાથી આવેલ લોકેટનું પાર્સલ આપ્યું. અને મહારાજે હાથમાં લઈને પાર્સલની ડબ્બી પોતાના મોઢા ઉપર ફેરવી અને ડબ્બીને ચૂંબન આપ્યું. પછી મને કહ્યું કે ‘અંદર બે બુવા છે.’ ત્યારખાદ મહારાજ પાર્સલ મને સ્વાધીન કર્યું. હવે અંદર ઉધારીને જેતાં ફોટાવાણું લોકેટ અને ભાબી સાહેબનો પત્ર હતો. તે પણ મહારાજને વાંચી સંભળાવ્યો. ફોટો હાથમાં પંદર વીસ મિનિટ રાખ્યો હતો. આરતીમાં આવેલા ફરેક માણસને બતાવીને કહેવા લાગ્યા, ‘આ જ બુવો મને લઈ ગયો.’ મહારાજે આવા શબ્દો ઉચ્ચાર્યા હતા તે જ લખીને મોકલી રહ્યો છું. લોકેટ મને સ્વાધીન કર્યું, અને સંભાળીને મૂકવા માટે કહ્યું. બાઈસાહેબને નમસ્કાર કહેને એ જ વિનંતી.

સાઈદાસ

માધવ - દેશપાંડિ

ઉપરના પત્ર પરથી સ્વ. તાત્યાસાહેબ નુલકર ઉપર બાબાનો કેટલો બધો ગાઢ પ્રેમ હતો તે સમજય છે. બાબાએ ‘લોકેટમાં બે બુવાઓ છે’ એવું કહીને ‘તાત્યાસાહેબને પોતાની બરાબરીના કહીને તેમની આધ્યાત્મિક શ્રેષ્ઠતા તો દર્શાવી જ છે. પણ ત્યાર પછી તાત્યા સાહેબના ફોટા સામે જેઈને બાબાએ ‘આ જ બુવો મને લઈ ગયો’ એવા જે ઉદ્ગારો કાઢયા, તેની ઉપરથી એવું સમજય છે કે, તાત્યાસાહેબનો આત્મા એમના દેહ ત્યાગ પહેલાં જ બાબાની સાથે એકરૂપ થયેલો હતો તે સિદ્ધ થાય છે.’

ધન્ય તાત્યાસાહેબ નુલકર।

અંતે શિરડીમાં ભજન તત્પર।

દેહ જેમણે વિસર્જન કર્યો ॥૧૧૬॥ અધ્યાય - ૩૧

